

સ્વ. માનસંગુજ બારડ રમારક પ્રદે - સંગ્રહિત

વર્ષ ૨૬ મું
અંક ૧-૨
સા. ૨૦૧૫-૧૬
સન ૧૯૮૬
ઓક્ટોબર-નવે.


માનસ

તંત્રી-મંડળ :

પ્રા. કૃ. કા. શાસ્ત્રી
લા. ના. કૃ. ભટ્ટી
લા. સૌ. ભારતીભાગેન
શેતા

આચ. તંત્રી : સ્વ. માનસંગુજ બારડ

૨૬ મે હીપેટ્સવાંક



ભગવાન હૃથીકૃષા વિષણુ : અંભાત
[પ્રા., ડા. ને. પી. અમીનના સોલન-યથી]

ઝાંખન જવાલા

પલ પલ મારે અંતર જાગે, આ શી ઝાંખન જવાલા !
 ચોગમ મારી આંખથી દૂકે ડેના એ અણસારા ?
 પલ પલ મારે અંતર જાગે આ શી ઝાંખન જવાલા !
 ૨ રંગણીની ધરતી સંગે હાગણ્યો ચર રેલ,
 દૂર-દૂરે સારસ-યુગમે કલ કલ ગાંદે કંબ,
 જાને મારા ઉરમાં આજે કોયલના ટહુકારા ?
 પલ પલ મારે અંતર જાગે આ શી ઝાંખન જવાલા !
 રે મહેરી મંજરી તેણે સિમત સુહાગી વેરે,
 લંગલારે નમતી વેલી ઉર ચેતાણું ખોલે :
 જાને મારા ઉરમાં જાગે હળવા રે થડ્હારા ?
 પલ પલ મારે અંતર જાગે આ ન્યો ઝાંખન જવાલા !
 જાગતી તોયે જામણ્યા-બેણી જોન ધરીને મઢાણું,
 ફૂલ-ફૂલેખ રૂપદા ઉરનાં એકલી એકલી માણું,
 ડોણ કરીને સુજાને તેણે નમજ્યા રે ઈશારા ?
 પલ પલ મારે અંતર જાગે આ શી ઝાંખન જવાલા !
 ચોગમ મારી આંખથી દૂકે ડેના એ અણસારા ?
 પલ પલ મારે અંતર જાગે, આ શી ઝાંખન જવાલા !

૩. નિર્દ્દાશ ઉચ્ચોગૃહન, મહેરાષ્ટ્રા

જગતીશ ધનોથર ભાઈ, વિસ્તનગરી

Always Ask for PASTEURISED MILK AND MILK PRODUCTS

- Such as ◦ Flavoured Milk
 ◦ Sugam Shrikhand
 ◦ Sugam Gulabjamun
 ◦ Special Agmark Chee

Because they are ◦ Sugam Ice-cream

- Nutritive And Cheaper.

Also insist for "BARODA DAN" a quality cattle feed as it

- Increases Milk Yield
 ◦ And Wealth of Farmers.



**BARODA DISTRICT
CO-OPERATIVE MILK
PRODUCERS'
UNION, LTD.**

BARODA DAIRY, BARODA : 390 009

48]


૧૯૮૬/ઓક્ટો.-નવે.

[પણી-દીપાત્રવાન]



શ્રી ઉમા-મહેદીર : અંભાત
(પ્રો. ડૉ. લે. પી. અમીનના સૌનન્ધિ)

શ્રી ભુવનેશ્વરી પૂજન યંત્ર
SHREE BHUVANEshwARI Poojan Yantra



શ્રી ભુવનેશ્વરી પૂજન યંત્ર

પવિત્ર થઈ, પવિત્ર વાતાવરણુમાં, હૃત્યપૂર્વક શ્રદ્ધા અને જાહીતપૂર્વક પૂજામાં
'શ્રીભુવનેશ્વરી પૂજનયંત્ર'ની સ્થાપના કરી. મન, વચન, કર્મથી પૂજન ડરવાથી મન-
વાંછિત ક્ષળની પ્રાપ્તિ થાય છે. નવરાત્રાનાં અનુષ્ઠાન તથા પૂજા માટે જરૂરી છે.

આજના કણિશુગમાં વિદ્યાલયાસ, ધન, વ્યવસાય, આધિ-દ્વારાધિ-ઉપાધિ, સંતાન,
ધન, વિમારી વગેરે માટે 'શ્રી ભુવનેશ્વરી પૂજન યંત્ર' સિદ્ધ છે. મૂલ્ય : રૂ. વીસ
અદ્યાત્મ, ધર્મ, જીબ, સંસ્કૃતિ, જ્યોતિષ, આચુર્વેદ અને સેવાની નિવિધલક્ષી
પ્રવૃત્તિઓથી પ્રૌણ્યવત વીથીધામ : પ્રાપ્તિસ્થાન : શ્રીભુવનેશ્વરી પીડિ

અ. પુ. આચાર્યશ્રી ચરણસુલીર્થ મહારાજ સ્મૃતિમંહિર,
'ધનશ્યામ ભુવન', મહાદેવવાડી, ગેડગી - ૩૬૧ ૩૧૧, ચુંઝાત (ભારત)

EXPRESS HOTEL

Hospitality with latest facilities & amenities

R C. Dutt Road, Baroda-390 005

Ph 323131, 320113, Tlx-0 75-311, FAX 0265-325980

18, Alkapuri, Baroda-390005, Ph. 325744, 325960

Telex. 0175-488, FAX-0265-325980

HEMANT INDUSTRIES

Manufacturers of Import Substitute Items, Air movies and
testing of cylinder. 279, G I.D.C. Estate, Makarpura, Vadodara-390010

૪]

૧૯૮૯/મેઝો.-નવે.

[પદ્ધિતિ-દીપોસવાંઃ

निः

‘पथिक’ प्रत्येक अंगेजु महिनानी १५ भी तारीखे प्रसिद्ध थाये छे. पछीना १५ हिवसमा अंडे न भये तो स्थानिक पोस्ट ओफिसमां लिखित इरियाह कर्नी अने गेनी नक्ल अवे भोक्लवी.

० ‘पथिक’ सर्वेषिणी विचार-आवाना अने ज्ञाननुः भासिक छे. अबनने जीविगामी अनावता अभ्यासपूर्ण अने शिष्य संसिद्धिक लभान्नोने स्नीकारवामा आवे छे.

० प्रसिद्ध थर्थ गेवी भुनिने इरी प्रसिद्ध करवा भारे न भोक्लवाना लेखकोंके काण्डा राख्या.

० इति सारा अक्षरे शाहीथी अने कागजी ओक ज बाजुओ लभेवी होती लेउन्ने. इतिमां डोर्ड अन्य आपानां अवतरण भूक्तां होय तो अनो गुरुराती तरजुमो आपयो जडी छे.

० इतिमाना विचारेनी ज्ञानाभावी लेखकनी रहेण्या.

० ‘पथिक’मा प्रसिद्ध थती इतिमाना विचारी-अभिप्रायो साथै तंत्री सङ्घमत छे अभ न समज्युः.

० अस्तीइति पाठी भेजन्ना ज्ञानी रिक्ती आवी होरी तो तरल परत कराये,

० नमूनाना अंडनी नक्ल गाए ३-५० नी रिक्तो भोक्लवी.

भ.ओट इंडिय एवा लेज्या पथिक कार्यालय, भद्रवन, एविस-शिल्प, अभ्यासाद- ३८०००६

आध तंत्री : २३. भानसंगलु थारूङ

तंत्री-मंडण () वार्षिक लघाजम : देशमां ३.३०/-
प्रा.के. डा. शास्त्री () विदेशमां ३. १११/-, ४२५ ३. ३/-

२. डा. नागललाल लही, ३. डा. लारतीभडेन शेलत
वर्ष २८] आसो स. २०४५ : ओक्टो-नवे. सन १९८८ [अंड १-२

२८ भा. हीप्रेत्सचांक

[क्र. ३. १०/-]

नवा वर्षनी लही जमना

वर्षे ऐज पसार येव वरस्ये संपत्तिनानां थयो तेष्ये शांति न, सौभ्य ना, ज्ञ अष्ये लागी पडयां लागतां. अष्टायार वधो, न आसन इन्हुँ, संसिद्ध आवे गर्द, आवे डेर, इपाणु हे प्रश्न। तमे शाने नथी दाणता ? शा छे वांड प्रज तयो ? समज कै चोभ्या नथी आवती, लाही छक पडे अशो दिवस ना जेवो पडे, हे प्रश्न। तथी सीध्य अने सुशासन भये, संशुद्ध आवे इरी, अवी अंतर्ना अहो अम नवा वर्षे शुभा आर्थना.

विनांति

वार्षिक आहेको पोतातुँ के पोतानी संरक्षा डोकेज पा शान्तातुँ लघाजम ३. ३०/- ६७ न भोक्ल्युँ हेष तो सत्वर भ.ओ.थी भोक्ली आपया बाटिक विनांति. सरनामामां गोण वर्तुलमां पडेलो. अंड क्या भासवी आहेक थयातुँ कुणे छे. ये भास पडेलो लघाजम भण्डुँ अलीष्य छे. अगाउना देवाजम ऐकूँ के ऐक्की वडु वर्षोना आका छे तेजा पथ्य सवेणा भोक्ली आपया दृपा डेर. अंड दायमां आवे अगाउना लघाजम भोक्ली आपनारे आवा वर्तुलने घ्यानमां न केवा विनांति.

‘पथिक’ना आश्रयदाता ३. १००/-थी अने आश्रवन सदायक ३. ३०/-थी थवाय छे. लेट तरीके पथ्य रुप्तो स्नीकारवामा आवे छे. २३. श्री. भानसंगलाईना अने ‘पथिक’ना यालडेने ‘पथिक कार्यालय’ना नामना भ.ओ.थी. डॉ.इंडिय भोक्ली आपया विनांति, आ छेवी ए प्रकारती तेम ३. ५० थी लर्ह आवती वडु लेटनी २५८ अननामत ज रहे छे अने अनुभव आव व्याज ज नपराय छे.

शुद्ध : वाचो. पू. ७, शीटा २२ दहा विभाग्कुमार

१६८६/ओक्टो.-नवे.

[५

કાંઈયો :

અનુકૂળમણ્ણિકા
પૃષ્ઠ

૫૫૬

જતો ના શ્રી. પૌયુષ પંચા, 'જયેતિ' ૬.	પતનીના વનપ્રવેશી	શ્રી. ઈશ્વરચંદ્ર લદુ "
દીપોસન દો આંબો ડો. ભાતુપ્રસાદ પંચા,,	થઈ નથી શકતી	શ્રી. જ્યોતિ મોહારી ૧૧
આંબો	ડો. હેમત દેસાઈ,,	શ્રી. વારિજ લુહાર "
ગમે છે ડો. ખમેંદ્ર ભાસતર, "મહુરરમ"	ગરજા	શ્રી. નબિન પંચા,,
વનોની લીલામાં	ડો. ડિમાંશુ લદુ,,	શ્રી. રજની પાટક "
સરેરો (કંચ્છી) શ્રી. આનંદુમાર આડે ૧૦	ગરજા	શ્રી. ગણન પટેલ "
"રણનો ભમર"	વૈદ્ય વી. એમ. મહેતા,,	કંચ્છી વાણીનો વીરડો (કંચ્છી) શ્રી. હરિદાસ કે. કંચ્છર ૧૨
નર્મદા-પરિક્રમા-સંખ્યા કહેવતો		ગ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેણી ૧૩
મન થયું		શ્રી. નોગેન મણ્ણિયાર ૧૪
"પદ્માવતી માણલીનું ગીત"		શ્રી. કાસમ જઘમી ૧૫
ચરિતો : ડો. હારેવારા નાનાજી શેડ		શ્રી. હાકરસી પુ. કંસાડા ૧૬
સર્વેજના શ્રી શિવરામ શુક્લ		ગ્રે. રહિલાલ નિ. ન્યાયારી ૧૭
ગિલુભાઈ બધેલા		શ્રી. દીપક કગતામા, 'અંકુર'
કાંતિવીર સ્વામીરાવ ઉર્દેં પૃથ્વીસિંહ આજાદ		ડો. મહેશચંદ્ર પંચા ૨૦
અંકુ કિંગતી આલાંકથન	ડો. આનોહં ટોયાયા, અનુ. શ્રી. હેરેસ લદુ	૨૩
સાધારણાના સત્યાગ્રહી સેનાની		સ્ન. ડો. નવીનચંદ્ર આચાર્ય ૨૪
રાજ્યોવીર છેલ્બાઈનાં લખ અહૃતીય કાંતિહાસ-કર્તાય		ડો. અમૃત રાણીંગા ૨૬
લદ્યુલાર્ટો : 'રસ્તું રંગુનવાલા'		શ્રી. આનંદુમાર આડે ૨૮
સુલેહ		શ્રી. જયત કુમાર મા. વ્યાસ ૩૭
મિત્ર		શ્રી. કાસમ જઘમી ૩૮
આર્થનાદ		શ્રી. ચિન્મય પટેલ ૪૦
નોંન કિનારે		શ્રી. દશ્શેશ દાસ, 'દાસ'
શિક્ષણ અને કલા : શિક્ષણ (કંચ્છી)		ડો. મગનલાઈ આર. પટેલ ૪૫
શિક્ષણના માધ્યમ તરીકે દૃષ્ટાન્તું મહત્વ		શ્રી. જિતેન વી. થાડ ૪૮
ગુજરાતી સાહિત્યકારોના વિકાસમાં એમના શિક્ષણનું પ્રદાન		ડો. પંચસર પરમાર ૫૧
કંચ્છની કંભાગરીકલા		શ્રી. સંજ્ય પી. હાકર ૫૬
કાંતિહાસ-સંશોધન:		
પ્ર ગીત આશીર્વાદાં જિયાઓ વરેરે		ડો. ચદ્રકૃત ડ. ભટ્ટ ૫૭
સિધ્યાંસુત્ર (૫૮)		સ્ન. નર્મદાશંકર ડે. મહેતા ૫૩
માણીન ઉપનિષદોના નારીનિર્પણ		ડો. કાંતિલાલ રા. દવે ૫૪
ભારતીય માણીન સંકુળિભાં સામાયેલા વિદેશી તત્ત્વ		ડો. હરિપ્રસાદ ચાણી ૫૭
માણીન સુધ્ય અને આદુંનિક યુગનું શહેરી આગેઝન		ગ્રા. લુ. વી. પટેલ ૭૦
માર વાસુદેવ થુચ્ચ		શ્રી. ચંદુલુસાદ ડ. દેવાઈ ૭૫
સ્વામિનારાયણ સંપ્રદાયનો એક વિશ્વિષ કેસ		શ્રી. દદરૂદ્ય વ્યાસ ૭૧

૬ |

૧૯૮૮/અષ્ટો - નવે.

[પથ્યિક-નીપોત્સવાં]

संपादकीय

“पथिक” २८ वर्षोंती मंजिल घेडा आ दीपोत्सवांकुरी रहुभा वर्षमां प्रदेश करे छे. आजे जेना आद्यतंत्री २८. मानसंगण आरड हुतात नथी, पथ जेमना अमर आत्माना आशीर्वद “पथिक” हिपर अभीष्टिकृष्ण जय छे ए अगे जेना प्रकाशनतुँ कार्य जेमना अवस्थानना ज भासमां हाथ धर्युँ अने खिने वर्षे २८. मानसंगण आरड स्मारक ट्रस्ट’नी स्थापना करी आगल वधे जय छे जेमां अतुलनी राक्षे छिये. जेसक, “पथिक”ने कायमी प्रकाशित थर्टुँ राख्याने माटे ज्ञेठी अनामत २५ अमे जेना अद्य सार्ग जभा करायी शक्या छिये अने हुए अद्ये लाग सर करवानो छे. आम छां “पथिक”ना छितिथिंतो अमने हुइ आप्ये नय छे. डोर्ट एक पथ भिन्नो हुए भाली नथा जरो डे जेमां जेमां जेमां जेमां एक पथ आज्ञवन सहायक न नोंद्यावेल होय. वार्षिक ग्राहकोनी संचया पथ गतिमां छे. वर्षे १९८४ पाच्य-हस बटे तो पाच्य-हस ज्ञेठी थाय; एकदरे स ज्ञा सच्यवाती रहे छे. अमारी आदरशीय जेवन्सी संस्थानो आमां अमने सहायक्यून छे जेमो अमने साभार आनंद छे. याकु अडो आटे जलेहरभ्यरोनुँ प्रभाष्य नदिवत छे, आम छां दीपोत्सवी-व्यंक माटे अमारा गण प्रभाष्य संतोष डेही शक्या. राज्योट्टना अमारा आत्मीय, ट्रस्ट इडेना भाष्याता वडाल कविता भीयूषकाई पांच्या अने वडेहारामां लाल निवास करी रहेला वर्तमानप्रकार श्री. अविनाश भिज्यार, तथा पोर्टफ्लना अमारा आत्मीय श्री. नाथालाल ना. ऐपोरेलानी जलेहरभ्यरो लाली आपवामां नोंद्यावत सेवा छे जेना आभार नोंद्य देतां अमने आनंद थाय छे. समय जरा आकरो होई आप्या पानानी आवनारी अड्या पानानी आवे छे, तो अड्या पानानी आवनारी पा पानानी आवे छे, पथ आवे छे जेनो अमने संतोष छे. क्षणज्ञा लाल असामान्य रीते नवीं गया होई नाना सामिक्षे ते तो गणे दूर्घो आवे जेवा पदित्यिति सरन्नांछे जेने कारणे नार्थानी जेवा वरताय छे, पथ परम कृपाणु परमामानी परम कृपा अने २८. आरजना पुष्यते कारणे अमारुँ नाव तेजानमां पथ आगम आद्युँ नय छे.

“पथिक”मा आवता लेणो वजेजेना विषयमां जेक्षण भर्याता दूसीमांले निष्ठिव कर्ये छे, ए निशे अगाउ थेहुँ स्थृत रख्यन रख्यामां आद्युँ छे. काहेयो तो प्रथम्यां ज दीपोत्सवांकुरी पूरतां भर्याइत रहां छे. लघुगतात्त्वो दर भिन्नो नानी गोरी आपवामो रवैगो राज्यो होतो. पथ जेतथी छितिलास-पुरातत्वना अने अन्य संशोधनना लेणोनो भोग लेवाता होतो. आमांची अवया लघुनुतोगो पथ भाग दीपोत्सवांकुरीमां ज लेनी. हा, धर्मिक्षम्भूत द्वितीयांत्रिया लेनी, पथ वर्षमां नव्य चर्चा वसु नहि, नेव २८. मानसंगणा धेयकृप छितिलास-पुरातत्व तेम अन्य सामाजिक राजकीय आर्थिक शैक्षिक्षुक वजेरे संशोधनमूलक लेणो हिपर आपातुँ. आ विषयना निष्पत्त लेअहोना “पथिक”ने हुइ छे जेनुँ अमने गौरव छे. हा, अमारा एक सिङ्कहरत पुरातत्वसंशेष बढक प्रेता. डो. ६५मुख संक्षिप्त्याना अमने लारे जेट परी छे. आम छां असार्या॑ कृष्णमुख व्यास अने गुजरात छितिलास परिषद्द तथा सीराष्ट्र छितिलास परिषद्नां भुवरी अधिवेशनो अने गानसनेमां रजू यता अक्ष्यास-विष्ण्याना लेखकोनो अमने सारो. भडारो छे. आमां कृत्वांक तो उत्तम प्रकाशनां संशोधन आवे छे. आनो लाल डोबेने अने भाष्यमिक शाणाज्ञाना विद्यार्थीज्ञाने भगे ए पथ अमारी लावना छे. जेमने उपयोगी थाय तेवा लेख अन्य सर्वसामान्य वाच्याने पथ जेमना य नमां रुदारै होरे जेवा लेख छे ज, आथी डोबेने अने भाष्यमिक शाणाज्ञा तो आहुक रहे छे, हिपरत अन्य प्रकाशना अ.इ.डो. पथ “पथिक”ने याहे छे ए पथ अमारे आटे आनंद अने संतोषपनो विषय छे.

पथिक-दीपोत्सवांकुरी]

१६८६/ओ४३०।-नवे.

[७]

‘પથિક’ના રથાપક નવ. માનસેંગળ આરડ કર્યક્રમ હતું તેથી ‘પથિક’ના વાચકો કર્યામાંના તેમની કર્યા અહાર જઈ વસેલા કર્યા ભાઈઓ અને જેમની સંરથાગો પણ છે એટથે દરેક મહિને કર્યા બાપાંની યા તો કર્યાને કશગો લેણ પણ આપવાનો અમારો નિયમ છે. લદુવાળાંઓ બાંધ થઈ છે એટથે એ નહિ આવે, પણ સંશોધન-લેખાને તો સ્થાન મળ્યે જ જરે.

વધતી જતી મૌખિકીને કારણે અમને કલેકશન આવે છે કે અન્ય સામયિકીની જેમ ‘પથિકાંતુ’ પણ લવાન્નમ વધારો, પણ અમે એમ કર્યા માગતી નથી. ફાતાએ પણે હાથ લાગે કરી સહાય મેળની લઈશું, પણ ભાંત નહિ વધારિયા, કારણ કે ‘પથિક’ના મોટા ભાગના આઢક તો હાથેને અને માધ્યમિક શાળાઓ છે, તો યોંઠ પુસ્તકાલયો પણ છે; એમના અનેટની પણ મર્યાદા હોય છે.

અમને કર્યાની કર્યા સહિત્યસભાના માન, પ્રમુખ શ્રી જેનુમહાણ માધ્યમારની હૃદી છે, તો સુંઅર્થિના માણ મેધય અને કર્યા આગેવાન શ્રી. રવજી કે. ગણ્યાના તથા શ્રી. કિશનલાઈ ભાટ્ટિયાની અમારો ઉપર અગીનજર લે. લેખકોમાં ડૉ. ગિરીશ વાણીયોરા અને એવતમાલ(ભાગાષ્ટુ)ના કલાવિદ શ્રી. આનંદપુર આડેની માઝી નજર છે.

ગુજરાત-સૌરાષ્ટ્ર-કર્યાના નામી અને નવોહિત લેખકો અને કવિજ્ઞાનો ને સહારો સતત છે તેને માટે ઉપરના રહાતુલ્લાલો સહિત એ અધાનો અભાર અની ‘પથિક’ના હરેક પ્રકારના ચાહકોને નવા વર્ષના અભિનાન આપિયે છીએ.

-તાંત્રી

ગુજરાત ભાગ



જવાહરલાલ નેહેર
જન્મશાલી
1889 - 1989
Jawaharlal Nehru
Centenary

પિકચરાંતુ પૂછ પિકારાશીલ રાષ્ટ્રનું જીવંત પર્ટીક છે.
જવાહરલાલ નેહેર

પન વિભાગ, ગુજરાત શાખા



૧૯૮૯/અંકો. - નવે.

[પથિક-દીપિત્તસવાંદ્ર]

જતો ના/શ્રી પીયુષ પંડ્યા, 'જયોતિ'

તને અંધારા બોકાવે

કે અભવાળી

યા ડોઈ શાત દિનારા તોંયે

તું કથાં જતો ના.

મુગુણગી જૂની

ભીતરની તારી તરસ ધોપવા

કોઈ એક ધૂ'ટ પોવા લખયાતો ના,

તું કથાં જતો ના.

હેઠ અભવિહોલું થાંત ઘેમ

કે વટાટાપ લનથોર,

હેઠ જીજળાદુદ કરતાં જરણ્ણી

કે નિરંતર સાગરનો શોર,

તું ધરી અનધતું મન અખંડ

નિચ મહીં વિચરને એકલાપં,

કોઈ એક રથો સલવાતો ના,

તું કથાં જતો ના.

કે. ઈ-૨, ગ્રન્થમેન્ટ ક્વાર્ટર્સ, રાજકોટ-૧

હીપોત્સવ હૈ આયો/ ડૉ. લાલુ પંડ્યા

ધૂમસેર ધરી ધૂપણીની

પૂજન કાજ પથાયો,

ઉમાપતિના અર્યાન કાને

સાવન સાહુ આયો !

અધાના તાંડવનીત જનત શાંતિપાઈ પદાર્થો,

વિકારન હેઠે અહિતનો જગ્નાહ દીપ જગાયો !

શાખર પર ખલ અના દહેરાયો !

સાવન સંત પદાર્થો !

કૃષણ માંલે કેસરસણી લિલિ થઈ ચીતરાયો,

મંહિર નાંદર મંજુલ સોત યાંકરૂણ અદ્યાયો !

સગત જીતર-નહાર નચાયો,

અલુમાર અની આયો !

નદીપટ નટરન જાન તણો શું માન યાદ ફલાયો,

મનમોહનદીલાં મનદાન કરતાં રંગ લાગાયો !

લાલર અસીનાદ પણાયો !

હીપોત્સવ સમાપ્તમાં હો આયો !

કે. કુચિર, પંચવડીનગર, રાજકોટ-૪

પથિક-હીપોત્સવાં]

આધ્યાત્મિક ડૉ. હેમન્ત હેસાઈઝ

દોષો, આમ દીરી જોના એ યુદ્ધારમાં આધ્યાત્મિક,

મહેદી જીઠચો ના, એ જ વહેવારમાં આધ્યાત્મિક !

નોકે વધુંથિ પાર સમાચારનાં આધ્યાત્મિક,

'આયો' કથાની પૂર્વે આજ દારમાં આયાં !

વિવરયાના રંગ કાંઈ હોશ લાધ જરો અરે,

આધ્યાત્મિક વસંત જેમ ને પળવારમાં આધ્યાત્મિક !

પહેલેથા તમે ખૂબ સુશોભિત હતા, હોશ,

આરે તો વળા રોકાના મઝવારમાં આધ્યાત્મિક !

આધ્યાત્મિક, જુઓને, પંખી નવાં કંચાંદ્યી આધ્યાત્મિક,

સત્કારના આ પૃથ્વીના શાખુગારમાં આધ્યાત્મિક !

સ્વર્પું જરૂર ? ના, હાર્દય તમે વેદું લહેરાતું !

ઉપરથી તમે મૌનથા ઉદ્ગારમાં આધ્યાત્મિક !

કે. સો. કુનિ, આધાકલન, રાજકોટ-૫

ગમે છે/ડૉ. ધરેન્દ્ર માસ્તાન, 'મધુરમ્ભ'

નવનમાં ગમે છે, હદ્યમાં ગમે છે,

વિશુલ્ય ! તારા પ્રતાપે દુરિતો નમે છે.

કદી વર્ષાધારે, કદી ઇલસુવાસે

તન નોકે છું તાં આનંદ અરે છે.

ધોંકણું કુદરતમાં તું મધમદે છે,

જીવનમાં આ સૌરલ સુજાને ગમે છે.

કદી ચાહની રાતો, કદી અંધાર ગાડો,

જીવનમાં જે આવે તે સંચિતકે છે,

ધરા-પ જે રોકા-જરણ અભજે છે,

તે જીવનમાં રમ છે, હદ્યમાં ગમ છે.

કે. સી/૮૭૫, કેદ્દીનામા ચક્રવા, ભર્ય-૧

વાનાની લીલામા/ડૉ. હિમાશુ લહુ

(શાનારણ્ણા)

જોની લીલામા મધુમન રસ સુંદર હસે

દરતં જાંબાલી કાવત-જરણી ત જ બસીતી !

અનકાના હેણા પુલાકત યતા ધન્ય અનતાં,

નાલે ચૂં ના તાં નલ વસુદ્વા લર્ણ વિતરે,

તથી રસ્યા કરો મનભર રિશા ચિત્ત ભરતી

કથાના આવાપો બનિત સરમા અતરતે !

કે. ર, રામદુષ્ણાગર, પીરાણી હાઈરસ્કુલ પાણા

રાજકોટ-૨

૧૬૮૬/ઓક્ટો.-નવે.

[૬]

संप्रेतो/श्री. आनंदकुमार आडे
आंध व कडे भिलेला वेदा,
हे ज 'संप्रेतो' हिंदी आडे,
आंध धतरो योजन : "आनंदके
संप्रेते संसार अपेतो...!"
हिन गाम के भौतिक आय,
नजरमें हरपत नदरत आय,
रनेहलाय टरवतेती जेत
वटे हे नाय, जेण अचत आय.
हथ अलेने सुअ प 'कुआ' हठ यो,
पोडा पथ फेलाय हडी विध,
भास धतरी आय मुडे
पीवेला सागर अपेतो !
आंध धतरो योजन : "आनंदके
संप्रेते संसार अपेतो !"
मुण्ड पोडा मुंदे खिलाईते,
विलग्न जभम मुंदे खिलायते.
मिंधरनु छेक मसाले सुधा
हरपत हरवती धर्दा भिल्याते.

पनपरडे वर पसंन न वो,
आंध मुंदे भन बारे विध,
मिंधरमे विध, जेर पिधा, पथ
आमुन हाणे हरदार अपेतो !
आंध धतरो योजन : "आनंदके
संप्रेते संसार अपेतो !"
धरमे झुशीय वरण्णर विध,
अज तां सुन्ही लही सहर आय,
डिमतलु दी कडो मेरे,
झालरमे पथ सुन्हु घर आय
हररात जनमडेद लेजती,
दी पथ अर्पात विधेतो,
भासुम धर्दने मुख डिल
भज डोक सोधागर अपेतो !
आंध व कडे भिलेला वेदा,
हे ज 'संप्रेतो' हिंदी आडे,
आंध धतरो योजन : "आनंदके
संप्रेते संसार अपेतो !"
६. यंपनवाडी, जागु चोक, एवतनगर-४४५००१

"रघुनें अमर"/नौदी वी. एम. भड़ता
(वक्षंततिलक)

वेलीप्रतान उपरे इलडु हसे छे,
सुवास धान इरवा धमरो धसे छे.

राठी हतो रघु तष्णा अनशिंग गंध,
भाषेल ना अवनवी हिये सुंगंध.
ओवा समे थाई रवो अरुणो ग्रामाय,
धृती तथा पट परे प्रसरी रताय.

लेपां कांता कुसुम आवण भिजाना,
लेपां कांता कुसुम आवण डेराना,
जेमां न गंध, कुसुमे नहि रंग राग,
ना इप के सहज डेसर धूपचाव.

इली हतो सखर आज गुलाम-आजे,
वातो हतो पवन मंद वसन्तराने,
तालं गुलाम भनने गमतां निहाणा,
भाषी सुवास अविजे अनां निराणा.
६. ६, शाशुका रोड, भावनगर-३६४००२

पत्तनीना वनप्रवेश/श्री. ईश्वरबांज-बहु
(शिखरिष्ठी)

अहो ! तुये त्यारे पति अमुसरी धीट अनथी
अनेशी डेहांगे विकट वननी संकट-भरी,
भधा प्राणी सांघे सहजकपवी वर्तन करी
छती लीधां सोने, तपलवननी ओपदण्णा.
सही भूंगा देहे कटु विषम ना देहे परम्परा,
'सतीशी' सेवामां रत परिश्रमे 'नाथ' तीजव्या
अनोआ संसारे भहन उरता वैकवज्युं,
भहुं ते लूटावी गरवविषु ते गौरव धरुं,
हे दी-हे शिशुरीभगानीं रीस-छालुका,
सहे धिंगामस्ती, भर यही सरे जप-मधुका,
हीसे आधी अंकी अकहलट ते श्रेत अलहै,
अने मोनी रेपा नवल दहने सौम्य गहडे.
क्या पुष्पे वाख्ये शुभि अवननो तोप शिलो !
जगे जागु तेथी वहन, सधी ! सौलाग्यतिलक.
६. 'स्मृति', लक्ष्मीनारायण नडोल्या, वलसार-१

थर्थ नथी शक्ती/श्री. जयंती देवीकांठ

जगता रपनी भरती

नलकृष्ण थर्थ नथी शक्ती,

भगवान् लिलनी धुड़कन

तमारी थर्थ नथी शक्ती !

परमां याप छे सौरक,

अडकना थर्थ नथी शक्ती,

गरबता गेवनी सवारी

अमृतम् थर्थ नथी शक्ती !

३. ज्वाहरनोऽ, ओआर्म-३६१३५०

रेशमी टोणाव/श्री. वारिज. लुहार

हलेष्ठी हुं होय छे वेवाटमा,

सामे भगे हुं रेशमी टोणावमा,

भरभाद झुमाडो वधे वरी वगे,

विस्तार भारी होय छे अस आगमा,

ने २५००ना पद्मा त्वया न्यां सांजनो,

लोडी वहेतुं थाप छे चोपासमा,

जेहाद झुका खूनो नो आथमे,

हरियो पछाई होय छे ग्रावामा,

चारे तरह परवाय पगवर सांजनो,

दरयो पछाई होय छे अस आगमा,

३. आरसिया रेह, वडिया-३६४४०

गञ्जली/श्री. नलिन धुंडु

कायमो हेहेतां काय छे,

सायमो हेहेतां साय छे,

अयरज याती हेसेलाया,

आंचेडो हेहेतां आय छे,

धनकारा तो वधो लाय छे,

झटडो पहतां आय छे,

धर्म-हुरं-बर धन जुतुं हुं,

झांगट नाहो नाय छे,

धसमस पूर शा शास आपने !

ओम अयाय क याय क.

पाड मानने आ पथरनो,

किंव अजोमर टाय छे,

१. नित्यानंहिनी सोसामी, से. २, अमदावाद-६

परिषद्दीपोत्सवां

कुवि/श्री. २८८८ पाठ्क

कुवारेक भरती-जीत गाय छे कुवि,

कुवारेक निर्बन्ध दुंगरमां लमे छे कुवि.

कुवारेक लघरवधर ४५८ रहे छे कुवि,

कुवारेक आद्याली ढाँढ्यी रहे छे कुवि.

कुवारेक नलभंगमा धूमे छे कुवि,

कुवारेक निरादिका-तीरे रहे छे कुवि

तेथा हेहा लोक हरे जगतनां :

ज्या ना पहेचे रवि त्या पहेचे कवि.

इः-पी-सं-ग अमु वहावे छे कुवि,

सुपी-सं-ग हसी इवावे छे कुवि.

जेथी कहे प्रमु खुद गीतामां :

मनुष्यमां त्रेषु अने छे कुवि,

ज्यारे अने अं-व अवर्मीमा मानव

त्वारे पहेलो अं-व वांचि छे कुवि.

सं-सृति आतर पोते भरी जहाने

सं-सृति सहा जवती राये छे कुवि.

कुवारे ना भरतो के मरातो कुवि,

कुवि सर्वज्ञापी छे चेतन-स्वरूपे.

प्रलय थर्थ समय नष्ट याए सुषिट,

कृत थर्थने जवतो रहे छे कुवि.

३. अस-१, इवेदस नं. ३१, भीड़ापुर-३६१३४५

गञ्जली/श्री. गलानन पटेल

तरहडे रेती अने पगलां भगे,

भुगनी तुषा अने जरखां भगे,

नाम व्याकुण, अं-प पोका-शुद्ध भगे,

सांगस्थी फृक्सस्थ दो उमायां भगे,

टेरला रोमायथा भृक्ताय तो

आपया सं-धने जरखां भगे,

धाव, तारा हारनी तरसे पक्ष,

दूरता क्षी खासते तरखां भगे,

छाईना आलमां भिलिखि नगर,

कुवांक अहेशता नयन नमखां भगे.

३. आर्द्ध-डोमर्द्द फैसल; चीमदी-३६६५२१

परिषद्दीपोत्सवां

[१६८८/ओडेटो-नवे.]

[११]

કંચ્છી પાણીને વીરદો/હરિદાસ કે. ઠક્કર

- ૦ પિંડ કિતરો પાણી જિની, ગેજેસ' તું ગાર,
નથી તથા ન જારાલે', તું પિંડને સંભાર,
પોતાની જરૂરિયાત પૂરતું પાણી લઈ, ગળાણ
વડે તું ગાળી હે, નાની-તણાન આગવાની વાત નિક
નહિ, તું પોતાના પૂરતું સંભાળ હે.
૦ રામ એ કોષ, રહિમ એ, એ કોષ યુદ્ધ મહાવીર,
ઘટ ઘટમે વેઅપેગે 'હરિ', એ ઠિક્કો જ

પણું ને પીર.

કોઈ રામ કહે, કોઈ રહિમ કહે, કોઈ યુદ્ધ કહે,
કોઈ મહાવીર કહે, પણ ઘટ-વટાના વાપેલો ઈશ્વર
તો એક જ છે, એને પણ કહે કે પીર કહે.

- ૦ પણી ચેતા માટુંને કે : લોન વિને અધ્ય ચુલુ;
પણ મહેં કે ન કોપેણો, નો મધે અસાંને વેણુ.
મહીઓ નાણુસોને કહે છે કે તમારામાં ધર્મ-
આવના ન હોય તો એર, અલે તમે ચણ ન નાખો,
પણ કમસે કમ કુદરતે ઉગાડેલાં જાડ તો ન જ
કાઢો કે જેના માથે અમારું એસવાનું સ્થયાન છે.
૦ ભાવર ગિડે હિકડા થઈ, હલે હિલી-મિલીને,
'હરિ' વસ્તાં મોરે નિયષ્ટમે, જ નિયો મિલી-

પિલીને.

ભાવનો સહૃદ એક થઈ હળામાને યાદો, હસી-
દસીને જ્ઞો તો જીવનમાં જરૂર વસ્તાં મહેંરશે જ.

- ૦ જનની જણું ત સાની ભક્તા સુર વીર ને દાતાર,
સંદ જ્ઞા 'હરિ' હો જ લાલા, જ્ઞાડ મિલે

પૂરો પ્યાર.

હે જનની ! તું એવી સંતાન જણું કે જે જાની
ભક્તા થર વીર કે દાતાર હોય એને એવી-સિંહ
બેવાં-તો એ જ સંતાન સારો કે જેને પૂરતો આર
મળ્ણ શકે.

- ૦ કંબરી વધ સપ્ત ભેરી ત મિલે કણાતે નથ-
ને આધર,
જ થઈ સપ્તનું ધાર ત છને; ઊંઘર
અનાંય પિંડને ઘર.
(સાપને અસુક મુદ્દે નવી કાંચણી આવે છે

ત્યારે એ પોતાની જુની કાંચણી ઉતારી મુકે છે એ

સાપની કાંચણી) જ્યારે સાપ સંગાથે હતી ત્યારે
સૌ એનો આદર હરતાં હતાં, પણ એ સાપી જુદી
થઈ ત્યારે એમા ઉંદેશે પોતાનું વર અનાયું.
સારોશ એ જ કે મહાન વ્યક્તિ સાથે રહેલ સામાન્ય
વ્યક્તિ (પતિદેવ રહેલ થી) પણ વધુ આદર મેળવે
છે, પરંતુ એ (સામાન્ય વ્યક્તિ) અભિજાતથી અમિત
થઈ મહાન વ્યક્તિથી જુદી પુઢે છે ત્યારે એના
અરિતવને કોઈ પુછું જ નથી.

- ૦ દોસ્તી તાં એડી હિને ક જ પિર ને પાણી;
'હરિ' હિંદુકસે કિરી વિને, જુદાઈ સકે ન.

કોષ જાણું.
દોસ્તી તા એવી કરવી જોઈએ કે કેમ દૂધ ને
પાણી કે ને એક થઈને સાથે ભળી નાય એને
જુદાઈ કોઈ જાણું ન શકે.

- ૦ દોસ્તી તાં એડી હિને ક જ પિર ને પાણી,
તપ અચે ત પાણી બરે ને 'હરિ' પિર પણ
કે ઉંણાણી.

હોસ્તી એવી કરવી જોઈએ કે જેવી દોસ્તી દૂધ
અને પાણીની છે, તેમને દૂધને ગરમ કરીજે તારે
એમા રહેલું પાણી કે કે મારા મિત્રને-દૂધને આંચ
આવવા નહિ હું, અલે તું પણ જહી, મારી
વરણ થઈ જાય તો વાગી દૂધ પણ મિત્રની આવના
નાણી એવો જ પ્રતિભાવ વ્યક્ત હરે કે મારા મિત્રની
પહેલાં (એવી બચાવવા) હું જ જીલ્લગાઈ રહીને
અભિમાં પડું, પણ મારા મિત્રને કાટ પણ ન હતું,
ખરી દોરતી તો એવી જ હોય.

- ૦ ન ચય નુરે, ન કિલ હલે, 'હરિ' સિરવા
થિયે ન કણ;
ધિલાનિયું ગાલિનું થિયે અખેસે, જ હુંબે
હેત બેરેયા મન.

મારા સ્નેહની વાતો તો આંખથી જ આંખ
દારા જ થાય, એમાં હોડ ન હાલે ને જુલ ન
ચાલે, વળી કાન પણ સાખદા ન થાય, માત્ર આંખની
નાખરથી જ હૈયાની વાત જણ્યાઈ જાય.

- ૦ ભારત માન, ભાંડું હલોતા હિલીમિલીને;
'હરિ' સુખ-કુખેં મેરા રધ, નિયોના પિલી
અભીને.
[અતુસાધાન પા, ૧૪ મે]

नर्मदा-परिकमा-संबंधी कहेवतो :

[संक्षेप]

आतुरजन अने निरीक्षणो आशरो लड्ठे शहन-
विद्य पामेली नर्मदा-परिकमा-संबंधी कहेवतोमा
अमुक स्थगो, व्यक्तियो, सगवह अगवउना वित्रना
लाज्जिकुटाए थथान पामी छे नर्मदा-परिकमा कहेवतो
लक्ष यस्तु दोक्वायीना आयूष्यवृत्तप कहेवतोना
भजनाभायी छुटी भरतो भरतो आगण धोपे छे.
अहीं नर्मदा-परिकमाभाय आवतान स्थगो संबंधी
आतुरजनन्य कहेवतो लोङ्गाण्हि वगेरे आप्यां छे ते
पैकी डेट्लाक दार्यात्तुपे लहिंगो :

“काणा अलही खूटा डेक्का, जेही है आवसरका भेया”
सं. १६५७ मा १८१ वर्षी अति दीर्घ उभरे
अवसान पामनार मालसरना दोक्प्रिय महात्मा
माविहासल लांगी काणा अलही पहेरता. अमना
व्यक्तित्वुं शहनविन अहीं अहिं धेयुं लेई
शक्य छे.

सिनोरनी जना अने कियार आजु प्राप्त भेण्वाने
आ रीते रङ्ग थठे छे :
“सिनोर गाम शंकरतुं ने उपर लगवी धग्गा;
आवापीवाना ऐरसद्वा, अस नाहवानी ऐक मन.”
तो वणी दोक्लभे रमता भील होइराना नंदी-
(राजपीपणा)ने स्वार्थी अने लक्जनविलीन गण्यावेद
छे. याणेदानी पाक मोरा वाट, मंहिरा, धर्मचाणा-
शेनी तथा करनाणी भोजन-सगवउना निर्देश पैणु
क्षम्यमां लेवयो छे :

“नौं गाम नांदो ने शह गाम सिनोर,
आउं भीतुं करनाणी ने रात रहेउं चालोह.”

ईदरखण्या पासे जेरा गाम सामा छाँडे छे,
हनापाथीना दृष्टिये परिकमावासीने लाढे कै चेतवयी
अभाई छे कै अहीं अहु थाक्कवा लेउं नथी :

“जोराना वा ने भरथीना धा;
अथा अचे तो गुरुरेखर ला.”

जोरानां अर्थी समा डातिव हनापाथीना वामायी
अनार आटे गुरुरेखरना रहेउं लेपभासक भनाहुं,
झेके त्या साप वीछी तथा दिंसक प्राणीयाना

पथिक-दीपेत्सवांड]

सं. श्रा. विपिनबंद २. त्रिवेदी
आगमनथी रहेउं मुकेल अनतुं; जोडे आ परि-
स्थितिमा सुधारो थयो छे.

नर्मदा-परिकमा कहनारे आ सगवड-अगवउनो
भ्याव राखनानो छे ते

“आदा भादा और कांटाका नहीं बाटा...”
मेट्टेवे कै लोट कांकरा अने कांटानी भोट नहीं नथी,
‘नर्मदामां कंकर जेटला शंकर’नी रटखा करनार
डेट्लाक परकभावावासींगो आ यानाभाय धोपे
पृथ पंथ धोपे छे अंगो. आजी आरामधिय भो-
द्धा भतेनो कटाक्ष जुओ :

“दोदा भर दग्गना और भोदा भर चक्कना.”
परि. कमा कहनारे जोराकमां कैर आवतमो भ्याव
राखयो जेंगु गर्वहर्वन आ कहेवतमाथी भले छे :

“कुट्टी गर्छ खूयसीमे, भाल रखो अधरात,
भावी भियारी कुट्टीयां रहे सारी रात.”

अहीं अनन्ती मझति धर्याई छे. जो नर्मदायात्री
जोआती छल्ला(कुट्टी) आय तो ये जहाही पनी
ज्यवथा ज्यवा आद तरेव ज खूभन्तुं हुँग सतावरो.
आत आय तो वणी अहीं रात सुधी निरांत, पृथ
इरी आधी पेट्टुं लाइ चूक्कवाना तक्कीह थरो,
परंतु डोरी(कुट्टी) देवागं आवे अने पग्पाणा
आलवाहुं न लेय तो रात सुधी निरांत ! आगण
दधां वधां पुनर्वाट आवे त्या

“पुनर्वाट पर प्राप्यना वासा,

संज सवारे अनन्ता सांसा !”

युभानहेथी नानासांल थड्ठे युवाली भेण्वतां ऐ
मार्म भापवा पडे जलकाणमां कहेवाहुं के

“संज पडे तो सांब्बी जाना, अत जर्झीगो युवा ली;
आहेपीगो जेसद्वा, लक्कीही दिवाणा,”

आहेकेथरतुं आगान नाम अहूरेखर, परंतु दोक्लभे
अनी छनी काँडेहु जुही ज नेवा भगे छे. अहीं
द्याहुं प्रभाष आहुं, पैसानी ज पूजा. स्वार्थ-
सगाईने कारणे गरीभनो कौटि आप पूछतुं नथी
अवीं छनी दृश्याह जिलाराय छे आ शम्भोमां :

१६८६/ओ४४३.-नवे.

“अहंकरेश्वर गाम, आत्माराम,
जंपली भाजेण, आक्षवण्णा इवा,
गरीब थयो ते छवदा भुयो...”
तो वज्ञा अन्य स्थगनी लाक्षिष्ठिकता
“अडोल हजलतना भधये पाणी,
सान सरोऽने शेडुं धाणी;
जोगे वालुं धाणी पछी नडि पाणी.”

अंकिष्ठेश्वरी कृष्णाजनक जवानो पांडो २८०२ स्तो चन्द्रिस
वर्षथी छ. ए पहेला वासनोली पछीनो लिमलेश्वर
सुधाना भार्ग कृष्टदायक हेवायी कृष्णाजनक भनी
रहेनो, पसार थनार चोहारी जिहता :

“कृतपोर भतपोर ने विभेश्वर
कृरी न देखाउ परमेश्वर.”

‘आंग्गु आंग्गु’ तेये लहाये ए क्षेवत लख्योनी
छ. ए उपरांत लक्ष्यी भपडो (स्वार्थ दंड) इङ्ग्रिप्रोग
पशु यात्रानुने काने पडे भरौ.

आम नर्मदा-परिक्षमावासी भाटे अनुभवपेथना
आधारे ‘स्थानिक भुजोण’ आनी क्षेवतरपे लोङ-
वाल्यीमे तीवार राणी छ.

ठै. कोलेझ, अंगुभर-३६२१५०

मन थयुं/की. जोगेन मधुयार

मन तागी ज्वानुं भन थयुं
ने पछियां छवानुं भन थयुं.
भालीचालीने भंजिल ना भणी,
होडवानुं हांझवानुं भन थयुं.
बदनसीभी कै तमे मगडर थ्या,
मुजने ले शूकवानुं भन थयुं.
बारायुं एक अंध भीतरथी हुं
थुं हुं, ए लघुवानुं भन थयुं.
ठै. वदवालिया शेरी, भेरभी-३६३६११

[अनुसंधान पा. १२ नुं चालु]

अमे लारतनां संतान सौ हजीभणीने यालीमे
छीमे, सुभ दुःखमां सावे रही हसी-हसीने ज्वाने
छीमे.

० नोंजे कम वे से ७० ४२, ‘हरि’ गेयो तां करे
जिमाक;

निंदी सुईने कम वे तडे उते कुरै ४२ रतर ?

जे काम जेतुं होय तेनाथी ७० थाय, भीमाथी
न थाय, भीनो तो अगाड करे. तानकडी सेप्तनुं
काम होय त्यार त्वा तवनार श्य कामनी ?

० पिंडे केकाणे वज्ञ भिडे, ज हिरये पिंड-पिंडले
कम;

‘हरि’ रतर उते कुरै ४२, जिते रांभा
चिरे यम ?

पेत-पेताना स्थाने हरेक व्यक्तिनी महाना छ,
मेटाई छ. मेचोने याभीतुं काम करवा भाटे ‘रांभा’
ज अगत्यनुं उपयोगी सावन छे, एने स्थाने यां
तवनार काम न आने.

० वाट थये वाय, डैय ये उनी, डैय ये तागी,
ज उक्षियों नमीने तये, करे उनो आय भांगी,

रस्ता उपर वाव (इवा) होय तो ते ते कै
बींडी कहे, कैष धीउरी कहे. जाहेर अवनमां पहेल
व्यक्ति ने सजगताथी-नग्रानाथी नम भनी भिक्षी
रहे तो कहे : अति-अरग्गि थहरे डिक्की छ. (तोहरी
करती ल्ली रटाइओ-समाजमा सी सावे हजीभणीने
थावे तो एना यारिन्य विशे शंकानी चातो थाय,
ने सौथी अवित रहे तो समाज एने यांडी-
अभिमानी कहे.)

० हाँडरकूव-केरा ३७०४३०

કોઠારેવારા નાનાળ શેઠ

શ્રી. કાંદારસી ગી. કંસારા

હેમારેતે પુજો નિરંજન, ધિણોધર સંભરન,
અર્થાત્ બાહુદા કંઈકેલ આય, કંઈ અસાંને ચમન,

મુંલ ભાતુશ્વમિકે નમન। -કંદિ નિરંજન

કંઈમેં અથડાસા તાહુડો સિંધળ ચુગણીંન શાવન રક્ષણાય દિલ્હીન બાહુદાઓ
અલ્લાહિનિલુ દ્વારા સામે લોને કુરાની વેરી ગિંધાન અથડા અણ્ણંગં ગાંધી વિખ્યાત તાહુડો.
ઈ તાહુડોએ કાઢારા ગામ, સેઠ દેક્ષેવળ નાયક ને સેઠ જોકાવાસ તેજપાર કેડા પનોતા પુત્ર ને
દાનવીર સેણીંને વતન. કાઢારા ગામન ભાટિયા વેરારી અટાઉના ભાસા ને ગ્રામાણિક. ઘરમે
જગહાન નેંડો ચુશીય ગુણીયત બધ્યાંપત્તા ને કન્યાએ કુંવર કેડા બ પુત્ર.

મુરજ મારજ હુંણ પદ્ધાર્યા નંધ, ઉત્તોધૃ જિસમેં સુકરલે તારો અમકાને રસ્તે મથા બોધો
પ્રકાશ પથરી દો આય, ધન ટાંબે પ્રકાશણ ઉથા આકાશને અંગણમેં સંદ્યા પૂરી રંગ આય.
ધન ટાંબે લોનો માંડેલારી હિક્કો આગામી મહિ રોંગે અંદરમેં અણી પુણી. વેલ જોડો જાડો
કાંઈ વદા હબી રક્ષ ને ધનમેથા પિંન-પિંનલવન વરેણુ ઉમરલે હિક્કો આહમી, પાંચ-ચારી વરેણુ
ઉમરણ હિક્કો બાંધ ને બ છોકરા ઉત્તરને કાંઈ મથા આયા. અંદરમેં થોડે છેટ દરિયામેં હિક્કો
વડો વાય લભો સંકરણાય તથાર ઉભો વો. થોડા બ્યા વાણુ ને મચવા કાણેણ નજિકમેં જીલા વા.
વડે વાણો માલમ કાંઈ મથા ઉભો વો.

“અર્ય, પુજા, અટાઉ સેઠ કે અનેને નિયાયો મિલ્યો વો. કેર મુંબાઈ હવેવારો આય?”

“મુંને વડો પુત્ર નાનાળ, અચ્યો આય, આરે વરેણુ ઉમર મંડ થઈ આય, પણ લાચાર અંહ્યા,
ને વરેણુ લગ-લગાઈ કુશરલ આયા, વેપાર તુંઠી ધો, એતી તુંઠી પક્ષ, હટઠી બંધ ડેણી પક્ષ.
અસાંને ગામ કાઢારેંગે વેપાર કે એતીમેં હિંદે ક્રમાણુને ભરેસેંસો નાય. મુંલ અવરણા થઈ, વડે
છોકરેકે મુંબાઈ હવાધરણંતો. હિક્કો બ વરેણુ ધગધ વેંધો, અસાંને ગામન મેસરી લગવાનણ મુંબાઈએ
અંદર મથા મેદીણ-ગિયાણેણ હુકાન આય. અંદરલ મનુર ને બ્યા નજિક રેતા કાણીક અનાન
રસકસ ને પરસુરણ ચિંત-નસત વિકને ધોયો આય. વેપારીકે ભલાભણ્ય હિંદ આય, ધનણ હુકાન
સાફ-સુફ ડેણી ને ધોયો ચિંતે ક્રમહુકાનને કરેને આય. નજિકમેં વિરી આય. નજેણુ સંવરડ
ઉંનાં ચિંતા ને રાતને હુકાનને સંવરડ કિંધી, હિં ટાંબે બ્યા ટોય રસ્તો નાય.”

“હિંદાં આય અસાંને લા?”

“હી આયો.”

લુંન નાનાળ માઠે પડી લાગીને નિંબા લા દેજારાઈ કેંદ્રથો ત્રોયળ અણ્ણુંમેં બાસુન
પુર ઉમટથા. માળ આશીર્વાદ પ્રાપ્ત કરીને જુવાન નાનાળ અટાઉ સેઠુકે પ્રચુંમ કરીને કાંઈ મથા
માલમજ નજિક આયી ઉભો.

“હી અણ્ણી રહા હાણુ આડે સેપિયાંતો, આલમ! અંને આખરે છિયાંતો.”

“આસરો મુખાને, સેઠ! ભાળ સાર-સંભારણ જલાભધારી મુંલ.”

“છેણ મુસાફરી આય. લગવાનને ભરેસે છોકરેકે પરદેશ પેકેલાય છિયાંતો.”

“अबज्ञे सहजेने दी सुखनवंतो आय हृ असांने गाम मस्तेन शास्त्री भाराज चोभावा : ‘सेठ ! भाल डिसमत लुटी वेधा; लघपती चिंधो।’”

“आंगे भोंगे भन ने पिर लगवान आंगे भवो करे भाषम। ही हिक्को तुपियो जिनो, छाकेण्ठ मुसाफरीने भाकेने, वडु न तो इठ सको. लकाई जिनलन।”

“इ हुरो चोता, सेठ ? ही आज मुसाफरीने भाको ? न जिनाने, सेठ ! आँधु भाटिया ने घोण-मिठे असांग सेहिया. आँधु भिठे असांग भाधतर ने असी आंग विषा चोवानें ने, आ ! त हूंन धूंधो क्षिपेवाय अचेतो, कमधी चिंधो. गोय अपैथार मुंलाल डोडी वेधा से भन टाढु ल जे अधेव पञ्च तुपिया भंगी गिंधोसे. इ इपियो क्षुद्धार भवें ला ज रप्ते ने अँधि जाराय दिक्कर भ कला. भाके भोंगी सेठण हुकान तां आँड छडी अचिंधो. सेठके आँड सुखायुतो. भक्षाभयु करीने गोय न गे वार विन्यी भाके न्यारी करीने महां याहो अचिंधो. तिन याहो आँड समायार मुलाधूयो।”

मुंलालमे अचे आद पञ्च उ वरेमे नानछ पगभर थाए यो. निंदा ला तेजपारके मुंलाल
डोडायी. गोय ला वेपारमे लायु भमाया, तेजपार भीमारीमे युक्तरी व्या, तेजपारन संगिर भाल-पुत्र
गोक्कुवास काका नानछान संरक्षण-वालीपछु निर्वै शिखाय भ्रात डरीने वध थया. नानछ शेषछ
आँधु संतति न वध. उनीला अवसान पुचा डुकेण्ठ लायुंछ मिवक्तन रेह गोक्कुवास तेजपार स्वतंत्र
मालिक व्याया.

के. गंगामन्त्र, अंगर-३७०११०

“पहडायेली माछलीनुं गीत”

शुं करशो भाषीमार अभोनो ?

हवे अमारी ओळ आँधु आ भेषद लुको, आजु सुझी रेत,
तमारी वडवा दीधी लूखना भोरिग लरभ्या ऊव समेत,

थया छा उक्कर पारावार,

हवे शुं करशो भाषीमार ?

सपना नेवी अडण तमारी लग-क्षीलाये थास ज्योछक नाव अमारी भषदरिये भोडानी दूरी,
अमे अधूरे छन गेया-शुं आकाविकण, सुने सुने वडवानवनी जाण लगाणण अधेव्य दूरी,
हौटां झाङण सपना परयोदानी पेहे, हाथ तमार अमे नथी, छ वाधायेला टहुकानो चित्कार,

ठडी, शुं करशो भाषीमार ?

लहोरे लहोरे रक्षजातु आ गोत हवे ला-अंधाकृष्ण पगडता भोजन-द्वालके छ लुधवाट समाणू,
क्षीलें गीतेनी भरती गई ओसरी साव अवायक, खयुं सोले सोल फाये छवन जुवा टाणू,

हवे अमादुं छावुं सुझा दरियाकहि, पगडे पगडे हुए चही डाइ भाली छीप तजु अवतार !

ठडी, शुं करशो भाषीमार ?

अमे तो उक्कर पारावार,

कासम ज्ञभी

६. अ.स-डीमर्स डोलेन, जैथिंगा-३८३२५४

સરખેજના શ્રી શિવરામ શુક્રલી

[ગુજરાતના એક પ્રકાણ પદ્ધિત]

ગ્રા. રસિકલાલ ચિ. ત્રિપાઠી

સામબેદના પ્રભર પંજિ શિવરામ શુક્રલી કચાંના હતા, કઈ ગતિના હતા, કચારે થઈ ગયા, જે મદ્દોનો ઉત્તર 'કૃત્યાચંતામણુ' નામક અમના જ રેખેલા ગોલિલ ગૃહસ્થના ભાગ્યમાના એ શ્રોકામાં અણ્ણાયા મનોષુ શક્ત ૧૫૬૨ (સ. ૧૯૬૭) ના આવણુ વિદ્ધ જન્માણ્ટરી અને શુક્રલી રિશ્વામ શુક્રલીના પુત્ર શિવરામે 'કૃત્યાચંતામણુ' મધ્યની રચના કરી, એ છે.

આ ઉપરથી સમજનું છે કે આણ્ણા લગભગ નખુસે વર્ષી પૂર્વે વિકાણ ૧૬૬૭માં શ્રી શિવરામ શુક્રલી હૃત હતા, એ સમય અફરનો ગૌત્ર શાહજહાન હિસ્તિની ગાડી ડિપર વિરાજમાન હતે ત્યારે શિવરામનો જન્મ વિત્ત રિશ્વામત ત્યાં થયા, પરંતુ અમના હેડેટર્ન્ઝ કચારે થયો એ કઢી શક્યા એવું નથી.

પરંતુ નમદાટે શુક્રલીએ વસ્તા સામબેદના અક્ષયારી, શ્રીમાળી ગતિના શ્રી ગૌરીશંકર ઓાંઝે શિવરામ પંજી જે માહિતી આપ્યા છે તેનો સાર આ પ્રમાણું છે: ગુજરાતમાં અમનાવાદ રિશ્વામાન સરાયન ગમાનાં રહેતા માણ ચાતુર્બેદી ભાલણું શ્રી રિશ્વામ શુક્રલીને ત્યાં શિવરામનો જન્મ થયેલો. કહે છે કે આણ્ણાચસ્થામાં એ મૂહ શુદ્ધિના હતા ને તેથા લાંબું અણું શક્યા ન હતા, પરંતુ શિવરામને માતા આણ્ણાના ભારે અણું હતા; આ વાત અમેષુ અમના 'સુસેવિના' નામે અન્યના મંજલ શ્રોકામાં આણ્ણાના હરદીન વનદાન જીપરથી પણ પ્રમાણિત થાય છે; કેમકે "પિતા વિશ્વામ, ગણ્યપતિ અત જગન્માતા આણ્ણાને પ્રચૂમ કરી" કહે છે શિવરામની પર્ણી જન્માનું હતી, પરંતુ માતાજીના હૃપાણા જ અન્યાયા હૃર થયા હતા !

શ્રીમાળની સંકૃતા જરા નાચ એ એક હંતકદ્વારા પણ પ્રયોગિત છે :

શિવરામના અક્ષયારી પ્રબન્ધન થયેલી આંધ્રા એક વાર પ્રબન્ધ કિસ્સુના વેશે અમને વેર લિખ્યા માગયા ગવાં. જારણું અમના લિસ્કુન જોઈન શિવરામ પેતે લિંગા આપવા આરણે પહોંચ્યા. અમને જિત્તા આપવા રીતાર થયા નેણન લિસ્કુન કહું : "હું કષ્ટ લેવાની પ્રચળાથી આવ્યો નથી, હું તો તન કઈડ આપવા આવ્યા છુ." શિવરામ સનણ થયા ક અમના છાટદીન છાગવણે આવ્યી છે, તેથા અમણું કહું : "જીત્તા આપવા આવ્યા !" ત્યાર લિસ્કુન કહું : "તારુ મેં ઉઘાડ, મારે અમા થુક્કું છુ !" "હું તમના ડાંડ પ્રલાણું કરું જ્ઞા અલારે તા આપ પ્રવનદ્ય ખારણું કરું છે તેથા આપ કષ્ટું છે તમ કરું તા એ સનારાર-નરદૂધ થાય, મારે કાઠ બાળ આવા કરા ?!" જગદ્દ્વારા કહું : "એમ હેઠળ તા તરા હથળા પહુણા કર, હું ત્યા હૂંગાં, તથા એ હાથ તું જે લખાણ ત વાન્દાન્દેનેકરો કરી રહશે !" અમન કરીન માગાળ અતવાન થયા !

આ અતાન પણી શિવરામ 'કૃત્યાચંતામણુ' વગેરે અનેક અન્યે રચયા, પણ ત્યારથાને પોતાના અન્યોનું પ્રમાણેનું જન્માના પાસ લાલ કરાવતા એ પોતાના અન્યે કાઈને વારાણુસી ગયા ને ત્યાના વિદ્ધાનો સમસ્ય અમણું પાતાના અન્ય રજૂ કર્યા, પણ અન્યાના પોત પ્રમાણું જિદ્દુતાથી ઈષ્ટાવણ થયેલા કાણાના પાડાણા કહું : "તારા જીત્તા અમારી સમસ્ય શા મારે રજૂ કરે છે કે લ, અમને કર્ણિન સ્વાધીન કર એ અમા હાણ્ણા પણી પણું જે અણી નહિ તો જ અમ એ અન્યેન પ્રમાણું માનીશું !" એમ કહેન્નાય છે કે એ પણી શિવરામે ગંગાતીરે આણુકર્ણિકાના બાટ ડિપર શિતા [અનુસંધાન પા. ૧૬ નામે]

ગિજુભાઈ બદેકા

[ભાગકેળવણીના પ્રષેતા]

શ્રી દીપક જગતાપ, "આહુર"

ભરતમાં આગકેળવણીના ઘણાથત ખૂર્મમાં ડાવિવર રહીન્દનાથ યજોરે પ્રકૃતિના શિક્ષણું દરાં આરંભી, તો પછિમ લેટે ગુજરાતમાં ભાગકેળવણીના સ્તરાંત્ર વ્યક્તિત્વ અપદાનાર, આગકેળવણીના પ્રષેતા અને 'આગકેળના ગ્રંથી' તરીકે પકડેલા આપણા ખ્યાસા ગિજુભાઈ બદેકાની જન્મભોગતાએ હમણાં જ જીજવાઈ ગઈ.

૧૫ મી નવેમ્બર, ૧૯૮૫ ના રોજ મૌરાધ્રના વણા જામે ઔરીચિય આલાણું કુદુર્મા જન્મેલા ગિરજાનાંડે ભગવાનજી પ્રથેકાંને ગુજરાતમાં મોન્ટેસરી-પદતિની ભાગકેળવણીના પીજ રેખાં, ભાવનગરની શાખાનાં ક્રોનેન્ઝાં એમણે શિક્ષણ લાલ્ચું ૧૯૮૬ થી ૧૯૮૨ સુધી એવા આદ્ધિકાંના રહ્યાં ૧૯૮૩ માં પિરિસ્ટ્રોક્ટ કોર્ટ ખ્યાલરની પરીક્ષા પસાર કરી વહેણાણું એપ્રિલમાં વક્તીખાત રદ્દ કરી. ૧૯૮૦ માં એમણે ભાસમાંદ્રની સ્થાપના કરી. એ પણ ૧૯૮૩ માં 'આલ અધ્યાપન મંદિર' સ્થાપ્યું. ૧૯૮૫ માં 'શિક્ષણુર્પન્ના' માનસિક શરીર કર્યું. ગિજુભાઈએ ભાગકેળિય ઉપર અસંચય પુસ્તકો લખ્યાં, જે પૈકી અનુરૂપાન્યાન્યાનાં ૫ પુસ્તક, શિક્ષણુર્પન્નનાં ૪૦ પુસ્તક, ભાગકેળિયના ૧૪૦, એમ ૧૭૫ પુરતક લખ્યાં હતો. ભાગકેળિયના આપણાં વિદ્યાળ વાચન અને લેખનકાર્ય કરનારા આપણા ગિજુભાઈ એકમાત્ર ભાગકેળિયકાર બણ્યાય છે. ઈ.સ. ૧૯૮૮ માં ભાગકેળિયના સેવા માટે રણજિત-રામ સુવર્ણચંદ્ર એનાસત થયો. એમને ભાન સાહિય એટલે "ભાષા, રત્ન અને રીતી મગને સાહિય કર્યું" નોંધા. હદ્વાને ડોલાને, ખુદીને તેજ કરે, જિયાસાને પોરે, આત્માને ઉદ્ધાર અનાને તેવું છતો હસ્તું રમતું એવું હસ્તયાના જીડાણુંથી જાણુંથીને જીવનરૂપ શીખવા માટે અહાર આરી ગણ્યું સર્જન એટલે સાહિય."

ગિજુભાઈને 'શીધભ્રોગ નાટથપ્રવૃત્તિ' ખૂબ અમલી. એમાં દ્વીપ તરવાતી, નિયાં ઇસકો, સંસાઈ સાંકણિયા, વરેરે ભાવવાર્તાઓના સંવાદ નાટકો-દ્રેપે ભજવાવતા, વણા ભાગકેળાને કુદરતી વાતાવરણુંના પ્રકૃતિ દરાં શિક્ષણ મળે એ માટે નદીકિનારે કે હરભરાની પ્રેરણમાં લઈ જવાતા, એવી ભાગકેળાને જોગે મુક્તા નિલાર કરી શકે, એમનું માનતું હતું કે 'આવા પ્રવાસ ભાગકેળના માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ થાય છે.' વણા ગિજુભાઈ વાલી-કાંપફર અંગે અહુ સંગ્રહ હતો. એઓએ માનતું હતું કે ભાગકેળના સંપૂર્ણ વિકાસ માટે ભાગકેળાને વાલીએ વરંગેનો જીવત સંપર્ક જરૂરી છે. એવો વાલીને મળાવા એમને વેર જતા, જેથી આજાક ડેવા વાતાવરણુંના રહે છે એની આદિતી મળે અને એ ઉપરથી ભાગકેળને માટે યોગ્ય ફરવાતું એવા વિનારી શક્તા. ગિજુભાઈએ ભાગકેળિયમાં ભાગનાટકોને સ્થાન આપાને નાટયક્ષેત્ર કાંતિ સર્જી હતી. એમનો આગ્રહ હતો. કે ભાગકેળાને સમજી એમની વધારેફાને 'ખાનમાં રાખાને સહજ સ્વાભાવિક હૃદયાન-સહિત અને જોગ્યપૂર્ણ નાટકો લખવાના જોક્યો, એમના નાટકોના રેંગમાં ન હોય તો આખતું. પણ આએક લાઈટ વેશભૂતા મેક્યુપ વરેરેની જરૂર નહિ. એ સાથેને ઉપલબ્ધ હોય તેનાથી કામ ચલાવાને હતમ રીતે નાટકો કલજવાના વાતાવતા એ એમનાં નાટકોની સંઝાતાતું પ્રમાણ હતું. આલનાટો દરાર ગિજુભાઈ ભાગકેળની જિવાસાને અને કદ્યપનાને પોણું આપના માગતા હતા, એ ઉપરાંત ભાગકેળાં રહેલો સંકેચ ફર કરવો, વાફદરુતા લાવવી, શખદાંડોળ વધારી ભાષા-વિકાસ વધારવો, અતુકરણ અને અભિનયશક્તિને પ્રીવાચી, એ દરાર ભાગકેળની શિક્ષણ અને કાંસ્કારી અનાવવાના અનેસાર હતા. ગિજુભાઈ કહેતા : "તમે જાણ્યો છો, નાટકો દરાર કું ભાગકેળે શું"

આપવા માગું છે? નાનકડી દુનિયાનાં નાનકડી ને અનલાઇન એવાં આળડોને મોટી દુનિયાનો અન્નો અતાવરો છે. એમને આંખો છે જ્ઞાન અનુભૂતિ વેતાતું મેળવી શકતો નથી, એમને કાન છે જ્ઞાન અનુભૂતિ અનુભૂતિ નથી, એમને જીબ છે જ્ઞાન અનુભૂતિ વેતાતું આવતું નથી, એમને સમજ છે જ્ઞાન સામ્યો સમજણું મેળવી શકતો નથી એ બધા માટે એમને આપણે તક પૂરી પાતા નથી તેવાં આ આળડોને નાટક દ્વારા સાચા દર્શક, સાચા વક્તા ત્રૈણા અહાદુર અને અળવાન અનાવાનો છે.”

આળડોના જગવાન ગણ્યાતા આવા ગિન્યુલાઈ જ્યારે આજો આપણી વર્ચ્યે નથી ત્યારે આળ-જગત ગિન્યુલાઈ વિનાતું સનું સનું લાગે છે. બરેખર સમય પ્રથમાં જે આમૃત પરિવર્તન લાવતું હશે તો જે-પ્રથમ આળડેવણી પ્રેરણો દિનિકાલ અદ્વિતો પદ્ધતે અને સાચા અર્થમાં આળડો આંખે એમના વિશ્વને સમજવાનો પ્રયત્ન કરશે તો જે એમની જન-મન્દિરાંથી જીજેવી સાર્થક ગણ્યાશે. અરું કે, ૩, સારેસ્વત સેસાયની, પ્રેક્સિસર ડોલેની, રાજ્યીપણા-૩૮૩૧૪૫

[અતુસંધાન પા. ૧૮ થી]

પ્રગટીને પોતાના અન્ય અભિનમાં પદ્ધરાયા! ચિત્તાનાં અધિં લાકડાં અણીને ખાખ થઈ ગવી છતો શિવરામનું એક પણ પુરુષ અલ્યું નહિ! અભિન શાન્ત થયા પણ શિવરામે એ અધા અન્ય ગંગામાં પદ્ધરાયા, એ આપી રાત જાણમાં રહ્યા છતો સવારે લાદાર કાદાચ ત્યારે કુલાપવનના જેમ એ જીંનયા નહિ! કાશીના વિદ્ધાનોએ એ પછી શિવરામે અભિનન્દન આર્થિયા અને એમના અન્ધેતું પ્રમાણ સ્વીકાર્યું!

આ દંતકથાને આજુએ રાખીએ તોપણ શિવરામ શુક્લતું પાદ્ધિય તેં સ્વીકારાયેલું જ છે. એમજે રોલા ૨૭ અન્ધેનાં નામ નાચે પ્રમાણ છે:

૧. કૃત્યનિંતામણિ (ગોલિલ ગૃહસ્કુલો ઉપરાં ભાગ), ૨. સૂષેધિની (ગોલિલ ગૃહસ્કુલાનું સારી કંઈકાણી પ્રોયોગ-પદ્ધતિ), ૩. શાન્તિનિંતામણિ (પ્રોયોગ), ૪. શાન્તિ ચિન્તામણિ (મુલ માત્ર), ૫. આદ્યનિંતામણિ (સર્વ આદ્યવિષયક નિષ્ઠાયિ), ૬. શ્રદ્ધાપદ્ધતિ (અધિં આઢોના પ્રોયોગ), ૭. દુદ્ધનિંતામણિ (લઘુરૂપ અંગેનો નિષ્ઠાયિ), ૮. દુર્દ્વારાપદ્ધતિ (લઘુરૂપનો પ્રોયોગ), ૯. મન્ત્રનિંતામણિ (તાંત્રિક કર્મનિંદ્રાયિ), ૧૦. મન્ત્રનિંતામણિપદ્ધતિ, (આહુનિક પ્રજન હોમ શતગ્રદી યન્ત્રપ્રણિષ્ઠા વગેરે), ૧૧. વાચનિંતામણિ (અલગ્યા), ૧૨. વતનિંતામણિપદ્ધતિ (અલગ્યા), ૧૩. આર્થિક કર્માદ્યાદિ, ૧૪. મનવધારાનાંતર્ગતમનવધારાં કર્માદ્યાદિ, ૧૫. છાન્દોગ્યોપનિષદ્ધ-વિત્તિ. ૧૬. કંદીપિતૃતિ, ૧૭. આદ્યકલ્યાણિ ૧૮. ચતુર્ણા ગાનાનાં “કવિછન્દનોદેવયાતા; ૧૯. પુષ્પદુર્વિતૃતિ (પાટશ્યમાં છે એવું સંભાળાય છે), ૨૦. આદ્યપ્રથાપ, ૨૧. અદ્યપંક્તીકરણ, ૨૨. વાસ્તુશાનિત, ૨૩. હન્તાચય-સમુદ્રય, ૨૪. નિરજિનાદીનેન્દ્ર, ૨૫. રમાતંદીનાહિ પ્રોયોગ, ૨૬. આરૌચનિષ્ઠાયિ, ૨૭. ગૃહકારિકા (ગોલિલ ગૃહસ્કુલની પદ્ધતિની). ઉપર્યુક્ત અન્યસમૃદ્ધમાંથી ‘સૂષેધિની’ સામનેદીઓના થયા જ સંસ્કૃતોને લગતો અમૃત્ય વિષનન્ય છે. [આ અન્ય ઈ.સ. ૧૯૪૩ માં માત્ર ર. ૩ ની કિંમતે પ્રાપ હતો, આંખે એની હિંમત ર. ૫૦ છે.] એ સ્પૂર્ણાનં સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શાસ્ત્રી-આચાર્યના શાભેદવિષયક પાઠયપુસ્તક તરીક નિયત થયેલે છે.

નોંધ : આ કેઅની બધીભરી વિષયો ‘સૂષેધિનીપદ્ધતિ’ સ. ૫ દુર્ગાંત ત્રિપાઠીના પ્રાસ્તાવિક કેઅને આધારે લખેલી છે. આ પુરુષકાના પ્રકાશક યૌખર્યા સંસ્કૃત સીરીઝ, વારાણસી છે. શુદ્ધારાના આ વિદ્ધાન માટે ‘આલાંદોપત્તિમાર્દ’માં નાચેનો ઉત્તેખ છે:
યદ્વારાતિસમૃહસ્થો પ્રામે વી સરખેજકે। શિવરામો મહાનાસીતસામયેદે કૃતશ્રમઃ ॥
૬. બો. ને. વિદ્ધાભરન, આશ્રમ રોડ, નાટરાન સામે, અમદાવાદ-૩૮૦૦૦૮

પથીક-દીપોદ્ધસ્વાંક]

૧૬૮૬/ઓક્ટોબર-નવે.

[૧૬

કાંતિવીર સ્વામીરાવ ઉદ્ઘોષથીસિંહ આજાદ

ડૉ. મહેશચંદ્ર પટેલ

લગભગ ૨૦૦ વર્ષે સુધી માં ભારતી અંગેનેની ગુલામીની જાળીમાં જફરાબેલી રહી. આ જાળીને તેઠાં ઈ. સ. ૧૮૫૭ થી શરીરને ઈ. સ. ૧૯૪૭ સુધી જેના અનેક સપૂતો માથે કરેલ ખાદીને મેદાને પડ્યા હતા. ૧૮૫૭ માં ઝાંસીની રાણી લખનીબાઈ, તાત્યા ટોષે, નાના સહેલ વોરેથી મંડીને ૨૦ મી કલીમાં વીર લગતસિંહ, પ્રકુલ્લયંડ ચાકી, ચંદ્રોખર, સુખેન્દ્ર, રાજગુરુ, વીર સાવરકર, વીર છખમસિંહ જેવા અને નામી-અનામી સપૂતોને આ જેમને આજાદ કરવા પોતાના જીના જીના લેણી રેખાં હતા. જેવા શરૂવાતીની યાદીમાં તાજેતરમાં વીરગતિ પામાનાર કાંતિવીર સ્વામીરાવ ઉદ્ઘોષથીસિંહ આજાદનું નામ તેજસ્વી અક્ષરાથી કાતરાયેલું રહેશે. એમણે દેખને આજાદ કરવા માટે અનેક માતનોઓ અને કષ્ટો, જોખમો અને વેદનાઓ સહન કર્યું હતા. અચંડ શક્તિ અને લોખંડી માનસ ધરાવનાર એ કાંતિવીર એગનાં પરાક્રમે દારા અંગેજ સરકારને હયભયાવી નાખી હતી. એ મહાપુરુષનાં જીવન, અને કાયેને યાદ કરીને એમને હૃદયપૂર્વકની શરૂઆંગલિ અર્પણનો આ નામ પ્રયાસ છે,

લગભગ ૩૦૦ વર્ષે પૂર્વે પૃથ્વીસિંહ આજાદના પૂર્વને હૃદાળને કારણે રાજ્યપુત્રનાને છોડીને પંનલભમાં જઈ વસ્યા હતા. ઈ. સ. ૧૮૮૮ માં પંનલભમાં ભારે દુધકાળ પદ્યો હતો તેથી એમના પિતા માત્ર છ વર્ષના પૃથ્વીને બદને અલાહેશ ગયા, આમ બાળક પૃથ્વીનું બાળપણું રખપદ્ધીમાં વિત્યું. નાનપણમાં એહો આંબણી-પીપળા, તીરકામઠાંની રમત વગેરે રમતા અને ડેર ચારાવતા. ઈ. સ. ૧૯૦૫ ની ખગભાગની લાહો દેશમાં રાષ્ટ્ર્ય જાળું લાયતા મહત્વતું કામ કર્યું હતું. એવે વખતે પૃથ્વીસિંહ પંનલભના કાંતિકારીઓના પરાક્રમેથી આડવ્યા, એમનામાં દેશપ્રેમ માટેની લાગણી જન્મી. એ અરસામાં પંનલભક્ષેરી લાલા લખપતરયને અંગેજ સરકારે સણ કરી હતી એ જણ્ણુંને ૧૪ વર્ષના કિશોર પૃથ્વીસિંહના હૃદયમાં આગ લાગી; એ આગ આજાદીની પ્રાપ્તિ સુધી જલતી જ રહી. એમણે કિશોરપદ્ધતામાં જ વિદેશી ધૂસરસીમાંથી ભારતરધને મુક્ત કરવાના ચાપ લીધા અને એને જ જીવનકાર્ય અનાંતું. એમને લાગ્યું કે ભારતરધનું રહીને એ કાર્ય સરળનાથી થઈ શકશે નહિ. એ વખતે એમેરિકાના ભારતવર્ણના કાંતિકારીઓ “ગદર પાર્ટી” રથાપીને એ દારા હિંદેને આજાદ કરવા મથતા દરા. એ વાત પૃથ્વીસિંહે જાણી. એમને “ગદર પાર્ટી”માં જોડાવાની તીવ્ર ઘર્યા થઈ તેથી એહો અનેક સંક્રાંતા વેઠા વેઠા નનિબા યાદુને અમેરિકા પહોંચયા અને “ગદર પાર્ટી”માં જોડાઈ ગયા. આ ગદરપારીના લુલાને હિંદેને આજાદ કરવા ડેર પણ સાથન વાપરવા તૈયાર હતા. એહો હિંદ્સા કાંતિકારીઓને શશ્યો પહોંચાવાનું કામ કરતાં પણ અયકતા ન હતા. ગદરપારીના મરણથી અનેલા કેટલાક જુદાનો, પીસામાં રિસોલ્વર્નો અને કારતૂસોની રહીને, કાંતિનાં ગીત લખકારતા લખકારતા રસીમર આરદતે દિવંભૂમા આવવા રવાના થયા, પરંતુ એહો કલકત્તા ખંડરે પોદીસના હાથમાં જગ્યાઈ ગયા. આમાં પૃથ્વીસિંહ પણ હતા. એમણે સિહેતપૂર્વે પોલીસને થાપ આપી અને ત્યાથી જટ્ટી થયા. એ પણી લાહોર થઈને અભાલા પહોંચયા. એ વખતે એમની જાંમર ૨૨ વર્ષની હતી. ૭ જિસેન્બર, ૧૯૧૪ ના રોજ એહો પોતાના જિનને મળતા અંબાલાના રાજ્યભૂત છાત્રાદ્યમાં પહોંચયા. અંબાલાની પોકીનું એ અંતાથ્ય પર ચાંપાતી નાન્દ રાખતી હતી તેથી એ અંતાથ્યમાં પૃથ્વીસિંહને લેઇને અંગેની ગળતિયા લહનસિંહે પૃથ્વીસિંહની આતમી પોલીસને આપી તેથી તરત જ પોલીસ ધન્યપેક્ટર અમરસિંહ આદા વેશમાં આંતાથ્યમાં પહોંચી ગયો. અભમસ્ત શીખ

જીવાન અમરસિંહે પૃથ્વીસિંહને જોગાયી લીધી. એ છન્નપેટર બધી જ તૈયારી સાથે આવ્યો હતો. એથે તરત જ પૃથ્વીસિંહ સામે રિવોલ્વર ખરી, અન્ને વચ્ચે નરા પણ અંતર ન હતું. અમરસિંહ રિવોલ્વરને ચોડી દ્વારે એ પૂર્વે, ડિલ્ભોભાં જે તેમ, અત્યંત અપળતાની જાપદ મારીને પૃથ્વીસિંહ રિવોલ્વર આંચકી લીધી. એ પછી અન્ને વચ્ચે દંડદુષ્ટ થણ્ઠ થયું. પૃથ્વીસિંહ ગોદાસ છન્નપેટર પર સાવાર થઈ ગયા. હવે આજી પૃથ્વીસિંહના કાથમાં હતી, પરંતુ કંતિકારીને આદેશ હતો કે “કાઈ પણ હિંદાનો જાન ન લેવા” તેથા પૃથ્વીસિંહે રિવોલ્વર દેખી લીધી. એ તકનો કાલ વધુને અમરસિંહ ચ્યાપા સાથે પૃથ્વીસિંહ પર તૂરી પડ્યો. પૃથ્વીસિંહની ગરફન પર થા કર્યા, નીચે થા ચૂક્યાને પૃથ્વીસિંહે એની પાસેથી ચ્યાપુ પણ આંચકી લીધું અને રઘવાલેલા સિંહની જેમ અમરસિંહ પર ધર્સી જરૂર જેને પકડ્યાનો તથા દીવાલ સાથે પછાડ્યો. છેવટે અમરસિંહ પાણી ગ્રાદો કે પૃથ્વીસિંહને કંપને લેવા એ લોદાના ચાણું ચાવવા જેવું છે. એ અન્ને ખૂબ જ ધારાયા હતા. લોહીના ખાયોચિયાં ભરાયા હતા, તેથી એ અન્ને રૂપી પઢાડ. ત્યારાં એ અન્ને હોસ્પિટલમાં દીખલ કરવામાં આવ્યા. હોસ્પિટલને સર્ફ ન અંગેઝ હતો. એથે પદાજ્યા વગરના ચામણને સાધનાર મોગીની જેમ પૃથ્વીસિંહની ગરફન પર ટોકા લીધા હતા.

કારાવાસની યાતનાયો :

આ યતનને લીધે પૃથ્વીસિંહને ૧૦ વર્ષની આરે ડેની રૂળ થઈ. એમને ડેન્મા ડેની માટેની જૂનાં કંપણ આપવામાં આવ્યા. એમણે જેવાં એ કંપણ અંગેર્દી કે જેમાંથી અસરખ્ય “જૂ”નો દ્રગ્લે થયો. એમણે એવા ગંધા, ગંધાતાં કંપણ પહેરવાની માનસિક તૈયારી કરી લીધી. એ કંપણમાંથી માત્ર એક લંગાર લીધી, એને મૂળગામી બરાબર મસલ્યો અને એ પદેરી લાંદી. એ પછી અપોરે ૧૨ વાગ્યે એમની સમજ ૪૦ રતલ મફાઈ ભરેનો રૂપો મૂળવામાં આગ્યો અને હુકમ કર્યો કે સંલે પાંચ વાગ્યે તપાસ કરવામાં આવશે ત્યારે ૪૦ રતલ મફાઈનો લોટ થયે જેઠે અથવા કોરડા ખાવા તૌકાર રહેવું પડ્યો. એમણે જેવમાં ડેન્મો પાસે દ્વારાવામાં આવે છે એ વાત સંબંધી હતી તેથી જેવના અણિયા સાથે હાથ ધરી ધર્સને ચક્કી પોસવા તૈવાર રાખ્યા હતા. એવા તરત જ લંગેરિને દ્રગ્લે એથી ગયા અને પાંચ વાગ્યાનું પહેલાં બંધી જ મફાઈ રૂપી લોટનો રૂપો લરી લીધી. એને ધ્યાળ્યો ઓછી સર્ફ ગયા. તે નાચે જેલ-અધિકારી આવ્યા. જોંગતા પૃથ્વીસિંહને લેછને એવો તાફુચા : “આ સમય દણવાનો છે, જોંગતાનો નથી... અથવા રોડકા પડકો.” પૃથ્વીસિંહ ખુલારીથી જીલા થયા અને ૪૦ રતલ લોટ ભરેનો રૂપો હાજર કર્યો! અવિકારી અંખવાળો પડી ગયો, પરંતુ એને થયું આમાં નીચેના ભાગે મફાઈ રાખ્યો આ અન્નારો જીપર લોટ ભરી દીધો એ તેથી રૂપાના તળિયા સુધી હાથ નાખીને એથે ભાતરી કરી. આપો રૂપો સોટથી ભરેલો જણાનો તેથી જેલ-અધિકારીએ પૃથ્વીસિંહનું રાખન રાખનાર ડેની વેદરને ધમકાયો અને પૂર્ણાં; “સાચું જોલ, આ મફાઈ કોણે દળી છે?” પૃથ્વીસિંહે વચ્ચે પડીને અભિકારીને જણાની દીકું : “ભાતરી કરવી હોય તો કાણે આવીને આરી સામે ગેસને એટદે અખર પડી જશે ચક્કી કોણ પીસે છે.” આવા શરૂવીર અને હિંમતભાંબ હતા પૃથ્વીસિંહ આગામાં!

કાળાપાણીની કાળી કુઠની :

અંદામાન રાપુની જેવને ‘કાળાપાણીની જેલ’ કહેતા. અંદાલાની જેવમાંથી પૃથ્વીસિંહને વધુ કંપ સણ આપવા માટે કાળાપાણીની જેવમાં મોકલ્યા. આ જેવમાં ખૂબાર તોઢાના ડેન્મોને રાખવામાં આવતા. આ જેવમાં ડેન્મોને નભ કરીને ભોડાના પાણીમાં પડાળી રાખેલા કોરડા હૃદાસ્તવાની સણ કરવામાં આવતી. એ માટે મલભૂત જીવાદ રૈકવામાં આવ્યો હતો.

जल्दाहनो एक ज डेरडो केंद्रीनी चामडी उतरवी नाखतो। केंद्रीओं द्वारनी जेम अशाढ़ा पातला पाउता भेण्या अनी लय त्यासुधी डोरडा इटकारवानी सज्ज थती। इटकाक डेंद्रीओं आ जनथी छृत्यु पथ पामना तेथी इटका आईने भरवा करतां भूम्भ-हृताल पर जर्हने भरवानुं आथी केंद्री सेठनसिंह साथे पृथ्वीसिंहे पश नक्की क्षुरुं अने भूम्भ-हृताल शब्द करी, अभेन्हे अनन अने जण अनेनो त्याग करो। जे व्याकुण दिव्यतिमां सात दिव्यसे पसार थया। सातभी रात्रे अभेने लाग्युं के पाण्यो वगर हवे शक्ती शक्ती नहि! अभेना पश पथारी छेडी आण्यीना वासष्य तरडे अखवा लाग्या, पाण्यो गटखट्यावी ज्वानी तीव्र ईच्छा थई, परंतु अभेना अंतरात्माके अभेने अभ करतां रेक्त्या, जेओं पाण्या वल्या अने पथारी पर पछाड्या, परंतु पाण्यो वगरनी पथारी अभेने चिता अमान लागी। दूरीथी ऊठिचा, पाण्यीना वासष्य पासे गया अने पाण्या वल्या, त्रिजु वार पाण्यी पीवानी अदृय छक्काथी पाण्यीना वासष्य पासे गया, पाण्यीनुं वासष्य हाथमां पश लीडुं, परंतु अभेने होडे अगाड्या लय के तरत ज अंतरात्माके लगवे। जेओं जेन्थी अराधी ऊठिचा अने अहार पहेरा भरता चेतीहार पर जे वासष्य ईंक्षुरुं ने जर्हीन पर टीणा पडवा। आम अननी विवशता समझ आत्मपणों विवर्य थयो, जे पक्षी पश जे अंडग राजधोऽग्नी राजहृष्ट यालु ज रवी, धारे धीमे भूम्भ तरस झेठे वरी गया, १३ दिव्यसे पूरा थया, अभेने अंतकाण नक्कु भासवा लाग्या, अवार्मा ज हाडतर आवी पहेव्या, अभेन्हे आठ डेंद्रीओं भद्र लर्हने नाक वाटे रज्यरनी नणी भारद्वे अधी शेर हृष्ट अभेना चेटां रेइच्युं, हडीला पृथ्वीसिंहे भावार्मा लाय नाणी जिल्ही करवा अपत्तन क्षेत्री, परंतु चेटां आगर्मां हृष्ट शोपाई गम्युं हुं, जे पक्षी तो आ नित्यकेम अनी गयो, त्रीजे दिव्यसे पृथ्वीसिंहे ऊठी करवामां सहज थया, आम लय भास याल्युं। जे पक्षी अनन जण साथे वरत्रो पश त्युं दीधां अने क्षडकती ठंडीमां नज्ज देहे युल्ली लादी पर पक्षी नहेत्युं पश्यं झुरुं, अभेना भिज्वा अभेना छुवन अंजे चितिल हता, अभेना परम भिन्न पहित जगतरामे चेताना दोषीथी पश लधोने अभेने भूम्भ-हृताल छेडी देवा विनती करी, पृथ्वीसिंहे जेक्का जे न ज थया, पृथ्वीसिंहे दोस्तिक्षमां जर्हने समलाववा आटे पहित जगतरामे क्षय आधा, छेवट अने भिज्वा दोस्तिक्षमां भग्नी शक्ता, अभेना हरभ्यात्मकीर्तीथी पथ्य पृथ्वीसिंहे उपवास न ज छोएवा, छेवट अनेक गिरेनी लाग्याथी वक्ष थर्हने पृथ्वीसिंहे १२५ दिव्यसना उपवास छेडवा पडवा।

दोउती गाडीमार्ंथी हुतुभान-झुक्को :

ई.स. १६८१ ना जुवाईमां आंदोमानना केंद्रीने भद्रसनी जेवमां लर्ह ज्वार्मा आव्या, त्यांथी पशु असेहा आटे पृथ्वीसिंहे नें क्षडकतानी गाडीमां ऐसाडामां आव्या, गाडीमां भरी अँड्हे लय योलीसो अभेनी चेती करता हता, योलीसोमे दायकडी छेडीने अभेने परवानगी आपी, संदासमार्थी पाण्या इरतां अभेने नेवुं के योलीसो ज बता हता, क्षेत्रो पथ विलंभ क्षया सिवाय पृथ्वीसिंह ३० आईक्की झेपे हेउती गाडीमाथा हृष्टी पडवा, अभेना जोड्यु छेक्काई गया, थोडे हूर जर्हने गाडी योभी, योलीसे जेणामार करो, परंतु पृथ्वीसिंहे तो आपे आग लाय धरीने, द्वारनी आचापूर वाड हूदीने अठ गरीब भद्रसनी दूर्पतीमां संतोष गया अने गाडी निराश अनी धीमी गतिअे आगण वर्षना लागी।

पृथ्वीसिंह भद्रसनी के भक्तसी पृथ्वीसिंहनी लाया समज शक्ता न ढंता तेथी याकाक पृथ्वीसिंहे “ईन-क्षडाल जिंहायाद” उच्यारने भातरी करी आपी के चेते आजादीनी क्षडतना कांतिवीर छे, गरीब भद्रसनी पासे अभेनी भूम्भने संतोषवा पूर्वुं अनाज पशु न हुं, पृथ्वीसिंहे भद्रसनीकी कुहाडी वडे

શૈવીજ્ઞાનાં પંદ્રન તોઠયાં એ પછી ૧૬ વર્ષનાં વહાણું વાયાં જેમ છતાં જાંચેલ સરકાર એમને પછી શકી ન હતી.

ઈ.સ. ૧૯૨૨ થી ૧૯૩૦ સુધી ભાવનગરમાં એમણે ભાયામની પ્રદૂતિઓ ચલાવી વિર અગતચિંહન સુખદેવ અને રાજયુદુને કુસી જાળી ત્યારે પૃથ્વીસિંહ એનો વિરોધ કરવા મુંખાંતા કોમન્ગ્રન રેઝ ગેલીસ સ્ટેશન પર હુમ્લો ક્રોડી હતો. એ વખ્તે સરકારે એમને પદવા માટે રૂ. ૧૦૦૦,૦૦૦ ઈનામ જાહેર કરેલું, પરંતુ એમો પદવા ન હતા. એમણે તો સદાનંદ નામના સાચું અનીને આખું અંબાજી અને રાજરથનમાં આજાહી માટેની ધૂણી ધર્માવી હતી!

ઈ.સ. ૧૯૩૨ ના મે માસમાં કરીમખાન નામ ધારણું કરીને રથિયા જવા નીકળ્યા, મહામદઅલીના નામે ક્ષયૂલ રથા અને એ પછી પોલ રિચાર્ડ માર્કેના નામે રથિયામારાજ કારણું જાયાસ કોણે, નારાયણાસ નામધારણ કરી પોડીચેરા આંધ્રા. હવે એમની વાસવાદી ચણવગમાંથી અદ્ધ હી જઈ હતી તેથા ઈ.સ. ૧૯૩૮ માં ગાંધીજીની સમર્પોત્તા આત્મસમર્પણ કર્યું. એ પછી જ હેઠાં અને હુનિયાને એમના રેખાચિક પરાડુણેના લખું થઈ હતી.

સ્વામીરાન, દ્વારામ, સ્વામી સદાનંદ, કરીમખાન, મહામદઅલી, પોલ રિચાર્ડ માર્કે, નારાયણાસ અને ઈથીયીસાંસ ડાક્ટર વગેર અનેક નામો ધારણું કરીને તથા વારંવાર વેખપદ્ધતી કરીને જોખમી જિંગ્રી જરતી છુતાં પૃથ્વીસિંહ આજાહ દેસને આજાહ કરવા માટે પોતાનું સમગ્ર જીવ સમયું હુંદું. ભારતની આજાહની ભાગીદારી વિર પૃથ્વીસિંહ આજાહ જેવા અનેક નામી અનામા કાતિનીરેના જીવાલખાં ભીના જીન દોકીયા જીના જેણે છે. કાતિનીર પૃથ્વીસિંહ આજાહ વાસુતેને પાખ્યા છે ત્યારે દેશને આજાહ કરવા માટે એમણે હેઠળી વાતનાઓને વાદ કરીન, દેશની આજાહને આખાહીના ફેરવા માટે વાતનાઓએ સહન કરવાનો નિષ્ઠાર કરીને એમને સાચી શ્રદ્ધાજ્ઞિ અર્પિયું. અસ્તુ.

૬. કંતિલાસલબના, સૌ. યુલિવિસસ્ટી, રાજકોટ-૩૬૦૦૦૫

એક કિંમતી આત્મકથન

મારા મને હું જમે તેટલો દદ હોંક કે ઈથર સુધી પહોંચવાનો મેં અપનાવેલ રસ્તો સાચો છે એવું માનતો પણ હોંક, પણ સાથે સાથે એ પણ વાનમા રાખ્યું જોઈએ કે મારા અપનાવેલ પ્રાર્થિક આધ્યાત્મિક માર્ગને પણ સીમાઓ છે અને બાળું એ કે ભીલાઓએ અપનાવેલ માર્ગ બરોલ્યું નથી એવું જે હું માનતે હોંક તો એ જીલબર્લેનું છે. યાસેટટાની પારખાયામાં મારે કંઈએ હેઠું હોંક તો એમ કંઈવાય કે મારાચી એમ ન મનાય કે ભીલાઓએ અપનાવેલ માર્ગ ઈથર સુઝડેવા નિયો કશાય એવું પણ અને કે મારા કરતો એમના માર્ગ વધારે પૂર્ણ અને પ્રકાશિત હોઈ શકે છે. ઉપરાત મારા અને મારો પોતાની રસ્તા જુદા જુદા જીવાચી અમારા વચ્ચે અંતર છે એવું માનવું પણ એદું છે, કેમકે અતે તો એમ જુદા જુદા માર્ગની પણ ન ઈથર મણ્ય જવા મણ્યાની કશાય છી. આપણે અધ્યાત્મિક એક જ પરમાત્માને મેળવવાના ઉદ્દેશ્યાની જુદા જુદા અભિજામ અનુભાવી પેટ્ટાની જીંદગીને પરમતરના આદેશને અધીન થાયા રહ્યા છી. આપણે આમ એ તો માનવું જેડું એ કે આધ્યાત્મિક દાખિયો તો આપણે જરૂર જાઈ-બાઈ છીએ અને તેથા આપણે લાઈઝોની જેમ જ વર્તવું જોઈએ. સહિષ્ણુના પૂર્ણ તારે અને કે જ્યારે એ પ્રેમમાં પરિણિમે.

[અનુ. શી. હેઠાં બદ્દ]

દો. આનંદિલ ટોયન્ઝી

અધિક-હીપે (સ્વચ્છા)

૧૯૮૮/ઓફટો-નંબે,

[૨૩]

साधरकांठाना सत्याग्रही सेनानी

स्व. डॉ. नवीनचंद्र आचार्य

आपरकांठा ये युगरात राज्यनो पहलतनो निवडो छे. आ जिवदामां मोगसा ऐतिहासिक अने वेपारनी दण्डेचे भडतवतु स्थान धरावतु नगर छे. लाक्षां ये अन्या विवाहीय प्रवृत्ति आटे जाणीतु अन्यु छे. आ नगर अमदावाढी लगभग से. कि.मी. इथाने आवेलुं छे. आ नगरमां स्वातंत्र्यसेनानी भयुरदास गांधीनो जन्म असे होतो.

गांधी-कुटुंब मेडासामां अभगप्य गणातु. भयुरदासे अमना प्रायभिक डेणवाची साधरकांठाना डेमाई गाममां लीधी हती. अमेलु शदआतमां खलक तरीके काम क्युं भतु. खारे खारे अमेलु पोतानी कुशाग्रशुद्धिये रुपाच सीतानां भोजी परेरे राज्येभां ठारकारी तरीके पोतानी सेवा आणी मुंदर वर्कावट क्यां होता. त्याराघ अमेलु स्वातंत्र्यनी चणवणमां लोद्या हता.

शहरातमां अमेला राज्याची लाप्त्य करता. अमेलु धोरे धोरे स्वदेशानो प्रचार करवा भांड्यो. आ फरम्यान अमेला धोरे धोरे वेपारमां वेळाया अने प्रामाणिक वेपारी तरीके नामना काढी. आ पछी धोरे धोरे अमेला वेपारमांचा समाजसेवा तरइ वर्षा.

आ कार्यमां अमने मालासाना सुप्रसिद्ध डेणवाचीअर मालानवाल गांधीनो सारो सहकार भज्यो. धोरे धोरे अमेला लारतवर्षीनी आजाहीनी चणवणमां रस लेवा लाग्या. १९१७ नी सावर्मां होमरक्षनी चणवणी लारतवर्षीमां वेव पहलवो. मेडासाने शांगांधीज्ञ आ रंगमां रंग्या. अ. गांधीज्ञ राजेन्द्रवालां अने इपालानी सांगे रही अपारपूर्णा ऐझोने न्याय अपार्यो. आ पछी अमेला आजाहीनी चणवणमां सुकिय अन्या. भारडेलीनी चणवणमां अमेलु तद्वक्षलाएने मुंदर सहकार आप्यो. आ पछी अमेला आमाजिक करवा प्रेरया. आ मा टे अमेलु मेडासामां रहेणां पूर्व ८५०. मेडासानी भ्युनिसिप्प घूटकी झूत्या अने अमेला बहुमतीया यूटाया.

अमेला स्वदेशीनी चणवणमां काम करवा लाग्या. दृष्टव्यी, अरपूरपतालिवारण, संविनय लंग तथा १९४४ नी चणवणमां अमेला रव्या. अमेलो अनंत नार जेववाल सेव्या. अमनां कार्यमां अमेलो य हुलाल खुलाल, परसेतमहास, रमण्याल सेवा, पूनर्वय देशी, भेदरजना पूनर्मय दंडया वगेरेना सांकेत साथ सांपूर्ण.

अमेलु साठां पासेना साही गामे गांधीमोहरती रथापना करी रिटियामध्यति याहु करी. आणीतु वेचाप्य वगेरे कार्यमां गाम लोडानेस सुंदर साथ संपूर्ण. अरपूरपताला प्रश्न अमना कार्यमां क्षाडी ओट आवी, पछु अमेलु गामलेडाने काठ दाद आपा नही. अमा सर्व कार्यकरो खण्डाला काम करवा लाग्या. आहा अंदिरना कार्यमां भन्नालग्या. भोगीवाल गांवा अने हारिलाएने सरकारे पढीली लीपा छतां पृथु अमेलु आ शार्य पूर्ण धरण्याची याहु सांपूर्ण.

भयुरदास गांधींचे घोट वर्ष मुळा जुळा जुळा देशी राज्येभां नोकरी करी हती. आ देशी राज्येभां भोरी भेदासांशु दधाविया सीतावाल वगेरे मुख्य हतो. अहींता राज नोंदें पोतानी आवक पवारवा जुळा जुळा प्रधारना कर मग्न उपर नाप्यां हता. राज्यमां जुळा जुळा राते अटपटा चावती हती. प्रग्न आनायी त्रासी अष्ट हती. अमेलु काठ रण्यावधी न भतु. राज्यना आर्या कायाना वित्रैव करवा ग्रन्ती अक्षम निरवार करी.

दाश(भयुरदास) आ समेलु मेडासाना अटेवे विटिवा राज्यना वती गणाता. मेडासानी आचार्यांचे भोज आपासानो भोजा लाग्य ईंडर राज्यानो होतो. मेडासानी आजुव्याक्षु ईंडर सीतावाड मोरा रीटाई १९८६/योडी-नवे.

[परिक-दीपितसवांह]

महावर इथल वजेरे भद्रेना राजगोपे अभनी गैलनी मुख्यकरणी विशुद्ध वस्त्रा इवेदी नमुदा हता. प्रल अधम रीते छवी रही हती. राजगोपे राज्यनो अधो रेसे चेताना मोजगोप घट्टक घर्यता, २.५४८ना छिने अवगणता. राज्यना अधिकारीया अनेक रीते प्रलने कृत्तवा हता. धीरे धीरे डाहाना धार्थी प्रलभं लग्यति आवी. मुंबईमा प्रलभं उल्ली रथापला थर्द एमां वर्तमानपत्रोमि सारो आश अवध्यो. भयुरदास गांधी अना अवगण्य कार्बफर रक्षा. अनेक वर्षो वाह वस्त्रा संवर्ध पडी प्रलने विश्व थयो. राजगोपे प्रल आगण नमुद्द खल्यु. प्रलभं डेव चेतानी सर्व भागधृत्यो राजगोपे पासे कृषुल इरवी. अनो धर्मो मोटो पहिया वाक्षितोरमा पहियो. तेना राजगोपे वस्त्रा अमानुषी इवेदी प्रल पर नाप्या हता. अभेषे प्रलने मन हावे तेम लूट्टवा गोही हती. वाचसिनोरना नवाप्ते नाठको. शोध गवान्नो हतो. प्रल पासे अलग्यनीयी विहियो इवेदीहो. प्रल राजना आवा नास्थी कृष्टाणी थर्द हती. अजना अतिनिधियोने मन हावे तेम लूट्टो. प्रलमे भयुरदास गांधी पासे इरियाद करी. भयुरदासे राजगोपे हठमां दाव्यव न थ्युं तथा वाचसिनो. र ओही तत्काल चाल्या ज्युं वजेरे जननी धम्कोगो. राज तरस्थी भयुरदासने भणवा आवी. भयुरदासे आवी धम्कोगोने न गव्यां प्रलनी आवे रही राज समे संवर्ध आव्यो. आपरे प्रलने विश्व वज्यो. धीरे धीरे प्रल राजना त्रासमांथी सुक्त थया भावी.

अभेषे शीथ्यव धर्मां पूर्व थदा हती. अओ. धर्मे गोप्यव अने कर्मे डिंडु हता. अमो लार्दवर्षी अवतान्मा भानता. जेववास दरभ्यान अभेषे चेतानु नित्यकर्म आकु राख्युं डु. अनेक वार अभेषे लेखवास भोगव्या होतो. जेववास दरभ्यान अभेषे पेशावर्नु दृ थ्युं हतु. आ हाँथी ओओ अनेक वार हेसन थया हता. छेत्रे आ हाँने लाधे (ता. ६-८-५३) अभेषे रवर्गवास थयो.

अभेषे चेतानु समस्त छवन भारतवर्षी आजाही मेलवामा अवरी नाप्युं हतु. आजाहीना आहोक्तनमा अभेषे मोडासाने कॅन्दर्मा राखेहु. अभेषे मोडासामा अधरेडु लाईप्रेती, भडिला महिर, गोडासे डेणव्यु अंडा वजेरे रथाप्या अने पगमर अनाव्या. समव आहोक्तनमा अभेषे मुख्यवामानोनो साथ सारो अडो होतो. अभेषे डिंडु-मुख्यवामा नेव अटावा वस्त्रा प्रयत्न हर्दा हता.

[अनुसंधान पा. २८ तु चाहु]

थर्द सहीना शुभ्रातना ईतिहासमां चेताना आवा तथ्य भक्तान विरव ईतिहास-कर्ता व्यो द्वारा अलसेचा कृतादे उच्चवाच अहं 'महा मानव' तरीके भूमी विचेता भानव हता. जनता अभेषामा शेवत्तर इवेत्यु आरोप्यु हेती, अभेषामा 'भमत्कारऽहौ शाकानु' आरोप्यु कृता. अभेषामा भानवताकुता अन धमुक्ता भायरव्युत भारत्ये ए 'लाङ-तप्तन' अन 'लाङ-हैव' तरीके लोक्यामो लोक्यांहेत्य अने लोक्यातामा प्रस्यापित थर्द थया हता. अव्यो 'शिवद्य जर्ति' 'भगवान भरम्यामो अवतार' वजेरे डेणवासा. अभेषे हैवी सहाय छे अभ भानु. डिंडुआ अभेषे हेव तराके 'थस-थस' ते 'लोको लेगहर' तरीके, तो शुरुवत्या. अभेषे पांड पीर के खुदाई आव्या तरीके भानता. लोक्यांहेत्यामा अभेषे भा जोडवासा, हैवा आसापूरानी अने जवहीवरता तथा भानववासा इताद अने ओही शमनवाना सहाय छे अभ डेणव्युं हतु.

जनताना कृष्यामा लोक्यामा कृष्यामा, लोक्यामा अने लोक्यातितो द्वारा डेवताहु पुरुष सेभावेत्य उच्चवाच भानवतापूर्व अने हैवी शुभ्राया विश्वमित हता असे लोक्यात्यामा उच्चवाच अवोहितु तराके प्रस्यापित थया, 'नर धारे तो नारोप्यु थर्द थह' ए डेवत उच्चवामे थर्द थह ही लाली. २. आदृत डोलेन, १५३६-३१०४५०

मधिक-दीपेत्याप्तं]

રાષ્ટ્રવીર છેલબાઈનાં ત્રણું અદ્વિતીય હિતિહાસ-કર્તૃભૂષણ

[જી. મશતાહુદી વાંદુના]

ડૉ. અમદ રાહીંગા

સૌરાષ્ટ્રમાં અનેક વીરો થઈ ગયા છે, પરંતુ વીર છેલ્બાઈ અથે જનતાને અણાડ ચેમનો અભિ-
પેક શા માટે કર્યો અને અવધારન યુગ સુધી છેલ્બાઈની સમૃતિ શા માટે આકાંક્ષા રહી છે ? આ માટેનાં
ધિતિહાસ-કારથ્ય તપાસવાં પડે. એ યુગ લખ-કર અંધાકારયુગ હતો. વિદેશો વિદ્યા વાનું હેઠળ અને
રાજાનવાર્દ્ઘાલીના શુદ્ધભેના ઓથાર હેઠળ જનતા ભયાનક અસામાનિકો અને અસુરોના નાસથી
નાદિમાં પોકીની ગઈ હતી તેવે કપરે ને વસ્તે સમયે જનતાના તારથદાર વીર તરીકે છેલ્બાઈનું
અઠિદાલિક પ્રાકથ થાય છે અને અસાધારણ જનસમર્પિત વીરત્વ દ્વારાની જનતાને અભય-કવય
પ્રફાન કરે છે તથા જનતાના વીર તારથદાર તરીકે અદ્વિતીય ધિતિહાસ-કર્તવ્ય અનુભે છે. સૌરાષ્ટ્રના
લોકસાહિત્યમાં આથી જ છેલ્બાઈનો સૌરાષ્ટ્રના શિવાળ, રાણુ પ્રતાપ, સૌરાષ્ટ્રના ચિહ્ન, જનતાના
તારથદાર, ગરીબોના પેલી તરીકે જનસાહિતે થયો. લોકાભિયુદ્ધે પ્રાતિ યવતું કંઠિહાસ-કારથ્ય એ જ
છે કે છેલ્બાઈનું શોર્ઝ ડોક રાખ્ય કૃત્વા કે રાજને ગ્રિવાયા થા રાજના રાજ્યનો પ્રદેશવિસરાર
કરવા મહેં કરવા અથવા જનતાની કંદેશામ કરી હિવિજ્ય કરવા માટે ન હતું, છેલ્બાઈનું વીરત્વ
શુદ્ધમાર્ગો. અને પ્રલાપાઢકાણી જનતાને સુકુત કરાવવા માટે સમર્પિત હતું, દુષ્ટોને હડ દેવા તથા
નરાખ્યોના નાશ માટે લોકદ્વારાણુદી શોર્ઝ હતું. આવી જ કંઈક પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં અવધતિ
શિવાળ મહારાજના સમયમાં ઉત્તેન થઈ હતી. અસુરોના આતંક્યો વરત જનતાને વીર છેલ્બાઈનો
અવધતિ શિવાળ મહારાજનાં દર્શનની જાંખી થઈ અને જનતાના તારથદાર તરીકે ધિતિહાસનાં
અંકિત થઈ ગયા.

આવા અદ્વિતીય વીર છેવલાઈનું 'ઓરુ' ધર્તિહાસ-કર્તાન્ય એ અંબકારસુયગમાં કાંતિહારી સમાજ-પરિવર્તિક તરીકે હતું. એ અંબકારસુયગમાં જ્યારે મનુષ્યની મનુષ્યત્વ તરીકે કોણીને હિંમત ન હતી, સમાજમાં વધ્યાં કારણોનાર કુમારી ગયેલાં, કુછાં હોય ગયેલાં અને માનવ મનીને દાનવ બની ગયેલાં લોડેને સંન્માર્ગ પાછ વાળોને સમાજમાં પુનરસ્થાપિત કરવાની આવના કે વિચારનો ઉદ્દેશ જ થયો ન હોતો. ત્યારે વીર છેવલાઈને વિશ્વ વીરત્વ લાખ્યી પરારસ્ત કરેલા દાનવોના હૃદયમાં માનવતાને પ્રીતિપ ગ્રાગયાને ઉદ્ઘાર્ય અને અનેક આવા નિપયાણી તરતાને ડેવાનમાંથી ઇન્સાન જન્માય્યો તથા સમાજમાં ઉપયોગી જનાવી રહ્યાને અધાર્યો. વીર છેવલાઈને દાનવોને માયો હતા એના કરતાં તાપી હતા એની નામાનવિ અહુ મૌયી છે અને આ અધી પ્રેરક પ્રારંભ પુનાનિત કથાનો સર્વત્ર વ્યાપક રીતે ગ્રાસક્ષ છે. "નાના નાયા" અહુવારાપતા અને સમય ગીરતા અનન્તિકૃત કષ્ણને લઈ એઠેલા ઔદ્ધાર આસમાણું ને હેઠળી બંધુ-મેલદી, અધ્યાનક અયદ્વદ્દની જરૂર, કાળજીન અલ્લાશાદ, હવણ દાનવબોરેનો ઉક્કાર કર્યો. પાદસમાણું-સામા વીર છેવલાઈના રૂપણી કથીર-સમા હુટ્યો કંચન અન્યા. અનાંથી પણ સાચેશે રીતે તો જન્મી રૂમારન ખાતું ચલાવતો જટો જુગારી માનવ તો અન્યો, પરંતુ એરું હૃદય-પરિરીતન એવું થયું કે એ જટો જુગારી ખર્મદુલ્લાલાર 'જડાથ' કર મહારાજ' તરીકે સર્વત્ર પૂજનીય બની ગયો. મહામહ નામના



૧૬૮૯/એ/કે/૧.-૧૩.

ਪੰਜਾਬ-ਵਿਸ਼ਾ/ਸ਼ਕਾਂ

દેખારના વેશમાં ખૂંખાર ડકુ વીર છેલબાઈ ઈધરતા આરાવનમાં મગ્ન હતી ત્યારે હશાથી હત્યા કરવા આપ્યો હુંઓ. આવે સમયે છેલબાઈએ અને કૃમા આપી અને મહાંમદ ખૂંખાર-ભાથી એનું હિંદુપરિવર્તન શેનું થઈ ગયું કે એ સાચોસાચ્ય ઈકર અની બગેઠા તથા અહ્વાણની પ્રાણ-જીવની મળન અન્યો અને સર્વત્ર પાછ ઈકર તરીકે સંમાન પામ્યો. દાનવોને માનવો તો જ્ઞાન્યા, પરંતુ મહાંમદ ખૂંખાર અને જટા જુગારી જેવાને માનવ ઉપરાત માનવથી વિશેષ માનવોનાર ઈધર-ભક્તિન પ્રત્યે ત્વલીન બનાવી મેમની જીવન ધ્યન અનાદ્યા, દાનવનું માનવમાં ને માનવનું માનવોનાર શીર્ષીફરણ કરવાનું મહાન ધૂતિહાસ-કર્તૃવ્ય છેલબાઈએ એ અંધકારસુગમાં ચિહ્ન કરી અતાવું, એ વર્તમાન જ્ઞાનગુણતિના સુગમાં પણ અસંવિષ્ટ ભનેલ છે.

એમનું નોઝું ધૂતિહાસ-કર્તૃવ્ય તો સવિશેષ ઇપથી જગહો છે. એ અંધકારસુગમાં હજુ તો ગાંધીજીના આગમનો ઉદ્ઘાટન હતો, વાલ-નાલ-વાલના પડવા—“સ્નરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે”—સૌરાષ્ટ્રના અંધારથૈરી રાખરાજવાંશાચાહીના આથાર હેઠા હજુ સતેજ સંભગતા ન હતા, આવા કષેત્રે સમયે વીર છેલબાઈ મહાન રાધ્રૂલક્ત અને રાધ્રૂવીરના સર્વાપે પ્રગત થઈ સવિશેષ ધૂતિહાસ-કર્તૃવ્ય અન્યવાન માનતા ભારતીના મુક્તિયતતા અડિતજ તરીકે ઉચ્ચ રાધ્રૂલતિપૂર્ણ ધૂતિહાસ-કર્તૃવ્યો દારા નવા સ્વરૂપે, રાધ્રૂધર્મો વોક્સેન્ફ તરીકે પ્રગત થાય છે. ગાંધીયુગની જાબર જરૂરતી વીર છેલબાઈને રાધ્રૂધર્મ અન્યવાનો માર્ગ જરી જાયો.

રાધ્રૂમુક્તિ કાને રાશ્રૂવીર છેલબાઈએ ઉચ્ચમાં ઉચ્ચ આહુતિઓ આપી હતી. સૌરાષ્ટ્ર સાગારવાના નહારા મનસૂસા સાથે જ્યારે ગોરી લદ્દમતે સોરકેમાં વેશવળ ખાતે ડો. ગેરધનદાસ સહિત પાંચ દેખબકોની હત્યા આયાત કરાશેલા અસામાનિક વિટિશ અહૃતૂરે દારા કરાવી ત્યારે સમય દેશ અનુભૂતી જાઈયો હતો, ગાંધીજી સરદાર સહિત રાશ્રૂતા નેતાજો ચિંતિત અન્યા, આવે સમયે ઉચ્ચ રાધ્રૂલક્તિની રાધ્રૂધર્મી છેલબાઈએ જલતી જ્વાળામાં દૂરી પરી, વિટિશ હડ્દમતને છંકી લખકાંની હતી અને હત્યારથોને પ્રાચુર્ય દીધા. ઉપરાત્મ રાધ્રૂવ્ય કાયદીકરો ને નેતાજોને રાખરાજવાંશાચાહી પ્રદેશમાં પ્રવેશવાની મનાઈ હતી ત્યારે રાધ્રૂવ્ય અને કાંતિકારી વોક્સેન્ફને આશ્રય અને રસ્થા રાધ્રૂલક્તાએ મનું લતું. રાધ્રૂમુક્તિ મહૂર્યા સારાભાઈને ધૂપ્યા રીતે રસ્થા આપી સરદાર પાર કરાયાં હતી, તો શહીદ લગતસિંહના સાથીદારને ગુરૂત આશ્રય આપેલ હતો. આ બધા વિટિશ હડ્દમાં સારે ઉચ્ચારી અગ્નારતાના છેલબાઈની ઉચ્ચ રાધ્રૂલતિપૂર્ણ રાધ્રૂસેવાનાં કાર્ય હતા.

મુક્તિહાસનાં આ તથકો ભારતવર્ષ અને સમય વિશ્વમાં મેળી કાંતિકારી જિયલપાથલોનો હતો, વીર છેલબાઈનાં, કાંતિકારી સમાજપરિવર્તનક છેલબાઈના મુક્તિહાસ-કર્તૃવ્યાંમાં રાશ્રૂવ્ય અને કાંતિકારી રાધ્રૂમુક્તિસંામન્યાં વિરલ કર્તૃવ્યનું છોણું હું કે ઉમેરાયું. વિશ્વની મદાન અમેરિકન કાંતિ, રશ્યપન અને હેન્ય કાંતિઓ, આધિક્ષિય મુક્તિ-અટોલનો દરા જ્ઞાન માત્ર નિદ્વિન પ્રારિણ શોપિત જનતા સાંનાન્યાદાની સુલાનીની શાંખાના તોડીને સુલા થઈ રહી હતી, આ વિશ્વનાં આસરની ભરણ સુકત ન હતું. મહાત્મા ગાંધીજીના ભારતવર્ષાં આયુભનથી આ રાધ્રૂવ્ય જુવાળ ગેર ચરમ સીમાએ પહોંચી રહ્યો હતો. આવી મુક્તિહાસપરિશ્વિતિઓ વર્ષે સતત વિકસનિવ મુક્તિહાસપુરૂષ છેલબાઈ આ અધા કાંતિકારી અને રાધ્રૂવ્ય રંગે રંગાયા, નિયારે વધાયા અને યા હોમ કરીન વિટિશ સલતનતને ઉચ્ચાડો પડકાર કર્યો. વળા વીર છેલબાઈનાં લગ્ન સીરાધ્રાની સામાનિક અને રાખરાજ જગતના આદ્ય ચેનાવક, “કાંતિકારાવાદ હિતવર્ધક સહા” અને “કાંતિકારાવાદ રાજકીય પરિણાત (સૌરાધ્રૂ કોચેસ)’ના આદ્ય સ્થાપન તથા ગાંધીજીના સદ્ગાપક અને માર્ગદર્શક, વર્ગીલ અંધુ-મસમાન આપાજન મુક્તિહાસપ્રચિદ્ધ અન્નિટર પથિક-દીપોત્સવાંક] [૧૯૮૬/અંકાડો.-નવે. [૨૭]

हेषपतरेम लक्षणातु शुद्धसनी पुनी साथे थाँ। आमाथी पथु राष्ट्रभक्त छेषभाई महात्मा गांधीज अने सरदार पटेल वजेन्ना निकटना संपर्कमान आया। साथे साथे सौराष्ट्रना जगतेर गथाना कांतिशारी पशुभाई शुद्ध अने क्षेत्रभाई डोडारी नगेर साथे कांतिशीर छेषभाईना संपर्क अने संघर्षा बनिष्ठ अन्या तथा कांतिशारी संघर्ष माटे छेषभाईनु भानसपरिवर्तन पथु थयु।

खिति छुझमत सामे उडाडी भगवत व्याद राष्ट्रभक्त छेषभाई राज्होटनो धनिहास-ग्रसिद सत्याग्रह थतां एमां दृढी पउया। आ सत्याग्रह-समये गांधीज्ञाने एकीस हितवना अनशन पथु ४५० दृढां छतां; उथ राष्ट्रभक्त छेषभाई यारे महात्मा गांधीज्ञाने निज जन उपूर्ची रीते सम्पादित इडवी।

विकाबगढ़-सत्याग्रह थतां एने छेषभाई देवरथी आपी, लालीजारीथी धनवेशाज्ञानी पोते जाते सेवा-चाहीरी करो। आ दृढमान खिति कावतर, ऐरीथा राष्ट्रना लाडीदा सरदार वक्तव्यभाई पटेव ५२ घूनी झुमकानु भानवगर अने प्रभलपरिवर्तना अधिवेशन प्रसंगे जातरके रयायु।

राष्ट्रना सहनसीधे सरदारशी अची गया। समय लारतवर्षमां हाहाकर थई गयो, गांधीज ज्वाहर राजेन्द्रपालु ने महादेवभाई हेसाई-सुहित राष्ट्रना नेताज्ञाने अने राष्ट्रती जनता भगवाणी जडाया। आवा राष्ट्रिय विपत्तिना समये राष्ट्रिय नेताज्ञाने आं कावतराज्ञाने पक्षी नशियत करना राष्ट्रभक्त छेषभाई आटेनी खुलूँह प्रभाईय मांग उडावी। आ समये खिति चरकरने प्रयाप जनमन पासे शुद्धुः पहुः अने छेषभाई आ कावतरनो पर्दिकाश कर्त्ता तथा नशियत उरी, आनाथा गांधीज उरदारशी अने नेताज्ञाने प्रकना थाया तथा समय लारतवर्षमां राष्ट्रभक्त छेषभाईनी प्रयाप सा थई। सरदारशी ए छेषभाईने “राष्ट्रवीर” ऐवुँ प्रभाईय मिरुद आयुः।

इवे आजाडीना उमेकेनुँ दालुँ आवो नहुँ डहुँ। ऐताजीसनी कांति वधते छेषभाईनी राष्ट्रिय कार्यहरौ अने नेताज्ञाने प्रतेनी सहायुद्धीन तथा अंतर्ग धनिष्ठ संघर्षा, नेताज्ञ सुभाषणा अहुँ श्रीविद्याकाश साथेना छेषभाईना डुकुँवत् संघर्षी। अने नेताज्ञ सुभाषण ज्यावे लारतवर्षमांवा अंतर्धान थया त्यारे छेषभाई अने नेताज्ञ सुभाषणा अहुँ साथेना अंगत संपर्कने कावये खिति छुझमतने छेषभाई क्षणानी जेम घूंयना लाज्या दता, त्या तो आजाडीनो उडाकाळ आवो पथु गयो। जूनागढना नवाच पाहिस्तनमां बल्णी जर्ता छेषभाई जूनागढना नवाअने सत्य समलवनानो निष्पांग छतां राष्ट्रभक्तिपूर्वुँ प्रयाप कर्त्ता, भरवा ऋषुलु अने दिक्षित करना सुधी नस्त आवारियावाहनी जनतानी नवारे भानवगर राज्यनु शब्दावारी तो लक्ष्मे छेषभाई सरदार पहेंवी गया अने वारे छेषभाईने लेड्हते जनतामां प्रावृत्त्याव थयो तथा तिंमत आवो गर्ह, वडोहगना गायकवाहने पथु राष्ट्रभक्तिपूर्वुँ सदाव आपी राष्ट्रकृतव्य वलावयु।

आवा असाधारण अने आद्वितीय वथु महान धनिहास-कर्त्तव्य अनानार राष्ट्रवीर छेषभाई कांतिशा पथु दता, जे वधते राष्ट्रिय मुक्तिसंग्राम लडातो डो त्यारे स्वतंत्र व्यापीनता अने स्वराज्यनी आजाडी प्रतेन ईर्या आही दृष्टि तेम चिंतन आवे रपूता विशे अहु जे आजाडी आजाडी पातणी समज डानी ऐवुँ देशना डेटवाह दृष्टितो विचारता डाना तेमेआं राष्ट्रवीर छेषभाई पथु हता। छेषभाई कहुँ लहुँ के “आपांडो देश रवतंत थाय एज जस नव्या, रवाधीनताना सुदृढा डेटवाह लेडो ज भेजवे ते सामान्य आम समुदाय वंचित रहे एने पूर्वु स्वतंत्रता न क्षेपवाय; एवा सुराज्यनु निर्माणु थयुँ लेड्हमे डेनेमां तजिवानी गरीब लेडोनो उडावर थाय, गरीबीने अन्याय तेम दूंटदाट अने सर्व प्रकारसी असामाजिक डाकुगीरीयुँ अस्तितव ज न होय। आपवे सौमे आवा ज्वर राष्ट्रनु निर्माणु डरवाहुँ आवो क्षे,”

[अनुसंधान पा. २५ तीव्र]

‘રસૂલ રંગુનવાલા’

ક્રી. આનંદકુમાર આડે

‘ચાર આના, ચાર આના; ડેય પણ ચિંતા ચાર આના !’ રસૂલ હકિસાં એલેશ સુરુઆત કે, સે રવજીઓડે સિલાષુ ન. પુંલે ચાર મેણ્યો ઢીનો છી’ જ ડિરેવિરો શિંદો વો. રવજીલા પિંટે અંડે વારેણ ડેસિસ ત ડ્યાં, પણ જડે ‘ઈન્ટિનું’ ન સેવાષુ તડે છીનાં વરવારી હિરાએઠે હક્કથ કરેને બ્યો: ‘તું વિન્બિને છેડા રેખ ચંદ્ર અથ, ધનજી રાડું સોવાને નતિનું’. માસુદી ચિંતાવસત વિશેખાય હેડો ધરાય મચાયતો સે આય કુરો ?’

‘પાંન પેટન જ્યાં પાંને સુણે નતો ત ઈ પન્ને ડેરું મરજે ભાર રાડું’ પાય તો ભલે પાય. આઉ ચેલાય વિન્યા ને તત્ત્વથ થઈયે ત ? કુટ્યાથવારી હંઠઠાને છેરો, પન્ને ઈ સુણે ત થઈ રહ્યો.’ હિરાએઠે રવજીલાણ જાલ જાસદ્ધ ન, પણ તેં જ્યતાં છી’ કંધેને જાલ પતાયલા હલ્લી નિષ્ઠાય.

‘રસૂલ બેદો ! તો વટે વાયસર આય ? પ્રાયમસને વાયસર દિલી બ્યો આય.’

‘હા, જિલ્લામાં ! વાયસર આય. એ વળતું ચાર આના ગિનતો, અંડે પનરેં પઈસેમે જિંદોસેં.’

‘અલે ! આસો વે સે ડિઝ. નિંદો વડો હુંદો ત તું કંબલાય ડિને ન ?’

‘હા, જિલ્લામાં !’

‘ત’ આઉ તેંક કિંડી જેતિવિષસે !’

‘આઉ ત કિંતે જ ધર્યો અંધ્રાં.’

રવજીલા આરા આદા ને અભિનું કદલ લગા. રવજીલાણ રતી અભિનું રસૂલએ ગમણું ન તડે ધન હિરાએઠે પુછે: ‘જિલ્લામાં ! કાકા કુરો ચેલા ભંગતો ?’

‘કાકા ઈ ચેંતા ક હિંતે એરો ડિરેવિરો વિધેતો. ભાવતાલજ રાડું ધનીનું સોવાને નતિનું’.

‘જિલ્લામાં ! આઉ ધરમેં અચી કરેને રાડું પાઈંધીન ન તો. હી ત હં આય. એલે વગર કમદધધી ક્રીં થિંધો ક હરેં હરેં એલધેસેં ત ધંધો ચોપટ થઈ વેધો. ધનીનું સોવાને નતો તેમે આઉ કરીશો? કુટ્યાથ મથે વેપાર કરિયાંતો. જાલ વિશેખાય નિઠો: અંઈધાં. કુટ્યાથ જડે કિંત વિન્યા ?’

‘કુટ્યાથવારો સે દૃઢાથવારો ! તુઅસે ગાલિનું કરિયેતા ? હકાલે ડિંધેસેં તરેં અભર ચેધી !’

‘કાકા ! સું પણ હિંદુ અંધ્ર હશ્ચલેવારા !’

‘અરે પણ પાંને છોરો પાંને સુણે નતો ત હી ફેરીવારો છી’ સુષ્ટુધીં ? અંઈ ધરમેં હલો.’

પ્રાયમસને પર્ય સુધારેલા ધંધે મથાડું ક્ર્યાં, પણ જ્ઞાયા ન તડે હિરાએ રસૂલને બ્યા.

‘એદા રસૂલ ! ન્યાર ત, લા. હી કરો વાયસર ડિનેં આય ? ભરાભર વે નતો !’

હિરાએ પ્રાયમસને પર્ય અને વાયસર રસૂલને હથમેં ડિંધે જાલ કર્યા. રસૂલ બ મિલિટાં બ્યો વાયસર વેરાય ડિને.

‘હિતરા પઈસા ડિંધાં ?’

‘પઈસા ન ખ્યે, જિલ્લામાં ! મિસ્ટેક સુણ જ હુંધ. બ્યો છી’ ખ્યે કરે ત ચેલા.’

હિરાએ ધર કરો પાછા વરેઆ તડે કાકા સામે મિલ્યા.

‘વિચાડો, વાયસર કંબલાય લિને અને પર્ય આસો કરે લિને ?’ હિરાએ હથમેને વાયસર વતાંન અને જાલ ક્ર્યા.

‘पंज ई॒ तै॒ भै॒ ने॒ भा॒ भवो॒। वा॒ यस्तर॒ लघुलाय॒ दिन॑ तै॒ भै॒ उपकार॒ न चै॒ वाने॑?’

‘आँधि॑ ठैन॒ भमतावारी॑ उभूल॒ त करिंधा॑ क न॑ भै॒ भासी॑ ती॑, पञ्ज॑ छोडो॑ छानावार॒ आय॒। भमता॑ गरी॑ छोडै॑ अथे॑ अँडे॑ रैस॑ आय॒। तिथो॑ निंदी॑ हटो॑ आय॒। कुटपाथ॑ अथे॑ वरी॑ घो॑ आय॒। झ॑ ती॑ पुरो॑ करेता॑ ने॑ आँधि॑ हुंधथे॑ पुकियां॑ घा॑ अयो॑।’ हिरण्याधु अभियें॑ से॑ भमताज॑ आँधि॑ छिखकाणा॑ ने॑ रवलाला॑ अभियें॑ से॑ रैस॑ छिकाणो॑।

‘पुं॑ मु॒ कै॒ समन्य॒ म !’

गाल॑ वधे॑ न तेंद्याय॑ हिरण्याधु॑ रसो॑ भै॒ दह्या॑ वेआ॑।

रवलाला॑ कै॒ रस्त॑ थक॑ चाय॑ पिंद्याय॑ मिलाय॑ ने॑ चायने॑ भिडे॑ स्पाह॑ द्विरी॑ घो॑। वारीवारै॑ छोडै॑ भासु॑ घरमे॑ अचुकानाव॑ घर॑ करे॑ घो॑।

रवलाला॑ घर॑ लुग-लुने॑ आय॒। घरतरते॑ नरियें॑ डेकाणा॑ रैआ॑ नाँध॑, चोभासेमे॑ त घर॑ घो॑ डोरातु॑ चुपेतो॑। रवलाला॑ आमुली॑ नोकरियात॑ ने॑ उला॑ भाकु॑ दुवा॑। रिटायर॑ आय॒ तेतुयो॑ धनी॑ कै॒ पेसन॑ मिलेती॑। ताउ॑ भेडो॑ घरबो॑ अरयो॑ पुरो॑ करियेता॑। लुग-लुने॑ घरें॑ रिपेर॑ करियें॑ त भुज्या॑ रैषु॑ घे॑ ओडो॑ हालत॑ हुँध॑। लायेणु॑ जगनेणु॑ शुनो॑। घर॑ झ॑ ती॑ उलो॑ आय॒। कडे॑ धुसी॑ गोदाम॑ से॑ राम॑ जाणो॑। घरके॑ फुरसत॑ करेणु॑ घेंय॑ नांय॑ ने॑ घरमे॑ भमता॑ अंधाशी॑ आय॒, तेंसे॑ घर॑ विषेणु॑ ईला॑ प॑ नांय॑। ‘गमे॑ ती॑ घिये॑, आकामे॑ पञ्च॑ घरके॑ संलाशीने॑ विडे॑ हुँज॑ !’ आपा॑ एदी॑ भरामण॑ डेवा॑ वा॑।

घरमे॑ शांतिसे॑ न घोपडी॑ वाये॑ सगाने॑ कै॑ न डै॑ से॑ गाल॑ करे॑ सभाणे॑। रस्ते॑ अथे॑ दृतरी॑ राहधारी॑ वधो॑ पध॑ हुँध॑ अने॑ दीरोवारा॑ कुटपाथ॑ अथे॑ अडो॑ जमाय॑ करेने॑ निहा॑ वा॑। निंदी॑ निंदी॑ हृषितेणु॑ भाऊ॑ कराणी॑ हुँध॑। हिरेविरेल॑ पार॑ न रेमो॑ वा॑, तेंमे॑ वधे॑ रवलाला॑ अवाज॑ झ॑ शेळनाले॑ रोग॑ लागु॑ घो॑ वा॑। अवाज॑ सुणी॑ सुलाने॑ रुक्षो॑ यक्षकवाह॑ लोगो॑ एदी॑ हालत॑ वध॑।

‘हियारी॑’ कुटपाथने॑ डो॑ उ॑ ते॑ गंडी॑ लिख॑ लगो॑ ने॑ रवलाला॑ सोवाल्यु॑ न तडे॑ पोविस-चोकीमे॑ तकशर॑ विषाय॑ आय॒। हिको॑ गोविस॑ सन्तो॑ झ॑ रस्तने॑ अगियो॑ पुकिया॑ द्विधो॑ रेगो॑। पोविस॑ कै॒ इसिने॑ रवलाला॑ भन॑ धुसी॑ कुक्षाक॑, पञ्च॑ घ्ये॑ ती॑ त पोविस॑ ने॑ रस्तके॑ घेना॑ विध॑ चाय॑ पिंधे॑ लिया॑ वा॑ ने॑ ईताने॑ भया॑ इयो॑। अस॑ लक॑ लक॑ डेख॑ लगो॑ : ‘चाय॑ पिधेला॑ भाकु॑ भरेंता॑, नीय... डरामी...?’

‘डो॑, दुरो॑ थ्ये॑ वरी॑ ?’ हिरण्याधु॑ कै॒ इडक॑ पिध॑ से॑ पुछल॑ लगा॑।

रस्त॑ ने॑ गोविस॑ टैसे॑ चाय॑ घियें॑ वा॑। सरकारी॑ भाकु॑ गञ्ज॑ तुस्त॑ वधर॑ नतो॑ लहो॑!

‘चाय॑ अने॑ तुस्त॑ नतो॑ दुरो॑ सभाव॑ आय॑ ?’

‘झ॑ त भुज्यात॑ आय॒। आयणु॑ करामत॑ तो॑ उिं॑ नांय॑। यो॑ अगर॑ घरगो॑ अये॑ ने॑ भा॑ चोर॑ आय॒ पिरांठीयो॑ त यो॑ यो॑ दुरो॑ वधर॑ धक्षी॑ विनो॑ !’

“झ॑ आँधि॑ दुरो॑ ता॑ यो॑ ?

‘भत्यालने॑ भाभो॑ भत्यालनी॑ भराभर॑ समजेतो॑। झ॑ ओ॑ किरायाल॑ वे॑ त झ॑ आँधि॑ लिख॑ पञ्च॑ घेतो॑। हिकु॑ कै॒ चायणु॑ करामत॑ न्यारण्यु॑ वे॑ त दंबध॑, वरांधार॑।’ हिरण्याधु॑ लुक॑ जडेते॑ रवलाला॑ घरमे॑ भार॑ आया॑। पोविस॑ उ॑ वा॑। रवलाला॑ घ्यो॑ : ‘पोविस॑ ला॑ !’ दिन॑ छोडोरेने॑ झ॑ ओ॑ अंधीकरन॑ फैन॑।’

‘साहेब॑ ! मु॑ तां ध्यु॑ डेसिस॑ कै॒ समन्याल॑, पञ्च॑ नप॑ समजे॑ झ॑ नतो॑।’

‘डो॑ ? आयो॑ घिये॑ नतो॑ त आँधि॑ देसालाय॑ विनो॑ ने॑ अधि॑ पञ्च॑ झ॑ ओडो॑ भभाय॑ करेने॑ कुटपाथते॑ वै॑ रो॑, त नित॑ झ॑ आँधि॑ हिकु॑ घेड॑ भिलोने॑ चाय॑ पिराय॑ संग्रावा॑ !’

'साहेज ! हुंधरे मध्ये म भारेओ. अप्ये त अंध नमर नोट करने चाहिए' इरियाः करे सज्जां !
तत्वध वधी न पे तेलाव डिरआई रवज्ञभाजे ध्य अलेन धरमे झडे व्या.

'तुं कुलाय विष्मे भयो भासियोंती ?'

'आँड कुओ डो न ता ? आँडे चांती, दी गेविसनारा त कुटपाथवारैज गुलाम थ्या अंध.
सरकर पगार तेती धनियां वृद्ध त छनीडी दी कुटपाथवारा उिता. कानून पांचाय अव, पाच्य अमेला
विन्हा त चां याबान अच निन्हो. सुपालुप थ्या हुना. भयो भासिया त मध्या जुहा गेवो. कायद्यो चे-
तो क हुंधरे मध्ये म भारेओ ! काप्यो युछ्यो आय. कानून न ध्य अलासार्टी त ध्य कपाला समन्हो...'

ने दी कम चार भेणे सुधी दीने ही ज ध्य द्यो रेगो. रवज्ञभाल धुनियां भष्मवार्त व्याह. वरल
भाकु अंवधी व्या. तेती डोय पाय ध्य धनीन्हो सुखुंवत न गें. डिरआई स्फुल वटातु चिक्कवस्त
भंगव्य लगा. छेतो गाविलुं केचु द्यो, ने छेती निसाराळ नेडेके निमायो उिला. स्फुलक ला
लनाहो. न न नाह नेसें आवार्त, न नात. कुठ रस्ताने भेणियो सुमाव भिशीने भनते असर
करे व्यो.

सुर ज्ञानार रवज्ञभा 'अनाव्यु' चोउण्याते अने वडप्यमे लिक्के निढें छोरेसे, कुटपाथ-
वारे स्फुलव्ये' भारो ऐसे ते रवज्ञभा उच्च व्या. वरचाया निको पूढ इरिय विहा. कारणूं क रवज्ञभाळ
मेवहालीमे' स्फुल वरमे' अवी वरल इम करियो वो. आवांधा भेमाणु अची पे त सामेने
भुजेता अप्ये से आण्ही अनियो वो. कुटा पर्हसा त इन वटे आयम रोवा ज वा, अप्ये तडे' कुटा
पर्हसा रियो वो.

हिक्कार रुपेयेन्हुं डो नेहुंच्यातु छिक्की नोट ज्यां निकी निको पूढ. त्रप्या टाळे रवज्ञभा
धरे आया. मग्या तपेलो ज वो ने यौवू लगा : 'ही नोट छुटेवा निने' आय. हरामी भष्मवाससे
पनारो ऐसा आय...'

स्फुल भविष्यमे' अचीने उन्हो रेगो. रवज्ञभा गान्हिं डिघे डिघे थक तके रस्त चे : 'काका !
आरियुं कुटी पर्हवुं क थी रेया ?'

'तुं हेतातु हेतो विन्य.'

'आँडे प रेवाथ अयो नंधयां. उजेजे आँडे छिक्की नोट कुवसे' उिनो व्य. ईगोटी नोट
आँडी जिनेला आयो अंध्यां. काका ! ज्यां नोट पाणी डरिल.''

रवज्ञभा ज्यां नोट था क्तो. डिरआईने हरभ भनमे भावाणु न तडे' क्ती' व्यो : 'स्फुल !
तुं ही ज्यां नोटने कुरो डरिल ?'

'क्क वेपाराके अ ठिंघासो ?'

'धतरे तुं अवमासी डरिल ?'

'आँडे त माकुडे न्यार करने अवमासी डरियातो, जित्यां ! वेपाराके ज्यां नोट ज्येंभी
क्काये पाप नाह. उत पाप जे पर्हसे कमायतो. काका त रमानजे पर्हसे कमाईता !'

'से का' लवा ?'

'ईमानधारासे कमाईता धतरे ज तां वरण छालत असाय आय. पापलु कमाणु कमाय ते
तेन्हो वर उगमगाट करेतो. दी ज्यां नोट आँडे धरमे वधी, जिल्हामा। हरामलु कमाण्हीतारा सोल
नोटजे डिसाल रपे नवो, पाय पत्तानेह डमाण्हीतारेके लिक्के' उपियेह ज्यां पाय भेती अभरेती.
जित्यां जुङ विव उता ते क आउ लान पर्यु ज्यां ते जुङ्हे कुसमधु भनेता तेलाव जनने
पथिक्तीपीरसवां।]

‘हुसमय पश्च विद्यांतोऽन् रस्तवेष्येवं गाल कृ अते आभरलं शप्तं लाणुं छाकृ सुख्यापनं हुवा ती’ छाकृ छारा नक्षर हरेने हवयो व्यो.

रवणभास त भिन्नेभिंज सुसदी रेआ, पश्च ईदाज सुगंधो न वो, बरमें सुधारो हरे लेड्युं गालियुं त धोये वंड्युं. छाकृरो उभरलायक थधते पश्च कमवोषु वो. छाकृरो ह धमलु जिमारी वध. धोरी कमालीयुं हुंशी आहरके चिंधानयुं थगड्युं लगेत्युं वर्द्युं. तुम-जुने वरेड दी.भाले धरेह लागु घो वो. रेखच वेठं पायरी हुळ. धरने छार धरतीहै प्रयुआम करेलाय कुं नभी गेधा तेंजे लरेसो रेओ. न वो. रवणभास पर संबारेने विद्येआय क वरेके रवणभास संबारेने विद्या अंध से समाल्पु मुकिल वो.

धर हीड करेला कन्दाटी पंजोंसे तुपियेमें तध्यार घो वो. पहसेल तज्जिंज हरेला रवणभास वार विन्यथ लगा तडे कुटपायते हुल्हड भर्यी पध. रवणभास आरीभानु नक्षर कृणं त भिडे फेरी-पारा हुक्कोने सरसगान भेरो. हरेने-लग्नं धा हुवा.~ पेलिसवारेण लारी हुना वध. रस्तव पिंडके समानले द्रौ लारा निचे रेखेने व्यो समान भेरो. हरेला घोडुं कृथ लगो. रवणभास भनमें विचार आयो : ‘ही ज लाणु आय, लाणु भासो लागें आयो आय.’ रवणभास अवियां वेचा ने द्रौडे हथ लगायो. रस्तव घोड़धो आयो ने ये : ‘काका ! आंठं ही दुरो ता क्यो ?’ रस्तव द्रौड अवेंज छासिसेदें.

‘असाने वरमें हैलाय आवे ? ही दुरो कुटपाय आय ?’ द्यु अद्य हरेने रवणभास द्रौड लारी-मेंतु लारा ला क्का. पेलिसवारेण लारी रवणभासे धर सामे हुवी वध. लाकु घोडी आया. हुल्हड भर्यी पिध. लाल लारीमें लरालु. रस्तव भम आध व्यो. चुगायुप न्यारियो रेओ. पेलिसवारा छनडे लारीमें वेचा वरेने भर्यी व्या. घोर ली रस्तव हुक्कोने सरसगान वरिपेर थध व्यो. रवणभासे भनमें वो ती ज यो. रस्तव रस्ती घो. हनीडे लारी युधी वध. पुश्तिमें ने युश्मिमें आदहिरा करसु लगा. तेर-ई लारीमें तु धनीउ पाकिटते नक्षर पध. पाकिट अद्ये हरेने न्यायो त पाकिटेमेंतु सो सोउ पंज नोडुं सुरी पृष्ठ्युं. नोडुंमें कृ-ट लगो तीं रवणभासे घोसत लघ आयो. धन पहसेल तज्जिंज नक्षर हुने एड विचारसे रवणभासे विन्येता तध्यार व्या. ही विज्ञा सामे ज लभी वध. धन ये : ‘अधा ! आंध रस्तव लाने हे हुंडीये’ इगाय तिनाँ ?’ रवणभास पिंडके विचारमें व्या वा. लीनांगे हथमें पर्द संले पाकिट वो. पाकिटडे क्काटमें व्या क्क्या ने धरमेनु आरा व्या. ‘आउ देर-ई पाको अचांतो. कन्दाटी अयेत हनडे लमें वेरांडा,’

दिवसाई भिंधरनु पाणा वर्षा. क्काट डोश आन यो तडे हनीडे पाकिट उभालु. अन्नरक्ष-से न्यारेआं त भिंज सो सोउ पंज नोडुं. ‘लगेता, पहसेल तज्जिंज थांध वह आय.’ ही यथ हरेने रसेडे लारा वर्षा तडे विचार ये : ‘अज अधा रस्तवासे समानले द्रौ कुगाय तिनां. विचारेने लाणु तुक्कान थक्क घो.’

‘ही दुं हैरो ती ये ?’

ने तिन ज लाणु कन्दाटी अचाने उमो घो.

‘अयो अयो. भासो यो आध लाणु’ ते आया व्यो, हेर-ध अविधा.’

‘ता, लेख ! ही विडोने वधत नाय क्काकृ सुले क्कय क्क्या हुंना ?’

‘शेवानसकु गाल क्कोंता ?’

‘हा, लेख। हनीडे यो ज अउ चार दीं वाट न्यारियांतो. गोडवान्सु तज्जिंज थांध विन्ये त आंध कारिंवरे के हमते अवेदां व्या !’

पठसा कन्द्रारीवा भरु आया अंधे ई सोची करने हिराए पाठिटल पठसा कन्द्रारीके अंधे इन। कन्द्रारी रसिद दिन। कन्द्रारी हस्तेयो वो अने पञ्च ज मिलिएमें रवज्ञा आया।

हिराएहै त रवज्ञा वटे कन्द्रारीज अने पठसा सुप्रत क्यां तेज गाव केणी हुध, पथु भगव-
में त रस्तण गाव हस्ताधी हुध। रवज्ञा के मनी ऐसो ज साव क्याँ : 'रस्तणे कुरो थो ?
रस्त आने कुरो हिटाय वे ? अने छोरेने सरसान आई हिगाय दिनां ?'

'अंधे करने हखथो वो से अंधे तुरी थो !'

'आडे ई न डेख वो, गरिबत्त पूते पग डिने, पथु गरिबत्ते पेतते कडे पग न डिने,
बढ़पथमें आडे ही कुरो सुन्नो ? पाने छो अमनोय विडो आय। छन्ना अंधे कुरो क्याँ ? अने
जुडो क्यांधिवो वो तेल ज धय कपी विधासे ?'

'तोडे पथ ध छोडो वलो लगेतो ?'

'छन्नसे आंधे धरती नदरत कुवा आय ! रोड छोडो आय, पिंड पूरतो कम यतो, परोपारी
पथु आय, डिने भूम समध डरेतो। छन्ने ज उधो वारे करे ने वेर वारी ? मुँके छो लगेतो !'

'धा ? कुरेने छो ? ई कुरो करिधो ?'

'ई म यो, मेहो गी यो, छन यें वे, धिल ते तो तोडे जान पथु डिधेसे अने हुसभष
हुधो तेने भया फाउधेसे !'

'मयो फाउधो ? कुरो पोर्पाराधने राज आय ? छन्के त पोलिसवारा जली व्या अंधे !'

पथु रवज्ञा गाव अहुरी ज रध अने पुटियानुं अवाज सुषेका भिट्यो : 'काका,' रवज्ञा
पुट वरेने न्यारो त सामे रस्त उलो वो, रस्त वे : 'काका ! मुँ कडे आने भराय थिये ओडो
धारो पथ न वो अने आंधे सुन्ने वंग न क शुनो, भूम तुक्षान अयां !'

'हुं ई ! शुरीने आयें, मुनर ? हिराए भुरीसे पुष्ट लगा,

'जित्तुमा ! आंधे ती वर पवरने अंधर्यो, आरतु कुटपाथवारो अंधर्यां, पोलिसके कुटपाथ-
वारसे वेर नाय, किनीके कुटपाथ वगर हले ता' नाय, किनीके कुटपाथवारेने ध्यान रभाषु अपेतो।
आंधे वरवारा अयो, कुटपाथवारेने छासाक आने धानमें नंध अयें, पथु, काका ! आंधे मुन्ने
भूम भूम तुक्षान ठयां अयो !'

'कुरो यो ?'

'मुन्ने सरसमान त पांडो भिसी वेधो, पथु पठसा व्या से व्या, धंधो करेका पञ्चसे तुपिया
भंगी आयो फुवेसे ई ज पठसेने सन्ने पाठिट सुन्ने उपडी व्यो.'

हिराएहै रवज्ञा कोरा न्यारो ने तिन ज याहे रवज्ञा कृष्णना लुअध, छन्नल पठसा
पांड इड करने उपडारने भारसे छन्के वरी लिने विडेका ना चोकासी। रवज्ञा छामानधार ने
मेके छन्नान वा, वलवारा वा, होगिटल पठसा पांडे न अपे, जेके विचारल पांडे छन्नान वा,
धरते ज छन्नो यां : 'तालं पसाए अहु विन्य, तोके पठसेने पाठिट वरमें ज उधो वो.'
अने तिन याहे हिराएहने में छायी यो, झारण ? भुक्तमें पाठिटल पञ्चसे तुपिया कन्द्रारीके
डिनां वा तेने हिराएहै अइसोक यो, छनी पुष्टयो : 'उ पाठिट रस्ताने वो !'

'ओ ! ओ, लक्षा ?'

रस्त हिराएहै अने रवज्ञाके न्यारिधो यो, किंके भुव अंध आय अने इत्यो पांडे ज
धिधो तेल आसार डेखानें-ता-होसियार छोडोरी से जाथी यो वो,

पथिक-हीपोत्तमां]

१६८६/भोडो,-नवे.

[33]

'पातिल पर्वता त कन्द्रीहि देवालु वेचा.' हिरभाई थो.

'सत्यानास थिये आने !'

'मुंने पंग न कुणो, मुंके आधु दुखाय सुख्योंता ? आधु पिंड कन्द्रीहि पर्वता डिनेल गाल ठाण वा, मुंके दुरो अपर ?'

ई विल रस्ताने हुवो. ई विल हृत्याखवारेने हो. हिरभाईमें धन्ते पिंडल माल सहन थया अने रस्त वो : 'जिजुआ ! आंधु आद्योस म करिल. काळा ! हो परेसानील आल नाय, ही उड वडी गाल नाय. जिकी' थध थो. से थध थो. आद्योस म करिल.'

रवज्ञासा रस्तलु हुडी विलवरी न्यारे हरेने हरी वर्षी. उक वर्ष क नंजिया थो. से न समलालु. कन्द्रीहि आयो. छिकुपेली बितडे उली करे दिने. दोर्दांकरने भयोपतत थध थो. तकलिह ओडी थष्ट, पशु रस्तलु अचनिन्य वधी पिंड, ई अडे मुकु घरने कम डेणु कर्गा. ओकार त धन्ते नेमे पशु न वो, पशु रवज्ञासे अन त भिजेमिंज क्लार्धि रेयो.

रस्त निगर प लक्ष्या न वो. ने रस्त अप्यो प न वो. अधवारेल अने भयवारेल थध थो वो. वा. उं दियेमे रस्त घरने थध युको वो.

उं उं कम निरहरेतो तीं तीं परालव थियेता एडी धारणा रवज्ञासा डेणु लगा. रस्त भिशुलु सेवा करिया वो. अन रभ्यांधा वो, घरल रेनक व मूर मे रस्त थकी वधी पिंड हुध. रस्त थकी वर रोनकवारी लग्यांधा वो. रस्ताने नक्से वरडा अद्योवा लगा. हो.

हिकडो दीं वरी अभतकार थो. भिशुक नवाहु लगी. योयांधीज गोविसनारेल लारी आवध. ओसारेसे भिडे फ्रीवारा चेती व्या. भिडे पिंडले आल उपाडे हरेने हव्यांधा थ्या. रस्त मालसमान उपाडे न ने खुबीसे वर्षी सिरी व्या. लारीवारा आया ने आलसमान उपाडेला लगा. रवज्ञासा हिकडी पलदा विचार ठाया ने योय रस्ताने सरसमान सिए रवज्ञासा वरमें आया. रस्त रेमधिल आय, विलवर आय. धन्ते उपकारने लार ओडो करेलाय रस्तलु हुटोलु धन्ती हिकड-जत ठाया. रवज्ञासा रस्तलु हुटोले समान अडे हरेने वरमें आयाते अने समेवारे आपछेमे उसा. रुठ हरेने हिरभाई अभतकार न्यारयु लगा. उंहीडे भोरी युसी थध.

'आंडे पशु रस्ताने रंग लगी थो. रस्तलु हुटोले समान आंधु पिंड अस्ती आया ही त गरज्य थो. चोयाजे !'

'अस्ती न अयां त यां केंडे ? पांते धन उपकार के आय.'

'आंधु हुंक्ये' हेरान थेता. उ विचाडो त कींय वे नतो !'

'मुंके तुं समलाय...'

रस्तकै उं उं पर्वा करिया हुवा तीं तीं पिंडल रस्त तोरा. डेक भमताजे तारसे तलांधा वेचा. हिकडे पुटियो थो. ओडा भ्रसंग हस्ता आर्यांत. खुटकरो थिलु मुरिक्क थध थो वो. भयांधमथा आहूत लवध आवधते ने आहतमेंतु उंहो अचेने आगे आयो. नते.

ओमासो विडो ने रवज्ञासा के दूर्विन्यात आरगम विन्यालु थो. निंदो भा अग्मार थध थो वो. धरमे ज्वाअधारी उपाडे सरो एडो थो. ओय न हो. विने विग्र युटो न वो. रवज्ञासा नेंनी उस्या तेनीं व भारी वरसाद थो. ने घरल ओसरीने अतर छिली थो. हिरभाई तां मुंऱु थ्या. पेट-ले नष्टयो. कमने न वो. ओडा धमसे वसायी हुध. घिलवड करेलाय रस्त व वो. रवज्ञासा वी उं दिये मे पांडा वरेवारा हुवा. अठ ठां थध युक्त धनाने कागर आयो. उपाडी भारीमेंतु कागर विधे

३४]

१६८६/ओऽटो०-नवे.

[पथिक-हीयोत्त्वांक]

ને કાગર ભરાકર નરિયેંણ ચુવાકળ જગાતે પો. ચુવાકેસે કાગરને વિખાચુ મિડે કુસાળ ચુડો વો. કાગર પલરી પો. કાગરમે કુરો હિંદેદો વો. સે કિંદે અપર ન પિંડ. અમૃત અમૃત અપર ઉદ્ધવંધા વા...કાગર મિલ્દો...સમજયાસી...કુરો થિયે...તેં વગર છુટ્ટો નાથ...ભરાકર આય...અસ ખરતો જ સમજેલા મિલ્દો. નિષ્ઠા સમજેને વો, ફેસલે કરેલે વો. સે હિરાએ પલમેં ફેસલે કાયા...નાયા...

કાકા કિરિયાકરમ કરેને પાણ આયા. રસૂલ વરણ યાર બાય ચાર કુટળ જગામેં નિંદાડી હટકી જમાય કરેને વિઠો વો. 'રસૂલ રંગુનવાલા'ને પાટિયો લગે પો. વો. પાટિયા ન્યારે કરેને રંગલા ઉજા રેયા. ઘરમેં વિનેલા છાણીને મન અગિયા પુછિયાં થ્યો. તુંબાં ક રાડ તંકીને ભજ નિના ઈ પણ થ્યો. રસૂલ સામે આગો. રંગલાને હથમેને ઓરો ગિનાતે વરમેં આયો અને ચેં : 'જિલ્હમા! કાકા આયા...'

ઈને ઈ જ આવાજ રંગલાકે સુણેલા મિલ્દો. રંગલાણ નારાજ વરતી થ્યો વે તીં 'રસૂલ ચેં': 'કાકા! માર્દ કલા. હાણે હિરાએરા કરે નાંધ થિયે. આંગુ મેરાનાંસે દુષ્કાન થિયું વધ અને પોલિસિણ મયાકુટ મિટી વહી. હસા અંધ થય થા અંધ.'

રંગલાને એડી નજરસે રસૂલ હોયા. નાર્માં, એંસે 'જાણી' સમજેને વો. સે રસૂલ સમજું થ્યો. હિરાએ એસાદેસે રસૂલકે ચ્યાં : 'તું હિતાનુ હલ્યો વિન્ય.' એસારો. કરિથી ટાણે રંગલા ન્યારી તડેં છાણીક ઈ થ્યો કે હાણે વરજો પણ આચરો ખૂબો. હુંઈ પણ હિતાનુ વિન્યાસી અને પુછિયાંનુ ચોકી વરી થ્યો. ન હક્કાલા સગે એકો દૂંચ વરી વધ હુંચ આણીએં વિડેલાય જગા પણ મિલદ ન વધ ને વેર પાણ આયારી તડેં 'રસૂલ રંગુનવાલા' પાટિયસે સ્વાગત થ્યો વો. વર હિરેતો તડેં છતર પણ હિરેતો. પણ માણ પેઢા હિરેતા, પોથે વર હિરેતા ને ગેય છતર!

રંગલાને સડ વધ રેં. છાણીનુ હિકડો હરદેન મેલાણુ. હિરાએ મન ઈને ગાલ કર્યા. નંબિ છતર ન્યારી. સે પણ ચુપાચુપ અ ફલાર કુપિયેણુ વેરસથ રસૂલકે ને પાણીએ સમજુને છનુકે દુષ્કાન મંટેલા જગા ડિનેમે આવધ...તેંણ લથ થિયું હિરાએ હરેં હરેં હિકડો પોથે અધ ઈ ગાલિયેણુ ચાંદું એલિંધા થ્યા. કરે ધડકાણ થિયેતો તેંણ વાટ જ ન્યારિંધા વા, પણ રંગલા ચુપ વા અને એચાંધા ચાંદુંથાં. રસૂલ સિએ મિડે ચુપાચુપ જિલ્હા વા. ચુરસ્ણ વરસાર વિધી રધ. 'વિન્યાંનો, હી સુંને ઘર નાંય, કુરી નાંયારો. ઓરો સુંને ઘરમેં થયો આરેતો. આંકે મુશ્ણ ગરજ પાછ નાથ. આંકે રસૂલ લખલાન થિયે. મુશ્ણ હાણે હિન ઘરમેં રોણું હરામ થિયે થ્યો. આય. હી ઘર ચુંલાય નાય...' ચાંદી હિતરો ચાંદી હુંના ને છાણી થ્યા. થોડાં ખાંદી પણ.

એસે ઘર હાણે થકે ચાંદી વો, ઈ જ રસૂલ જાખયરક હોણી આયો. જાખયર છાણીક તપાસે, ખલાજ કે, ઇન્દ્રિસથ ધારાએ કિણી ડિનેં અને નિપટ આરામ કરેણ કલામણુ કે.

રંગલાણ તાણિયા. સુધેરે હી બાઈ હી લગ્ની થા. હી રાત રસૂલ રંગલાણ તાત મન ધનસે સેવા કે. રસૂલ સેવાએ લગ્ની પો. વો તેસે હિરાએડ નાણણ અપર ન પિંડ

હાણે રંગલા હરેં હરેં હિરિફર હેણુ લગા વા.

આંધાએ કાંનાં રસૂલકે લિકાયણુ સેનાંથી ન જો... હિકડો હી છાણીને રંગલા ઉથિયે તેનુ મેર રસૂલકે થાય ડિનેલાય આરા વેઆ ત થાયથેં દથજ લારીનારો ઉભો વો. લારીમેં સમાન રઘેલો વો. સમાન મથે 'રસૂલ રંગુનવાલા'ને પાટિયો આધાસ હોશ ન્યારિયો થ્યો વો. સામે સંખ ઉભો વો. છનુને મોં ડાટરેલો વો. ચાયને હોપ ડિનેલાય હિરાએ વટે વેઆ તડેં પગવેં થયો રથ્યા. કરેને ચુણું લગ્ની હી કાંની પગે થ્યો. પગતે થયો રથ્યાને કુસકે કુસકે રુહી થ્યો. હિરાએ નીચે પથિક-હીપોટસ્વાંક]

पट्टे विठा ने रस्ते के माझे करायल डेसिस क्या, भवतासे भनायां।

दुंगारी सुनोने रवज्ञभाज अभ युक्ती वधा आरो अयीने न्यायी त रस्ते अने हिरआई वडे विठा अंधे।

रवज्ञभाज डोरा धान व्यो ती दुंधे दुंधे चोख वडो : 'युवा हाहिल, काका ! आउ विन्यातो। दाढ़े आड़े हेरान नंधे करियां।'

'तु' हित वाने, रस्ते ?'

'जिज्ञामां ! मुंगु हिकर म फल ! धरतु आर त सजु धुनियां आक्षी पर आय. भरमे रेवारे-के जगे सोडी पे ती ?'

'रस्ते ! तु' नाराज थड्हने विन्येतो ?' पुत्र धंकर चो.

'ना, ला ! आउ नाराज कैसे थिया ? नाराज लारेलाय विन्यातो. आँडे असर नाय, असाने पछु धर वो, अंगलो वो, ते ते मेट्टुं वधाउं. लाट लडेजलती हुई. मां-पे छुवा, ला-मेथ वा, धुनियांमे अज आँडे लेक्को अंधायां, लाढे त्रैय पछ यें नाय. न त त धर ये आय, त धरवारा यां; न आ, न पे, न ला-लेशु ! मुंगले दुरो न वो धुनियांमे ? पछ अज छीये नाय. ती खस्ती आय ने भय आसमान आय. ईतरो खस आय. दही छही याही वेंधेतो त धरताए भोरेमे भयो रणी करने गोठेवां मिलधो. आकासने अतर आय.'

'...धर छडेने दुख नाज्ञातो. मुं थडी अज्जे धर दुखी न थिये, अस ह ज यादियातो. आउ वंधास ने भिडे सुणी थडी वेंधा. काका परेसान विन्येतो...'

'जिधुगीमे धर लनाय संगधास फल से लाचान लायेतो. मुं थडी डायने धर असांट थिये से मुडे अंजूर नाय...'

'वेपार होला धुनियां पर आय, पछ हिते वेपार लेरो सहारो. जिलधो, मां-पेणे व्यो; मिलधो से मुं धारी वो...'

'पट्टासा त हथले भेव आय. आँधे पट्टेलु चिंधा म फल. दिन धरमे आउ भिरबत जमे अंधायां. मुं लुको शों क्षेया आय से दिन धर्ण धुशीदाय क्षेया आय...'

रस्तेल गाल चूणी गेवां ती रवज्ञभा झों ओह्या न. धारी धारीने अनडे नेरेला लगा रस्ते पर रवज्ञभा सामु न्यारी यें...

रवज्ञभा दुरो करियेता अनलु आतुरता मिश्निने भो भये डिस्की वा.

दुरो दुरो रवज्ञभा व्यो : 'येया रस्ते ! तु' क्ये आय एरो ता 'डाल न करे' सो. भावाईमे मुंगु हितरी चांवत ता सो. पुत्र पछ नाय रभें, तोलु चांवतसे ज आधाहमे नु उमोने यो. अंधायां... योय हिरआई डोरा नेरी जिलाने व्यो : 'दाढ़े ताङे हिते प विन्येषु नाय. अनव्या तु असा लेरो ज रेन.' धारो अंधे करने रस्तेल लारी भयानु पायियो अथुने रस्तेल धुकानते भंड्यां.

हिरआई अधियुं द्वाडीने रवज्ञभा दुरो न्यारी व्यो. रस्तेले हियो भसाम आयो. ई रवज्ञभा-ले पड़ेमे नभी यो ती रवज्ञभा. रस्ते के हियेसे लगायें. हिरआई. अधियेमे मुश्तीज असुउ वा.

हिकडी पल...अन हिकडी पलमे सले, तानावरण अयपुशाल थने व्यो.
दृ व्यापमन वाडी, जग्गुयोड, वेवतमाल-४४५००१

३६]

१६८६/ओ१३०.-नवे.

[पथिक-वीथोत्सवां]

સુદેહ

શ્રી જ્યાંતકુમાર મા. વ્યાસ

ગોપાલદાસ અંગલાના કૃપાઉન્ડમા આંટા મારી રલા હતા. એમના ભાઈ નાતુભાઈ તથા કુલેન કંકુલેન અને એમના વચ્ચે મનેળ નહોતા. વરસો વીતી ગયાં હતાં છતાં એમની કુલંખ જીવાં ને જીવાં હતાં અને સારે માટે પ્રચંગે પણ બેગાં થતાં નહોતા. આપા સુતુ પામ્યા તાર બાદ ગોપાલદાસે બધી જમીન રાણી લીધી હતી, નાતુભાઈએ જીવનનું મોહું મહાન અને દુષ્ટન રાણી લીધી હતી, જ્યારે કંકુલેન એમના પોતાના લાગ માટે કોઈ ચંદ્રાં હતી.

ગોપાલદાસના પત્ની સરજાના થથાં સમજુ અને ધાર્મિક વૃત્તિના હતાં. એમને કુલંખમા કલેશ થયો હતો એ કરા પણ ગમતી વાત નહોતી, એમો ગોપાલદાસને રોજ સરળવતાં : “હું તો તમે અંને ભાઈ પૈસેટે થથાં જ સુખી છો. હવે તો આ કુસંપ કાડો અને હળામળાને રહેણ. આપણે થથાં સાથે લઈ શું જવાનાં છીએ?”

આ છેલ્દું વાક્ય ગોપાલદાસના મગજમાં જિતરી ગયું. એમને પણ સરજાના વાત સાચી અને અર્થવાળી લાગી : “પેસાના લોકમાં મને આ વાત આટલા હિવસ ન સમજાઈ એ. અહું એહાં થયું. યાદે, નગ્યા ત્યાંથી સવાર.” એમ વિચારી એમના કુલંખના ગોર ગણ્યપતભાઈને મોક્ષાન્યા અને એમને સુદેહનું કામ સાંચ્યું.

ગોપાલદાસ આટાડો મારી રલા હતા ત્યાં જ ગાડીને અવાજ આવ્યો અને એમાંથી નાતુભાઈ અને ગણ્યપતભાઈ જિતયો. થોડી જ વરમાં રિહસા આવી એમાંથી કંકુલેન જિતયા.

“ગોપાલભાઈ! જુઓ, આ તમારા કલા પ્રમાણે અવાને એકાંકી લાગ્યો શું. હવે હું જાહેર.” કંકી ગણ્યપતભાઈને જિતય લીધી. એવામાં સરજાના પણ ગઠાર આવી પહોંચ્યા. એમો જલદી જલદી દરવાળ આગળ ગયાં અને કંકુલેનનો હાથ આવી એમને વરમાં લઈ ગયાં. ગોપાલદાસે પણ નાતુભાઈના ખલે હાથ મુક્યો અને અંને જણ સાથે જ વરમાં પ્રવેશ્યા.

થથા વખતથી નાતુભાઈ અને કંકુલેનની છદ્યમાં થતું જ કે ‘આમારા કુલંખની જલ્દી મનમેળ થઈ જય તો સાચું. કુસંપથી કોઈને લાભ થતો નથી. જીવદુંદું, લોકો વાત કરતો હોય છે એ જુદું?’ એટલે જેવે ગોપાલદાસનો મહેશો લઈને ગણ્યપતભાઈ આવ્યા કે તરત જ આનંદની વગર નાતુભાઈ અને કંકુલેન ગોપાલદાસને “ત્યાં જવા તૈયાર થઈ ગયાં હતાં.

“હાશ!” કરીને ગોપાલદાસ નાતુભાઈની જોડે જ એકો સરજાના કંકુલેનને પોતાની જોડે બેસાંયા. ગોપાલદાસનો પુન ડેન અભેરિક્યા થોડા હિવસ પર જ આવ્યો. હતા. નથી એ હેઠલટની મોરી તિંની લઈને આંણો હતો. એ અહીં પરખાના આંણો હતો. અને સરી છાડીની શાખમાં હતો.

સરજાના જાહ્યા, વરમાં લઈ ગોળ લઈ આવ્યો અને દરેકનું મોહું કરાયું. બણ્ણાં વરસે બધી ભેગો થયેલો! દરેકની આંખમાં હર્ષનાં આંસુ હતાં, નિંદા કરી હતી જેણાં આંસુ હતી અને આસ તો દરેક જથે પોતાની જુહને કારણે એક થનામાં આટલાં બધીં વરેણી અફારણ હિલંખ કર્યો હતો એ પથીનાં આંસુ હતી. ડેન જરૂરીને પાણી લઈ આવ્યો. અને બધાને આપણું.

બધાં શાન્તિથી થોડો વખત બેઠો એટલે ગોપાલદાસે વાત છેરી : “જુઓ, નાતુભાઈ અને કંકુલેન! આપણે પ્રશ્નકૃતાથી થથાં વરો પાછાં લેંગાં થથાં એ થથાં આનંદની વાત છે. આપણે સંરક્ષાર જગી જિક્યા એ આપણું જીનનું ભાવિ બતાવે છે. આ ભેગાં થથાં એનો બધી જણ તમારે તમાર્ઝ ભાગીને પથિક-દીપોત્સવાંક]

૧૯૮૬/એકોડો-નવે.

[૩૭

आपवानो छे, मने नहि. सरजबाना ऐक ४ वाह्ये—‘आपसु बधां साथे लहुं ज्वानी छिए ?’—मारे अद्य अभ भाँगी नाखो, छुट आगाणी नाभी अने अधाने भेगां क्याँ. आ अनमेण आपसां भाँथा हैंडके शपही बे थशे अने कुहुं अ पथ नेत्रज्ञेतामां बधारे आगण आवरो. मारे ऐपूर्वक हडेवातुं छे के आपा गुजरी जया तारे जेमनी भिक्षकतनी वडेंचण्ठी थहुं शक्ता नहोती तेथी आपसु नव्होने नमांदुप बहुं हतुं अने आपसु सांबंध पथ तेथी क्षार्ह गये हुतो. हवे जेनी गेअ वडेंचण्ठी बशे अने आँठेने अन्याय नहि थाय. आपसांमाना देवके ऐक्षमीजांनी ज्वर पउवानी छे; लेमडे भारी पुत्र हैतन परखुवा भाटे अडीं आवो. छे तेने भाटे सारी छाकडीनी ज्वर छे. मारे तो आजना जुवानवर्ग नेउ भास आणाभाष्य छे नहि एटले हडे छाकडी सारी डोरे अने भने अपर नहि पडे, भाटे भारे, नानुभार्ह ! तमारी पुत्री इपांनी महद देवी पडेश. आवी अधी मुखडेली भारे छे.”

जोपालदासे वात पूरी की एटले नानुभार्हे तरत वात शह छही : “जुओ, मेटा लाई ! नेम तमारे मुखडेली छे तेम भारे पछु भारी मुखडेली छे. इपां अेझ.भी.भा.अ.स. तो थहुं गर्ह, पछु हवे अने ‘भेटनियी हेम’ काढवा भेडुं महान बांधुं छे तेथी भारी रक्षमनी ज्वर पडेश तेथा इपां भाट सारा डॉक्टर छाकडी शाहुं छुं. आ कामभारी भारे डेतननी महदनी ज्वर पडेश. आ भारी मुखडेली छे.”

पछी तरत जे कुहुंहेने वात शह छही : “अल्या भाँठेओ ! भाउं तो सांभेगे. आ भारी जितु छे ते क्या वर्षी आरसुं धीराष्य पास करशे पडी अने अनिनियर थयुं छे. ए भाटे पैसा क्यांथी छाढवा ? हैंडे उपाय अतावो, वणी भारी पुत्री रमा छे तेने दीझा. थयो छे. अने हवे अपरेशन हृशववातुं छे. अने वर तो अने वरसे जे गुजरी गये एटले हवे भारे आ आपरेशनना पैसा क्यांथी द्वाववा ? लाई ! हैंडे क्षेत्रे.”

अधाने एक्षभीलांनी मुखडेली सांभेगी विचारना भांधुं. थेडी वार पछी जोपालदासे वात शह छही : “जुओ, आपसु बधां हैंडिली-इन्ड बिजुं करीओ. जेना व्याजभांथी आपसु कुहुं बना सव्वोने हैंडे प्रकाशनी महद अपरो, जेनी के लखुनर भाटे, भांडी भाटे, धेंधे शह करवा भाटे वगेर. जेने भाटे हुं भारा तरथी ए लाख इपिवानो द्वागे. आपुं छुं अने ज्वर पडेश भील एक लाख पथ आपीक्षा.”

पछी नानुभार्हे आगण चक्राद्यु : “जुओ, भारा तरथी एक लाख इपिवानो द्वागे आपीक्षा.”

पछी हैंडुंहेने पथ भेदावा : “जुओ, लाई ! हुं तो प्रायमिक शाणानी शिक्षिका छुं. भाउं गुजरान हुं मुखडेलीयी व्यापातुं छुं. भारा पति तो हेक्काये वरसधी हेवलोक पाम्या छे. हुं हैंडे एक रीते हृदुंभाना सभ्योने महद हैंडी शक्ती. जे आणडोनो अल्यास कांडो हाय तेग्ने भारी पासे लक्ष्या भेक्षणे. आ रीते हुं पथ महद करीशा.”

बधाने आ हैंडिली-इन्डनी वात अत्यंत गर्ही गर्ह, अधी वात शांतिथी अने आनंद्या पती गर्ह एटले सूरजभाने दैन छरीने नानुभार्ह तथा हैंडुंहेनां डेहुंभाना अधाने एमने वेर जमवा भाटे भेक्षणी लाधा. अधाने अच्युतक आवेक्षा नेस्ने नानुभार्ह अने हैंडुंहेने पथ अच्युतमां पडी गया. इपां तरत जे जेली छही : “पृथा ! सूरजभाने दैन आण्यो हुतो तेथी हुं आण्यो छुं.” जितुओ पथ हैंडुंहेनने वात हैंडी.

बोधुं हैंडुं अ साथे जमवा भेहुं हतुं. सूरजभा अधाने आपह भी त्रिने पीरसतां हतो. हैंडे असु आनंदमां हतुं. इपां जेनी सभी दो. डेतांडीने पथ जेनी साथे लावी हती अने आलाडी फ्रान अने डेतननी नेउ जमवा भेसारी हली. इपां पथ डेतननी भील बाणु जमवा भेडी हती अने डेतनना डानगो डेतडी विशे गुच्छुल हरी रडी हली. डेतन थेडी वेडी वारे भारी आपेक्षडीने

[अनुसंधान पा. ११ नीचे]

‘भूत्र’

श्री. कासम ज० अ०

बारहुं भूत्यु. पोताने लेता बैंत ०८ प्रकाशतुं चडेहुं धागतुं हतुं ते मौं भवहुं लक्ष्मी निगरने भसान चहेतो पथु सहेज भरक्को.

‘अरे विजग !’

सिंहत वेरता निगरे हुकारमां गरहन लक्ष्मी अने पछी वरमां दिट्ठि देखता भोल्यो : ‘हेम डाइ देखाहुं नथी ?’

‘आठ दिनेभु आदशाही मिली हैँ ?’

‘ओम ?’

‘हा, हुं आले सवारथा तने पाद करतो होतो.’

‘डम ? डाई आस कारण ?’

‘ना, अभरतो...पथु तुं आव्यो ए गम्यु ?’

‘मन भूजाहुं हतुं अटके थयुं ड...’

‘ना, ना, भरोपर छे. निगता डोने कहे ? हुं पथु भोर थर्क गयो होतो, तुं ऐस, हुं कमल्लां ०८ आवुं छुं, पथु ढेर तपियत डेम छे तारी ?’

‘ऐम दिट्ठि नक्कि हाट्या दहि...वसा वावटा फरकाववाना छे बल तो.’

निगरतुं आप बाहेतो होय ऐम प्रकाश अने ताकी रहेती भोल्यो : ‘सरस...चुं काई नवुं लभायुं छे कै ?’

‘ते काई लभ्युं ?’

‘अमारुं तो समज्या हो, पहेला पत्रकर ने पछी कवि, जमे त्यारे जमे तेतुं लभी नाभीज्ञ, पथु तुं रजेगथी कवि, तने लभ्या वगर थेन न पडे. हुं तने ज्ञायुं ने ?’

निगर भवकारी भोल्यो : ‘तुं तौयार थर्क ल, लभ्य-यार गजव लभाई छे. हुं ऐके छुं ?’

‘अम बडी ०८ आव्यो, ए-यार लोटा रहिने...’ छहेतो, अपी वगाउतो प्रकाश दुवाल लाये अथष्म लभी सरकी गयो.

निगर आटे धर अलापयुं नथी. ऐक्के टेमल पर पठेलां पुरतक जेवा भाऊर्या, धानां देसवा मांडां, तां ओक्के काऊस-अहमा गडी वगेतो कागण जेयो. कुदूखल थां ऐक्के कागण जेहायो, पल्ल लभायना शीर्षक पर अनी नजर चेहरी गई. ए अमक्को, ऐक्के वांचयुं दर कर्तुं. वांचतो गयो तेम तेम गोस-येमरमां पुरायो. होय ऐतुं अनुभवाहुं गयुं. बधकारा वर्ती गया. लभालु पूर्तुं करता तो जाहुं हाङ्की गयो। आंत वावटावरण तगाएर लभ्युं, पेटमां कंडीक यमराहुं लभ्युं. कागण पूर्ववत् भूमी पुरतक वयारथो भड्की दियुं. आर्हां रहेहुं तकलीकृप सागतां, क्षणानो परसेवो लूछतो, इधातो ए धर अहार नीक्को त्यां ०८—

‘हेम, क्यां चाल्यो ?’

‘अस्तीयां पथु भूजारो थाय छे, हुं जर्दाश ?’

‘जेहामेह ?’

‘हा.’

[अवुस्थान पा. ४२ तीये]

परिष्ठ-हीप्रैसवांड]

१६८६/योहोटी.-नवे,

[३६]

આત્મનાદ

શ્રી. ચિન્મય પટેલ

શરણાકૃતો ગૂંજુ જીદી. ઢેલ ટઘૂકચા. સોણ થણુગાર સજુને આવેલી જામની સનારીઓના કંડોમાંથી સુરૈની સરવાણીઓના જરા હૃદચા. જાણુંકે આખ્રમાંજરીની મહેંકદી એક સાથે કોકિલાઓ દટુકી જીદી. ૨ાંગેરંગી વલ્લો સજુને મહાલવા નાકળેવી ગીતદેવીઓના રાગમા ભતુરપ વ્યાપી ગઈ.

આજે એમની વધાલસોઈ સખી અંજલિનાં લગ્ન હતાં. ગીતની રમજટ ન લગાવે તો સખીઓ શાની? જમનાર્દી આધુંપાછું હોય તો ચાલે, પણ બનણીતોમાં કંઈક જીણ્યપ રહી જાય એ ન ચાલે. ઉત્સાહકર્યા અનેરા જાનંદાંના નાચતી-કૂદાણી આ સખીઓને નિહાળાને તો ઘડીભર એવું લાગતું હતું, જાણુંકે એમની પોતાનાં લગ્ન ન થઈ રહ્યા હોય!

આધવળુને અંજલિ એક દીકરી હતી. ચાળાસ વર્ષની વરે પહોંચયા છતાં આધવળું અંગાધું સતું જ હતું. ફેલવાં છે કે ઈશ્વરના દરરાજમાં દેર છે, પણ અંધુર નથી. આધવળ સ્વામી ઇયાનંદ સરવરતીનાં લખાણેના પરિચયમાં આવ્યા અને એમના જીવનનાં નનો દીપક પ્રગટનો. શાયો-મંત્રના સતત જ્યપ એમણે અને શારદાપહેને આરંભ્યા. પરિતાળાસ વર્ષની વરે પહોંચતી પહોંચતાં તો એમની પત્ની શારદાઘડેને અંજલિને જન્મ આપ્યો.

પતિ-પત્ની અંને પરોપદ્ધતી હતી. જામની સૌ કાંઈ એમના પ્રત્યે મેમતા રાખતાં. અંજલિ પણ આખા જામની દીકરી હોય એમ બરેદર જેના સુધે સુધી અને જેના દુઃખે દુઃખી થતું. અંજલિ જામની પ્રેરક વ્યક્તિનો પ્રાણું બની ગઈ હતી. એટલે જામનાં ત્રી-પુરુષો પોતાની દીકરીનાં લગ્ન હતી હોય એમ મહાકાર્તા હતાં.

સુખીઓ. અંજલિને હેઠાં હેઠાં શુદ્ધાગીરી રહી હતી. જામના સંજ્ઞનોને સારી જેવી રકમ એકન્તિત કરીને અંજલિ માટે તેલા સોનાનાં વરેણ્યા અને ડેટાંથી ચુંદર વલ આપ્યાં હતાં. અંજલિના શરીર ઉપર ફાગના અને વલ્લો સખીઓએ ચ્યાણ્યાં જેના પ્રેમના ભારથી એ દ્વારા કાંઈ ગઈ. જેની આંખો દર્ખનાં આસુધા છલકાઈ જીદી. વડીલીનું વાતસદ્ય અને સખીઓના પ્રેમયા એ ધન્ય બની ગઈ.

લગ્ન-મૂહૂર્ત મંડાયું. આસોપાલવનાં તોરણે માટેદોસેલી રહ્યો હતો. ઇલેના ફેરમ પ્રસરી રહી હતી. જોર મહારાજનો હુકારો થયો એટલે વરકાયા આવ્યા અને આજુ ઉપર જોટાયાં. ચારે આજુ આનંદના સાગર લહેરાઈ જિયો. એટલાં એક આશુસ વરદેણના પિતા હનુમાનલાઈને માંયેથી દૂર કાંઈ ગયો. એણે શુસ્પુષ્ટ કરી.

જોર મહારાજ વર-કન્યાના હાથ પહડીને હસ્તમેળાય કરાવવા માટે એકમાનંતા ઉપર જોધવા જાય છે ત્થી પૂવાંકુંદાં થેથા હનુમાનાસી આધ્યા અને અરારી જીથા : ‘જીજાં હે, જોર મહારાજ!?’ અને પોતાના પુત્રનો હાથ એમણે પડીને પાછો એંચો જીદી અને કણ્ણું :

‘મહારાજ! આ કન્યા સાથે મારા દીકરાનાં લગ્ન નહિ થાય.’ આ શરૂદી સાંભળતાં જ માંદારામાં સાંખ્યા પડી ગયો. ગીતો થબી ગયાં. એણો આગળ જોદ્યા : ‘ચાલો, આધવળ! બરમાં મારે તમારી સાથે વાત કરવી છે!'

અને હનુમાનલાઈ આધવળની સાથે બરના એરાયામાં ગયા. જાણીયો. અને આખજનોને કંઈ સમજાયું નહિ અને વરસાન પોતે પણ ગૂંઘવાઈ કરીને જીડા વિચારમાં ઝૂણી ગયા. બરમાં આધવળ કરબી રહ્યા હતાં.

'હનુમાનલાઈ ! મારી આખર રાખેનું તમને અત્યારે આ સત્તું ?' એધવજુએ ભાવેથી પાબી ડારારીને હનુમાનલાઈના પગમાં મુક્કી દીધી.

'જુઓ, એધવજુ ! તમે મને છેતરો છે, મારા દીકરાની કિંદળી સાથે તમે રમત આદી છે. આ લગ્ન કોઈ સંતોશમાં થઈ શકે એમ નથી.' હનુમાનલાઈએ ગોતાનો આખરી નિર્ણય સંભાળવી દીધી.
'પણ.....'

'પણ ને અણ, મને તમારી મુંગી દીકરી સાથે મારા લોકરાનાં લગ્ન કરવાં નથી. હનુમાનલાઈએ વસ્તરદ્વારા કર્યો અને એધવજુ કંઈ પણ કહે એ પહેલાં આરામાંથી અહાર નીકળી ગયા. એધવજુ પણ એમની પાછળ દોડ્યા.

અંજલિ જ-ની ત્યારે જ્ઞાન મળનું કાલું કાલું મોલીને આનંદ આપતી હતી, પરંતુ જ્યારે એ પાંચેક વર્ષના થઈ હતી ત્યારે બરમા જોક્કી હતી અને પહેલાંના વરની આગ લોઈને ભયથી ચીસ પાડી જીવી હતી. એ ચીસ આખરી અની ગઈ હતી. એકના એક દીકરી માટે એધવજુએ બધ્યા દેશ-ધારા કરાવ્યા, પણ એ ગોલતી ન થઈ. ટેટ્વીથ માનતાઓ માની, પણ વેર નિરાશા સિચાય કંઈ જ ન મળ્યું. મોટા મોટા દક્કાને પારે અંજલિને વિશ પ્રયા, પણ તમામ દક્કાને અભિપ્રાય આપી દીધોલો :

'એધવજુ ! તમારા વાતસલ્યને સમજુએ કીએ, પરંતુ અંજલિને ગોલતી કરવાના કંઈ જ ઉપાય અમને છાય લાગતા નથી.'

હિસેસે અંજલિ વર્ષો અનાં ગઈ. એના શરીર ઉપર ઇપે વેરો બાદદો. એક ચારી સંસ્કારાંસ ભાષ્યને એણું પહીંણે પહીંણે પાડી પ્રાપ્ત કરી. આર ગાઉ દરને એના જેણી ઇચ્છાની અને શાખું છોક્કી નજરે પડતી ન હતી. એ પિચારીને માત્ર એક જ પોડા હતી વાચાની. બરકામ અને બ્યવહારમાં કાશેલ અનેલી દીકરી માટે એધવજુને કોડ જગ્યા અને અંજલિને સારે વેર વળાવવા દુરતિયાની રોક આરંભી રીથિ, સરળ, વિવેકા અને દેશઅકિતનાં સાંખુંનાં સેવતો હનુમાનલાઈના પ્રાણુસુખ એમને ગમી ગયો. પ્રાણુસુખે અંજલિને જોઈ લાદી અને લગ્ન માટે હા ભાષ્ય દીધી.

અટ્યારે પિતાએ લગ્ન અટકાઓયું એ પ્રાણુસુખને ન સમજાયું, ન ગમયું, એરામાંથી ઉદ્કોરાઈને આવેલા પિતાએ કહ્યું :

'બેદા ! પ્રાણુસુખ ! હું અંજલિને જોવા આચોયો ત્યારે એની સાથે વાતચીત કરી હતી ?'

'ના, પિતાજ ! પણ એરા બ્યવહાર અચળતા હોશિયારી અને એનું સૌનંદર્ય જોઈને હું જિતાઈ રહ્યો હોલો. મને અંજલિ મૂળ જ ગમી ગઈ,' પણ અટ્યારે પાત શી છે ?' પ્રાણુસુખે અંજલિ તરફે નિહાળાને પિતાને પ્રશ્ન પૂછ્યા.

[અનુસંધાન પા. ૩૮ થા.]

નોઈ કેતો હતો.' ડેવડ માંદ હસતી હતી. ઇપણે સુરજભાને કાનમાં કંઈ વાત કરી. ધીમેથા રૂણે મેળતા એ કુક્કા કરો એક એક કુક્કડો કેનન અને કેનડોના સુખમાં મુક્કી દીધી. આ જોઈ અથાં હસવા લાગ્યા. ડેવડો શરમથી નીચું જોઈ ગઈ.

ક્રેસ્ટ પર દ્રોધિયા કંદુણા ગાયક સાયગલટું ગીત વાગી રહ્યું હતું :

'મનકે જૈરોડો મોહસે બદલો, હું ખાલી સુખ મન જાઓ.'

૩. એક૪/૪, શાની સોસાયટી, ચુલુવાઈ ટેરો, અમદાવાદ-૩૮૦૦૧૫

પથીઝ-દીપોત્સવાંઃ]

૧૯૮૬/એક૪ટો.-નાને.

[૪૧

‘આણસુખ ! એટા ! તં મેરી જીવ કરી છે. અંજલિને તં પસંદ કરી છે, પરંતુ એ તો બાળપણથી ભૂગી છે.’

પિતાની વાત સાંકળાને પ્રાણસુખને એ ધડી તો તમને આવી જ્યાં અને એ નીચે પછાણ એ પહેલાં હતુમાનભાઈએ એને આથમાં ઝડીં લીધો. આ અધું જેહને જનૈયા પણ આથર્વાં સુકાઈ રયા.

થોડી વારમાં જ પ્રાણસુખ સ્વરૂપ થઈ ગયો. થોડો વિચાર કરીને નિર્ણય કરી પિતાને કહ્યું :

‘પિતાજી ! જમે તે હોય, પણ હું એને મારી ધર્મપત્ની માની જ ચુક્કો છું, એટથે હવે તો એની સાથે પરણે જ છુટકડો.’

‘નહિ, આણસુખ ! એ કરુણજ અની એક એમ નથી. હું તારી જિંદગી અને મારા ધરનો મોઢો અગાઉવા માગતો નથી. સાથે, અથવા જનૈયા બિલા થઈ જાયો. જન અત્યારે જ પાછી જરૂરી હતુમાનભાઈએ પોતાને આખરી નિર્ણય જણાવી હીધો.’

અરમાનોનાં તોરણું લાઘીને આશાના દીપ પ્રગતાની ચૂકેવા. જોધવજનો મહરજાકંદ્રાનો મહેલ દરી પડ્યો. વહાવસોઈ પુત્રીના ભાવિનો અધ્યક્ષ અને એની કદ્યનાનો આધાત ગે સહન કરી શક્યા નહિ.

‘એટા ! અંજલિ !’ કહેનાની સાથે જ એ ત્યાં પટકાઈ પડ્યા અને એમની આંદોલાને માટે પહોળા થઈ ગઈ.

અંજલિએ પિતાના આર્તનાહને ઓળખ્યો. એના રોમેરોમ જીવાં થઈ ગયાં. આતીસ વર્ષ સુધી પિતાના સ્નેહનો અમીરસ પ્રીતે ઉછેરબી એ એકદમ આજાઈ ઉપરથી જીવી થઈ ગઈ. પિતાની આંદોલાને એ પિતાના શરીર ઉપર પટકાઈ અને ત્યાં જ એના મેમાંથી આર્તનાહની એક જાયનક ચીસ નીકળી પડી ; ‘પિતાજી !’

પરંતુ માત્ર ઓધનજ પુત્રીના એ અવાજને સાંકળી ન શક્યા.

ફરીથી શરખ્યાઈ ગૂંજ જીદી...પી...પી...પી...

૬. ૫૪૮, જયંત પાર્ક, મેમનગર, કષ્ણાવતી-૩૮૦૦૫૨

[અનુસંધાન પા. ૩૬ થી ચાહુ]

‘થોડી વાર મેસને, હું રોયાર...’

‘ના, યાર ! પીછુ વખત અવાજે તો આવીશ.’

‘હું નહિ સુધરે.’

જિગર પરાણે દસતો હોય એમ નહિ જેવું હાસ્ય દેરી તાંથી નીકળી ગવે.

જડપથી વેર પહોંચી જવા ઠચુતો હોય એમ એ ઉતાવળો ઉતાવળો ચાલતો હોનો. મગજની નસી તલ્લાતી લાગતી હની, એજે વાચેચા લખાણુનો એક અદ્ધર જાણે ડામ હેઠા હોય એવી વેહના એ અનુભવી રહ્યો હોય અને અંજલિદ્ય એ લેખતું શીર્ષક ‘કુમાર ચન્દ્ર-વિજેતા કવિ જિગરનું અક્ષળે અવસાન !’ એને ચારે તરફથી બીંસાતું લાગતું હતું.

૬. આર્દ્દસ-કોમર્સ ફોલેઝ, એયાધા-૩૮૦૨૫૪ (જી. સાગરકાડા)

૪૨]

૧૯૮૬/ઓક્ટો-નવે.

[પણિક-નીચોત્સવાંઃ]

ગ્રીબ કિનારે

શ્રી દ્વાર્ષિક દ્વે, 'દીપ'

પથિક-નિવાસના નાનકડા અગ્રીયામાં ભાધાનાં આજોં આજોં ડિરખુ ચોગેર પોતાનું રિમત પ્રગટાવી રહ્યા હતાં... સુર્ય પણ ઝડપથી ક્ષિતિજ તરફ ખસી રહ્યો હતો... એ રીકે ક્ષણેઓના જ સુર્ય કયાંક અદરથી થઈ ગયો અને અંદરકારે પોતાનું 'પોત પ્રકાશવા માંગ્યું, મલક મલક કરતા તારલાગોએ અનુભની જોહિ આરંભી હતી. અવામાં જ એક તારથો જેના પ્રિયજોનો સાથ છોડીને અર્થો જીવન તરફે... એ અરતા તારલા તરફ મનોજની મીઠ અંધાઈ હતી. એની જીવી આપો તારલાની ગતિને માપી રહી હતી. એનું મરતક એની પ્રેમિકા રિમતાના જોગામાં હતું. રિમતાની ડેઢળ આગમાંનો મનોજનના વાગમાં પ્રેમથી હરી રહી હતી. મૌનનું સાંભાળ્ય હતું. આપરે રિમતાને મૌનસનાથિ તોડી...

રિમતાએ જેના પાલવથી મનોજની આંસુ લુછતાં લુછતાં હતું; "મનોજ! આમ કથાંસુર્યી રહ્યા કરીશ! જો, રહી રહીને આ હાસ્ત કરી છે તારી! તારા હૃદયમાં જે ગમ હોય તે તું મને કહે. શું તું મને પ્રેમ નથી કર્યો?"

રિમતાની આંસોમાં આંખ પરોવિને મનોજે જવાબ આપ્યો:

"રિમતા! તેં જ તો મને પ્રેમની વ્યાપ્તા શિખવાની છે."

"તો પછી તું મને કહે... તારા મુખ પરની આ ઉદાસી મારાથી હવે સહન નથી થતી."

"રિમતા! મારું હુઃઅ મને જ જળી જવા દે. મારું હુઃઅ સાંભળીને તું તારાં મૂલ્યવાન અશ્વુંએનો જોગ આપ એ મને મંજૂર નથી."

"જો તારું હુઃઅ વહેંચી શકું તો એ હું મારું સૌભાગ્ય... જે વાત હોય તે મને કહે, તારા હૃદયનો બોજ હલકો થઈ જશે. જો, હવે તને મારા સમ છે."

"તું એહું જુદ કરે છે તો કંઈ કું કું ... કે મારી જેરહાજરીમાં તું...તું રહેવા દે, સાંભળીને તને હુઃઅ થશો." મનોજે એણામાં પરાયું ફેરફારું કર્યું.

"જો, મનોજ! મેં તને મારા સમ આપ્યા છે. વાતને છાડ કરી છે તો હવે કહી જ નાખ..." રિમતાની આંસોમાથી ઉત્સુકતા હલકતી હતી.

"હા, પણ જો, રિમતા! મારી વાત સાંભળીને તું એવે ન સમજાની કે મને તારા પણ રિધામ નથી. મને તારા પર અસૂટ વિશ્વાસ છે, પરંતુ મેં સાંભળ્યું છું કે મારી જેરહાજરીમાં તું... કોઈ અન્ય પુરુણે મળવા જાય છે શું આ સર્વી જાત? સમાજ તારા તરફ આંગણી ચીધે છે એ મારાથી સહન નથી થતું. મને અખર છે કે તું ગંગાજળની જેમ... પરંતુ કચારેક મને જાગ્રે એવું લાગે છે કે તને મારી પણેથી ડાઈ છીની રહ્યું છે... અને હું તને જોગા નથી માગ્યો તેવી જ..."

રિમતાની આંખમાંથી ટાકડાં અશુ મનોજના ગાંધ પર જઈને પણ્યાં અને એ અશુએને મનોજના થાગ્યાને રોકાણ. પણી રિમતાનું હતું: "મનોજ! આ જ વાત તે મને હક્કી કહી હોત; તારી મારા પર સંપૂર્ણ હક છે."

"રિમતા! હું તને પ્રેમ કરું છું તેવી જ તને મારા અધિકારીમાં જકડવા નથી માગતો."

પથિક-દીપિત્તસંવાદ]

૧૬૮૬/ઓફાઈટ.-નવે.

[૪૩]

“ મનોજ ! હું તતે આ વાત કહેવાની જ હતી, પરંતુ મનની ગ્રંથવાળી વચ્ચે એ વાત મનમાં જ રહી ગઈ. એ સત્ય છે કે હું એક પુરુષને મળવા જાઈ છું, પરંતુ... કહે તારી આપ્યો પરથી આ રહણનો પડ્યો હતી જરૂર. સમાજની આંખોમાં તો આપણે કદપૂતીના રમકણ છીએ અને એની આંખોને તો ઇકત્ત તમારો જેવાની જ ચ્યાસ છે, પરંતુ આપણે એ સમાજનો લોગ નહિ અનીએ, કારણ ક આપણે બંને જેક્ષણને એમ કરીએ છીએ, અનહંડ ...”

સિવિલ હોસ્પિટલ પાસે આવીને એક ગોટા રિક્સા બેની રહી. મનોજ અને સિમતા જેમાંથી જીતપણી. સિમતાના કદમ જ્યાપને હોસ્પિટલ તરફ પડતા હતા અને મનોજ એની પાછળ તથાતો જતો હતો. હોસ્પિટલના દાદરા ચડતાં ચઢતાં મનોજે પૂછ્યું :

“ સિમતા ! તું મને આ હોસ્પિટલમાં ડેમ... ચું એ અહીં વાંનો ટોકટર છે ?”

“ તું પહેલાં ઉપર તો ચાલ, તતે એની પણ ખ્યાર પડી જરૂર.”

સિમતા હોસ્પિટલના એક વોર્ડ પાસે આવીને જીલી રહી. ધીરે રહીને ઇમતું ભારણું જોદ્યું. આટલાની કોઈ દર્દી સુદેલો હતો. મનોજ અને આંશ્રયથી જોઈ રહ્યો. સિમતા મનોજને એના પદંગ પાસે વાઈ આવી. સિમતાના કદમોનો આહાર થતો જ એ હરદીએ આંખો ખેલા. એની આંખોમાં આંખું હતો. પીઠ પાછળ તહિયો મૂકીને એ ધીરે રહીને એકો થોડો અને પણી સિમતાનો હાથ ગોતાના હાથમાં લઈને કહ્યું : “ સિમતાખણેન ! તમે આવી ગયા ? હું કચારનો તમારી જ રાહ જોતો હતો. હવે તો હું શાર્તિયી મરી શક્યાંથી.”

“ દીપક ! એવું ન ખોલ, મારા આઈ ! જે, મારી સાથે ક૊ણ આવ્યું છે જે જે, આ મનોજ ... અને... મનોજ ! જે આ દીપક, મારૈ ખર્ચની આઈ, જનમ્યી જ એ અનાય છે અને ... અને કેન્સરનો દરરી ! ખોલતાં ખોલતાં સિમતાનો અધાર જીનો થઈ જરૂર. સિમતાના આંસું જોઈની, દીપક કહ્યું : “ સિમતા ! બહેન ! મારા રોગ પર તમે આંસું ન વેદ્ધશો. આ રોગ જ એવા છે તો ! કેન્સર એટથે કેન્સરથી, અનુંને, મનોજબાઈ ! ”

“ ના, ના, દીપક ! તતે સાટું થઈ જરૂર. ” મનોજે આશાસન આપત્તા કહ્યું. પણ દીપકે પોતાના રોગ પર હક્કાતો હક્કાતાં કહ્યું : “ મનોજબાઈ ! મને મુર્ખુનો કોઈ જ લય નથી, પરંતુ હુંઘ તો એક જ વાતનું છે... કે મારે સિમતાખણેનથી હર હર જવાનું છે. સિમતાખણેને મારા માટે શું નથી કર્યું ? ... જે, એજો ન હોત તો હું અનાથની જેમ કચાણ સર્જાને હોત. ” આટલું ખોલીને દીપકે એક લાંબો શાસ લીધો, પણ કહ્યું : “ સિમતાખણેન ! તમને યાદ છે ? ... મને તો આપણી એ પ્રથમ સુવાકાત આન્દેયે જીને તે તેરી જ યાદ છે. જે રક્ષાંધનના દિવસે હું મંદિરના દરવાજ પાસે કોઈ રાખડી આંધનારી રાહમાં જીલો હતો અને તમે... તમે કોઈ રાખડી ખાંધનારી રાહમાં ! તમે મને પ્રેમથી રાખડી આંધી કરી નથી મેં મારા આંસુઓની બેટ તમને બરી કરી અને પણી તમે મને ‘બાઈ’ અનાંધી હતો... ” દીપકની આંખોમાં જૂતકાળ તરી આંધી હતો. પણ જ્યારે એખો ખોલવા માટે મોં જોદ્યું કે તરત જ સિમતાખ દીપકના મોં પર હાથ મૂકીને કહ્યું : “ અસ, દીપક ! હવે વધુ ન ખોલ, જે, તારા મેમાંથી લોહી નીઠો છે... ”

“ સિમતાખણેન ! આજે મને જેટલું ખોલ્યું હાય તે... તેટલું ખોલ્યો જેવા હો... પણ... પણ... ”

“ દીપક ! હું... હું... હમણાં જ ડેકટરને ખોલાવી લાવું છું... તું... તું... તું ! ”

[અતુસંધાન પા. ૪૭ નીચે]

૧૬૮૬/ઓક્ટો.-નવે.

[પથીઃ-દીપિત્સવાક

શિક્ષણ :

ડૉ. મહાનલાઈઝ આર. પટેલ

શિક્ષણના વિવિધ અર્થ આ પ્રમાણે છે : શિક્ષણ એટલે કે ગ્રાફાયું એથ ઉપદેશ વગેરે, અંગેજમાં એ Education Learning Teaching Instruction વગેરે શાહેરી ગોળખાય છે. શ્રી જીમાંની કાર્ય નોથા જોવે છે એ મુજબ અંગેજ સખ્ખ 'એન્ટ્યુલેશન' પાછળ લેટિન મૂળ (ad+duco; e, out) અધાર અને buco to lead દોરવું)નો અને સંસ્કૃત પર્યાપ્ત ચિનય(વિન્ની, ચિ વિશે અને ની હોરવું)નો અર્થ પણ માણસના જીવનને અધાર આણવું-પ્રેરવું એવા જ છે.

શિક્ષણ માનવજીવનના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે. એ માનવજીવનને પવિત્ર અને ધાર્મિક અનુભૂતિ એવી એનો મુખ્ય ઉદ્દેશ કરાયું પવિત્ર અને અભ્યાસ તુલના ગ્રામ કરવા અંગેનો છે. શિક્ષણ સંપાદિત કરવાથી વિકિત પોતાના જટિલ પ્રશ્ન સરળતાથી ઉકેલી શકે છે. શિક્ષણ જીવનના અત્યેક ક્ષેત્રે સાચી ડેળવણી આપવાનું કાર્ય કરે છે. એના દ્વારા વિકિતને પ્રકાશ દાખિ અને સમજ અળે છે, તેથી શિક્ષણનો વિષય ખૂબ જ ગંભીર છે.

શ્રી નાણિયાંડુ રતનાલ ભાઈ 'કાન્ટે' વૈહિક કાલથી માંનીને છેક ગોગણીસની સદી સુધીના સમય-ગાળામાં જગતના વિવિધ દેશોમાં ડેણવણી વિશેની વિચારણ તથા એ સંબંધે અધેગે ડેવા ડેવા થયા એનો પરિણામ આખ્યા અને માનવસંસ્કૃતના વિકાસની દ્રિષ્ટિ એનાથી એમાં કંધાં કંધાં તત્ત્વ આખું છે. અને ઇવું નીરુંયાં એ એ દર્શાવવાની જોગના જેમના 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તકમાં પ્રતિયાંધિત કરો છે.

આચીન સમયની અસ્તીપ સમાજમાં શિક્ષણવિષયક આધ્યાત્મિક અને ધૈર્યો સ્પષ્ટ હતાં. ધાર્મિકતા અને નીતિની ભાવનાનું ચિંતા, ચારિયતું વાંચાર, અંગ્રિતરનો વિકાસ, નાગરિક અને સામાજિક દરખેનું શિક્ષણથી, સામાજિક કાર્યક્રમનાની ઉદ્દીપન અને રાષ્ટ્રીય સંસ્કૃતિની જાળવણી તેમ પ્રસાર એ અધી જાતો સિદ્ધ કરવા માટે શિક્ષણ અનિવાર્ય છે. એનો મુખ્ય ઉદ્દેશ સહૂતનિંમાં પર્યાપ્ત થયો નોઈએ.

શિક્ષણનો મુખ્ય હેતુ માનસિક વિકાસ જ છે. એ હેતુને સિદ્ધ કરનાર લોછ ઇસો અને હર્ફિં ર્પેન્સર યોગ્ય જ કંધું છે 'એ વિષયો બાધાવાથી આપણું શુભરાન ચલાવી શકીએ તેના પર વધુ ધ્યાન આપવું નોઈએ.' ગાધીજીએ પણ મોખ્યું છે કે ડેળવણી સ્વાવલંખી હોલી જેઠીએ. ડેળવણી એટલે પાણક કે મતુષ્યનાં શરીર મન અને આત્મમાં ને ઉત્તમ અ શો હોય તેઓને સર્વાંગી વિકાસ સાધીને એઓને અધાર આખુંના નોક્કે, તેથી સમજને અતુલ્ય પહીનિનો ઉપયોગ કરીને વિવિધ વિષયોનું જીન વિદ્યાર્થીઓને આપવું નોક્કે, વળી અમનું જીર્ણ કરતી અને જીવન સાથે એતું અતુલ્યંધાન પદ્ધિનીપોતસવાંહ]

थाय तेवी कैणवस्थी आपवाना प्रयोग करवानी प्रेरणा पथ ऐमध्ये आपी छे. ऐमां रसिकन अटोल्सटोयना विचरोना पथु विनियोग थपेको लेवा भगे छे. स्वीन्द्रनाथ टागेरे पथु शिक्षण उत्तम गङ्गावुं छे.

शिक्षणमां परीक्षापद्धति पथ जडी छे. प्राचीन समयमी आ पद्धति ऐक या भीज स्वरूपमध्यमां छे. फा.त. महाभास्तमां वर्षान्वया अनुसार छोरवो अने पाठ्येनी दोखायार्थी परीक्षा राखेत हस्तिनापुरी ग्रन्थ पाहरे भेगी थाए. हुयेकिन सहित छोरवो अने भीम सहित पाहवो परीक्षा भा उपरिथन थाया. ऐक वक्तु पर ऐक भनावती पढी भृगुमां आवुं. भाव अन्तर्न आ पक्षी जम्भुमी आंभ वीधीने ऐमां उत्तिर्थ थयो.

आ उदाहरण परथी २५८ थाय छे के १०४ गाथी भाव ऐक ४७ व्यक्ति पास थाए. डेट्सुं कृष्ण परिषाम आवुं ! आने बो आवुं कृष्ण परिषाम आपवानां आवे तो आधापडेने धराइने येथोपा आवो पढे. संस्थाना संचालको अने समाजना डेट्वाक लेङ्गा पूछ्यो के “महाशय ! पभार सारो लां रायो छा अने साधावता तो क्षुं नथी !”

समाज द्वारा लेवा प्रकारतुं शिक्षण आपवानां आवे तेवा प्रकारनी ग्रन्थ थाय छे. लेक शारीरि भानसिक अने नैतिक ऐवा नष्ट प्रकारना शिक्षणतुं सूचन करे छे. तला ए व्यक्तिनी शिक्षणपद्धतिम सहायार व्यायाम चतुराई शिष्यायार अने विद्या पर ध्यान आपवानुं लक्षये छे. कुद्ध अने स्व त्रैतागो विकास साधवा भाटे दोइ अधित शीघ्रवानुं छहे छे, भारत्य के गणितना अक्षमासृ व्यक्तिने औडिक शक्ति भेजे छे अने ऐना परिषेष्ये ए गाननी भीजु आपतोनी परीक्षा करी शे. तहुपरांत शरीरनो विकास साधवा भाटे मानसिक अभ्यासनी पथ आवश्यकता रहे छे.

जर्मन डिव श्वेतेऽमे वनस्पतिशाख आखिराम तथा आडृतिक विद्याओना अध्यापनत संबंधमां नवो प्रकाश पाइयो छे. ४३ पहायेभाना पथु ऐकता छे अवुं ऐमध्ये सिद्ध करी अतावुं छे

विद्यार्थीभाना चंचलता वाली होय छे. आ चंचलता हृष्ण नथी, ऐनाथी निमास साधवान दहो सापेहे छे; लेकै ऐक भायत स्पष्ट के के व्यवहारमां उपयोगी थाय तेवा प्रकारना शिक्षणुन ताती जडर छे, समाजने शारीरिक भानसिक अने नैतिक शिक्षणभनी विशेष आवश्यकता रहेत्वा छे शिक्षण द्वारा व्यक्तिने राजनीतिक आर्थिक तथा समाजिक धरिलासने लगती माहिती भगवी नेइभे आवा प्रकारतुं गान भेजवनार व्यक्ति क्ष समाजनी उत्तम हस्ती अनी शक्ते.

विश्ववा विविध समाजेमां आले क्ली-शिक्षणी पथ वाली जडर छे. इसो हहे छे के स्वीक्रे पुरुषोने विशेष उपयोगी भी राके ए भाटे ऐमां जडृत्यातो दृष्टि समझ राखी ए मुग्ध ल्ली-शिक्षणो पाठ्यक्रम घडवे लेईयो. स्वीजोने शारीरिक शिक्षण पथ मण्डुं जेठीये के ज्ञेया ऐमान शरीर स्वस्थ रहे, सौन्दर्य वये, कृष्णपूष्ट संतति उत्पन्न करी शक्ते. वारी ज्ञानोने भरत सीध्य अने गूढ्याकाम पथु शीघ्रवानो लेईयो.

आपध्ये ए पथ लक्ष्मुं न लेईयो के द्वाजल सभये व्यक्तिने आमोहप्रमेह के भनोर्जन भाटेना साधगोनी पथ आवश्यकता रहे छे. संगीत कला अने धक्किता द्वारा आवुं भनोर्जन संपादित थाए छहे छे. आधुनिक गैगानिक अने टेक्नो-वैज्ञानिक युगमां व्यक्तिनो सवांगी विकास थाय तेवा प्रकारतुं शिक्षण समाजे आपवुं लेईयो.

सामान्य रीत ऐकता स्थापित करवा माटे शिक्षण अने जेती शैक्षणिक संस्थांचो महारवनो माग लज्जेवे छे. एक रीत लेकडे तो विद्याधामो ऐकतानां मेठां स्वप्न छे. जेमा भाव व्यक्तिगत वेकासने ज तडा सापडे छे एवुं नथी, सामाजिक उन्नती पशु विशेष संलग्ना रहेली जेवा भेळे १. साचा शिक्षणकारी जाननी वाले प्रक्रिया-'अवयोध' 'संवेदन' अने 'संकट'—नी ऐकता पर भाव भुजे २. अभ्यास करती वापते आ व्याय अवस्था पर व्यान आपलुं खूब ज झडी छे. वणी ए पशु ३६ राज्यां नेहुऱ्ये डे जे शिक्षण आपणां झारीं पर ग्रसाव पाडे अने इतनने विविध रीत अपेणी अने ते खूब ज महारवनुं छे. हर्फी रपेंचरे साचे ज कड्यु छे डे उपर्योगिया शिक्षण प्रकारक अने उपर्योगी शिक्षणे पाळुं पाडी हाईचुं छे,

विश्वना जुळा जुळा शिक्षणसांख्यिकीं समाजानुसार प्रगत्यनने वधारे उन्नतिशील जनावरा १.२३ सधन प्रयासो कर्या छे. योसां सोडतिस खेळो अने एरिस्टोलव जेवा तत्त्वज्ञांतांगी शिक्षणक्षेत्रे विधान द्याणा आपेणा छे. दिवारोत्तस अने थ्युसिशार्ट जेवा प्रसिद्ध ईतिहासिनिटी चेताना आणो द्यारा समाजना विकासांते सुंदर कार्य कर्या छे एमणे परिस्थितिने डेन्हमां राखाने चेताना आणो द्यारा समाजना घडतरभां अने नवसर्वैनमां अद्युक्त लार्य कर्या छे. प्राचीन सभ्यती विश्वना द्यान लेप्तोल्ये संवेदो अनुसार शिक्षणाना सिद्धांत निधानित करी प्रगत्यनने वधारे उपर्योगी ने तेवा प्रकाशतुं शिक्षण आपवा प्रयासो करेवा छे. जेम यांती परिस्थितिशङ्क डेटलीक मर्यादाज्ञाने छने मुरुडेलालो पशु उद्यवाणी छे, तेथी आने शिक्षणाना शिरे भारे ज्वाअदारी रहेली छे. युवा-जींना विकास अने बडतर माटे शिक्षणाचे प्रामाणिक रीत अने निधायी चेताना इतरो अनवरी इंग्रे. शिक्षणां ले कसूर लेवा तो समाजाने विकास इधारे ए खूबतुं न नेहुयो.

धृतिहाहविकासांग, अरद्दार परेव युनिवर्सिटी, वस्त्राभिवानगर-३८११२०

प्रत्युत्थान पा. ४४ थी]

'ना...ना, अडेन। हुने डोळदरने यो...योवाववानी कोठे ज जश्वर नथी. भगवानने एक जर्णा तारले के...के जन्मेजन्म आटे हुं तामरो ज आई...आई...' आगण शांदी अटकीया अने किंतु भरतक सिमताना योग्यामां ज द्यो पशु. सिमतानी योसेयी वातावरण पशु लाले शोकमन जगु. घाणा समय सुधी सिमता दीपकिं भरतक प्रेताता योग्यामां राखी रही. भोजनी यो पशु अराई आवा.

भीज विश्वनी सधारे ल्यारे भनेपाज अने सिमता रम्भानामां यां त्यारे दीपकना अजिन-कारणी ज्वाणामो ठंडी पडी गर्छ छो. सिमताचे राख्यो दाथमां लीधी त्यारे अनां आसु राख पत्ता लाग्यां. राख्यां पशु लाले दीपको यहेरो हेपासो हुतो अने ए कडी रखो होतो : मतावडेन। जन्मेजन्म सुधी तमे भरां ज अडेन रहेशा ने की...'

नीना किनारानी लाली रेलीमां खूपातां खूपातां सिमता अने भनेजनां पगलां पाणी पासे अनेवा अटक्या. सिमताना दाथमां असिथ्युं भांडो, धीरे रहीन ए असिथ्युं भांडे सिमताचे नीनां व वेळां पाणीमां झूळी दीदी अने क्वांच दुखी ए असिथ्युं भांडे आगण जसो नेठे रही... २७. आभार सोलायी, निजमुपुरा, वडोदरा-३८०००२

શિક્ષણના માધ્યમ તરીકે દૃષ્ટરતું મહત્વ

આ. જિતેન્દ્ર વી. શાહ

દૃષ્ટરતે અગ્રેજમાં 'રેઝર્વ' કહે છે, એમ છતાં દૃષ્ટરમંડળ એ નથી માત્ર રેઝર્વમ કે નથી માત્ર સરકારી દૃષ્ટર સંગ્રહવાનું સ્થળ; એને ગઠલે જે ડેઈ બખાલનું ડેઈ પણ ભાગ્યતના સંર્વર્ભમાં અનિહાસિક મહત્વાનું હોય તેવા બખાલને વૈરાણિક ડેને સાચવાં, જગતનાં, એમાંથી સંરોધનમાધ્યમો યાદીમો પ્રકાશિત કરી સંશોધનકારો સંસ્થાઓ વહીનટકારીઓના ઉપરોગ માટેની વ્યવસ્થા કરતું સ્થળ એટલે દૃષ્ટરમંડળ [Archives].

દૃષ્ટરમંડળની પગરચું ફાનસમાં ઈ. સ. ૧૭૩૮ માં થયાં, વિનનમાં ૧૮૩૩ માં, ભારતવર્ષમાં સુઅર્થ ખાતે ૧૮૮૧ માં અને અમેરિકામાં ૧૮૪૪ માં શરૂ થયાં, મદાસમાં ૧૮૨૬ માં હેરાનાદમાં ૧૮૪૪ માં, કલકત્તામાં ૧૮૮૧ માં, પદિગ્યાં-સુવનેશ્વરમાં ૧૮૪૮માં, અકાનેરમાં ૧૮૪૫ માં અને અમદાવાદમાં ૧૮૭૧ માં દૃષ્ટરલંડાર પાતળિનાના રાજ્યાત થઈ, આ તો દૃષ્ટરમંડળના લાખીના ડેટબેક ઉદાહરણ છે.

ઈ. સ. ૧૭૧૮ ની હેન્ટ્ય ફાંટિ આદ આકારીચુકમાં રિલાયની અગત્ય મૂલ વધી છે એ સમગ્રાં વાગ્યું અને આની રિલાયનિક આકારીચુકમાં લેન્ટની ગંભીર ભાગ્યતના પ્રાપ્ત થઈ: (૧) આધુનિક આકારીચુક સંસ્થાઓની રથાપના કંઈ, (૨) આકારીચુકની લંડર યુ મતિના સિલ્વિનનમાં નાહેરતનમાં અન્ધાર પારવાં અને (૩) રાજ્યની જૂના દસ્તાવેજની જગતની જગતની જગતનારી નક્કી કરવી.

મોટા આગામ દેશોમાં સુધીય દૃષ્ટરમંડળનેનાં અકાંઈજન] સથાપના વ્યાવહારિક અને આંદ્રકૃતિક જ્ઞાન એ કારણેસર થેબી જેવા મળે છે, વ્યવહાર ભાગત જે તે સંલેખામાં રેઝર્વ શોખાયું હોય કે પ્રાપ્ત થયું હોય, જ્યાર સાંસ્કૃતિક કેવે ઈતિહાસલેખકો તથા સંશોધનકારો દ્વારા રાષ્ટ્રીય પ્રાતીક્ય આપણી સંસ્થાઓની રથાપના દ્વારા જેવા મળે છે.

દૃષ્ટરમંડળનો રેઝિસિયિક ઉપરોગ માત્ર તાનેતરનાં વરોંમાં જ નથી વિકસણા, પરંતુ એનો ધ્રેણ વિકાસ દૃષ્ટરલંડારની સામનીઓનો થયો છે. દૃષ્ટરમંડળની ઘણી વિવિધ રેઝિસિયિક સેનાનો અભિક્રવાનો રહે છે, વાચનાલય માટે ગોરડાઓની સુવિદા, દસ્તાવેજે પ્રસિદ્ધ કરવાની પહીંતિ, સાંખ્યિક પ્રકાશનો ભાગ્યત તથા સંશોધન-માધ્યમમાં રીપાર કરવા માટેની તૈયારી હોવી નોઈએ. આ સાથે દૃષ્ટર-વિધાની તાદીમ, સાધનો તથા નાશકાય લેગવાઈની સુવિદા આપવયું છે.

શાળાના રલે પણ આકારીચુક દ્વારા આકારીચુકનો ઉપરોગ એના પ્રતિહાસના શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ છે અને લોકપ્રિય છે તથા એ હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે.

વિકસની ધર્થી શાળાઓમાં સૂચનાઓનો આપ્તિ વખતે કે સમગ્રાંવતી વખતે પ્રાથમિક સાધનોનો ઉપરોગ કરવામાં આવે છે. એણો આ રીતે છાં તો પ્રાથમિકાગત પાઠચયાસ્તકાને પૂરક અને છે અથતા તો એણો મૂળ સાધનો દ્વારા નવસ્થાએ કરે છે. એ શિક્ષણકે શીખવા માટે આ પહીંતિ સ્વીકારી છે તેમો દસ્તાવેજ તરીકે આકારીચુકનો અનુચ્ચ ઉપરોગ કરે છે. એમાં પણ ઈતિહાસ સમાજ-શાસ્ત્ર અને ભૂગોળ જેવા વિપરોલી એણો મૂલ અસરકારક પુરવાર થયેલ છે.

'દૃષ્ટરમંડળ સાથે શિક્ષણ'ના આથી નીચે સુખાયના દ્વારા છે:

(૧) મૂળ દસ્તાવેજે સાથે એ અભ્યાસ કરે છે તેનાથી સંખ્યિક માહિતીનું એકનાંકરણ સંબંધન તથ પરિણામ અનુસ્યોદ રિટે મેળવી શકાય છે.

(२) ને વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓએ સાથે જૂથમાં રહી દસ્તાવેજ વડે અભ્યાસ કરે છે તેનથી સહકારની આવના ડેણવાય છે તથા ચર્ચા સાથે યર્માન્તે કોઈ જેક શોક્સ મળ ઉપર આવી શકાય છે.

ને વિદ્યાર્થીઓનિયમિતપણે ધર્તિહાસ ભૂગોળ અને સમાજસ્થાનનો અભ્યાસ કરે છે તેનો હુમેશાં ભૂતકાળના તથા વર્તમાન આનવસમાજના અભ્યાસી હોય છે.

‘દિતર સાથે શિક્ષણ’ના ખ્યાલ બણા હેતુ છે ; જેમણે (૧) દિતરલાંગરની સંરથામાં એક સંશોધન-દમ હોય જેઠે કે જ્યાં વિદ્યાર્થીઓ મૂળ દસ્તાવેજેના સંપર્ક માટે મળી શકે, (૨) શિતલાંગે વિદ્યાર્થીઓને મહારં થાં લેખાયે તથા જેચે આર્કાઈઝ-સંશોધનની તહીનીકી-પ્રયાશાખાવાની લેઈએ, (૩) મૂળ દસ્તાવેજેનું પ્રદર્શન જુહી જુહી શાળાંના જોડિવતું નેઈએ, (૪) શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નાદું/થાંડું રેકર્ડ મેકવિનું નેઈએ, (૫) શાળાના ઉપયોગ અર્થે સાધનો એક્ષિત કરી રજૂ કરવાના લેઈએ અને (૬) રેકર્ડને રલાઇઝ પર કે હિંમેસ્પી પર પ્રદર્શિત કરવાના લેઈએ. આ ‘થાંડું’ મુખ્યત્વે વગાં માં કે સામાન્ય શાશ્વત / પ્રવચન આપવા સારું શિક્ષણને ઉપયોગી કરું.

દસ્તાવેજ સાધનો બાગડો અને જુવાન વિદ્યાર્થીઓને આપવાથી આર્કાઈઝનો ઉપયોગ કરનારની સંખ્યામાં માત્ર વધારે નથી થતો, પરંતુ ભાવિષ્યનાં પાઠ અને દુસ્થા સંશોધનારોનું સર્જન પણ હેતુ છે.

ને આર્કાઈઝ સંરથા ‘આર્કાઈઝ સાથે શિક્ષણ’ આપે છે તેઓએ માથિક રીતે ચાર પગલાં લેવા નેઈએ : પ્રથમ બાગડો અને જુવાનો સાથે કામ કરી શકે તેવા પૂરતા કર્મચારીઓ હોવા નેઈએ, થાંડું વહીની સત્તાબીશ પસેરા ઇડ એક્ષિત કરવું, વાંગું યાગા તથા દુનિવર્સિટી પાસેરો થાડી રહેત મેળવવાની, હેલે ચોથું આર્કાઈઝની સંરથાના શિક્ષણ-સંરથાની સ્થાપના કરવી નેઈએ.

દિતરના વિવિધ દુર્ઘટના ઇન લિથાઈ કુટ્કર્વર્મ કુટ્કર્વાઈ પરદીય વંદ્ત તથા ઉંદ્ર તથા પિસ્કેલી એવાં પ્રાણીઓએ અને ગરબી પ્રદર્શન થુદ આગ પૂર તથા પરચાદાની તુકસાન થાય છે, આ તુકસાન પામેલ્ની દિતરને પ્રદર્શનના રાખવાની લેઈએ અને એ અદ્યાનવાના ઉપાય પણ દર્શાવવા નેઈએ, જેના પરિણામે પ્રજ્ઞાને-વિદ્યાર્થીઓને દિતરનું સંરથાનું કરવું કેટલું અગત્યાં છે અને પ્રથાશ આવે, ઐલેલા કે લેખાણ શાહીનો કરવાનાં પણ નજરે નેથેલો પરસુઓનું ગાન પણ વધુ વનિષ્ઠ અને છે.

શિક્ષણ એ પરિવર્તનનું પ્રતિનિધિ છે. દિતરલાંગરમાં સચચાનેલી નાડિતીના આધારે ભૂતકાળમાં પ્રવર્તતી ચીજાન્નરૂપોના આવની ઝાંખી થાય છે. ભૂતકાળમાં ચલચુંના વપરાતી ચીનેને તેમ નાણું તોલમાય વગેરેનો જ્યાદા આવે છે, પ્રાર્તમાન આવ સાથે એની તુવના કરી શકાય છે. દિતરને દારા મહાતુભાગોના કાર્યો, દેશ માટે હોલેલી ફાનીયો, સહન કેલાણ કરે, એમની સહનશીલતા, જનનાં નોભમ, સ્વતાંગ માટે ચણવાનાં આપેલ દીપા વગેરે જેચો અનેક હક્કાકોની વિશે સચ્ચોટ જ્યાદા માઝી શકાય છે.

દિતરોની સહયોગ સમયો-તાત્પર્ય તાત્પર્ય ભૂર્જીની કાપણ કાગળ ચ.મનું ટેન્ટ માધકોદ્વિદ્યસ રજૂ કરવા, એનાથી જિદ્યાર્થીઓને જ્યાદા માયે કે આર્કાઈઝના ડેમિક વિકાસ હી રીતે થેથેલ છે, પાટગનરોની ફેરફલી, એમ કરવાની કારણું, એતિહાસિક પરિણાનો, સત્તાબીશોના તથા મહાન વિકિત્યોના કારણું, એના ઉપરથી એમના કાર્ય ચરિત્ર વગેરેની ઝાંખી પણ દિતરલાંગરના ઉપયોગથી થાય છે. દિતરલાંગરના દસ્તાવેજેના પ્રદર્શન પ્રકાશન વગેરે દારા લોકશિક્ષણનું કાર્ય સાધી શકાય છે, ધર્તિહાસનું શિક્ષણ ચાર દીવાનોની અંદર આપી શકાય છે અને અન્યત્ર નહિ એ અભિગમ દિતરલાંગરનો પ્રદર્શન દારા દૂર કરી શકાય છે.

‘આર્કાઈઝ નીડ’ની ઉપલબ્ધી દર વર્ષે કરવામાં આવે છે. આ સમય દરમાન વિવિધ હૈનિફ
પથિક-હીપોસ્ટસ્વાં]

વર्तमानपत्रे तथा सामग्रियामां आर्डोहंज अंगेना लेख प्रसिद्ध करो शक्य, वायुवार्तावाप आपौ शक्य तथा शाणा डोकेन्द्रेमां आपौ व्याख्यानो पर्यु आपौ शक्य. ज्ञानियो विजयुभ्य शेषद्वृज ट्रैप मार्होदिस्मस वगेरे द्वारा आने शिक्षणु आपौ शक्य छे. आस कीने सारतना समकालीन छति-हासने निश्चयना भाटे तो ए अगत्यनु साधन छे; ज्ञे के आरत जेवा लोगोलिक अने संस्कृतिक विविधता धरावता देखामां दतिलास-संशोधको भाटे संशोधन भूम्य अर्थात् अने छे. सामान्य स्थितिगता संशोधको द्वारा दूर दूरनां रथेगाये आवेदा दृष्टरखंगरोना मुलाकात लेवानु समयना अलावे राक्ष अनतु नीपी त्यारे दृष्टरखंगरने लोधि संशोधको दृष्टपट्टा ज्ञानी थाय छे अने दृष्टरखंगरमां रहेकों आवु-निक उपरवाहा द्वारा संशोधको पोताना जेव उपर अनो उपयोग करी शके छे. 'आर्डोहंज वोड' दृष्टयान दृष्टरखंगर भालानी मुख्य क्षेत्रीमा तथा अनो तापा हस्ताक्षी क्षेत्रीयोमा प्रदर्शन पर्यु योजना छे. प्रदर्शन ए दृष्टरखंगरनी साथे अनिवार्य पछे संकायेती आपाना छे. जननां वितरणु अने विस्तरण्यानी पायानो ढेहु साकार करवा भाटे ए भद्रतनो जेकम छे. विद्यार्थीयो अने बाहेर प्रल अनो लाभ लाई शके तथा दृष्टरत्नी अगत्य समग्र शके ए ढेहुथा एक संसाध भाटे झुल्यु मुक्यमा (आपन डाउन) अने छे.

आर्थिक शाणाना विवार्थाने विविध चियो, नक्षा, देशनोतायोना द्वाटा, आवाम, टपःख-रिहिटो वजेरे द्वारा पर्यु सारी रीते शिक्षणु आपौ शक्य छे. डोकेन्द्र-इता सुरीना निवार्थाने दृष्टरेमां शुं शुं आवे, दृष्टरेनी सहायक समयो कठ कठ, विविध सत्यामण्डेतु दृष्टर कठ कठ रीते संशोधको उपयोगी थाई घेइ, आनयो दृष्टरेनी माहिती कठ रीते जेकित रुवा वजेदीनी लघुकारी पूरी पाइवा. राजकीय सरहदोमां समयांतरे डेवा दैशर थाय छे ए पर्यु माहिती मणी शके, ज्यारे डोकेन्द्र-क्षमा करतां उपरना विवार्थाना. समक्ष दृष्टरेमां नियमित विविध विपि-आपायोनुं तान, ए समयती शैली, पर्याय-शाफ्टो अने अनो अर्थ, विविध संवंतो, जेतिलासिक तथा ज्ञेगोलिक ज्ञानानी माहिती शिक्षणु द्वारा मास थाय छे. दृष्टावेजे उडेलावानी स्पर्धाना पर्यु राख्ना नेहुअचे.

फ्रेन्स भियो, डिस्किप्टिव विस्टर, ईन-डेक्स घन-वेन्टरी, डेटेक्शन गाइड वजेरे अनावामां आवे छे, ज्ञेना परिचयमे संशोधको अना शोधविषय भाटे ज्ञरी माहिती तात्कालिक मणी शके अने समयमां अचय थाय, विविध विधेने लगता डिस्प्ले पर्यु रजू करवा नेहुअचे. शैक्षिक ग्रोक्टरमा आगडाने जेकला के नाना सूपमां ताम डरवानी झूट आपावी नेहुअचे अने आपेहु चोक्स रीते कठी शक्कावे के अभ्या ज्ञजर आपां संदेशा लांसल करेश.

वर्तमान अनन्यां शिक्षणामां 'दृष्टरेतु' भद्रत्व निनप्रतिहित वजतुं ज्ञ रहेहु छे. कौष महेव-विशेषता के कठी विद्यावारेपनी आक्षयिकायोनो समोर रीते अने दृष्टस रीते ज्याप भेगवाये होय तो दृष्टरखंगर ज्ञ उत्तम स्थान छे. कौष महेवनी चिविध 'डेमोनी सिद्धि' मनाहायोनुं दर्शन पर्यु त्यो थाई शके छे. दृष्टरेनंजारो 'सर्वज्ञान पूर्वु' पाठ्यां रुद्धानो जेवा थहु ज्या छे. अनो अगत्यनो आवाय निर्जासाईति उत्तेजित डरवानो अने संतोषवानो तमज अवक्षोङ्करजित भीतव्यवानो छे.

आर्डोहंज अवो संशोधानो छे के ने संस्कृतिक विद्यारसद्गु धरावे छे. दृष्टर गोते मूँगु छे, पर्यु छनिलासपि॑ अने ज्ञेनुं करी होछे, अर्थात् अगत्य विजेतेतु विवार्थाना तथा प्रल समक्ष रजू डरवानुं काम दतिलास-संशोधको करे छे. आम दृष्टरे पर्यु भद्रत्व पुरुवाराप अने छे. दृष्टर विशाज जानाना समुद्रतुं एक संकुल छे ए दृष्टिये शिक्षणाना माध्यम तरीके दृष्टरत्वु भद्रत्व पर्यु ज रहेहु छे.

ગુજરાતી સાહિત્યકારોના વિકાસમાં એમના શિક્ષકોનું પ્રદાન

અલયાસક : ડૉ. ઈંદ્રચંડ પરમાર

સમસ્યા : વર્ગાંડમાં શિક્ષક દારા એકસરણે અધ્યયન-અનુભવ અપાણે હોય છતી નિવાથીઓને પર એની ધારી અને એકધારી અસર થતી નથી. આમ થવાનું એક કારણ વિવિધ વિદ્યાર્થીઓનાં અનેકવિધ રખાયેન હોય છે તે છે.

સાહિત્યક્ષેત્રે રસ તુંધિ અને વલણ ધરાવતા વિદ્યાર્થીઓ સાહિત્ય અંગ શિક્ષઃ દારા થતી રજૂ-આત પ્રયે વિશેષ ધ્યાન આપે, પ્રેરણ મેળવે અને કથારેક સર્જન પણ કરે જે સંક્ષણ છે. આવા વિદ્યાર્થીઓને માહિત્યપ્રેમી શિક્ષકનો મેમતા મદદ અને માર્ગદર્શન મળે તો એની સર્જનાત્મકતા સર્કિય અને એવી ધાર્થી સંભાવના છે.

સન્મિશ્ર શ્રી ઉમાશંકર નોંધી દારા સંપાદિત ગ્રંથ 'સર્જનની આંતરકથા'માં શાર્પસ્ટ સર્જનાત્મકતાની નાના આરંભ અને વિકાસ અંગેના આત્મકથાનક રજૂ થેવેલી છે તેમાં સર્જનના વિકાસમાં શિક્ષકના મહત્વપૂર્ણ પ્રદાનને સંકેત ભાગ રહે છે. આ બધાંથી સર્જનાને જ લક્ષ્યમાં રાખીને બધેવાની ન હોવાથી અને એમાં મર્યાદિત સર્જનાની સમાજિક થેવેલા હોવાથી સાહિત્યકારના વિકાસમાં શિક્ષકના પ્રદાનની સંભાવનાને વધુ વિશ્વાસ અને વાસ્તવિક ફ્લક પર જાણવા-ચક્કાવાની અભ્યાસને કરવિશ્વાસ કર્યાઈ, આથી ગુજરાતી સાહિત્યકારોના વિકાસમાં એમતા શિક્ષકના પ્રદાનની સંભાવના જાણવા માટે પ્રસ્તુત અભ્યાસ હાથ ધરવામાં આવે.

અભ્યાસના પ્રક્રિયા : ગમે તે તસે શાખવતા શિક્ષકાનિનિર્ધારિત સાહિત્યપ્રકારને એના આરંભકાળે સહાયપૂર્ત થયા હતા કે કેમ એ જાણવાનો આ સંશોધનનો મુખ્ય હેતુ હતો, આથી આ અભ્યાસ નીચેના પાંચ પ્રશ્નોના ઉત્તર મેળવવા હાથ ધરાયો હતો :

૧. સાહિત્યકારના ઘરતરમાં એમતા શિક્ષકનો ઝોળા હતો અરે ?
૨. સાહિત્યકારના ઘરતરમાં કઈ કાલાના શિક્ષકનો ઝોળા અભિવ્યક્ત હતો ?
૩. શિક્ષકના ડાકિયાનું સંગ્રહી સાહિત્યકારની સાહિત્યિક રૂચિનું વિતર વિશેષ થયા પરંતુ હતું ?
૪. શિક્ષકનો ડાકો જીવના સાહિત્યકારની સર્જનાત્મકતા માટે પ્રિક રહ્યો હતો ?
૫. શિક્ષકના અભ્યાસપત્રી કઈ વિશેપત્ર સાહિત્યકારના ઘરતર માટે જવાબદાર હતી ?

સંશોધનયોજના : નમૂનોના ગુજરાતી ભાષામાં વિવિધ સાહિત્યવર્ષપેમાં રચનાઓ કરતા અને પ્રગત કરતા સાહિત્યકારોનું જ્ઞાપવિશ્વ નિશાળ હોવાથી અભ્યાસક લગ્નભગ અસો કેવેલા મહત્વના સાહિત્યકારોની પ્રાચ્યમિક પસંદગી પાણ સાહિત્યકારના સરનામાની સુસભાના અને સાહિત્યકારની મહત્વા એ એ માપડ્ડ હતા, તેથી પ્રાચ્યમિક રીતે પસંદ થેવેલો નમૂનો જાથેદગે કે આડસિમક (incidental) અને હેતુલક્ષી હતો. સમૃતિપત્રો પણ અસો સાહિત્યકારોએ પ્રતિબાન આચાચ, તેથી આ ભીજા તથાં નમૂનો સ્વેચ્છિક રીતે પ્રતિબાન આપનારા સાહિત્યકારોનો અનેથો હતો. પ્રતિબાન આપનારા સાહિત્યકારોમાંથી એમતા પ્રતિબાન પ્રસ્તુત અભ્યાસના પ્રક્રિયાના ઉત્તર મેળવવાના સંદર્ભમાં વિશેષ હતા. તેવા પચાસ સાહિત્યકારોને અભિવ્યક્તાના નમૂનાઓએ પસંદ કરવામાં આવ્યા. આમ, પ્રસ્તુત અભ્યાસમાં નમૂનાપસંદીમાં બહુસ્તરીયતા આકસ્મિકતા અને હેતુલક્ષિતાની મર્યાદાઓને કારણે નમૂનાની જ્ઞાપવિશ્વપ્રક અનિનિષ્ઠિકતા સીમિત અની હતી.

પણી-દીપિત્તસવાંક]

૧૬૮૬/ઓક્ટો.-નવે.

[૫૧]

ઉપકરણ : પ્રસ્તુત અભ્યાસમાં ભાહિતીના એકબીજે માટે સાહિત્યકારોને એક પ્રસ્તાવપત્ર મેળવામાં આવ્યો હતો અને સાહિત્યકારોને એમના વિકાસમાં ફોળો આપનાર શિક્ષકોને પરિચય આપવાનું જ્ઞાનવાર્તા આવ્યું હતું, આ રીતે આ અભ્યાસમાં આત્મકથનાત્મક પ્રકારની મુક્તોત્તર પ્રશ્નાવદિનો ઉપકરણ તરીકે ઉપરોગ કરવામાં આવ્યો હતો.

માહિતીના વિશ્વેષણુની રીત : સાહિત્યકારોએ પ્રસ્તાવપત્ર પ્રત્યે આપેલા વિભિન્ન પ્રતિબાબોનું અભ્યાસના પાંચ પ્રશ્નોના સંદર્ભે વિશ્વેષણ કરવામાં આવ્યું. વિશ્વેષણુની આ રીત મુખ્યને એતિહાસિક સંસ્કૃતમાં વસ્તુવેજના વિશ્વેષણુની રીત જેવી હતી. પાંચેય પ્રશ્નોના ઉત્તરોની વિવિધ કલાકારોની રહેલા સાહિત્યકારોના આદૃતિઓ ગણી કરવામાં આવી હતી. ઉત્તરોની કલાકારોનું નિર્ધારિષ્ય અનારોગ્નિત અને આત્મલક્ષી હતું.

માહિતીનું વિશ્વેષણ અને અર્થધારણ : શિક્ષકનો ફોળો : “સાહિત્યકારના ઘણતરમાં એમના શિક્ષકોને ફોળા હતો ખરો ?” આ પ્રશ્નના ઉત્તરથે પચાસ સાહિત્યકારોના પ્રતિબાબોમાં ઉપ. કષ્ય માહિતી નિયોગી સારથી ૧ માં રંજ કરવાર્તા આવી છે.

સારથી ૧

શિક્ષકના ફોળા વિશે સાહિત્યકારોના પ્રતિબાબ

ફો	ના	સંદર્ભ	ડાલ
૩૮	૧૦	૨	૫૦

સારથી ૧ નું અભ્યાસોનું દશવિશે કે કે ૫૦ માથી ૩૮ સાહિત્યકારોએ એમના વિકાસમાં પોતાના શિક્ષકોનો ફોળો દર્શાવ્યો હતો. આમ, મોટા આગના સાહિત્યકારોના મને એમના વિકાસમાં શિક્ષકોનું પ્રદાન હતું.

શિક્ષકોની કલા : “સાહિત્યકારના ઘણતરમાં કર્ષ કલાના શિક્ષકોનો ફોળો સવિશેષ હતો ?” આ પ્રશ્નના ઉત્તર માટે ઘણતરમાં શિક્ષકોના ફોળોનો સ્વીકાર કરનાર ૩૮ સાહિત્યકારોના પ્રતિબાબોમાં ઉપવાન્ય નિયોગી માહિતી સારથી ૨ માં રંજ કરવામાં આવી છે.

સારથી ૨

ફોળો આપનાર શિક્ષકોની કલાકારો વિશે સાહિત્યકારોના પ્રતિબાબ

શિક્ષકોની કલા	ફો	ના	સંદર્ભ	ડાલ
શિક્ષકોની કલા	૩૮	૧૦	સંદર્ભ	૫૦
શિક્ષકોની કલા	૩૮	૧૦	સંદર્ભ	૫૦
શિક્ષકોની કલા	૩૮	૧૦	સંદર્ભ	૫૦
શિક્ષકોની કલા	૩૮	૧૦	સંદર્ભ	૫૦

સાહિત્યકારોની સંખ્યા ૬ ૧૨ ૬ — ૨ ૬ ૩ ૩૮

સારથી ૨ નોંધો સ્પષ્ટ થાય છે કે કે ૩૮ સાહિત્યકારોએ એમના વિકાસમાં પોતાના શિક્ષકોનું પ્રદાન હોવાનું દર્શાવ્યું હતું તે શિક્ષકોના માધ્યમિક કલાના શિક્ષકોનું પ્રદાન સવિશેષ રહ્યું હતું, ઉચ્ચ કલાના શિક્ષકોનું પ્રદાન માધ્યમિક કલાના શિક્ષકો કરતાં વિશેષ રહ્યું હતું, માધ્યમિક અને ઉચ્ચ કલાના શિક્ષકોના પ્રદાનના સાતત્વનો પણ ધોઢા સાહિત્યકારોએ અનુભાવ કર્યો હતો.

शिक्षकनो संपर्क : “शिक्षकना व्यक्तिगत संपर्कथी साहित्यकारना साहित्यकु दुष्टितुं धृतरे विशेष थवा आम्बुं हतु ?” आ प्रश्नना उत्तरपे प्रयास साहित्यकारेना प्रतिभावोमां भगवती भाविती सारणी ३ मां २४ करवामां आवी छे.

सारणी ३

दुष्टि-धृतरमां शिक्षकना व्यक्तिगत संपर्कना प्रदान विशेष साहित्यकारेना प्रतिभाव

हा	ना	वर्णगत संपर्क	संहित्य	कुल
२६	१९	७	७	५०

सारणी ३ तुं अवलोकन दर्शने के के ५० मांथी २६ साहित्यकारेने जेमनी साहित्यकु दुष्टिता धृतरमां शिक्षकना व्यक्तिगत संपर्कनुं विशेष प्रदान दर्शव्युं हतु, सात साहित्यकारेने जेमना शिक्षकना वर्णगत संपर्कना प्रदानते स्वीकार्युं हतु.

शिक्षकनो व्यवहार : “शिक्षकनो क्यों व्यवहार साहित्यकारनी सर्वनात्मकता भाटे प्रेरक ह्यो हतो ?” आ प्रश्नना उत्तरपे जेम तारसी शक्तुं के शिक्षकोंनो त्रय आपते के ते विवार्थी साथे थपेको व्यवहार जेनी सर्वनात्मकता भाटे प्रेरक रहो : (१) प्रेतसाधन, (२) धृतर अने (३) आभीयता.

(१) प्रेतसाधन : प्राप्त भाविती मुख्य प्रेतसाधक व्यवहारना विशिष्ट पासां आ मुख्य हतां : विवार्थीने उत्तम साहित्यना जेगाय फ्रेवरी अने जो वाचना प्रेरणा आपनी, पेताना अंगत पुस्त-अक्षयो विवार्थीने वाज आपनो, पुस्तको लेट आपनी, शम्भूकोंनो उपरोक्त समाजदर्शो अने शीघ्रपनो, साहित्यनिक जगतपो, साहित्यप्रति वनीकु १२वी, पेतानी साहित्यकु दृतियोना परिचय करवो.

आभीयता : आपत भाविती मुख्य विवार्थी प्रेतेनी चिक्कटनी आभीयताना विशिष्ट पासां आ मुख्य रब्बा हतां : विवार्थीनी अभ्यास अने आधिक आपते चिंता सेवनी, विषय-पक्ष-हाती अंगे भागीक्षणी आपनु, जेना विकास भाटे व्यक्तिगत नोंद राख्नी, प्रेरक पत्रव्यवहार करवो, स्वजन-सरणी हुँडे आपनी.

जेता प्रश्नना उत्तरपे विशिष्ट भाविती भारणी ४ मां २४ करवामां आवी छे,

सारणी ४

सर्वनात्मकता भाटे शिक्षकना प्रेरक व्यवहार अंग साहित्यकारेना प्रतिभाव

व्यवहारविशेष :	प्रेतसाधन	वउतर	आभीयता	संहित्य	कुल
साहित्यकारेनी संपर्क :	१४	२३	६	४	५०

सारणी ४ सुचने के के शिक्षकोंनो जेमना साहित्यकिम्बु विवार्थीज्ञा साथेनो व्यवहार धृतर-वक्षी विशेष रक्षो लो. शिक्षकना आभीय व्यवहार करवां प्रेतसाधक व्यवहाररुं प्रभाष्य विशेष रक्षुं हतु.

शिक्षकनुं अध्यापन : “शिक्षकना अध्यापनी कर्त विशेषता साहित्यकारना धृतर भाटे व्यवहार हती ?” आ प्रश्नना उत्तरपे जेम तारसी शक्तुं के शिक्षकना अध्यापनी आ वार्ष विशेषना साहित्यकिम्बु विवार्थीने अंगी सर्वनात्मकता भाटे प्रेरनी रक्षी हती : (१) अभिव्यक्ति, (२) प्रख्यातियो अने (३) प्रवृत्तियो.

परिचय-विवार्थीवांक]

१६८६/ओऽटो.-नवे.

(१) अभिव्यक्ति : साहित्यकारोना प्रतिभावेमाथी विशिष्ट लक्षण आ मुख्य होता : शिक्षकनी भाषा व्याकरणशुद्ध होती, उच्चारणो शुद्ध होता, जटी अभिनय साथे रजुआत करती, भाववाही विवारामध ग्रन्थावध अने रसभर्ष २०४०आत करती, असरकः२५ २०४०आत करती शक्ता माटे पूर्व तैयारी करेली होती, अध्यापनना वरत्तुरूप जे ते कृति विशे प्रेताना समीक्षात्मक प्रतिभाव आपा शक्ता, द्वितीय रसेदर्थनि करावतु.

(२) प्रयुक्तिमें : अध्यापननी असरकारकता माटे तास(Period)मां समित समय माटे अग्नानावता विशिष्ट अभिनमने रौक्षण्यिक प्रयुक्ति (Educational Device) की शक्ता.

प्रत्युत अव्यास माटेनी प्राप्त साहित्यी मुख्य शिक्षकों द्वारा आ मुख्यनी प्रयुक्तिमें अव्यावहारामां आनती होती : साहित्यकृति अने साहित्यकार अंगे विशेष वातो—संदर्भकथन करतु, द्वितीय भाववाही पठन करतु, वार्ता करेली, काव्यत्वनु गान करतु अने विद्यार्थीते गावा प्रेरना.

(३) प्रवृत्तिमें : अध्यापननी असरथी संनीयेत साहित्यिक आधारवाहामां थेणी नामेनी प्रवृत्ति-ओथी साहित्याभिमुख विद्यार्थीं विशेष लाभान्वित थेणा होता : स्वयं विक्षय, अनुवाकार्य, नाटनी-करण, अंड-प्रकाशन अने पूरक वाचन.

पाठ्यमा प्रक्षना उत्तरपे भलेली भावितीते आरण्य ५ भां २०४० करी छे.

सारखी ५

शिक्षकोना अध्यापननी विशेषताओं अंगे साहित्यकारोना प्रतिभाव विशेषताओंनी पासां : अभिव्यक्ति प्रयुक्ति प्रवृत्ति संहित अनुत्तरित दुख साहित्यकारोनी संभ्या :

१२.	१०	३	५	२०	५०
-----	----	---	---	----	----

संख्या ५ तु अन्वेषण करता स्पष्ट थाय छे के शिक्षकोना अध्यापननवदरूप अभिव्यक्तिरूप प्रतिभाव आपनारा ३० साहित्यकारोनांथी सौथी वधु संभ्या (१२)ना साहित्यकारोना घडतर भाटे प्रकाशक रह्यु होतु. ज्यारे प्रयुक्ति अने प्रवृत्तिनां पार्सा अनुके दस अने नाय साहित्यकारोना दिसाओंमा असरकारक नीवउतां होता.

तारश्चो : प्रत्युत अव्यासनां तारण्य आ प्रभावे छे.

१. मोटा भागना साहित्यकारोना घडतरमा अभना शिक्षकोनो झालो होतो.

२. साहित्यकारोना विकासमां अभना आधिकारी थाणाओना शिक्षकोनु प्रवन विशेष दहुँ.

३. साहित्यकारोनी साहित्यिक दुवितु घडतर अभना शिक्षकोना मुख्यते वक्तिगत संभर्ती थयु होतु.

४. साहित्यकारोना विकासमा अभना शिक्षकोना व्यवहारभांथी सभान रीते साहित्यकारु घडतर करतातु पास्यु लीथी वधु असरकारक होतु.

५. अध्यापन दरभान शिक्षकोनु अभिव्यक्तिडौत भावित्यकारोना विकास ५२ सौथी वधु प्रभावक होतु.

अध्यापनां शैक्षणिक इक्विटी : साहित्याभिमुख विद्यार्थींनोना विकास अर्थे प्रत्युत अव्यासना ध्यानपात्र शैक्षणिक इक्विटी आ प्रभावे छे :

१. साहित्य प्रत्ये विशेष दुवित घरावता विद्यार्थींनोने भाषाशिक्षक ओणभवा-तारतना सक्तिप्रवन करेवा नेहजे.

२. साहित्यक्षी विद्यार्थींनो साथे व्यक्तिगत के जूऱगत संपर्क जणववे। नेहजे.

३. विद्यार्थीज्ञाने भाषा अने साहित्य अंगेनी पायानी संकल्पनाएँ आपवी लेईज्ञे अने जहरी डोखेवा डेणववा दिशास्यन करवु लेईज्ञे.

४. विद्यार्थीज्ञाने रथेव दृतिने अपवेक्षने प्रात्साहक भार्गदर्शन अने मुवारणा अंग चोक्स सूचने करवा लेईज्ञे.

५. संडैचशीक्ष के बधुभान धरावना सर्वनक्षी विद्यार्थीने तारकी जोगानी अनामां आत्म-विश्वास विकसानवा लेईज्ञे.

६. विद्यार्थीज्ञाने गेतानी वायनकार्बडम निकाववा प्रेरवा लेईज्ञे.

७. विद्यार्थीभां साहित्यप्रति जन्मे जगे अने विक्से ए हेतु लक्ष्मां राखीने शिक्षक वत्रामां असरकारक अविवृतित करवी लेईज्ञे.

८. शिक्षके गेतानी अविवृतित असरकारक अनाववा जहरी डोखेवा डेणववु लेईज्ञे.

९. शिक्षक व्याख्यान सिवायनी पछ अद्यापननी ईतर पद्धतियो अने प्रयुक्तिएँ अजमावीने विद्यार्थीज्ञानां साहित्य-प्रति विकसाववी लेईज्ञे.

१० शावेय कर्मकोमां विविध साहित्यिक प्रयुक्तियोने स्वान आपवा उपरांत शिक्षके अंग आवे रहीने साहित्यक्षी विद्यार्थीज्ञाने सर्वन करवा उत्साहित कःवा लेईज्ञे.

पाठीया

१. किमांशकृ जेती(संपा.) "सर्वकनी आंतरकथा", पहेली आवृत्ति, गोगांवी ट्रस्ट प्रकाशन, १९८४
२. ईश्वर परमार, "सर्वकनी आंतरकथामां शिक्षक", प्रत्यायन, जन-सुन्मारी, १९८७, पृ. ५-८

[अनुसंधान या, प८ था]

के पुराणकालनी संस्कृतिनी प्रसस्ति भाव नदी, पछ आवे समकालीन प्रवंगा पावो अने परिवानो-रमारक पछ के. अदारमी-गोगायुसीनी सदीना क्वचनां लेक्कुवन अने गोगाङोतु दर्शन करावती आ क्लास-पति आ युगे माटे मूल्यवान अने उपगोपा वारसो के. भूतक्षणना भुव्योनी सम्बता सर्वनवाचित तेम सीर्व्यभान समजवाने ज्ञानां साधन भणा रहे के. आ कमांगरीना नमूना तदन नष्ट थय ए पदवां अनी सरस प्रातङ्कितिया थी लेईज्ञे अने योग्य जगत्तु थी अते जहरी के. मुक्तियम तथा आवना महेव ज्ञेवा सार्वजनिक सुरक्षित स्थगेये तो भूती संभान सावे आ क्लानमूना सच्चाई रखा के, पछ आनगी ज्ञानां महानोमां आ वारसाने तुक्कान थष्ट रखु छ अने भयावहु जहरी के. महानोतु ज्ञानां नवकर्जन थय के त्वा आ अवशेषे लुम अनी ज्ञानो थय के. भारतीयना-कृष्णीयताना प्रतीक-समी अने आकना दर्शकने आनंद आपती चित्रकला पुनरुत्थान मागे के. भांतियेना उत्तम नमूनाओनी योग्य जगवणी अने मुलवर्णी थरो अंगी अपेक्षा सी क्लाप्रेमी राखे ए स्वाभाविक के. के. ओसवाणी झण्डु, मुन्दा (कृष्ण)-३७०४२२

नोंद्वः: 'कमांगर' नी न्युत्पात निशे उपर श्री गोडावाल परमारी धारणा अमने प्रतीतिकर लाभती नदी. आ चिनकरी क्वचनां मुस्किम भेटे लागे के एटले आ शब्द असलमां 'कमांगर', केनो नजुकोने विकास 'कमांगर' के. 'कमांगर' नो भूम अर्थ तो 'धूतुष ज्ञानवानार' के, पछ पठीयी क्वचनां चित्रकारन अर्थमां रह थयो ज्ञानां के. सं. कर्वकार, भ्राकरमआर, ए स्वाभाविक कम के. -तंत्री पथिक-हीप्रात्सवांक]

१९८६//ओडाटा.-नवे.

કબ્રણની કમાંગરી કલા।

શ્રી. સંજય. ગી. ભડકે

ક્ષાન્સ અને રેપેન ખાતે આવેલી ડેટલીક પ્રાચીનતમ ગુદ્ધાયોમાં ભીતો અને છત પર ચિન્તા તથા રંગપુરણીની કળાસ્કર અંગેના પુરાવા મળ્યા છે. આ ભીતચિનો અને એનું રંગકામ જોક વૈજ્ઞાનિક અધ્યાત્મ તાત્ત્વથી સુખા ઈ.સ. પૂરે¹ ૩૦,૦૦૦ઠી માંડી ૧૦,૦૦૦ વર્ષના સમયાળણમાં હોવાર થયા હત્યા ! આ રીત સૌંદ્રી પ્રાચીન ચિત્રો અંદરને ૩૨ હન્દુર વર્ષ જ્યાં હોવાતું મનાય છે. અણિયાની ચિત્રકળાના આચીનતમ અવરોધ અભ્યાની ગુદ્ધાયોમાંના લાંબિયા છે. નેક એના અસ્તિત્વની ભાગ નીચે હુનિવાને છેક સને રેટાદ માં પહેલાંથી વર્ક હતી. અભ્યાનાંના લાંબ્ય શિથ્યો અને એનાથી અભ્યાન લાંબ લાંબિયાની કલા જેવી ઉત્કૃષ્ટ ચિત્રકલા, કબ્રણની ભીતચિનીકલા કે એને કબ્રણમાં ‘કમાંગરી’ કે ‘કમાંગરકલા’ જેવા ચિશેષ નામ અને લાંબિષ્ટ શૈક્ષણિક નામે ગોચરાય છે, તેમાં જેવા મળે છે. કબ્રણના લોકપરંપરાના ચિત્રારાને ‘કમાંગર’ કહે છે. શ્રી પ્રેરણિદાષ પરમાર ‘કમાંગર’ શ્યામ વિશે નોંધ છે કે ‘કમાંગર’ સંસ્કૃત ‘કર્ગાદ’ પરસા હતા. પ્રેરણ કર્માદ્ર ‘કમાંગર’ અને ‘કમાંગર’ થયો છે ત કામ કરનાર’ ચિત્રારા તરીકે રથાન પાંચો છે. એણો લગ્નપ્રથમને કે હિંદુઓમાં વેર વેર ડાથાયોડા ચીતરો આપે છે.

બી’ંત પર ચિત્ર ડરવાની પ્રેરણું માયુસને આદ્દાલારૂ મળ્યો છે. હજારો વર્ષ પહેલાંના પાયાખુગના ગુદ્ધાયોમાં ક્ષાન્સ રેપેન આદ્દાલા ચીન લંડા અને સારતરાઈમાં માનવ પોતાના સમયના લાવના અને સંરક્ષણના ગોંધાયોણા આપ્યો છે. ઘરમાં કે રાજકાળનામાં અયારા અંતઃપુરમાં કે દેવરથાનનીં ભીતચિનોમાં સર્વ પ્રકારના લાયો અને રેપેન અનુકૂળ કીયાયો પ્રકાશ મળ્યો છે. સહીએ પહેલાની ભીતચિનીકલાના ઉત્કૃષ્ટ નમૂના હજુ અને પણ ગુજરાતનાં ગામડી મંડિરો હેઠાયો અને જૂના રાજમહેલમાં સચ્યાયેલા છે. રાજરથાનાં ભીતસુરોલન માટે સાગેણી ભીત પર પાડી ચિત્ર કરવાને રિવાજ જૂનો છે, તો ઉચ્ચાના પણ અનુકૂળયો મહોદી. મહોદી મહાનોમાં અંદર-અહારની ભીતો પર ધર્મના, વારોના પસારોમાંના તમજ રસિક વિષયના પિત્ર પૂજા જ મ્રમાણુમાં અસ્તિત્વ પસારે છે ! એમનીં લોકાના મનમાં ચિત્ર માટે આદર અને રાસ્કડા ટકા રહ્યા છે.

ગુજરાતના ભીતચિનોની આચીનતમ પ્રથમ ધ્યાન આપવાનો વચ્ચે લાવનગર રાન્યને આપવો ઘટે છે. ચિહ્નારના જૂના રાજમહેલમાં ખાડ્યો ભીત પર ઉપરના ભાગે લાંચા પટમાં વખતિની છુટીકોરે ચીતળ પર ચ્યાર્ટ કરી ચિત્રણ મેળગયો (ઈસ. ૧૯૫૩) તેનાં સુખ્ય પાત્રો અને સેનાની ચિત્ર આ ચિત્રપદ પર કંબાચાં છે. આ ચિત્રો કમાંગરી શૈક્ષણિનાં છે. ઉપરાત્ત લામનગર-લાપેણીમાં પણ કબ્રણી કમાંગરોને કષાય કંગરાયેલો છે. ગુજરાતના કલાચ્યુનું શ્રી રચિષ્ઠાંકર રાજી કહે છે : ‘કમાંગરી કલાના કમાંગરો મોટે ભાગે રિશ્વપકળા સાથે સાંત્રણિત હોય છે, તરી અમનુ’ કાર્ય ચિત્રપદ ઉપરથી સુલાદીકળા તરીકે આવ્યાય છે, કારણ કે આવ્યા જ પ્રસંગાચયત આરતસી તકાયોમાં ઉપસાવેલો આડુતિયોમાં કોતરાયાના અચીનતાની તેન સંસ્કૃત સાંક્રાન્તિકમાં અધ્યાત્મિક તરીકે ઝોણાયાયો છે. આ કારીગરો જ્યાં કામ મળે તે રથ્યે જરૂર કામ કરો આપના, તેણે પ્રવાસી કલાકારનું જુન ગુજરાતાને કેમદી; જામ વિજાળા વખતમાં લામનગર કબ્રણાંથી આવેલા કમાંગરોનાં હુદ્દું પણ વસલ્યાં જામનગરના મહેલની હોડીની ભી જ પર ભૂલર મેસેનું હુદ્દ ચોતરેલું છે એને

જૂતા રાજમહેરી એક મેરીમાં એ સમયના જાપનગરના લોકજીવનનાં ચિત્ર ધર્શી વિગતે છત તેમજ બીત પર કંઈ કમાંગરોએ ચીતરેખાં છે.

કંઈનાં અનેક મફાનેમાં ભીતચિત્રાએ. મારી તાહુકાના મેરી રાયથું ગામમાં ઘોરમનાથના ભાગાની ડેવીમાં 'કમાંગરી' એ તેમાં ચિત્રવસ્તુનો વિસ્તાર ધર્શું છે. અનારમાં કંઈના અંગેજ અમલદાર જેસ મેકમરોના અંગલામાં અણે પોતાના મધ્યખંડની ચારે દીવાલો રામ-રાવશુદ્ધ, અશોકવનમાં સીતા, લંકાદાહન, જોવર્ષનખારી કૃષ્ણ, કાનગોપી, હરિશુદ્ધ, મુગ્યા વગેરે હસ્તો અને પણીઓ તથા ઇલ્લેખાના આકારોથી સકરે બેચેલી તે બીતાં મોનાર ટેખાય છે, ઈ.સ. ૧૮૮૮ માં મેકમરોએ પોતાને અંગલો બંધાવેલ, જેમાં ૧૯૮ વર્ષ પહેલાના ચિત્રથું જેવા જેણે છું. ભૂજના કંઈ-મુજિયમનાં નાગપંચમીની સવારીના ચિત્ર લેખેને તાજું થઈ જવાય. ચિત્રાની લયપદ્ધ પંક્તિઓ અને કમાંગર વાડા જુમાએ ચીતરેખું હિન્દુ ઠન્યાના લગતની મોરીનું એક દર્શન લોઈ અદ્વિતીય પોકારી જવાય. આધાના-મહેર(ભૂજ)ની કમાંગરી-ઈ.સ. ૧૭૬૨ માં એટાએ કે આનથી સરાખસો વર્ષ પહેલાનો કંડા તરણના દરારારદમાં રાનાયથુના પ્રસંગેનું સંગંગ આવેભન થેથે છે તેમાં જાડ પાણ પણ પક્ષી હેચ ગાર્વંશ રદ્દાસ વગેરે આદ્દૂર્ય આતીગાર રંગાથી ચીતરેદા છે, સારાપસ્ના સુખાનાં દરારાના ભીતચિત્ર કમાંગરી. પદ્ધતુંવના કેરણ કે જ અભ્યાસી હશે એને ઘ્યાય આપે છે. સગરીના દર્શયાં વેડાઓની જે વિચિત્ર આવતાહી આદૃતિઓ છિદ્રાવી છે તેમાં કાલ કરી હેચાયું છે. આ ચિત્રોમાં ચીનપૂર્વક અભ્યુ પોતાની પ્રાચીન પ્રશ્નાલિકા સાચી છે. શ્રાવસિંહજ રંડોડે પોતાના મુસ્તબ કંઈનું સંસ્કૃતિર્દનન્માં જગીના અભાગના ચિત્રોની વિગત નોથી છે. જગીના અભાગમાં મેંઝુદાનાં લક્ષ્ણ મુગરાજ માધવદાસ વગેરે તેમજ પાવદિયો વગેરે અભાગના સેવકોનાં ચિત્ર છે. મારીમાં 'ભૂતિયા બંગલા' તરંક ઓળખાતા ભક્તનાં અંદરના ઓરાદાઓની દીવાસ પર એકોસો વર્ષ પહેલાની કમાંગરીકલા હેલાનું શ્રી સરેન્દ્ર ઠાકેર નેથ્યું છે. આ અંગલામાં કુદરતી રજીના ઉપયોગો મેરા પોપટ કંઈનું જેવાં પક્ષી ચીતરવામાં આંબાં છે, જેના ૨૦ આજે એક કદી પણ પણ કમાંગરીકલાના અદ્દૂર નમૂતા દીવાલે નહેલા હેચા છે. સુન્દરાંશુ શ્રી પ્રકૃદ્ધશંકર વૈશ-દસ્તકના શ્રી અંલલિયાના ભક્તનાં પહેલે માણ સવાસો વર્ષ ડાર્યાં ભીતચિત્ર હશ્યું આજે સારી સિદ્ધિતમાં છે. કથ્યે મારી ખરી નથી કે રંગ જીવાનથી. સુન્દરાંશુ ડ્રાઇક ચિત્ર જાંખાં થઈ ગયું છે અને કથ્યાં એંગરાશીને લીધે જાધા પરી પણ ગયા છે. ચીતરદે સણંગ રેખાકન અને રંગપૂરણી કુદર રોતે થયેલ છે. અછો કમાંગરોને મન બીત મોદો ચિત્રવદ્ધ છે. પ્રયોગ પૂરો થાય ત્વાં ચારે તરફ લીટીની હડ મારો, અધ્યાત્મ ડોઈ આદ્વિક ભાત પાડી, અડોબઢ મીલું ચોકહું પાડી હુદે પ્રસંગ મૂખ્યો છે. અન્ય ધર્શી જગ્યાએ હાઈ પાણ શું કરે છે અને હેલાનું ચિત્ર છે એનો અશ્વરંતાં પણ હેલ્પ છે, જ્યારે સુન્દરાંશુ ચિત્રોમાં એટાનું નથી. અન્ય સ્થળોનાં ભીતચિત્રોની નેમ સુન્દરાંશુ પણ શિક્ષારાના દર્શે, રાજશાહી વખતની સવારીનાં દર્શો, દેવતાઓના ચિત્રો, ઇલ્લેખ વગેરે ચિત્રાદ્વિક ચિત્રકારીનાં દર્શન કરાવે છે.

કંઈ ગેંગટિયરે અને શ્રી રામચિંહજ રંડોડે નેથેલ છે એ મુજબ 'કમાંગરોનો વિકાસ કળાપ્રેમી રાય લખપતળ(ઈ.સ. ૪૭૫૩-૧૭૬૧)ના વખતમાં થયો' ઈ.સ. ૧૮૮૧ ની સાલના એક અંગલ પ્રમાણે કંઈમાં છાં કમાંગર હતા. આજે જાગરીના વેઢ ગણી રાકાય તેટલાયે નથી! કંઈની આ ઇલાનો ગેસન અદારાની સીતા ઉત્ત્પાતી જોગયુંસની સીતાની પૂર્બજીતાને પાઠ્યાનો એક અંદાજ છે. કંઈમાં ભીતચિત્રોનું આવેભન યુમ ચિહ્નત અને સાચુદિયાયક ગણુંશું છે. લેણી પોતાનાં ધરોનાં દૂરો ઊપર અને જાંચા દીવાલો ઊપર અંગલ પ્રસંગેએ ચિત્રો અચૂક હેરાવતાં, ઠાકર-મરિના ઓરાંડા પાંથી-નીપોત્સલ્વાંડ]

અને સાતું -સંતોનાં રહેણેથોડા ખર્ચિક ચિંતોનું આવેખન થતું. કદરાઈજોના બેઠકના ઓરડા તથા કડરાઈજોનાં અંતઃપુરા ઓરડા વિવિધ રૌલનાં અને ભાવલસાર્યો ચિંતો વડે શાળગરવામાં આવતા.

ભીતને ચૂના અને ચિરોલીથી લીસી કસોગેને એ તાજી ચૂના ઉપર મુખ્યત્વે લાલ કે કાળ રેખાઓથી સાથી કરેલા રેખાચિત્ર અને એમાં સપાટ ભરેલા વિવિધ મૂળ રંગોથી આ ચિંતો તાપદી એક વિશિષ્ટ રૌલીનાં જીવી રહે છે. ખજૂરીના દૂષા પાનની ખોંઢી વડે રેખાઓ આવેલ્લા એમાં લાલકદર રંગો પૂરેલાં ભીતચિત્રો આને પણ એટલાં જ સુંદર અને રખીનું છે, એકસરખી વદ્દ રેખાઓની આદૃતઓની અહીંતાની રંગમણ આપીને કમાંગેર ભીતચિત્રો નેત્રાઈક જનાયાં છે અને કદરી કમાંગરીને ગૌરવ આપીનું છે. શી. ન. મ. જોશી કદરી કમાંગરકલા વિશે પ્રકાશ પાડે છે કે 'બંદ્રખરનાં જિતોમાં રાજસ્થાની અમસ દેખાય છે, તો રાયથામાં હાહ ધારમનાથ પ્રત્યેની ખર્મભાવનાં યાગાં ચિંતોનાં અજીતાની છાપ તર્ફી છે, જ્વારે જૂનના આયના-મહેષુદ્દીનાં મુખ્યલંબોદ્ધી રખી નેટી રીતે રાજસ્થાન અને મુખ્યલક્ષણાની વિશિષ્ટતા વડે વણ્ણાયેલી કદરી કમાંગરકલા કાબાદ છે!'

આ કમાંગરી ચિત્રકારાના ચિત્રકારો-કમાંગરો કોણું? આ પ્રતીતા જવાયાર્થી શી દુરેશ દીજાંકિયા કરે છે કે "સમય ધતિકાસમાં એ ચિંતો નીચે ડાઈ નામ કે માદિતી નથી, માત્ર જોખપુરના રાજ અભ્યસિંહના ચિત્ર પાછળના વાખાણમાં 'કમાંગર જ્વાળ દસન' વંચાય છે. ઉપરાંત બખ્પતળ અને દેખણાના એ ચિંતોની કમાંગર દેખાય છે તેથી એમ નક્કી છાપ છે કે કમાંગર નામના ચિત્રકારો ચિત્રજ્ઞાનું કામ કરતા થાના. એ એમનું ધંધાતારી નામ લાગે છે. એઝો આ કાર્યમાં એટલા પ્રખ્યાત ચથા હુશે કે એ 'કમાંગરો કણા' કહેવાય છે. આ કાર્યમાં સુર્કિસ્મો વચ્ચે વધુ દેખાય છે."

આ કલાકારો સુર્કિસ્મે વચ્ચે હતા એ વાતની ગવાડ પૂરતાં અન્ય ભીતચિત્રોનાં પણ કલાકારનાં નામ મળે છે. હિન્દુ રંગના લગ્નની ચોરીનું દરખ છે, જેમાં ચિત્ર નીચે 'કમાંગર વાઢ જુદી' લખેલ છે. ઉપરાંત, ટ.સ. ૧૯૬૬ સાં ભાનાવાયેલું એક ચિત્ર છે તેમાં જાહેર વીરચૂડમણી રાજેગાર પહેલા અમભાવાદના આદ્યાંહ મહેષુદ એગારને શિકારાના સિંહના પંગમાંથી અચાન્દે છે અનું ચિત્ર છે તેની નીચે 'લચુ અલા કમાંગર ૧૯૨૨' એથું લખેલ વંચાય મળે છે. ૧૯૨૨ એ રિકમ સંવાદ છે.

વિશુદ્ધા કલાકારો અને વિવેચકો નેંબો અભ્યાસ કરે છે તે કચ્છના કમાંગરીકલા વિશે કચ્છ જોગેટિયરે ને નેંબી લીસી છે તેના બાંસ (મૂળ અંગેજ પરથી ગુજરાતીમાં) અને પ્રસ્તુત છે: 'કચ્છ પાસે એની પોતાની અભરી ચિત્રકળા છે કે જે 'કમાંગરી'ના નામે એણાભાય છે. કમાંગરીકામના જૂના અને આદુનિક નમૂના કચ્છમાં ફેરફાં કર્યાયે જેવા મળે છે... પ્રાણીઓ પણ્ણો ફૂલો, રોજબોરનની જિંદગીના પ્રચુરો, રામાયણ અને મહાભારતના દર્શય, હાથીઓની લખાઈ અને હરખાનાં શિકારના ચિત્ર અસાધારણ સૌદર્યથી દોરવામાં આગળ છે કે જે એમની કલ્પનાને પૂર્ણ રૂપ્યા અભિવૃક્ત કરે છે... આ રંગીન ભીતચિત્રો ૧૫૦ વર્ષ પહેલાની કચ્છના કમાંગરોની અહૃતુત કળા વિશે સારો પરિચય આપે છે.'

આ રસમણાથું જેવી લીસી ચિકારથી ભાંતો પરની આ ચાક રંગવાળાં ભીતચિત્ર આપણું નિર્બંધ અનંદ અર્થે છે અને રોકાણ પહેલાની મેનમુલ ચિત્રકારીની દર્શન કરાવે છે. બોક્લાંગનાં અહેંાવતી આ કળા ના હયાત નમૂનાઓનો પર સરકાર અને વિદાનો આ આસતની નેંબી દરવામાં ચિત્રાં કરેલો તો ગત યુગના નમૂનાઓનો દોપ અંગ જ્વાનો પૂરો કથ છે. ભીતચિત્રોમાં જૂનીકાળની [અતુસંધાન પા. ૫૫ નીચે] [પથીક-હીપોતસવાં]

પ્રાચીન ભારતવર્ષના લહિયાઓ વગેરે

[એમની લેખન-પ્રવૃત્તિઓ, ઈ.સ. ૧૩૦૦ સુધી]

ડૉ. ચંદ્રકાંત હ. લલં

એક પણ સંસ્કૃતની મહત્વાની લેખન અને વાચની પ્રવૃત્તિઓથી અધ્યાત્મ છે. આ દખિઓ ભારતીય સંસ્કૃત ઉચ્ચત કષાણી હતી. એક તરફ બ્રહ્મ તથા તત્ત્વજ્ઞાન વિકસન્યા અને બીજી તરફ એક ગણિત વિજ્ઞાન તથા ટેકનોલોજીની ક્ષેત્રોમાં પણ સુંદર પ્રદાન કર્યું. આ સિક્ષિઓ પ્રાચીન ભારતવર્ષની શર્દી ગ્રનેલા લેખનો અને વિચારકો વગર જાકય ન અનન. પ્રાચીન ભારતવર્ષના માત્ર મૌખિક પરંપરા (Oral Tradition) ન હતી, જાનને અંધર્ય પણ કરવામાં આવતું અને અંધો દારા જાનતું પ્રસારણ થતું.

પ્રાચીન ભારતીય સંસ્કૃતના સાધન તરીકે હસ્તપ્રોતોનું મૂલ્ય બાળું છે, કારણ કે શ્રદ્ધા જ્ઞાન-વિજ્ઞાનનું માધ્યમ અને જો આવા પ્રાચીન સમયમાં હસ્તલિખિત સ્વરૂપમાં હતા, આથી હસ્તલિખિત અંધો સુવાચ્ય અને એ આજ્ઞાને લીધે પ્રાચીન સમયમાં અંધો કષાણ અને એની પ્રતિલિપિઓ તૈયાર કરવા આટે એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો હતો તે ‘લેખક’ ‘લહિયા’ ‘કાયસ્થ’ વગેરે નામેથી પરિચિત થયો.

લેખક અંધોંનું લિપિકાર લહિયો અંધરચનાપ્રક્રિયામાં સૌથી પ્રમાણ પણે છે. ‘લેખક’ શાસ્ત્ર લેખકિયાના કાન્તિની માટે પ્રાચીનાં પણ શાખા નથી. આના ઉલ્લેખ રામાયણ મહાભારત જેવાં મહા-કાણ્યોમાં પણ આવ્યા છે. પ્રાચીન સમયમાં ‘લેખક’ હેતું એ વ્યવસાય પણ હતો અને લેખનકાળની પ્રતિક્રિયા પણ વધી હતી. વિનયધિકરણમાં લેખનકાળની પ્રતિક્રિયા અતાવાઈ છે, જાતકોમાં પણ આવા ઉલ્લેખ થયેલા મળે છે. લેખકના ચુણું ડેવા હેવા નેટીઓ એના ઉલ્લેખ મત્સ્યપુરાણે અને ગુરુપુરાણમાં મળે છે. શાર્ગંધરયાહીનિર અને પત્રક્રમીમંડ રાજ્યલેખકના ચુણોની લાંબી સુચિ આપવામાં આવી છે. આના અતુસાર એ સર્વ ભાગનો નિપુણ હોવો જેણીઓ એમ અતાવ્યું છે. મૌરેના સમયમાં લેખક પ્રશાસકીય તંત્રના એક સહય તરીકે રહ્યો છે. સાતમો સહીના એક અગ્રગંત અભિલેખમાં લેખક વિજોના ઉલ્લેખ જાણવા મળે છે કે એ રાજના પોતાના સયિંગોમણો એક હતો, જેનાં અવિકાર અને કર્તાંય વધી ગમેલો દાંનો.

લહિયા: પ્રાચીન ભારતવર્ષમાં દિપિ અંગેનું સર્વકાર્ય આકાશ અધ્યાત્મોને હસ્તક હતું, પણ આ કાર્ય લખવું અને અધ્યાત્મ એ મેમાં જ સોમિત થઈ જતું હતું, પરંતુ આ વર્ગ ઉપરાંત બીજે એક ધારામાં વર્તે પણ હતો અને એનું ‘આજુવિકાનું’ સાધન પણ લખાણ લખવા સિવાય બીજું હતું નહિ; એ ‘લેખક’ તરીકે જોગાવા લાગ્યો. વિરાટકાંયો મહાકાંયો અને બૌદ્ધ સાહિત્ય “લિપસ્યુનીવાચિય”માં આ પ્રકારનું પ્રાચીન નામ ‘લેખક’ હતું.^૧ “કૌટિદ્ય અર્થશાસ્ત્ર”—માં પણ આ નામનો ઉલ્લેખ આવે છે. આ નામનો ઉલ્લેખ અભિલેખમાં પણ થયેદો છે, પણ અધ્યક્ષરે આ નામ માટેનો અર્થ હસ્તલિખિત અંધોનો પ્રતિલિપિક અથવા લિપિકાર “કલાકાર” કર્યો છે; જેણો ચોકુંસ નથી.^૨ અભિલેખમાં લેખક વિજો કે ઉલ્લેખો આવે છે તેમાં લેખ કે કે વ્યક્તિ દારા તૈયાર કરીને એને તાત્કષેપ કે પથ્થર પર અતરવામાં આવતો તેનું સુચન હો છે. ખરી રીતે લેખ પથ્થક-દીપોત્સવાં^૩

૧૬૮૫/ઓફાટો.-નવે.

૫૬

तैयार करनारेन ०४ 'लेखक' की थकाय, ज्यारे हस्तविभित अंशोंनी प्रतिविधि तैयार करनारेन परं 'लेखक' कहेवाय छे. प्रतिलिपि तैयार करवानु' काम एक विशिष्ट प्रकारने धंशो छे, परं धंशाक्षय प्रतिलिपिका उपरांत स्वीक्रो, एमाय आस करीने जैन साध्वीओं साहुओं अने सामान्य मार्गसोऽग्रे परं वा जनतनु धार्मिक संकुट करवानी तीव्र धड़ा राखीने लाग लीवेल छे ॥

उपर कहु तेम लाइट्स माटे सामान्यतः प्रयोगेवो सौथी प्राचीन शब्द 'लेखक' होनो. आ संदर्भमां ऐ शब्द अंथकार नहि, परं लिपिकारना अर्थमां प्रयोगेवो. आना उत्तेज पूर्व नेह यथा ते प्रभावे रामायण भद्राकारत तथा श्रीक साहित्य अने जलडीभा परं यथा छे. आ परथी सेखतनी कला अने अनो व्यवसाय अस्तित्वमां आवी यूक्तां हतां एम स्पष्ट याय छे, एमा बिक्षुजीवोने धर्मियोंनी नक्त करवाना उपयोगी व्यवसाय आटे लेखनकला शीख गानी छूट आपवामां आवी छे अने डाई छोकरो लेखनामा अवसाय अपनावे तो पोते अनु शुजरान शान्तियो अने निरातथी करी शक्तो एम ज्ञानायु छे.

शब्दतंत्रमां राजक्षय आज्ञाने लगतां अने हस्तावेल प्रकारनां लभाषोनो मुसद्दो धडवा आटे तमज्ञानी ज्ञान फडी अने तेथी एवा कर्मचारीओनो परं विकिष्ट वर्ग विक्षेप. साहित्यमां अने अभिलेखमां 'लेखक' शब्द केटलीक वार आ अर्थमां परं वपरायो छे, 'भद्रावृग्य' अने 'जनतनु'मां आवा लभाषाना उत्तेज आवे छे. आचीन अभिलेखमां 'लेखक' शब्द धंशाक्षय वर्गना अर्थमां वपरायो छे.

'लिपिकर' या 'लिपिकर' : ई. पू. योथी शतांनीमां 'लेखक'ना अर्थमां 'लिपिकर' अथवा 'लिपिकर' शब्द वपरायेस छे. अशोकना शासनोमां आ शब्द धर्षी वार अयोग्येवो छे. संस्कृत केशों 'लिपिकर'ने 'लेखक'ना समानार्थ ज्ञानेवे छे, परं अशोकना शिलालेखोभा आ. शब्द ए अर्थमां वपरायो छे: 'लेखक' अने 'डॉतरनार', डेम्ड एमां 'लिप्य' धातु धर्षनु' अने डॉतरनुं एम ज्ञान अर्थ धरावे छे. गमना लिपिकरने केटलीक वार 'राज्यलिपिकर' कहेता. संस्कृत साहित्यनु अने आभिलेखिक लभाषानु' अध्ययन करतां भालूम पडे छे के 'लिपिकर' शब्द 'लेखक' करतां धर्षी आधी वार वपरायो छे अने ए शब्द 'लेखक' करतां 'प्रतिलिपिकर' अने डॉतरनारना अर्थमां वधारे वपरायो छे.

'हिविर': 'हिविर' लेखक माटे वपरातो भीजे याहू छे. मध्यभारतना ई.स. ८२१-८२२ ना एक अभिलेखमां ऐ पहेली वर अयोग्येवो छे. वल्लभीना ई.स. ४३१ सातभी अने आठभी सहीता लेखेमां साधिविशेषक डे के लभाषोनो मुसद्दो धरतो. तेने 'हिविरपति' अर्थात् 'हिविरेनो डॉ' कहो छे. 'हिविरपति' शब्द सूचये छे के एना हाथ नाचेना आतामां अनेक हिविरो काम करता हता. अहीं 'हिविर' शब्द स्पष्टतः आर्द्धनोनो अर्थ धरावे छे. हिविरपति भूमिदान वज्रे विपयोने लगतां राज्य-शासनो. मुसद्दो धरतो होतो. ध्यूवर लभे छे के 'हिविर' के 'हिनीर' ए झारसी भाषानो 'हिविर' शब्द छे, ए प्रायः ज्यारे ईरान अने भारतवर्ष वज्रे वेपारी संभंधो हता तेवा सासानी-समय ई.स. सातमा-आठमा शैक्षामां पश्चिम भारतवर्षमां प्रयत्नित थयो. आनी विरुद्ध हवील करता डॉ. पाठेय ज्ञाने छे के ई.स.नी सातमा के आठभी सहीमां भारतवर्षमां शक अथवा सासानी शासन न हु तेमन ईरान अने भारतवर्ष वज्रे पशु वेपारी अथवा संस्कृतिक संभंध आ सहीमा दरभान न हता. 'हिविर' शब्दनो अथवा अनो इपांतरेनो उपयोग पहेली वार सहीजो. हरभ्यान भणतो नथी. 'हिविर' शब्दनो उद्भव 'लिपिकर'नु ग्राहन ३५ 'हिविर-हिविर', सहेलाईयी थर्ष शडे छे. 'हिपिकर' अने 'हिभिर' अने शब्दानु भूग एक ०४ डरो, डेम्ड संस्कृत अने शकसी लागिनीभाषामो छे.

‘શુ-એન-સંગે’ (ઈ. સ. ૭ મી સદી) ભારતવર્ષના પ્રવાસ દરરખાન કરણીરણની મુલાકાત લીધી તે સમયે કાશમીરના રાજ્યથે દસ્તપ્રતોની નકલ કરવા ૨૦ લદ્ધિયાએની નિમણૂક કરી હતી ત્યારે લદ્ધિયાઓ તાં ‘હિવિર’ તરીકે જોગાયાતી હતા. ‘હિવિર’ શાખ કલ્હણની રાજતરંગિણી (ઈ. સ. ૧૨ મી સદી)માં આવ્યો છે. કાશમીરના ૧૧ મી ૧૨ મી સદીના અન્ય અથેમાં પણ આ શાખ મળે છે. કોમેન્ડના ‘લોકપ્રકાશ’માં (ઈ. સ. ૧૧ સદી) હિવિરોના જુદા જુદા ઉપકેદ જેવા મળે છે; એમકે ગંગાહિવિર (બાળર-લેખક), માનદિવિર, નગરહિવિર (પુર-લેખક) વગેરે.

કરણું કલ્ષિક કરણી શાસની અને ધર્મલૈખી : ભારતવર્ષના જુદા જુદા ભાગેના કાયસ્થ ચિનાય બીજા વધ્યા ડોડાયેથી લદ્ધિયા અધ્યવા કારદૂને જોગાયાતી હતા. રાજતરંગિણાં અધિકરણ (ધ્યેરી) સાથે લેજાયેલો કાંઈનું ‘કરણું’ કહેવાતો. કાયસ્થની માઝે ‘કરણું’ પણ ધર્મશાસ્ત્રની દાખિયે મિશ્ર વર્ણનો ગણ્યાતો.

હિલોનાર્ન ‘કલ્ષિક’ શાખદાટું અર્થવદન ‘કાન્તી ખત લખનાર’ એ રીતે કરે છે. ‘કરણિક’નો ‘કરણિન’ તરીકે નિહેંશ એક ગાતિ તરીકે નહિ, પણ લદ્ધિયાએનો સભૂત જેવો થાય છે. કરણી શાસની અને ધર્મલૈખી ખાંડ જ જુદા જુદા અર્થાં વપરાય છે.

કાયસ્થ : ‘કાયસ્થ’ શાખ ધર્મધારારી લદ્ધિયાના વર્ગ માટે બાધ્યભેસતો અર્થનિર્દેશ કરે છે. આ શાખદાટે સૌથી પહેલ-વહેલો ઉત્તેખ વાચલલયરસુતિમાં આવ્યો છે. ઉત્તર-પૂર્વ ભારતવર્ષમાં તો આઠમી સદી સૂચી લેખકો ‘કાયસ્થ’ તરીકે જોગાયાતી હતા. આજે તો કાયસ્થની અલગ ગાતિ અની ગઈ છે. ચુંચરાતમાં કાયસ્થની વસ્તી ચુંચતમાં જેવા મળે છે, જેણો ચિત્રગ્રામતના વારસદારી હેવાનો દારો કરે છે. ‘અંગાળમાંની કાયસ્થની’ ૧૨ શાખાએમાંથી ફક્ત ચુંચરાતમાં એની નખ જ કાઢા છે : (૧) વાલખ, (૨) માધુર, (૩) અલનાગર. ચુંચરાતની આ નખ પોતાજાનિયો એકખીજ સાથે રોટાયેરીનો વ્યવહાર કરી રહી રહ્યારે બાંગાળમાં એહો એકીની સાથે રોટાયેરીનો વ્યવહાર રાખે છે.

ધર્મશાસ્ત્રોમાં એહાને હીન કુળના ગણ્યામાં આવ્યા છે. જેણામાં આલખું અને ક્ષત્રિયતું મિશ્રણ છે. સૂરજાખજ કાયસ્થ પોતાને ‘શાકદ્વિપ્ય આલખણ’ કહેવારે છે, જ્યારે વાલખ કાયસ્થ ક્ષત્રિય જાતના છે. કંચ સેદ્ધલા-રચિત ‘કૃદ્યસ્યદીક્ષા’માં એમને ઉત્તેખ મળી આવે છે.

ધર્મશાસ્ત્રોમાં પ્રજાને ઉગ્રવિર કરનારાઓમાં જેમને આસ ગણ્યાયા છે.

વિશાનેશ્વર આ શાખદાટી રીતી કરતાં જણાવે છે કે “કાયસ્થ” એટલે લેખક અને ‘ગણ્યક’ : અખનાર-હિલાઅનીશ, એટલે પ્રલાભનોને કાયસ્થની આસ રક્ષા જોઈએ, કારણ કે રાજના માનિતા હેવાને લીધી અને સ્વભાવે લુચ્યા હેવાને કારણે એહાને હૂર કરવા મુસ્કેલે છે.” દેખીલી રીતે કાયસ્થવત કાયસ્થે. તરફના આ વલખને માટે જ્વાલાદાર છે. કોમેન્ડે ‘કલાનિલાસ’ ‘પાંચમો સર્જ’માં કાયસ્થની સોણ ક્રપકલાંદોનું નિરપથ કર્યું છે. રાજતરંગિણિના ક્રિલાક પ્રસ્તોતામાં આ કુટિલ પ્રકૃતિવાયા અને વિશ્વાસવાતી દેખાય છે. આગળ વધી કલ્હણ જણાવે છે કે શાખનું લક્ષ્ય કરવાચાચા કુરે કાયસ્થિક પોતાના સ્વજનોના રક્ષા કરે છે, પણ પાંચ કાયસ્થ આત્મિય લોકોના પણ પ્રાણ હરી લે છે.

‘લેખપદ્ધતિ’માં કાયસ્થને લોહુપ કુરે અને અવિશ્વાસ અતાંયો છે, એના ને પીડાતી પ્રજાનું રક્ષણ કર્યું જોઈએ એમ “કાયસ્થનિંદા”માં જણાયું છે.

કાયસ્થો લદ્ધિયા ઉપરાંત દરતાંદું લભાણોના લેખક તરીકે પણ નિષ્ણાત હતા તેથી કરીને રાજ-દરાયારમાં એહો મહાત્મવનું સ્થાન ધરાવતા હતા. આ લોકો રાજકાર્યમાં કાગ લેતા હેવાથા પથીક-હીપોસચવાંક]

सरकारी दृष्टिकोण में पशु जागता अने तथी एवं धर्मी युग्म राजकीय वाता पशु जागता यदेखा अभिलेखना लभान्नाथी २५४ भालूम पडे के के कायरेहा इति माननीय ज नहि, पशु युद्धिशाणी पशु हता। 'कायरेह' शब्दना जुहां जुहां अर्थधटन है। हालना संदर्भमां व्यक्ति के जे राज्यना कायरेहारीमां रहे छे तेने 'कायरेह' कहेवामां आवे छे। पौराणिक कल्पना प्रमाणे ईश्वरना कायरेहारीमां रहेवे। अने एनामां रहेली लेखनी अथवा तो अभिज्ञानी शक्ति रजू करता आद्य कायरेह हता, एमांथी कायरेह डेम उहालवी।

तत्त्वज्ञानीय अर्थधटन मुख्य ऐ कायरेह कहेवाय हे, कायरेह के अप्या ज आदर्शों तेम महात्मा-कांक्षाए। एना कायरेहारीमां डेन्ड्रित थयेल छे अने ए एना सिवाय इत्यानी पशु दंडार राखतो नथी।

शब्दात्मां 'कायरेह' एक साति अथवा वर्षा न हतो, ए एक एवा भाष्यसेतुं संजठन हतुं के जेमो जुहां जुहां वर्षा अने तानिएआभासी राज्यसेवा माटे हायल थयेला। सभय जतां आ भाष्यसेवा एमाने परं परागत व्यवसाय जिमो कर्या अने आपरे ए एक जानिमां परिणम्या, इतियुक्त हिंदुओं एवं जैनों नारायण द्विद्वयों धर्मवग-धर्म-स्थान धरावता हता।

पाठ्यीया

- प्राचीन लारतमां अंथलेखन, लेखापन संअहुत्य अने संरक्षणः ई.स. १३००
सुधीः (शुक्रात सुनि.नी भीमेच.डी.नो. मंडा निष्पां, १६८४)
- पूर्ववर : ईन्डियन पेलियोआरी (अ.), सू.भृष्ट, १६०४
- कठेणु, 'राजतरंगिणी' (संपा. स्टीन), वो. १.
- भगवद्गीतांउल, भाग ३
- पो.उमे जेनेटिवर, वो. ८, भाग १
- लेखपद्धति, परिशिष्ट-५
- हता विमलद्वारारी, 'वाईच्छ्रीराज औन्त लाईच्छ्रीरियनशिप औंड अनिश्चयन्ट औन्त भीडिवल धनिया', दिल्ली, १६७०

गुजरातभरनी २८८ नागरिक सहकारी एन-डी.एमां
वर्षीयी प्रथमस्थानगौरपवंतुं धरावती

राजकोट नागरिक सहकारी एन-डी.ए., राजकोट

(शेईयुल डॉ. यो.प. एन-डी.)

नागरिक लवन नं. १, डेमरकार्ड रोड, राजकोट-१

हेन : २८८७१-३३६९९-१७-१८ (पीमीज्यैक्स)

थापष्टु : ३. १२८ करोड़ : : धिराष्टु : ३. ८८ करोड़

लाभलक्षार्थ राजहेव	एस.एन.विवेही	वजुभार्थ वाणा
वाईस योरमेन	इ.या.मेन.डिरेक्टर	योरमेन

१६८८/यो.कोटा.-नवे.

[पथिक-हीगेत्सवां]

सरकारी हृतरो विशेष पशु जागृता अने तेथी एओ धूषी ग्रुप्प राजभूम्य वाता पशु जागृता, यहेता अभियेखना क्षमालाई स्पष्ट भावम पडे छे के कायरवें। इतन माननीय ज नहि, पशु उद्धिकाणा पशु हता, 'कायरथ' शब्दाना जुदा जुदा अर्थवृत्तन छे, हालना संज्ञेमां व्यक्तित के ने राजना कायरथीरामां रहे छे तेन 'कायरथ' कहेवामा आवे छे, पौराणिक कल्पना प्रभावे ईर्थवृत्तना कायरथीरामा रहेतो अने एनामा रहेती बेखतनी अथवा तो अविज्ञानी शक्ति रक्ष करतो आध कायरथ हतो, ज्ञेमांथी कायरथ डेम उद्दलवी।

तत्त्वज्ञानीय अर्थवृत्तन मुख्य ए कायरथ कहेचाय छे, कायरथ के बाबा के आदर्शो तेम महरत्ता-कौशलामा एना कायरथीरामा डन्दित धयेव छे अने ए एना सिवाय क्षात्री पशु दक्षार राजतो नथा।

शश्मानमां 'कायरथ' एक ताति अथवा वर्षा न हतो, जे एक एवा आधुसोउं संगठन हतुं ते एओ जुदा जुदा वर्षा अने तातिओभाई राजव्यवेवा भाटे हालव थयेता। सभय ज्ञाना आ भाष्यसोओ अभिनो परंपरागत व्यवसाय जिलो कर्ये अने आभरे ए एक तातिमां परिषिक्षा, इटियुस्ट हिंदुओ एओने थद साथे लेवा गयेता ज्ञाना एओ। ताति तरीके हिंदुओमा धूषं लागवण-जर्सुं स्थान धरावता हता।

पाहटीया

- प्राचीन भारतमां अथवेखन, बेखापन संअलुष्य अने संरक्षण : ई.स. १३०० सुधी : (गुजरात युनिनी पायेय.जी.नो. भदा नियम, १६८४)
- पूर्वोत्तर : ईन्डियन पैलेयोआरी (अ.), मुंबई, १८०४
- कृष्ण, 'राजतरंगिणी' (संपा. सीन), वो. १.
- भगवद्गीतामंडल, भाग ३
- पोम्पे एंडेटियर, वो. ८, भाग १
- बेखपक्षति, परिषिष्ट-५
- हता विभादुमारी, 'बाईच्छ्रीज औन बाईच्छ्रियनशिष्य औद्द अनियन्त औन भीडिवल इन्डिया', दिल्ली, १८७०

गुजरातक्षरनी २८८ नागरिक सहकारी एन्डेमां
वर्षीयी ग्रथभरथानगौरथवंतुं धरावती

राजकोट नागरिक सहकारी एन्क, लि., राजकोट
(शेड्युल डा. ओप. बैन्क)

नागरिक लवन नं. १, डेवरभार्ड रोड, राजकोट-१

फ़ैन : २८८७१-३३६९६-१७-१८ (पीओएक्स)

थाप्पें : डा. १२८ डोरोड : धिराप्पें : डा. ८६ डोरोड

वास्तुभार्ड राजदेव एस.एन.विवेही वजुभार्ड वाणी
वार्डस येरमेन ध.या.मेन.डिरेक्टर येरमेन

सिंहु संस्कृति

[ओक महात्मनो पत्र]

पं आत, दा. ८-८-३२

“यि. भाई यशोधर,

अत्र सर्व दुश्चिं छे. तमारा अनेपत्रा पहोचा छे.

भीज पत्रमां उल्लेख करेता Sind Civilisation याणा लेखे भाडुँ धान ऐच्युँ हुँ.

तेनुं Cutting भारी शृङ्खलमां शिवराहेर पासे नभावी राज्युँ छे. तमारा पत्रमां लेखेबां कारणेथी हुँ पछि सिंहु नदीनुं Civilisation नेनुं भानवामां आवे छे तेनुं स्वतंत्र पुरातन भानी शडुँ तेम नथी. ओक संस्कृति नाथ पामे अने शिंग प्रवेश पामे अे संभावना शुल्करेती छे. आई पत्र संस्कृति ओकाएक उड्डभन्य पामती नथी, परंतु आयीन थर उपर नवा आयारविवारीनी असर थडुँ कैर्ड्ह विशेष नवुँ ३५ अंधाय छे. ज्यांसुधी जूना थरनी संक्षेप प्रल ढाय छे त्यां सुधी जूनुँ नवुँ सम्बन्ध छे. ज्यारे जूना थरवाणी प्रलनो कमशः हांस थाय छे त्यारे नवुँ संस्कृत तरतु रहे छे. आपल्यी Mythology आ वस्तुनी सामी रीते काम पूरे छे. असुरी (Assyrianians) अने हेवा अने ओक प्रगतिना पुरो भान्या छे. असुरो मेरा गढना छे अटवे जूनी प्रल छे. हेवा नाना जेत्ते नवा प्रल छे. आ हेवोभायी देवमुष्यो थाय अने तार पठी भानवी प्रल थडुँ ओवा उड्यना छे. झुग्येनां पुरातन सूक्तोना “जहरी तहरी” वज्रे न समलय तेवा थम्बे आवे छे अने तेना अर्थी पालिना सभामां पछु अस्पष्ट थडुँ गया हता. सिंहु नदीनी प्रल काहाय स्थानिक वतनीमेता ढाय अे संभवित छे, परंतु Ethnically आयेथी तदन निरालो नडि होय, अंटलुँ तो आ मोहननो द्वे वज्रेना अवशेषेया साधित थाय छे ते शिवथितिनी पूर्ण भावना धर्युँ पुराण्या लागे छे. असुरो अने हेवेना शिव पूर्ण भान्या छे अे पौराणिक भावनाने टेका भगे छे अने आ सिंहामां लय पामेली जनिना अवशेषे ते ब्रात्य जनिना भुत्यो हता अम भाडुँ भानवुँ छे. वारेनो आयार-नियार वैष्णविना करता धूता तुता हता, परंतु तेहो संपत्तिवाणा अने वेपारी वर्गना हता अमे रूपैष समलय छे. वालो शिवपूर्वक हता.

सिंह प्रदेशनी पुरातन संस्कृतिनी भाषामां द्वादशाराज्ञ युद्धमां भाग्येह-सूक्तोनानी विशेष परोक्षा करी ओक जलतो वधारे प्रभाश पाडी थाहाय कै तेम ते शिवारवाहुँ छे. तेनुं स्थान, तेमां भाग सेनारा राज्यां, तेना टेहा वगेरे तारवाणा रेवां छे. भाद्रराध्रीय गानडीक्षामां कैर्ड्ह प्रयत्न थेयो छे. आ युद्धमां सिंह सौंदीरना सुखक्षना राज्य प्रलनो नाम निक्षेत्रे तो समनय कै ते प्रलनुँ ३५, आयार, विचार डेवां हता. अवकाश ढाय तेषु विचारवाणा मुद्द वध्या छे. लि. नर्मदाशंकरेना आरीवाहि

नोटः अमारा द्वयेत आलीन लित्र श्री. यशोधर नर्मदाशंकर महेताये अमारावाह ४, ता. १४-४-१९६८ निव्वसे उपरना पत्रनी करेली नक्लना डासियामां ज्ञानेवुँ कै

[प्रिय श्री. कै. का. शास्त्री]

‘विश्व हिंदु समाजारना अभिल १८ अंडमां तमारो विश्व तंत्रीवेष वाचा गयो. आज्ञ्या पहि वर्ष पहेला भारा पिताशीज्ञ आयसंस्कृति तथा सिंहुसंस्कृति संभवमां अने लेखेबा पत्रनी नक्ल तमने सर्वेक मोहिलुँ छुँ, जे तमारा विचारने पुष्ट आपे छे. भारा पिताशीना आ पत्र तेमना शताव्दी-अंथमाया लीद्या छे. मञ्जमां डेहो. — लि. यशोधर महेताना स्नेह...] -तंत्री परिक-हीपोत्सवां]

१६८६/ओ४५८-नवे.

६३

પ્રાચીન ઉપનિષદ્હોમાં નારીનિરૂપણ

ડૉ. કાળિલાલ રા. હે.

“ધધુયાખરી માનવસંકૃતિઓનો ધર્તિલાસ અતાવે છે કે આપણે જેમ જેમ પાછળના કાલમાં જઈએ તેમ તેમ ખ્રીજોની સામાન્ય સ્થિતિ વધુ ને વધુ અસરોપકારક માલૂમ પડે છે. આ આખતમાં હિંદુસંકૃત અપૂર્વ છે, કારણ કે એમાં આપણને સામાન્ય નિયમનો અપવાહ મળે છે. જેમ જેમ આપણે પાછળ જઈએ છાયે તેમ તેમ એકથી વધુ ખ્રીજોમાં ખ્રીજોની સ્થિતિ સરોપકારક દેખાય છે.” ડૉ. એ. એસ. અહેકરનું^१ આ વિદ્યાન ભારતીય હર્તિલાસના ઉપનિષત્કાલને જેટલું લાગુ પડે છે તેટલું ભાગેજ બીજી કોઈ કાલને લાગુ પાડી શકાય એમ છે. તત્કાલીન વિદ્યાના કોઈ પણ દેખના કોઈ પણ નારીસમાજને ભારતીય નારી કરતાં વિશ્વિષ તો શુ., ભારતીય નારીની સંભક્ષ પ્રતિષ્ઠા પણ ભાગેજ પ્રાપ્ત થઈ હો.

ઉપનિષત્કાલમાં પરિવારમાં પુત્રીનું સ્થાન પુત્ર કરતાં કોઈ રીતે હીન માનવામાં આવતું નહોટું, એટલું જ નહિ. યુ. ઉપ.(૧-૪-૧૭)માં ગ્રામ ઉલ્લેખ અનુમતા તો કેટલાક સંસ્કૃતી પરિવારોમાં પંચિના હૃદિનાની પ્રાતિ માટે વિશ્વિષ પ્રકારને ચિનિ કરવામાં આપત્તા હતો. ત્યારે પુત્રની જેમ પુત્રીને પણ અધ્યયન-અર્થે ઉપનિષત્-સંસ્કારી દીક્ષિત કરવામાં આપત્તી હતી.^૨ આવી કન્યાઓ સંભવતઃ આચાર્ય પિતા પણે અથવા નજીકના આચાર્યકુળમાં પાસ કરી અલંકરણપૂર્વક નિદ્રાલ્યાસ પૂર્ણ કરતી એવા ઉપનિષદોના પૂર્વવર્તી અધ્યર્થો(૧૧-૫-૧૮)માં ગ્રામ ઉલ્લેખ પરથી ઉપનિષત્કાલથી પણ આવી વ્યવસ્થાના અર્થિતનું અનુમાન કરવામાં કાંઈ વાંચા નથી. તે કાલમાં વોપા-અપાલા જેવા મંત્રદ્ધી ઋગ્વિજ્ઞાનો વાસ્તવાર એવી ગાર્ગી-ઝોણાં વિદ્યાતોજ તપતાં હોય તે કાલના સમાજે કન્યાશિક્ષયુની સુચારુ વ્યવસ્થા અવસ્થ વિદ્યારી જ હો. તત્કાલીન વિદ્યુત્યોમાંની કેટલીક અધ્યાપિકાનો વ્યવસાય સ્વીકારી કન્યાશિક્ષય આપવાતું કર્તાં અવસ્થ બળવાનું હો જ એમ પાણ્યિનીચે વ્યાકરણ અધ્યાધ્યાતી (૧-૨-૮૬ અને ૩-૮-૨૮)માં કરેલા અન્નાંદો આદેના ‘ઉપાધ્યાયા’ અને કન્યા-જાત્રાલયા માટેના ‘છાડ્યાદ્યાય: જાલાયા’ એવા જિલ્લેણે પરસ્તી કરી શકાય એમ છે.

ઉપનિષત્કાલમાં (૧) અલંકારીની અને (૨) સ્વોદ્વાદી એમ એ પ્રકારની વિદ્યાર્થીનીએવાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.^૩ આજુવન નૈષિક અલંકાર્યનું પાલન કરી શુદ્ધનાં ચૂદું રહસ્યેતું રીતન મેળવવા અલંકારિતનમાં જ શુદ્ધનસાથી કંચ માનનારી કન્યાઓ ‘અલંકારીની’ તરીકે એળાખાતી, ક્યારે વિદ્યા-ધ્યાસના અને યોગ્ય શુદ્ધનસાથી સાથે જીવન કરી ગૃહસ્વાશમભાનું પ્રવેશનારી કન્યાઓ ‘સ્વોદ્વાદી’ તરીકે એળાખાતી. ઉપનિષત્કાલમાં ગાર્ગી અને ઝોણાં આ પ્રકારની ખ્રીજોનાં આદર્શ ઉદ્ઘારણ છે. સંઘીદ્વાદ-મધ્યાત્રાની કન્યાઓ વિદ્યાલ્યાસની સમાપ્તિ વાદ કરુન કરતાં હોવાથી પુરુષ વધે એમના લગત થયા હોવાતું અનુમાન કરી શકાય અવસ્થ, અ. ઉપ.(૧-૧૦-૧, ૪-૨-૨)માં અપવાદ્યે આવવિવાહના સહિત સંકેત પ્રાપ્ત થાય છે અર્થ.

ઉપનિષત્કાલીન સમાજ પુરુષમટ્ટાક હોવા જતી પરિવારને પત્તી જ હોવાતું જણાય છે. ઉપનિષદોમાં પતિ-પત્ની અંત માટે પ્રયુક્ત દંપતી ‘પતિ’ શાખદેને અર્થ થાય છે : વરની સ્વામી. એ જ રીતે ઉપનિષદોમાં અઙ્ગુહમુક્તા ‘પતિ’ અને ‘પત્ની’ શાખદેને પણ ‘શૃઙુસ્વામી’ અને ‘શૃઙુસ્વામિની’ એવા અર્થના ઝોટક છે. આ શાખદ્રોગેણો ઉપનિષત્કાલમાં પતિ-સ્વેચ્છાપત્તીનાં ગૌરવમય સ્થાન-માનતું સુયતન કરે છે. આવા જ સ્થાનમાનોનો શ્વયક ‘લાલા’ શાખ પણ ઉપનિષદો (યુ. ઉપ. ૧-૪-૧૭, ૪-૫-૬, અ. ૧-૧૦-૧, ૧-૧૦-૧૭ વગેરે)માં વારંવાર પ્રોણલ્યેદો જેવા એમ છે. યુ. ઉપ. (૧-૪-૧૭)

માં સ્વપ્ન ઉલ્કોચ મળે છે કે પુરુષ જયાને પ્રાપ્ત કર્યા એ પૂર્ણ અને છે. યુ. ઉપ.(૧-૪-૧૭)માં ઉપનિષટાલમાં સર્જન અર્થે અહને પણ જયાની કામના કરનાર તરીકે દર્શાવીને ઉપનિષટકારે જયાના પહોંચ ઘણ્યતા જ સુચની છે. પત્ની માટે મુકુઠા 'લાયા' શાખાની ગણના છા. ઉપ.(૧-૨૪-૨)માં તત્કાલીન મહિમાદોત્ક તરવેામાં થેલી લેતાં ઉપનિષટાલમાં નારીના મહીયિ ગૌરવનું અનુમાન થઈ શકે અંગ છે, યુ. ઉપ.(૧-૪-૬,૬)માં રોતીની લદદી સાથે કરવામાં આવેલી તુંનના આ સંદર્ભમાં સ્યાહ છે. ઉપનિષટાલમાં (છા. ઉપ. ૨-૧૩ મા) મૈથુનની વાજેયે વરા-સાથે કરવામાં આવેલી તુંનના અને યુ. ઉપ.(૧-૪-૩)માં વામદેવ-ગોકુલ મૈથુનને ઓંકારદ્વારા ગણી જેની ઉપાસના કરવાનો અપાયેદો આદેશ જતાવે છે કે ઉપનિષટાલમાં નારીને બોગવિલાસનું 'રમકડુ' નહિં, પણ ઘરમાચરણનું 'સાધન માનવામાં આવતી હની.

ઉપનિષટાલમાં સંગર્લાંવસ્થા અસ્કૃતાવસ્થા કેવા વિશિષ્ટ સંલેઝોમાં નારીની સ્વતંત્રતા પર કામયાદાઉ પ્રતિનિધિ મુકુઠામાં આવતા.૪ આ સિવાયના સંલેઝોમાં એ સુસ્તા રીતે સમાજમાં વિચરણી જાણ્યા છે. કેદ ઈ. સ. પૂર્વે ૨૦૦ સુધી નારી ધાર્મિક સાહિત્ય ભષ્યતા માટે અને નિયત વરો કરવા માટે પૂરેરૂપ અવિકારણી હોવાનું ઢો. અહોકરપ પણ નોંધે છે. આ સ્વતંત્રતાના ઇવસ્વરૂપે ઉપનિષટાલમાં નારી અધ્યાપિકા (યુ. ઉપ. ૩-૩-૧), પેંસટકારી (છા. ઉપ. ૪-૪-૪), શુંગારસેવિકા (કો. ઉપ. ૧-૪) અને દાસી (છા. ઉપ. ૫-૧૩-૨, યુ. ઉપ. ૬-૧-૧૦) જેવા વ્યવસ્થા સ્વીકારી પરિવારની આર્થિક સ્વેચ્છતામાં સહભાગિની જનતી જેવા મળે છે.

પત્ની અનુપર્યિતિમાં પત્નીની સિદ્ધકતામાં પત્નીના ઉત્તરાધિકારનાં દર્શાન ક્રૂરવેદ(૧-૪-૮)ની જેમ ઉપનિષટાલમાં પણ થાય છે. યુ. ઉપ.(૨-૪ અને ૪-૫)માં પરિવાજકર્તાના સ્વીકાર વર્ણતે યોગીશ્વર વાગ્વાદ્ય પોતાની સંપત્તિ પોતાની એ ભાર્યાની વર્ણે વહેંચી આપવાનો પ્રસ્તાવ મૂકે છે જેનાથી આ હ્યોકિતનું 'સમર્થન થાય છે.'

અપુરુન સંધ્વા ક વિધ્વા ઉપનિષટાલમાં પોતાના હિયર કે માન્ય પુરુષ દારા નિયોગપદ્ધતિથી પુરોગણી સંતોષી થક્તી અને પુરુષી આધાર પ્રાપ્ત કરી થક્તી. ક્રીએક કારણેસર વ્યભિયાસના માર્ગો વળતી રહેતી એ મર્ગે જરી અટકાવી જેની પુરોગણ સંતોપતી આ પક્ષતિ ઉપનિષટાલમાં પણ સુપ્રતિષ્ઠિત હોવાનું જાણ્યા છે. ઉપનિષટાલમાં આચાર્ય ઉદાહરક આદુષિની પત્નીએ પત્નીની સંભંધિયી પતિના શિષ્ય દારા પુત્ર શ્વેતકેતુને નિયોગપદ્ધતિથી પ્રાપ્ત કર્યો હોવાનું 'મહાકારત (શાન્તિપત્રી ૩૪-૨૨) નોંધે છે.

ઉપનિષટાલમાં જ્યાં જ્યાં પૂરુષયતાના સંદર્ભમાં માતાપિતા અને આચાર્યનો ઉલ્લેખ થયેલો છે તાં તાં માતાને સર્વિભ્રમ અપાયેદા સ્થાન પરથા માતાની પૂજનીયતા અને તત્કાલીન પ્રતિષ્ઠાનું અનુમાન થઈ શકે છે.૫ તે. ઉપ.(૧-૧૧-૨)માં 'માતૃવેવો મદ' એ વાક્યમાં આ જ લાનાનો પ્રતિબોધ સાંભળ્યા મળે છે, એ કારણની આચાર્યપત્નીને પણ માતાનો સમન્વય પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી. આચાર્યપત્ની સાચેના વ્યભિયારને છા. ઉપ.(૫-૧૦-૬)માં અલ્લક્ષ્ય-સમાન પાપ ગણનામી આંધુરું છે. માતાની જેમ જ ઉપનિષટાલમાં પરિવારમાં સ્વસા અર્થાત્ અહેનતું પણ અસ્યાંત સંમનાનીય સ્થાન હતું. છા. ઉપ.(૮-૨-૮)માં થેયો 'દ્વારુદોકાન' ઉલ્લેખને આના સમર્થનમાં ટાંકી શકાય.

ઉપનિષટાલમાં સાભાન્ય જોનોમાં એકપાત્રિત્વ-પ્રથા પ્રચાચિત હતી. શ્રીમંત વર્ણમાં અહુપત્નીતરની પ્રથાનું પ્રયત્ન હોવાનું યુ. ઉપ.(૪-૫-૧, ૨)માં મળતા યોગીશ્વર વાગ્વાદ્યની એ પત્નીએના ઉલ્લેખના આધારે કરી શકાય. અવોદ્ધિક જેની બહુપત્રિત્વ-પ્રથાનો ઉપનિષટાલમાં ક્રીએ ઉલ્લેખ મળતો નથી, પથ્થિક-હીપેટસવાઙ્ક]

जहां सत्यकाम जयाक के गारी पुरुष जेवा श्रीप्रधान के मातृनामेहुगत अधिग्राना थे. उप.(६-५-१, २)में प्राप्त उल्लेखोंने आधारे डेटलाई उपनिषद्कथामां आ प्रथा अंबलानु दोनातुं ज्ञाने छे, पञ्चआवा विरक संहित्व उल्लेखोंना आधारे डॉड महत्वपूर्ण निर्णय करवा गेय नथी.

उपनिषद्कथामां नैतिकताना विरक उल्लेख अूच ज्ञाना हता. आय! ज तो राज अध्यपति डॉम जेवा जेवा दोना करता दर्शवाया छे के “मारा राज्यमां डॉड व्यलियारी ली डे पुरुषों द्याता नथी.” (ज. उप. ५-११-५). अबअता, रवेण्यायारी श्रीपुरुषोंना जून उदाहरण छठ. उप.(१-२५), ज. उप.(५-१०-१०), डॉ. उप(७-१) तथा यु. उप(८-३-२) अने ४-४-१, २)मां प्राप्त तो थाय छे ज. यु. उप.(४-४-१, २)मां सत्यकामी भाता ज्ञाना स्वभूमे पेताना अनेक पुरुषों साथेना जातीय संभवोंनो एकार करती निरपाई छे.

उपनिषद्कथामां अध्यापन के शास्त्रार्थ जेवा जहें २२ प्रश्नियोंमां मुक्तपदे भाग लेती श्रीग्राना उल्लेख (यु. उप.३-३-१ अने ३-८-१) तत्कालीन समाजमां धू-घट-प्रथाना अनसित्यनी गवाली पूरे छे.

उपनिषद्कथामां शिक्षाखनी विशाग तडा अने सामाजिक जगृतिना बारबु तत्कालीन नारी प्रश्नियों देव पर गहोयेली जेना भोगे छ. गारी अने गहोयेली अंबलयतो नक्षिकाओं तरीके शीर्ति इवायेली हती. अबलविद् राज जनकानो ‘अहूदक्षिण्य यत्’ प्रसंगे योग्येला अलोच(शास्त्रार्थ)मां तत्कालीन सर्वक्रेष्ठ अबलविद् गण्याता आर्यार्थ याज्ञवल्कयों अज्ञातायों सामग्ने करता, जेने पद्धारती, भूजंती, हतप्रस अने आर्यार्थकित करी हेती गौरवनंती गारीजे भारतीय इतिहासमां गेतातुं नाम सुवर्ण-क्षरे अकित करी दृष्टुं छ. ८ एं १ रीति पतिना भंगक गृहदर्शकवनने अज्ञातां, अभरकीटन्याये, अबलवाहिनी भी अव्य भूमिग्रामे पडोयेली अने “हे अमरन! वित्यो लरेता आयी गृथी भोगे ताय हुं शुं जेनाथी अमर यर्ह शक्तीय? जेनाथी हुं अमर न याओं ते लधने हुं शुं कुरु?” (यु. उप. २-४-२) ऐम भुमारीपूर्वक पूछती, लारे लीतिक संपत्तिने दुकानी, गानना गेतुना २-३, २-४येली भागवक्षयनो गरवी गृहस्थी गैत्रेयीतुं उदाहरण भारतीय इतिहासुं प्रोत्त्वल प्रकरण छे.

३. रामण उपाध्यायना शब्द आ संहर्भमां ध्यानार्थ छे. ऐमें लमे छे के “ज्ञेमां क्षेत्रं पञ्च संहेद नथी के वैकिं आयोना समाजमां नारीनी रिथित एट्टी उन्नत हती के आने वासमी सहीमां पञ्च विधितुं अधिकमां अधिक राष्ट्र पञ्च अवेदा दावा करी शके जेम नथी के ऐमें आने पञ्च नारीने एट्टुं उन्नत रथान प्रवान ह्युं” छे.

४. संस्कृतविभाग, सरदार पदेश युनिवर्सिटी, वद्धवलविद्यानगर-३८८१२०

प्राचीनो :

१. डॉ. अवलेकर शे. अस. (अनु. डॉ. भांडड डी. आर.) : प्राचीन भारतमां शिक्षण, पु. ३
२. ह. पू. पायमी सहीमां लभायेव सूत्रयथेभां लोगोना उपनिषत्-संस्कारना स्पष्ट उल्लेख मले छ. भनुसूति (२-२२६) पञ्च कौन्यायोना उपनिषत्-संस्कारने। उल्लेख हरे छ. यम जेवा भनुसूतिपरवूर्णी समृतिकार पञ्च अव्यात प्राचीन धार्मां लोगोना उपनिषत्-संस्कारने। उल्लेख हरे छ. वेदाध्यवन माटे आ संकारनी अनिवार्यतायी पञ्च उपनिषद्कथामां जेना प्रयत्नतुं अनुमान यर्ह राके छ.
३. यु. उप. ६-४-३ वरेरे
४. डॉ. अवलेकर शे. अस. (अनु. डॉ. भांडड डी. आर.) : उपरुद्धा, पु. १७०-१७१
५. यु. उप. ४-१-२ थी ४
६. डॉ. उपाध्याय रामण : प्राचीन भारतकी संस्कृतिक शुष्किका, पु. ६६
७. यु. उप. ३-८-१

६६]

१६८६/२०१४०-नवे.

[पर्थि-हीपोत्त्वां

ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં સમાચેતાં વિદેશી તત્ત્વ

ડૉ. હરિમથાહ શાસ્ત્રી

જ્યારે કોઈ એ કિન્ન સંસ્કૃત પરસ્પર સંપર્કમાં આવે છે તારે એ બનેમાં પરસ્પરની વનીઓછી અસર થયા વિના રહેતી નથી. ભારતવર્ષના ડેટલાક લોક પેપર વસવાટ ધર્મપ્રસાર વગેરે માટે પ્રોથી દેશોમાં જઈ વસ્યા ત્યારે એણોની ધર્મ, ભાષા, સામાજિક રજીક્ય પરંપરાઓ પ્રાયાદિની વનીઓછી અસર તે તે દેશની સ્થાનિક પ્રણ ઉપર થઈ. શ્રીલંકા ર્ઘ્રી થાઈપ્રદેશે ચીન વગેરે દેશોમાં પ્રવત્તતે બૌધ ધર્મ આતું સ્થોટ દાખાત છે. શ્રીલંકા તથા ઈન્ડોનેશિયાની ભાષાઓમાં ભારતીય ભાષા-એણા વિપુલ અસર પ્રવત્તે છે. વિદેશોમાં વસેલા ભારતયે ઉપર તે તે દેશની સંસ્કૃતિની પણ અસુધ અસર થતી હતી ને થાય છે, એવી રીતે વિજ્ય વસવાટ પેપર વગેરે કારબુંઘે ભારતવર્ષમાં આવી વસેલી વિદેશી પ્રાણોએ એક બાળુ ભારતીય સંસ્કૃત ધરે અંશે આત્મસાતું ફરી લાધા ને બાળ બાળુએ પ્રણોની ડેટલાક સિદ્ધીએણા અસર ભારતીય પ્રણાં પણ અપનાવી હતી.

ભારતવર્ષમાં ઈરાનના હામાની વંશના રાજોએ ડેટલાક પ્રદેશો પર પોતાની સત્તા જમાવી ત્યારે એણોના સામાજિકમાં પ્રોણયેલી આરાની-લિપિ પરથી ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષમાં અણોછી નામે અવનની વિપિ પ્રોણાઈ. આ લિપિ પણીના વિદેશી શાસકોએ થોડી સહીએ સુધી આલુ રાખી, પરંતુ ઈરાની ભૌજ સહી પણી એ ધોમે ધોમે લુચે થઈ ગઈ. રાજદરાબાદ રાજશાસનો મહેંદુતાતો સન્નોં વેરેના પણ ઈરાનની ડેટલાક અસર વરણાય છે. આગળ જતાં ઈરાનના મગ લોડો મારાદેતે ઉત્તર ભારતવર્ષમાં સુર્યની ઈરાની વેચભૂગા ધરાવતી પ્રતિમાને પૂજાવાતું પ્રયત્નિત થયું. સુર્યના વિવિધ રૂપોના 'મિત્ર'નો સમાવેશ થતો, હવે એમિદિનો પણ સમાવેશ થયો.

મહાલ સિકંદર ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષ સુધી વિજ્ય વિરતાર્થી, પરંતુ એ અલગુંની નીવડો ને મારતીય સાહિત્યમાં એની ભાગ્યેજ કંઈ નોંધ લેવાઈ, સિકંદરની સુધી અસર નહિયત લેખાય, કરતી એની પરોક્ષ અસર નોંધપાવ છે. આ યડાઈએ ભારતવર્ષ અને યુરોપ વર્ષનોના માર્ખ મોડોની રોંડી, ભારતવર્ષને પણીએ સેનાનો અને એની યુક્તાખાલિનો પરિવ્યક્ત કરું ગોને અહીનાં વિભિન્ન રાજનોને એક સામાજિક નીચે રંગાદિત કર્યાં. પ્રગતાચયક 'પરં' શખદ અને વિપ્રવાચયક 'યવનાની' શખદ સંસ્કૃતમાં પ્રયત્નિત થયા. જીન સાથેના વાચિનિક સંખ્યધ્યમાં 'ચીનાશુક' કંઈ પ્રયત્નિત થયો.

સિકંદર પણી સેન્યુસ અને એણિનોએક ઉન્ને ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષ લેગર સત્તા જમાવતા નેખણ બતા કર્યા, પરંતુ બેશ્ટ્રિયાના એડોનોના આ દિશામાં વધુ સંદગ્યાના સાર્પદી. ભારતીય સાહિત્યમાં એ વખતનોનાં આકષમણોના ઉલ્લેખ કરાયા છે. એ ભારતીય વખત રાજનોના સિક્કાએણા ભારતીય પ્રકાશ-પદ્ધતિ ઉપર પોતાની સ્પષ્ટ અસર પ્રાપ્તની.

પણી આદ્યા ઈરાનના પહૂંચા શાસકો, એણોના ડેટલાક રાજ ગો-દેશિન્સના સમયમાં (પહેલી દિમા) પ્રિસ્તી ધર્મના સેન્ટ ટોમસ ભારતવર્ષમાં આવેલા એની પ્રિસ્તી અનુષ્ઠુન થઈ. ભારતીય લિબેલોમાં સંખ્યા સંવનનાં વેર્નાં પ્રયત્નિત પહેલવહેલું આ પહેલવ રાજનોના અબિદેલોમાં જોવા રે છે, આ પરથી ડેટલાક એ સંવને વિકિનું આથ સરપ ગણ્યાની એની ઉત્પત્તિ પહેલવ રાજનો એ સાંકેણ છે, પરંતુ એ તર્ક થયો. શાકસાદ હોઈ છે,

યવનો અને પહેલવોની કોમ શાડો પણું ભારતવર્ષમાં આવ્યા ને એના ડેટલાક ભાગમાં સત્તાઃ
II. એણો દારા ઈરાની રાજ્યતન્રોનો 'સરપ' શખદ 'કાવા' રૂપાંતર પામી ભારતવર્ષમાં પ્રયત્નિત થયો.
કાશ્વરપ ચાણનાં સમયમાં અહીં શક સંવન શાશ થયો (ઈ. સ. ૭૮ મા), એ અધ્યપ્રયત્ન થાલુ છે.
થિક-હીપોત્સવાં]

૧૬૮૬/ઓફો. -નવે.

[૬૭]

કેટલાક વિદ્યાન આરેતીય નાટયશાસ્ત્રમાં જણાવેલી કેટલીક પરંપરાગ્રોમાં શકોની અસર હોવાનું ભારે છે; એનેક સ્વામિનું 'લદ્ધિમુખ' અને 'રાધ્યિય' શાખાના પ્રેરોગમાં યવનિકા (પઢો) શાખાનું તાત્પર્ય શાંકાસ્પદ છે, પરંતુ ભારતીય રાજાઓની બાચતની લોગોને પોતાની સેવામાં રાખતા હતા એ નિશ્ચિત છે. વરાહભિંદિરે નિષેખ પંચસિક્ષાંતિમાં, આસ કરીને પોતિથી અને રોમક સિક્ષાંતમાં વિદેશી જ્યોતિપ્-પદ્ધતિઓ પરતાપ છે. ભારતીય જ્યોતિપ્પમાં શક સંવત્તને અપાયેલું મહત્વ આ સંદર્ભમાં નેપથ્યાન છે. ગૈરેટ્ક વંશના સિક્ષાંતોમાં તથા ગુપ્ત સંપ્રાણોએ પદ્ધતિમાં ભારતવર્ષ માટે પારેવા ચાહીના ચિકાંગોમાં રૂપાંતરાઃ કૃત્વા-સિક્ષાંતોનું અતુંદ્રશ રહેલું છે.

શુદ્ધનું હેડિક સ્વદ્ધ આદેખવામાં તેમન બૌદ્ધ ધર્મના મહાધાનના ઉદ્દૂલ્બમાં કૃપાય શાસકોનું પ્રદાન મહત્વનું ગણાય છે. શક ક્ષત્રપેના જેમ કૃપાણના સિક્ષાંતોનો પણ પણીનાં અનેક રાજાઓના સિક્ષાંતો પર પ્રભાવ પરતાપ છે, આસ કરીને મગધના ગુમ સમાઠોના સેનાના સિક્ષાંતો ઉપર.

સાસાનાની તથા હુણ રાજાઓના શાસન રફતાના અહીં એ સિક્ષા પ્રચલિત થયા તેઓનો પ્રભાવ એ શાસનના અંત પછી પણ સૌક્રાણી સુંધરી ચાલુ રહ્યો.

હુણાએ બૌદ્ધ વિદેશને તથા નાવંદી વિવાહીને વધું નુકસાન કર્યું હતું. ગુરુંનો ભારતવર્ષના હોય કે વિદેશથી અધ્યાત્મા હોય, પણ એંટો હુણા સાથે ગાઢ સંબંધ પરાવતા હતા કેવું મનુષ પડે છે. રાજ્યપૂતોની રૂપ અતિગ્રામો હુણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય સિક્ષાંતોની એ વિદેશી શાખા થયા પ્રચલિત થયા હતા. આમાનો એક છે 'દ્રમ', એ ગ્રીક ભાષાના 'દ્રિમ' પરથી વ્યુટ્પન થયો છે. 'દ્રમ' શાખા સંસ્કૃત સાહિત્યમાં કેકોણે પ્રેરોગ્રો છે. ગુલબારી શાખા 'દ્રાક' સંસ્કૃત રૂપ 'દ્રમ'માંથી બીજી આવ્યો છે. બીજે શાખા છે 'દીનાર', એ રેમન ભાષાના 'દીનારિયસ'માંથી ઉદ્ભવ્યો છે. 'દ્રમ' અને 'દીનાર' મૂળમાં અનુકૂળ મસ્કુલ તાલના ઓછ અને રેમન ચિકાંગોની નામ હન્ના.

રેમન સાન્નાંય ભારતવર્ષ સાથે ગાઢ વાણિજ્યક સંબંધ પદ્ધતાનું તારે એ ભારતવર્ષમાંથી અનેક આદશ્યક વરતુંની આયત કરતું ને એના વિનિમયમાં એની પણે નિકાસ કરવાની વરતુંએ ન હોવાથી એને ભારતીય વસ્તુઓનું મૂલ નાશમાં ચુક્કવનું પડતું. પરિણમે ભારતવર્ષમાં આસ કરીને દીક્ષિષ્ય ભારતવર્ષમાં, રેમન સમાઠોના રેનાના સંખ્યાંથી ચિકા મળ્યા આવ્યા છે. 'રોમ' નગરીનો નિર્દેશ ભારતવર્ષના સાહિત્યમાં 'મહાભાગત(સભાપત્ર)'થી મંજુને ઉપદાય છે. રેમની 'મંજુદેશા' નામે મહિરા-પાત્રોના નમતૂન ગુલબારનમાં પણ પ્રાણ થયા છે. જ્યોતિપ્પમાં અહીં 'રોમક રિદ્ધાં' પણ પ્રચલિત હતો. ભારતીય જ્યોતિપ્પમાં પહેરાં નહોંનું મહત્વ હતું. મેયાહિ ૧૨ રાત્રિ ભારતવર્ષમાં આવળ જનાં વિદેશથી, ગ્રાસ: આર્દ્ધિવામાંથી આવી પ્રચલિત થઈ લાગે છે. અધિક આસ અહીં છેક વેદબદ્ધથી પ્રચલિત હતા, પરંતુ વાર આવળ આવળાં પ્રચલિત થયા છે. કેટલાક વિદ્યાને સાત વારીની પદ્ધતિ ભારતવર્ષમાં વિદેશથી આવી હોવાનું આવે છે. ભારતીય જ્યિત્પક્તામાં મધુર-શૈવોમાં મધુપ્તને ભારતીય હેલેનેસિક અસર મુખ્ય હોવાનું માલૂમ પડે છે. ભારતવર્ષનાં કેટલાક ગીતરિવાલેમાં વિદેશી અસર હોવાનું સંચયાનું છે, પરંતુ એને લગતા તર્ફ શાંકારાઃ કે વિવાદાસ્પદ લાગે છે, જનાં ઉપર જાણ્યા મુખ્ય ભારતવર્ષમાં આવી વેલો વિદેશી પ્રલાગોના પ્રભાવથી ભારતીય પ્રાચીન સર્કૃતિમાં અનેક વિદેશી તરન સમાવિષ્ય થયા.

શ્રીબંદ્દ અને દાનોનેશિયા નેરા અલઘ-વિદ્કસિત દેશોમાં ત્યાં જઈ વસેવા ભારતાણે દારા ભારતીય સંસ્કૃતિની અસર વિપુલ પ્રયાણ્યાં થયેલી. ચીન નેરા વિકસિત દેશ સાથેના સંયુક્તિની મુખ્ય અસર ભારતવર્ષના બૌદ્ધ ધર્મના પ્રસારની થઈ. ભારતવર્ષના અનેક બૌદ્ધ વિદ્યાનો ચીન ગયા ને ચીનના અનેક અવણો ભારતવર્ષમાં આવ્યા, પરંતુ એ એ હેરા વચ્ચેનો સંસ્કૃતિક સંયુક્ત મુખ્ય વિદેશીનો નિર્દેશાંનો -નાને ૧૯૮૬/ઓડો-નાને. [પદ્ધિક-નિર્ચિતસ્વાંક]

अंकमार्गी रहो. श्रद्धेये अनुभूति निभित चीतमां आरतवर्धना और धर्म विशे रहेह किसासा तथा अनुरोगनु दृप्ति.

आरतवर्धना उत्तर-पश्चिम आनुष्ठानी आवेदी अनेक विदेशी प्रजामोर्मां सुख्य हती पश्चिम अशिवामांथी आवेदी अशिवाएँ के युद्धोपीयन प्रजामोर्मा. अंकेनां शासन तथा वसवाटने लघी आरतवर्धना तथाकालीन संस्कृतिमां ते ते प्रजामोर्मा डेट्लां विदेशी तत्व समावेश पार्थ्या, परंतु अनी सरभामध्येये अे आरतवर्धना आवी वसेली ये विदेशी प्रजामोर्मा अहींनी संस्कृति, आस दरीते अहांना धर्म, अपनावी वेवामा श्रद्धेये उत्सव धरावेलो. डे अंकेना राजसत्तानो डास थतां अंको कृपयः आरतीय समाजमां आलता श्रया ने अंते अहींनी प्रजामोर्मा विद्वीन वैष्ण गया. अंकितो यद्युपी जरव्यास्ती अने धूरस्वाम जेवा धर्मेना अनुयायी आरतांगी वसीते गेताना धर्मनु अवग अस्तित्व द्यावी रहा, परंतु आपा पहेरवेश योरुक अने रीतांखानेमा अंकेना ३०२ आरतीय संस्कृतिनी असर विपुल अमालमां प्रसरी.

विभिन्न संस्कृतियोंनो संपर्क थतां परंपर अस्त्र वत्तांजाया प्रमाणमां थती रहे अे स्वाक्षरित के.

नूतन नागरिक संस्कृति अंक, लिमिटेड

(रक्ष. ओडिस) : २/५ मस्कटी मार्केट, कपासिया बजार, अमदावाह-२

सेन्ट्रल ओडिस : (अंकुभिन्नस्ट्रिट ओडिस) विकेटेटिया अयुषिली होटेलिट चार्चे, डे. मोटीबाई भार्ग, पांचटवा, अमदावाह-३८०००२. टे.न. ३४२६४२, ३४८६१८

अंकेनी शाखाएोनी आहिती

एंडिट वर्ग 'आ'

(१) मेहन ओडिस (मस्कटी भार्ग), (२) कापीवाह शाखा, (३) शांति डॉमिनियल, सेन्ट्रल शाखा, (४) आश्रमरोड शाखा, (५) रमियाल शाखा, (६) बापुनगर शाखा, (७) वासण्या शाखा (सेईक डिपोजिट वेल्ट साथे), (८) दुधधन धन रोड (भेमनगर) शाखा (सेईक डिपोजिट वेल्ट साथे), (९) पांचटवा शाखा (सेईक डिपोजिट वेल्ट साथे)

येवेन : श्री आत्माराम लोगीकाल सुतरिया

श्री कृष्णायुक्ती धी. फूडिया श्री ज्यातीकाल आत्माराम शाह

मेनेजिंग डिरेक्टर लेन्ट मेनेजिंग डिरेक्टर

ता. ३०-६-८८ ना. अंकेना प्रगतिहर्षक आंकडा

अधिकृत शेर लंडोण रु. २,००,००,०००/- यापांगा रु. २७,२८,६९,०००/-

कुल आवेद शेर लंडोण रु. १,३०,१५००/- धिरांगा रु. २३,१८,८६,०००/-

रिजर्व इंड इत्याहि रु. ४,६२,७५,०००/- डायंडरी रु. ३७,४३,५५,०००/-

लंडोण

नक्षे रु. १,१२,४००/-

आंकडे विविध अन्यत-योजनाएो तथा अन्य अंकेनी सेवाओ अंगेनी विगत-वार भाहिती भाटे अंकेनी नाळुकेनी शाखाना इमरु संपर्क साथे.

जनरल मेनेजर : अंधक लुपताणी

परिक-हीपोसवांक] १६८६/ओः कोटा.-नवे. [१६

પ્રાચીન મધ્ય અને આધુનિક યુગનું શહેરી આયોજન

ગ્ર. જ. વી. પટેલ

શહેરી આયોજન એ ભારતનો આજના સમયનો એક મહોરનો પ્રક્રિયા છે. જૂના અને નવાં શહેરોમાં જરૂરી વધતી વર્ષતીને કારણે શહેરી આયોજન (City Planning) ની સમસ્યા શહેરી આયોજકો (City Planners) માટે વિઠળાંથારાંપ છે. ભારતવર્ષનું શહેરી આયોજન ખૂબ જ પ્રાચીન સમયથી થતું આંદું છે. મધ્યયુગમાં પણ શહેરોનો વિકાસ થયો હતો. આધુનિક સમયના નવાં શહેરો જરૂરપથી વધતી વર્ષતાને કારણે અનેક અવનવી સમસ્યાઓની વીટણાં જય છે. જૂના શહેરોનું આયોજન કરતામાં ડેટલીક મુશ્કેલીઓ છે, તો નવાં શહેર વધુ ને વધુ વિકાસના જય છે. આ અંદું શહેરી આયોજન કરતા માટે આપણી પાસે આશીર્વિક વિકાસની રીતા મયોડિત છે. પ્રાચીન મધ્યયુગીન અને આધુનિક સમયના શહેરોનોંનો આયોજન વેરેનો અભ્યાસ આપણા સૌ માટે અગત્યનો અની રહે છે.

ભારતમાં શહેરી આયોજનનો વિષય નવો નથી, પરંતુ આ આયોજન વિષયમાં સીધી વધુ પ્રાચીન છે. હા, કદાચ આજના લેટલો વિકિત્પ્રક્રિયા પ્રાચીન સમયના નગરો-શહેરામાં ન હતો એ ચોક્કસ વાત છે, પરંતુ નગરોનો વિવરિતિત વિકાસ કરી લોડબોલ્ય સરળતા ગોળ્ય રીતે પ્રાપ્ત કરાય એતું આયોજન પ્રાચીન સમયમાં હતું. કારણવર્ષનું આ પ્રાચીન નગર-આયોજન આપણું એ રીતે જાણવા મળે છે: (૧) જૂના ખાર્દિક અંશોના આવત્તા પ્રાસંગિક વર્ષનું પરથી અને (૨) શિદ્ધ સ્થાપત્ય અને આયોજન ક્ષયાત છે તે તથા જોડામણ કરતાં પ્રાપ્ત થાય છે તે.

પ્રાચીન સમયમાં નગર-આયોજન હતું એમાં એ મત નથી, પરંતુ આ આયોજન ડેવા પ્રકારનું હતું અને કેટલા અંશો હતું એ આવત્તા મહત્વની અની રહે છે. અને આપણે ભારતવર્ષના મધ્યયુગી મુખ્ય-સમય અને આધુનિક સમયના શહેરેનું આયોજન તેમ શિદ્ધ-સ્થાપત્ય વજે લોઈએ છીએ ત્યારે આપણું એમ થાય છે કે આ તો કદાચ ૧૦૦૦ વર્ષ પ્રેર્ણનું જ અંદું છે. આ આવત્તા વ્યાપક નથી, પરંતુ શહેરી આયોજનની આભાતનો વિષય ખૂબ જ સ્ક્રબ અને જીગાંધીરૂપુર્વકની સમય તેમ સંશોધન મળી લે તેવા છે.

પ્રાચીન નગર-આયોજનને સારુ ભીજ આભાત એ છે કે એ અંદું આપણું ચોતનું જ છે કે પછી વિશ્વાના અન્ય દેશોનાંથાં આયાત થયેલું કે? આ પ્રાચીન પરંપરા અને નગર-આયોજન સંખ્યાં અંગેભાથી પ્રાપ્ત થાય છે. આને વિરતું અભ્યાસ અનેક પદ્ધતિમના અને ભારતાર્થિના વિદ્વાનોએ કર્યો છે. આ વિષય ઉપર એક પુરત્રે પણ પ્રગત થાયા છે.

કટલાક લોડા એમ માને છે કે ભારતવર્ષનું નગર-આયોજન જો પદ્ધતિમાં દેશાની બેટ છે. આંદું માનતારાંનોએ કદાચ આપણી સંસ્કરિતિના પ્રાચીન અંશો ન પણ વાંચા હોય. નગર-આયોજન વિશે ગેરસમન ભાલી કરતારાંનોએ બીબી. હતીની 'અનિશ્ચયનંત ઈન્હિનું ટાઉનખાનિંગ', દો. પ્રેસનાનુમાર આચાર્યનું 'ઝેનસાઈકલોપાડિઓ' એંદે હિન્દુ આર્કિટેક્ચર, નાગયાંદ્રાયાર્નું 'એ સ્ટરી ગોન વારતુ-વિદ્યા' અને 'ફેન્સ એંડ ઈન્લિન આર્કિટેક્ચર', દો. ડી. એન. શુક્લનું 'હિન્દુ સ્થાપત્ય એંડ આર્કિટેક્ચર', દો. વૈજનાથ પુરીનું 'સીરિઝ એંડ અનિશ્ચયનંત ઈન્હિનું, એમ. પિગેટું' 'અનિશ્ચયનંત સિટીઝ એંડ ઈન્હિન્યા' અને કૃ.બી હેલનું 'અનિશ્ચયનંત એન્ડ નિર્માણ આર્કિટેક્ચર' વગેરે અવદ્ય વાંચવાં જોઈએ.

ઉપર્યુક્ત વિદોનેએ પોતાનાં પુસ્તકોમાં ભારતવર્ણના આચ્યોજન વિશે ખૂબ લખ્યું છે. આચ્યોજન સમયમાં પણ ભારતવર્ણમાં ઉચ્ચ પ્રકારનું નગર-આચ્યોજન હતું, એટલું જ નહિ, ભારત-વર્ષનું નગર-આચ્યોજન તેમ ઉદ્ઘાત શિલ્પ સ્થાપન વગેરે વિશ્વના અન્ય ટેશોમાં ગયા છે.

મેહેં-લે-દો હળવા નાલ દા તથાશિલા વગેરેનો અવસરો અને સ્થાપન પરથી ભારતવર્ષનું નગર-આચ્યોજન સ્પષ્ટ જાણી શકાય છે. પરિબ્રાન્ના મહાન સ્થાપનના લાલાકાર ઈ. બી. હેવલે જાણ્યું છે કે 'યુરોપના ભાગગાળીનું શાહેરી આચ્યોજનનું' વિશ્વના ભારતવર્ણના પ્રાચીન નગર-આચ્યોજનના સિદ્ધાંતથી આગળ વધી રહ્યું નથી. ભારતવર્ષમાં ઉચ્ચ ડેટિનાં નગર-આચ્યોજન અને શિલ્પ-સ્થાપન ખૂબ જ પ્રાચીન છે એને આને પણ જેનો વિકાસ થઈ રહ્યો છે.

મહાકાશ-સમયમાં ભારતવર્ણની નગરોનાં વિસ્તૃત અને સૂક્ષ્મ વર્ણન છે. દોપરિને લખ્યું છે : 'રામાયણ અને મહાભારતના ભમય દરખાતનાં નગર-આચ્યોજનની એ સ્પષ્ટ થાય છે કે ત્યાં રાજ રાજ-કુમારો પ્રધાનો અમાદો તથા સેતનાયકોનાં મહાલય તો અનતાં રહ્યાં, સાથે સાથે નિવારીય મકોનો તથા વિશ્વાણ પ્રાસાદો ઉપરાંત સુલાગૃહો, મંદ્રો તેમ અન્ય વરતુંણા હતી.' અણોધા દૌલાભી કિફિન્ધા વગેરે નગરો ઈ. સ. પુ. ૧૦૦૦ વર્ષે પૂર્વે હતાં. નગરો એક વિશ્વાણ હતાં તેમજ અની રચના એવી હતી કે એના નિવિષ સગવડો પ્રાપ્ત થતી, જ્ઞાન આગ્ના કેટલીક ભાબોને વિચારણ લખના મળે છે. ડૉ. હસમુખ સંકળિયાના મત મુજબ 'આ સમયનાં નગરોને વિસ્તાર કાઢપણિક અને વર્ણનો વ્યાખ થણ્યો અંશો જ સાચ્યા જેવા મળે છે.' નગરોનાં જે પ્રાણી વર્ણન થયો છે તે પ્રમાણે પુરાવા એણા જેવા મળે છે; લેખક અણોધા ભાર યોગ : લાંબી અને લાંબી જોગના પહોળા હતી, લાંબા ૨૦ યોગન પહોળા અને ઉંઠરકાંડ પ્રમાણે ૧૦૦ યોગન લાંબી હતી. આ રીત જે વર્ણનો છે તે પ્રમાણે ખાડું જ એણું પ્રાપ્ત થાય છે. અણોધા અને કંકા ગોટાં નગર હતાં. નગરદોરો અને જોગુરો હત્તો. અણોધા એક જ માર્ગ પર વર્તી હતી, જ્યારે એની સરભાગુંની કિફિન્ધાને અનેક માર્ગ હતો. રસ્તા ધૂળિયા હતા તથા પાણી છાંટાં. અણોધામાં રાગો દીવા સુકાતા. આ સમે આ નગરોમાં મહેલો પ્રાસાદો, નાગામેદા ચોક, ચિત્રશાળા કુઠાગૃહો વગેરે હતો, પરંતુ પાણગતાઓએ એસાં કાલ્પનિક અને કિફિન્ધનાંઓ વડે ઉમેરો કરી વધારો કર્યો છે.

સ. પુ. ૨૦૦ પૂર્વે લાખેલા કીટિલ્યના અર્થશાસ્ક્રાંતા નગર-આચ્યોજન સંખ્યા સંગ્રહી સંગ્રહી વિશ્વતાર માહિતી છે. નગરોને વન પુલ તથા નાદીય રક્ષણ અખાતું. રાજ્યની રાજ્યાનીઓને સંખ્યા અની અનુભૂતા માટે વસ્તુને ડેટલાઇ પ્રમાણમાં નવાંનવાં ગામ અનાવીને વસાવવામાં આવતી. કીટિલ્યના અર્થશાસ્ક્રાંતા નગર-આચ્યોજનનાં સિદ્ધાતો અને વિવરણ પર સાત અંશ્યાં છે: આભા આચ્યોજનની સંગ્રહી કલા પર પણ ખૂબ માહિતી છે. આ અંશી પરથી જાણે છે કે એ સમે વિસ્તાર સંખ્યા કંદુરી આચ્યોજન-સાન પૂર્ણ હતું.

મનુદ્ધરાણું એંબ રંગદ્વારથી અને મનુદ્ધરાણું એંબ નગર-આચ્યોજન અનેના ઉદ્વેગ મળ્ણ આવે છે, રંગદ્વારાણું મહાનનગરની રથાપના તથા ગરુડપુરાણમાં ઉદ્ઘાતા વિશે માહિતી છે, આ ઉપરાંત કામિકાગમ કરણુંગમ સુચબેદાગમ વગેરે અ થોડા આ અંશી માહિતી વિસ્તારસ્પૂર્ક દર્શાવી છે. આ અંશી પરથી જણાય છે કે આ અંશનાં નગર-આચ્યોજન તથા સ્થાપન વધુ વૈદ્યનિક રીતે રજુ થોલ્યાં છે.

આચ્યોજન સમયમાં નગર-આચ્યોજનનો અભાવ ન હતો. આ સમયનાં અનેર સહી મંડિરો રાજભાગો તથા સાર્વજનિક રથ્યો પર વિગતવાર વિવરણ જેવા મળે છે. મેગનાનિસે પાટવીપુરુણું વર્ણન આ મુજબ કર્યું છે : 'પાટવીપુરુણ ૧૦ માર્ગલ લાંબું, ૨ માર્ગલ પહોળું' અને યારે બાળુ દીવાલોથી વેરાયેનું પથીક-હીપોત્સવાંઃ]

૧૯૮૬/ઓક્ટોબર.-નવે.

[૭૧

हुता, रस्ता, पाणीना कुरारा, तणाव होता वज्रेरे वज्रेरे लधां सार्वजनिक सुविधाओंनां साधन होता।'

उपर्युक्त रीते जेतां आयोन समयां नगर-आयोजन व्यवस्थित हुता, आजला जेवां विश्वास थेहेरे न होता, परंतु मर्याद प्रकाराना कै नाना सहेजे जेवां होता, जे नगर तरीके ज्ञानातां होता, दूँकमां, आ समये नगरोना राजभार्ग निवासधान, पाणीनी संबंध, नहेर कल्याणां स्थળ सुविधेर्य स्थाने होता, आ नगर-आयोजने कारबे दोडाने काठि मुदकेवांगे पहती न होती, वणी नगरोनी संभवा आणी हुती तथा नगरोनो वधारे, पथ और आणां थेता, आधुनिक युगां शहरी आधृत्या जेवा खास होती आकृत्या न होता, परिणामे भोटा भाजती नसती तो ग्रामजनेमां ज वराती, राजधानीओं जे भेटे अगरोनुं स्थान वरावती होता.

हांकाळीन चमवां नगरोनुं वर्षने हुयेनसंगे कठेहुं जेवा भये छे, जेनी नोंधेयोग्यां व्यापार्या मुक्तज्य 'नगरोनी आरे तरडे दीवानेनो कैट होता, दीवानार लोडा जेमां रहेता, रस्ता वांकाचूका होता, रस्तामोनो ज्यांने आणु हुकोगे होता, कालिया आणीमारी, नृत्य करेनारा, आँख वागनारा नगरथी अदार रहेता, नगरांमां भेणा लारता, केडा संगीतकांगा अने विक्रमाना शेअपीन होता, रंगनासी होता, जेमां वसतेतप्य भानवार्ग आवतो,' आ समवां वाराजसी गथा नालंदा दुर्शीनगर वज्रेरे मुख्य नगरो विशेनी नेंद्री भये छे.

सोबां काल दरभ्यान सिद्धाने समुद्दिष्टो उपयोग विधि अने स्थापत्य माटे कर्मी होतो, दुर्दमात्रात्य (सिल्हपुर) अने सहस्रविंशतुं लघ्य जगात्या (पाटलु) अध्यात्मा, लोर्ड वलवाल्य ओंचुवाल थान वज्रेरे अहोरोने इते किल्ला जगात्या होता, दगडांन वारमगाम दिगंबरां वज्रेरो नगरोने अध्यात्मां होता, सोबांका राजनीती राजधानी अलौहित्यपाटक (पाटलु)नां नगरोने इते कैट होता, जेनी पासे राशीनी वाव, सक्षमत्वं तगाव अने कांडा परं महिंद्रो कीर्तिस्तबो उद्घाने धर्मशाणाये, तथा पाठ्याणाये होता, नगरनी योजना स्वरितक आकाशनी अर्थात् यार भज्यूत जापुरेवाणा योरस आकाशनी होती, नगरना राजभार्ग डारमध्ये होता तथा भोटां मकानेथी रोजाना, आमां लक्ष्मीध्यात्मा तमा करेगविपतियोनी विश्वा हुयेलायो, पथ होता, आमा नगरांमां अर्थसंपत्ति अने कलासंपत्तिनो समन्वय स्पष्ट होते हेणाई आवतो होता.

मुख्य समय दरभ्यान मुख्यम थासेडाये जूनां नगर मुख्यां तथा केत्लांड नवो नगर वसावां, मुख्यम राजनेमोनो भोटा भाजतो वर्ग नगरप्रेमी होता, परंतु अयोग्ये नगर-आयोजनी सुविधाओ लोडा आटे खास अनावा न होती, अयोग्ये इक्के योतानों सुधसुविधाओने जे ध्यानामां राजभाल होता, केन्द्रस्थाने सुधसुविधाओ ध्यानामां राजभाल होवाथी मुख्यम शासको जैवानिक रीते नगर-आयोजन न करी इक्का, नगरोने इते रक्षेश भटे किल्ला होता, जेमां राज अने अनो अधिकारी वर्ग निवास करतो होता, हिल्ही अने आयाना किल्लाया परथी आ आमत २५४७ जल्दीय छे, आ अहुं करवानो मुख्य उद्देश शासकाय होतो, मुख्यम शासकेमां नगर-आयोजनो आधारकूत अलाव छोता, जेवे कारबे कैँस शुरूत नगरो न अन्या.

मुख्य समय दरभ्यान लाततव्यमां नगर-आयोजनां केलीक आमतो ध्यानामां लेवाई होती, केमाई अे समवान राजनेमोने विधि अने स्थापत्यमां विशेष रस होतो, जे आने पथ भेजूद छे अनो परथी जाणी शकाय छे, उत्तर लाततव्यमां आ निशेष नेवा भये छे, आ समय दरभ्यान महेतो किल्ला तथा मकानरा अन्या होता, आ रीते लाततव्यमां डिंडु मुख्यम अने सावे परिंयन क्वातो

सम-वय थे, ताजभदाक आने पुरावो छे. मुसिलम शासकोनी असर दक्षिण अने पश्चिम भारतवर्षमां नगरमां न विकसी शक्ति;

पूर्व आँधिनिक युगमां भारतवर्षना शासको अने देशना विकल्प आन्तर्गत शासको अन्तर्गत सुव्यवसित होते नगर-आयोजन माटे प्रयास कर्या. आनुं उत्तम उदाहरण ज्यपुर नगर छे. आ नगर ज्यसिंह भीलओं वसायुं. आहों राजना भेलकोनी आरे तरह एक सीधी रेखामां भकोना अन्यां छे. आभा नगरस्ती होते दीवाल अनेकी छे. ज्यपुर नगरानं कुनीं कुनीं स्थानेनां अने रस्ताओं तथा दरवाजों नाम राजवाहामां आवां छे. नगरनी ज्यशब्द वच्चे राज ज्यसिंह भीलों भेल छे, ज्यां पहेंचना माटे डेक्काय दरवाज यार करवा पडे छे.

अंग्रेजों भारतवर्षमां अग्रभर स्थिर थया. पछी पश्चिमी विज्ञान अने औद्योगिक निकास शह थे. युरोपना सारामां सारा नगर-नियोजनको भारतवर्षमां आयो. अंग्रेज शासकोने नगर-आयोजननो एक व्यवसित प्रकारनो कार्यक्रम अनाव्यो. आभां नगरना नागरिकोने विशेष सुविधाओं भगे अ माटे आस ध्यान आपवाहां आयो. १६ भी सहीमां दिल्ली वडोहरा गैस्कर वजेरे नगरोतुं आयोजन व्यवसित होते शह थह यह गयुं, परंतु अनो मुख्य उद्देश शासकीय अने रोनिक ज्यरियातो पूरतो ५ छतो. युध मोटा-पहेला रस्ताओं वच्चे वच्चे मुख्ती ज्ययाओं राजवाहामां आवी हती, जेथी लकड़रना सैन्यने ३५ थी आवान करवानी सरणता रहे; जेके आवा प्रकारतुं नगर-आयोजन नागरिकों माटे आस उपयोगी न हतु.

वासिनी सहीनी शहातामां नगर-आयोजन पर गंभीर शहै विचारवानी शहात थह. आ केमो पछी तो नगरपालिका-हस्तक शह थां. जल्पी औद्योगिकोडरथ तथा वाहनव्यवहारानां साधन विकसतां लोकोने शहेर तरह आकर्षणी वच्चु. हवे जलपथी वसतां शहेरोने मुख्य उद्देश भीवाना पाल्यानी व्यवस्था, सुव्यवसित सुडक-मार्गी अनावाहातुं, सार्वजनिक कल्याण अने सेवाना कार्य करवातुं शह यहुं. मोटा प्रभावामां नाल्यानी ज्यरियात जिली थह. पछी तो विविध शहेरोनी नगरपालिकाओं पछु आधिक भींस अनुसवना बागी.

स्वतंत्रता पछी भारतीय वस्ती ऐ जायी थह छे. आ अउपथी नवी उभेराती वस्ती भारतीय शहेरोनां हुवे डेक्कावा थेडा वयोरी रहेवा माटे वहु ने वहु आकर्षणी जेवा भगे छे. इ.स. १८८१मा भारतमां दुख २२४५ शहेर हतां. आभां १. लाल्यी वहु वस्तीचांगां शहेरोनी संघ्यां २१५ हती. आ शहेरो विविध कारबोहर विकास न्यायां छे, जेमा (१) शहरालीं शहेरो, (२) औद्योगिक शहेरो, (३) नवां शहेरो अने (४) प्राचीन-जूनां शहेरोना समावेष हठी शक्य. आ उपरांत जलपथी विकसता शहेर लोकों तो दुख १२ छे, जेमोनी दुख वस्ती १० लाल्यी वहु छे.

आने हेतानी २४ दका वस्ती शहेरोमां निवास करे छे. वणी शहेरीकरण्याकिया छे ते युध ज्यामी छे तोपथ ऐ अनेक समस्याओं जिनी करे छे. आभीष वस्ती शहेरो तरह रथांतर हरे छे. शहेरो आरे तरह ऐहाम रीत वये छे. सानाइपी ज्यानो रहेहाण्यामां इरवाई ज्य छे. मजूरों अने शहितो शहेरोमां आवे छेतेया रहेहाण्यामा प्रश्न विक्षिप्त अने छे. अरोजगारी नाची हवे संगभग अशक्य अनी गहे छे. शहेरोमां दृष्टि हवा अने पाल्यी, गंडा वसावाटो, वस्तुओना जिंचा भाव, लेणसेण, अपूरता पोषणवाणो जोराक वगेरेनां लोडा जोग अने छे. घून जगात्कार तथा अन्य असामाजिक तरयों बाहुं जिंचे छे.

पश्चिम-हीपीत्यवांड]

१६८६/थोऽटो.-नवे.

[७३]

આગ્ની ભજ્યાળીને કે પછી આધુનિક મુગનાનું નગર-શહેર આવે અને એ સમયાંએ વાટળાખેલા હે. જૂનાં અને નવાં શહેર જરૂરી નિકસે છે તારે કેટલાક પ્રમાણમાં ભાંગનોડ થાય છે. આમ કરવા જરૂરાં આપણી ચંદ્રતિના અવરોધ પણ કેટલીક જગ્યાએ ફુટાય હોવાય છે. આપણા આગ્નીન અવાજે મૂળભૂત રિંગમાં જગ્યાઓ રહે એ રીતે આગેજન જરૂરી બને છે. નાના નગરમાં પણ શિક્ષયુસ્સન્થાંજા અને હવાલાના વિકાસવાની જેઠુંને. આમીણ વરતીની શહેરોમાં ભળતી કેટલીક સખવડો નજીકમાંથી જ પ્રાપ્ત થાય એનો બ્યાવસ્થા જરૂરી છે. નાના ઉંડોગ આમીણ વિસ્તારના વિકસને તો રોજગારી માટે સ્થળાંતરા થાય છે તેમાં બાટાડી થાય. એ માટે તો જરૂરી છે બધાની પુરુષાં. નગરપાલિકાઓ બ્યાવસ્થાની રીતે કામ કરે, લેકે સહદીર આપે એ જરૂરી છે. આશા છે કે મોટા શહેરોમાં નગરપાલિકાઓ સુભ્યાવસ્થાની માસ્ટર-પ્લાન અનાવે અને એમાં રાજ્ય-સરકારો સાથ આપે. આવાં ૨૦૦ લેટલાં શહેરો માટે માસ્ટર-પ્લાન અની રહ્યા છે અને એની સહિતા માટે બીજાખૂર્ચુંનો અવધાસ થઈ રહ્યો છે; આ અધું કાર્ય આયોજનો માટે જોકે મધ્યાના એક દુખાવા-સમાન છે. આગ્ની અને નવાં નવાં શહેરોને મૂળભૂત રીતે ચાચવાની કેટલીક સુરક્ષાલોનો જીબી થાય છે, એમાંથી આયોજનોએ મળ્યાં શોધવાનો છે. આ કંઈન નથી અતી એલો સરળ પણ નથી.

१५. नवन सोसायटी सिल्वपुर ३०, पाटण-३८४३५४

સંખ્યા ૩

૧. કે. ગાન્ધીયર અને જી. ચાહિલ, “આર્થન જ્યોતામાસી,” ન્યૂઝેલ્ન્ડ્સ લેખન એન્ડરસન, કુન્ડા, ૧૯૭૧
 ૨. પ્રી.ગેન.વેસ, “ફાન્ડામેન્ટલ્સ ઓફ પોલ્યુસેન જ્યોતામાસી.” - પુટિલ્સી, સ્ટીલિંગ પિલ્ફેક્શન, ૧૯૮૫
 ૩. સી.બી. મારોટિયાન્ઝી,નેમિકિંગ એન્ડ કોમર્ચિયલ જ્યોતામાસી. ઓફ પન્નિયા,” આગ્રા, શિવલાલ અન્નાલ એન્ડ ડ્રોન્, ૧૯૮૬
 ૪. કુસુમલાલ દાતા, “ઈન્ડિયાન અણનિયેશન,” ખ નેશનલ જ્યોતાક્ષિલ જર્નલ એન્ડ ઈન્ડિયા, જૂન, ૧૯૭૨, પૃ. ૨૦૩-૨૦૭
 ૫. “કોરપિટિશન એન્ડ લોયન્ઝેર્સ,” નવેમ્બર, ૧૯૮૨, પૃ. ૭૩
 ૬. ડૉ. હસુમ્ય સાંકળિયા, “પુરાતત્ત્વ અને રામાયણ,” અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, ૧૯૭૩
 ૭. દરિયાસાહ ગ. શાસ્ત્રી, “ગુજરાતનો આચીન ઇતિહાસ,” અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી પ્રકાશન, ૧૯૮૩
 ૮. જયુ પેલે, યાહ અને જાની, “આચીન ભારતનો ઇતિહાસ,” સુરત, અપના પ્રકાશન, ૧૯૮૭

આરીરિક અશક્તિ અગર નભળાઈ માટે આચુવેંહિક

અક્સીર ઓષ્ઠ્ય

‘અભ્રક લરમ’ (સહસ્રપુણી)

અસ્તિત્વ શાસ્ક્રીય પર્યાપ્તિએ બનાવેલ સહસ્રપુટી અભ્રાંત લાસ્યમ

મેળવા લખો અગર મળો :

શ્રી ગુલાબકુંવરાણા આયુર્વેદિક સોસાયટી

એડી રેડ, પો.ઓ. નં. ૬૬

અમનગર (૩૬૧૦૫૧)

ਪੰਜਾਬ ਮੁਖ ਪ੍ਰਕਾਸ਼

वीर वास्तुषुलु युग

श्री. शंखुप्रसाद हरप्रसाद केसारी

ई.स. १७०७ मां और 'जेन्टल्स' भृत्य थयुं ए पधी दिल्हीनी छहेनशाली हिन्प्रतिहिन निर्णय थती गई, आंतरिक फ्रेंडों, अभीरानी सरानी अथवा रवतं नवानी मासि. माडेन भहत्वाकांक्षा अने भहाराष्ट्रना भहाराज्यना उद्यम साथे सूत्याओं अने नायथ सूत्याओं थेहेन्द्याहीने टकावी थक्या नहि.

सन् १७४५ थी खिंटिय सताए सौराष्ट्रमा ई.स. १८०६ आं प्रेवेष्ट फर्डी ए ६० वर्षना गाणामां सौराष्ट्रमा सुक्षोनी परंपरा अविच्छिन्न राज्यवानी, ग्रन्ते पायमाला करवानी अने देशने उन्नत राज्यवानी इन्ह लघु प्रेता उपर आवी पड़ी होय एम सौराष्ट्रमा दीवान अमरण, भेरामथ भवास, भा कुंभाल, राणा सरठानाल, ठाकोर वल्लिंग, कांगी शेखभिमा वगर अनेक तज्ज्वार-शोभीनोंमे दृव्य अने विस्तार वधारवा आटे सौराष्ट्रनी पवित्र भूमिने समरक्षभिमां पलटावी नापी. आ राज्याओं अने सरदारोनी आ दिंसक प्रवत्तिनी नेंद्र ईतिहासनां पानाओं उपर अरपहे देवाई छे अने तथा अनी यर्दा अहीं अरथाने छे.

आ नामावलिमा गोंडाना ठाकोर हालाल तथा गोना अतुगामी कुंभाल अग्रत्यना रथाने छे. ठाकोर हालालके गोंडाना गरास जेवा नानकडा राज्यभावी गोंडाने भोडुं राज्य यनायुं, परंतु अेषु आरेली प्रवृत्ति अना पधी कुंभालमे सविशेष विस्तारी, भा कुंभाले आ भाटे समय सौराष्ट्रमांगी शहरीर अने पराकरी पुरुषोंने निमंत्री प्रेता पासे राज्या अने रव्यं लुक्काणा अने परंही छता छतां अंत्रीमा पछु एवा ७ साथे राज्या.

ठाकोर हालाल पासे ई.स. १७४६ आं जूनागढी प्रेताना आभा ग्रीकमहास भजमूदारनी बेंस चोराई के गोवार्म गेली अने ए हालालना आउमा छे, जे देवा भान १५ वर्षों एक दुमार गोंड दूरभारामा आव्यो. अेषु युक्तिपूर्वक बेंस प्रेतानी छे अेम समित छरी हेता हालालमे बेंस तो आपी, पछु अने प्रेता पासे राखी लीपी. अनुं नाम ईश्वरण अंबासंकर युग.

ईश्वरण वधानं आवर्ता अनी कुताअचुक्कि अने प्रतिक्षावी अेषु हालालतुं मन छती लीपुं, अेट्हुं ज नहि, क्लम अने कराना सुमेवावा आ जक्तिशाली जुवाने ई.स. १७८५ सुधी प्रेते ६४ वर्षों यथा त्यांसुखीमां हालाल तथा कुंभाल साथे रही अभोनी राज्यविस्तारनी प्रवृत्ति तथा राज्यमनी प्रतिहिन वधारवार्मा अग्रत्यो लाग अवव्यो.

ईश्वरल्लने ए पुरो हेतो नेमामा भोटा वास्तुषुल तथा नाना लुकाखीसमे भान १५ वर्षों वेंद्रे सन् १७७४ मां लीअडी उपर ४०० सवारियुं नेतृत्व लाई सवारी करेकी अने अेषु पछु एमना पिताने पछले आली दूरभारामां तथा राज्यभिमां प्रेताना लुक्किला अने आहुआयुं प्रार्थन कर्तुं अने परिक्षामे अभीनी सामे अन्य राज्यपुरुषोंनी अटपटो छता राज्यकर्तानी प्रीति अने विश्वास संपालि छरी कीर्ति अने प्रतिष्ठा ग्रान कर्ता.

ई.स. १७८१ मां गोंडाना भायात ठाकडाना लेथीलनी कुंवरी गोरमंदर-राणाने पराषावेलां ते अयां त्यां तो भागरोजना रेखभिमांमे गोरमंदरतुं नवीमंदर लाई लीपुं एटेके ठाकुं के नवी आपी अने नवी गई, आधा भादुं लागतो अेषु कुंभाल पासे आवी नवीमंदर छती देवा आलाल छरी अने वास्तुषुल युग अभिरोज उपर यग्या. शेवे समाधान यारयुं अने नवीमंदर पालुं लाई जेह्या आव्या.

प्रथिक-हीप्रेतस्वांक]

१६८६/अ.१३०.-नवे.

[७५]

ઈ.स. १७८३ मां ज्ञानगर तथा पोराणदर संक्षयने लेटाणी अने रायणना शेषी हुँ अने भावीकृ भाए वाद्या घडो. कुंभाळजे वास्तव्यने राजनी भद्रे गोडत्या तथा जूनागढी अभरल्ल पशु आव्या, अने १ क्षा वच्चे खुनभार सुख याय अम हुँ त्यारे राजा सरतानछन्ने कहुः 'भलेक भीडु अहीनो जूनो आख्यास छे, अे नगरनी सेवामा छे छतां अे कहे ते भारे हम्बुख छे. भलेक आ वेड पोराणदरनो छे अम दैराव आपती भेवुचे हिनुँ' अपभान हरी उडाई भुख्यो, पशु वासखुल्लये अने राजरीति अने राजनीतिनो वात की अनो धर्म कैला राजमार्थी पाण। करवानो नथी अम हरी वेड पोराणदरने अधायेहा आ प्रसंगर्थी वेष्टु वासख्यामा अनो भुत्सदीगीरी तथा वाक्यातुर्थी सौ अभावित थया.

जूनागढ वारंवार ज्वानुँ थतुँ तथी कुंभाळजे वास्तव्यने एक महान अंधावी 'आपुँ' अने अे ज्ञाता त्यारे त्याँ जीतराता. एक वार दैरोह खेसेना फैवरा गामना रायणहा हरारारे नारायणीहर थतां अे गाम भाई आपवा नवाप खासे अवेक्षा तेने वास्तव्यने भणा ज्ञाता अष्टु फैवरा जोडाने त्यां भांडवी, जीनो कहनो लहर साफरक्षाव नामना चेताना भाँधने पशु सुखी दीयो.

एक वार ज्ञेतक्षसरना पादरमा आराम देवा भाए सुखाम होये अने आ गाम जोडाना पासे होय तो साँडुँ कही, छापो भाई वासखुल्लये ज्ञेतक्षसर लहर लीयुँ. ज्ञेतक्षसरना झाडी हराराशेने पकडी लीया, पशु थीन लहरारवटे नीडल्या, परंतु वासखुल्लये अंगेतुँ आखवा हीयुँ नहि अने वणते वर्षे त्यां हिल्दै. पशु आँख्यो.

आ समय हरभ्यान वासखुल्लनी मान अने भेजो जोडामाँ ०९ नहि, पशु जूनागढना हरारारमा पशु वधी गया हतां. नवापर्थी हीवान हुँवर्खल रिसाई ज्ञेतपुर याद्या गया. नवाप लामेहाने पोराणदरना हीवान प्रेमल हामार्थीने भोवाव्या. अष्टु हरारामां नवापर्थी अहय न राखतां वासखुल्ल त्यां हाजर कहा तेषु कुंभाळने कहेतां अल्ले नवापने प्रेमलने न राखवा सलाह आपी, नवाप तेथी वासखुल्लने लहर ज्ञेतपुर गया अने वासखुल्लनी समलवर्थी हीवान कुँभने नवापे इरीथा कारक्षार सेप्पी अने अनो अद्वामां नवापे कुंभाळना नशु कुर्वो देवाल हीलाई तथा आवाजने अनुष्ठान लाठ तथा लिमेरा अमेनो परवानो आपातुँ अधावी वासखुल्ल जोडाना पाण। आप्या.

ઈ.स. १७८० मां जोडान राज्ये सरसाधने अद्यो भाग भांडवी लीघेलो. त्यांना काडी हरारार डरसरवाणाने हायानी ई.स. १७८४-८५ मां वासखुल्लये सरवाई कहने कहुँ तथा परगेना यार गाम उल्जन्न वर्षां हता ते आपाद हरी गीर प्रदेशमा पांच गाम उपर अविकार भेगायो.

ई.स. १७८० मां फूलख नामना एक अंतेवासी सरवेया आभियाळना भाऊक्के अनो पासे उधराशी करतां एक वेपारीतुँ खुन करतां अने खिक्का हरवाने अद्ये जोडामार्थी हरपार हरी नोकुडे मेडल्यो, ज्यां ज्ञानगराना गाम भेवासना अवा शेता सांवे अष्टु वेर वांधुँ अने ज्वाँ शेता जोडाना उपर आवरो तो अनो सामग्रे हरवो भुखेक वर्ष पडेहे अंतेवा आभियाळने वडारा मेडली कुंभाळने भाउ फैज भेणवी, परंतु ए हरभ्यान ज्ञानसाहेबे वासखुल्लना निवृत पिता कुशरङ्गने भेक्षावी अने वच्चे समाधान हरान्नुँ.

ई.स. १७८८ मां जोडाने ज्ञेतपुर सांवे वेर वांधायुँ अने आमे पशु कुंभाळनी लक्ष्यां ज्ञेतपुर ज्ञाता लेवाना हती तेथा अष्टु वासखुल्लने वडारा मेडल्या अने अमाणु गापकवाई भणा भाडेया फैज भेणवी ज्ञेतपुर उपर वारक्कवा येजनाना करी त्यां कुंभाळ ई.स. १७८० मां रुपगांवासी यता आ येजनाना पडती मुक्काई.

‘कुंभुक्तु’ निधन दूतां वारस्कर्णो भेदो दस्ते। ये, दोडा रहेता के वास्तुकुन्ने कुंभाशु
मुत्रने पिता आहे तेम आहे के अने अने वन्देये आतीयता पथ्य ज्ञेवा ज छती। कुंभाजना अतुगामी
जेना पौत्र मृत्युकु थया। ये दाद अहु गंता अने राजशाहीमां धान ओळुं आपता।

मृत्युकुनो वेशेण वाचेवा नामनो कृपापात्र होतो ते मृत्युकुने पेताना अंकुशमर्त राखतो अने
अनी पासेथा दोराळ पडवी लेवा प्रवर्गनि करतो होतो। येहु नवाखनी सहाय पथ्य आनंदी रीते
भेवी हती। मृत्युकुनां सधी आदीया तथा कुंभ दाजुने आ भाट यिंता रहेती, पथ्य मृत्युकु वेशेणनी
विकुण्ठां काई सांचणावा तैयार न हता। ज्यारे वेशेण द्योराळुनो कृबन्ते क्षेत्रे के अधर पडी
तारे आदीयाचे वास्तुकुना संलाभ पूर्णी अने ये अनुसार आदीयाचे मृत्युकुने वधारे पढतो दाद
पाई दीयो अने अनी अतुभिति के जेम कही दाजुराज तथा वास्तुकु सैनिको लक्ष द्योराळु उपर
येवा। वेशेण लागीने कुंडारें गेयो त्या पथ्य देवै वाची अने पटकरें, पथ्य ये लागी गेयो। वास्तुकु
द्योराळुमां पूरी अंदोरास्त करी पाण। आत्या अने मृत्युकुने वेशेणनी निभद्धराभीनी वात करतों ये राजु
था। मृत्यु पथ्य दृ.स. १७८२ भां युवती जता कुंभर दाजुराज गाडीमे घेहा। वास्तुकुन्नु ये पूर्णु
मान राखता अने अनी संलाभ पूर्णता। १७८५ भां एक जमादार उमर कुर्याये वंथणी द्यावी दृष्टि
नवाअने कडेवराळुं के गोळा वंथमां पडे तो हुं भारो इक्क लक्ष वंथणी छेडुं। नवाये दाजुराजने
कडेवरावता येहु वास्तुकुने मेहाळत्या अने एमझे जमादारने संभवावी वंथणी नवाअने सेंपाव्युं। आ
सेवाना अद्वायां गोळाने अंलागिमा अव्युं अने नवायी द्यावी देवै गामो। उपर जमा हती ते
माई करावी। आम वास्तुकुन्ने पेताना भुवि अने अणवी अंलागिमा भेणव्युं तेथी दाजुराजे अने
ये गाम जागीरमां आव्युं।

वास्तुकुने दाजुराज मुरव्यां भानता अने अमेनी प्रजनमां पथ्य दोऽप्रियता वक्ती जती हती
ये नेई कृत्तिक असंतुष्ट भंतीजो राणी आदीआहीने अनेगृही दाजुराजे
वास्तुकुने आपेलुं जाम अंलागिया ई.स. १७८१ भां लक्ष लाळुं एटवे वास्तुकु दिसाई जमनगर
याद्या गया, ज्यां मेरामध्य अवासे अमेने गोदा मान साये नोळरीमां राखी कुंडारेथा थाणु निमज्जुळ
करी, पथ्य अमेने रेवावारुं मेरामध्य साये हातुं एटवे कुंडारेथा याचु येता लाई युवाभीराम रवा।

जमनगरना भेरामध्य अवासे थयुं के गोळानी हांडार युवान छे, राजमाता आदीआई परहेळ-
दार ऐ, एटवे गोळा रवाधीन करवाने सारो भेडा की, वणी वास्तुकु लेवो। हट मुत्सदी अने येहो
पथ्य येता साये की. आम विचारी येहु गेठिया झुकमे दाजुराजने योकावी धक्काववा मांडाया।
दाजुराज पासे उत्तर न होता त्यारे येहु कहु के तमे आप्ये हिवस रज्जुवासमां पडवा रहो लो, शराब
अने कही पठवी लो लो, राज्य कम-अक्कल आभसोने अर्हीन त. दूवे ने सुखदर्शा नहिं तो भारे
राज्यमां दाय धाववो। पडो, दाजुराज नाहुं नेई येहा हता त्या मेरामध्यना पथ्य एडेवा वास्तुकुन्ने
कहु : “मेरामध्य ! गोळाना गज्यमां दाय धाववो सहेंवा नवी. अवा राईदा सरभा होता नवी,
कोरीमा भेरीग होय की.” भेरामध्य कहु : “वास्तुकु ! तो मारा नोळर ऐ, तमने कठी मृत्यु, त्यारे
मे संवर्यी की.” वास्तुकु येहु : “शा भाटे भेन संधेंवी ! गोळाना धूषीमे अने भेडो क्षेत्र यारे
ने ! भारे उवाडे तुवाडे अनुं निमक छे. ला, यान राम ! भेरामध्य ! हवे आवो गोळाना दाय धाववा.”
येहु दाजुराजने कहु : “जीठो, आपु ! भेरामध्य आहे तेवा पथ्य जेवो. आप जम रावगना
योतरा अने गोळाना धूषी.” येहु दाजुराजने छाडी लक्ष गया येतो तंतुओ जमादी रज आधी
त्यारे दाजुराजे कहु : “अमे एकला नहिं अज्जमे, तमारे साये आववानुं की.” कामदार प्रागृथ प्रे
पथिक-हीप्रात्यवांक]

ભાગ્યો, દાણરાજે ખંભાળિયા પાછું સોંઘું અને વાસથળએ ગોંગા જઈ પોતાના ભાઈ શુલાભીરેને હુકોરથાથી તેવાચી લઈ અને ૭૦૦ રેનિડાની ફોઝ ક્રીડ જમનગરનું ગામ જમવાળી આવ્યું, આ સમાચાર ભાવતી જમનગરની ફોઝ એતી સામે ચીડી તેમાં રસુનાથળ તથા રષુણોણ હતો. ખજેશ્વી પાસે લગાઈ થઈ અને વાસથળએ અત મેળવતાં ધોરાળ થાણું નાભી, જમનગરની સેના ભાદર જીતરી ન રહે એ માટે ગડગરિયા પાણુંનો ડોટ ચથ્યું ૧૦૦ સવારો અને ૫૦૦ પાયફળ સાથે છાવણી નાભી. જમનગરથી પેશે ઠક્કર એવું જ સૈન્ય લઈ સામે આગ્યો, પણ એમાં પણ એને સર્કણના ભળી નહિ. વાસથળ પાણ વિલબ મેળવી ગોંગા આવ્યા, પણ એ સાથે જમનગર સાથે પાડું વેર બાંધતા આવ્યા.

જમનગરનો મેરામણ ખવાસ અભી ભાઈ લે તેવો ન હતો. એહું વડોદરાથી આખા સેલુસ્કરનું લખકર ભાડોથી મેળવ્યું તથા પોતાના ભાલુસો સાથે આવી ગોંગાના ગમાંડાંની ઈ. સ. ૧૭૫૬માં એક ભાસ સુધી પાયમાલી કરી, આ પ્રસંગ ઈ. સ. ૧૭૫૪ માં અન્યો જેમ તારીખે સોણ પ હાલારના કર્તા દીવાન રણકોડાણ એમાં અંધમાં આપે છે, પણ ચેડિલે એનો સામે પ્રતીક્રિયા માટે ન કર્યો એનો ભાલુસો. કોઈ ઈતિહાસમાં નથી, પરંતુ એવું લેખક જણાવે છે કે ગોંગાના જાણે દાણ તથા રથમલણે જમનગર સામે કર્યાના જમાદાર ફેટેહમહમેની મદદ આગી. વાસથળ ભૂજ વર્ષ ફેટેહમહમદને તેરી આવ્યા અને પહુંચી પાસે અંને પક્ષો વચ્ચે યુદ્ધ થયું, અંતે દીવાન રસુનાથળ—એ જમનગર વઠી વાસથળ ભુયને સમનલવી જમનગર તથા ગોંગા વચ્ચે સમાધાન કરાયું.

ઈ. સ. ૧૭૬૬ માં રાણીંગવાળાના નામના કાઢી દરખારે ગોંગા ઉપર અહારવંડ થઈ કર્યું તેને ખીણ કાઢી દરખારેના ટેઢા હતો. એવાંગવાળાના નાનાણી એની સાથે આવ્યા અને મોદું સૈન્ય જીજું કરી ગોંગાના જમ લંટવા માર્ગથી. જસદાણ અને જેતપુરના દરખારોએ સમાધાન માટે વાત શરૂ કરી, પણ જોણે એક પણ થરત રસીકારી નહિ અને દાણરાજે વાસથળને રાણીંગને પતાવી ટેવા કુકમ આપો. એ કુંપર હીલાઈને લઈને રાણીંગ ઉપર ચચા. એમના ભાઈ શુલાભીરેન તેપણાતું લઈ સાથે ગયા, આ લશકરોએ વાદરવડ સુકામ હતો ત્યાં પરસાદ પડ્યો, પણ એ પણી રાખરિન લુંચિયા વેરે લઈ ખગવટા ઉપર ચચા. ત્યાં તો ટ્યાક્સાર દાણરાજ યુદ્ધરી ગ્યાના સમાચાર આવતી એલદ નાનાણીએ હુમલો કરેલો. તેનો પ્રતીકર ન કરતો દાણરાજના ભસુના અભર આપી યુદ્ધ વધ કર્યું, ત્યાં તો સમાચાર મળ્યા કે ગોંગાની ખંબાં ખંબાં વર્ષ થઈ છે તેથી વાસથળ તરત જ ગોંગા પણ ઈર્યા.

દાણરાજ તથા એના ભાઈ દેવાળને અથનાવ હતો. દેવાળ કાદાવડ રહેતો. દાણરાજનું સૂત્ય થતો એનો માતુશી અદીયાનો વિધયા વહુ ગર્ભ વતી છે એમ જાંદેર કરી પોટો પુત્ર જીબો કરવા પ્રયત્ન કર્યો. વાસથળએ એને ૨૪૭ કાઢી દીધું કે “લાડેનાના પરિત્ર કુળને કલાક નહિ બાગવા હું”. ગાડી ઉપર દેવાળ એસશે અને રાણીને પુત્ર અવતરણ તો જીતરી જરો.” દેવાળને એબાની આદી એસાંચા, અદીયા રિસાઈ ધોરાળ આવ્યા ગયા. વાસથળએ એમને અદીકાયતમાં લાખા અને એહે રાણીને ગર્ભ છે એ વાત જોડી છે એમ સીકારતાં કોણાં પદ ગામ આપી દેવાળની ગાડી અલય કરી.

આ પ્રથમિ દરમ્યાન અદીયા તરફે રાજપુતોએ વાસથળનું ખૂન કરવા પ્રયત્ન કર્યા, પણ કુંપર હીલાઈએ અભાવી લીધા. દેવાળને ગાડી આપાવી રાણી અદીયાનો વિરોધ સમાચારો, એમ હતો દેવાળએ વાસથળને પ્રતિસયધીએના કથનને આધારે કારબારીપદ્ધી દૂર કરી કુરળ તથા જોરખનને કારબાર સોપત્તાં વાસથળ વેર એસી ગયા, પણ દેવાળ ટ્યાક્સાર એમને પાણ સમનલવી લઈ આવ્યા, પરંતુ નિરંતર આસતી આવતી ખકપરો તથા એના ગોંગા રાજ્ય મારે આપેલા જોગની ટ્યાક્સાર દેવાળને હોવાથી વાસથળ નિવંત થઈ જૂતાગઢ આવ્યા ગયા.

हरेभ्यान गायकवाण अने काठीमोनी जैंडण राज्य उपर भास वधी अने मंजोंगो कठी करी शक्ति अम नथी ऐसु लागतां देवाण छाकारे वासष्टुलुने भोलाव्या, पछु एओ न आवतां एमना पुन उभियास्तुरने भोलावी पोता पासे राख्या.

कृ. स. १८०२ मां गायकवाण्यु लक्ष्य लक्ष्य आभाष्य यदी आओ अने गेंडणां भाभर्वा लूटवा भाऊं तेथी वासष्टुलुने आवधुं पहचुं अने गायकवाणी भावशीर्भां जर्ह रंगीलास भवर्भुहार सेना साचे हता तथा पोताना संगा थाता ए नाते लूट अंध करावी, अंधाती रकम नझी करावी अने ज्ञान सहगता भगती भीजं राजोंने पछु वासष्टुलुने वयमां राखी पोतपोतानी रक्मे बुकर बुकर.

आठवी आठवी सेवा छतों हाकेर देवाण्ये अंबाणिया गाम उपर, वेरो फ्राप्ल कर्हो तेथी वासष्टुलु यात्रा जूनागढ यत्या गया त्यारे नवामे ऐसुं मान करी धामुसर गाम आवा आप्युं तथा एना पुन गौरीश करने कैठीनार भक्तवत्तां नवामे इक्क हतो ते सोयो.

वासष्टुलु विदुङ्क प्रभाण अटपट हतो अने एनी उपरवट यत्या देवाण असक्त हता तेथी फुंवर क्लुभाईने जूनागढ मेहकी, वासष्टुलुने सभगती देवाणामां राख्या.

कृ. स. १८०३ मां भुवाभीरामे भांडाधारमां थाणुं कापम क्युं. केवद्वा केशोद पासे हतुं अने नवामे ए वात घूंयती हती, केशोदाना मुसद्दी गेविंद्धु जालाये जैंडण्युं थाणुं छक्की भुक्त्युं. हवे ए नवाम साचे पेटीयोनो संघंध हतो तेती सामे लखुं हतुं तेथी वासष्टुलु अभरेली जर्ह गायकवाण्यु लक्ष्य लक्ष्य आव्या अने देवाणाली ज्ञानासा जर्ह तांची केशोद उपर फुमेवे कर्हो अने लूट यत्यावी, पछी केवद्वा घेवुं अने दर्यार, काळाभाष्ट गामांयी अंड्को अने तोयोना आर बरता हता तेमी सामे वासष्टुलु थेहा भाषुसो साचे एकदम देट हीधी अने पहेवे मेवर्ये जर्ह तववार लव्या, ए यार आक्षयोने घापी नाख्या अने अंगाश्य पहचुं. वासष्टुलु शतुनी तोयोमां भीला डोळी दीधा तथा गाम इन्हे करी पोतानी तोयोमांथी दर्यारगढ उपर तोप आडी ते सर क्यो अने पछी देवाण हाकेर गाम अहार ऐढेला तेने भोलावी गाम दोयेप्युं.

ए पधी राज्याकाट राज्यमां विखवाद पड्यो. वासष्टुलुने भोलावी भद्र आगतां एमवु एनो। इ.स. १८०५मां निकाल कर्हो अने पोताना पुन गौरीश करने राज्याकाट तथा रघुनाथाने सरधार राखी। कृ. स. १८१८ सुधी त्याना वलीवट कर्हो.

आ हरेभ्यान कृ. स. १८०० मां क्लिंवर्जु गुजरी जर्हा एनो कारकनो अर्ह दर्यारभाष्टी देवा नझी थ्युं, पर्हतु भंजेयो आपावा न देतो वासष्टुलु दारका यात्या गया अने वणती जमनभर आवतां जमस्तुहेये एने नेहरीनो फुकम आप्यो. एमो तां ज्वा तोयार यत्या, पछु देवाण्ये ज्वा न दीधा अने एमने कारभारी तरीके नियुक्त कर्हा, पछु सन १८१२ मां हेगु गुजरी जर्हा गावी उपर नव्यु आव्या. आ वर्षे वासष्टुलु अभरेलीमां गावकहावी लक्ष्य आव्या हतो.

नव्युला समयमां एनो इग्यात्र नव्यु वावेदो कर्त्तव्यी थर्ह पह्यो, पछु नव्युलु भुवाभी-शमना पुन जगन्नाथये पोताना अंगत भंजी तरीके राखातां नव्युलु एनी अटपट हतां हाकेर एने टप्पो आप्यो. आ वातानी वासष्टुलुने ज्वाथी एषुं ई. स. १८१२ मां राजनाम्भुं आपी दीहुं. नव्युलु ए स्वीकार्हुं नहि, पछु वासष्टुलु जैंडण आव्या नहि, एमो तो गायकवाणी सुखा साचे झ रचा. नव्यु ई. स. १८१४ मां गुजरी गया अने एनी गाहीये क्लुभाई एहा. एमवु जगन्नाथये अंगत कारभारी तरीके राख्या, पछु करज अहु थर्ह गयुं हतुं एटवे दुर्ल आज्ञा कारभारीनी सवाहीली वासष्टुलु पासे इपिया ७५ हजार भाव्या. एमवु क्युं: “मारी पासे पीसा नथी, पछु तमने अधिक-हीपोत्सवांक]”

“જરા હેઠળ તો મેળવી હતું,” એમ કહી એમણે ધોરણ ઉપલેટા વગેરેના શેહિયાએ પાસેથી રખિયા પાંચીશ હન્દર મેળવ્યા, બીજા મેળવવા પ્રયત્ન કરતા હતા ત્યાં દૂરજીએ કહું: “કાઈ આપશો માં એ વાસથુણે દેવના છે.”

વાસથુણ આપી શક એમ ન હતું એટલે એમને તથા એમના ભાઈ જુલાભીશામ અને બંનેના પુન્નોને ડેવાં નાખ્યા. એએ છ માસ ડેવાં રખા ત્યારે પોલિટિકલ એજન્સ્ટ ડેવટન એનેન્ટાઈનના દૃપાયાને સુદરજી શિવળેને એજન્સી આ કામ્યાં વાસથુણે મદદ ન કરે તો મારડ ગામ આપવા લાલચ આપી. વિદ્વલાવ દેવાળ કે ગંગાધર શાસ્ત્રી પણ કાઈ ગોદાન નહિ, પરિષુદ્ધ દસરાં જોડાયી નામના એલન્ટાઈનના દૃપાયાને વાસથુણના પુત્ર રખુંછેણ મળ્યા અને સાહેને વરણે પડવા વિનંતી કરી.

એનેન્ટાઈને દસરાંને કહું કે “હું ગોંગા જર્ઝિશ તારે વાત,” પણ ત્યાં ગયા પડી પણ એશે કાઈ કહું નહિ અને નેતૃપુર આદ્યે ગેતો, દસરાંને એહુ કહું તારે કહું કે “અમને નેતૃપુર લઈ આવો. એમને રોકે તે માખસોને કાઢી મુકુનો.” આ સાંભળી કુલાંધર દાકોરે ૨૦,૦૦૦ ડેરીનો દાંડ મુફ્તી વાસથુણ વગેરેને લુકાયા કર્યો. વાસથુણે વરના દર ગાડીની વેગી ૧૨૦૦૦ ડેરી લરી દીધી અને ૧૦૦૦ ન વેતા આગણી કરી. પોતાને દુદુંઘીએને હવે નાડરીઓ વિરોધ વખત રહેવાનું યોગ્ય ન લાગતાં ઈ. સ. ૧૮૨૦ માં વર પડી બેસી ગયા અને ૧૦૦૦ ડેરી દરારે મેરાળના માલા કામદારને કારણું વગર કે કરી પોરણ રના વારણ દોશી પાસેથી આ રકમ મેળગ્યા.

ઈ. સ. ૧૮૨૧ માં કુલાંધર ગુજરી ગયા અને ગાડીએ દેશાળના ત્રોણ પુત્ર ચંદ્રચિહ્ન ઉદ્દેશીતાઈ આય્યા. ગાવકવાડાંનું સેણું લાયો હતું તેવા વડોદરા તથા એજન્સીની ભસ્કરાયે ગેંગામાં પડાવ નાખ્યી તાકોણ કરતાં રાય્યી અદીઆચ્ય વાસથુણે બોલાની એના દ્વારા દૃઢ્યા કરાવ્યો.

ઈ. સ. ૧૮૨૪ માં દરખારમાં પાછી વાસથુણી જરાર પડી તથી દાકોરે વાસથુણે માનપૂરનું તેવાં ખાંબાળિયા પાછું આય્યું, એના પુત્ર જીવિયાંદ્રને દોરાળમાં મુક્યા તથા જગ્યાનાથેને દાકોરે પોતા પાસે રાખ્યા. ઈ. સ. ૧૮૨૮ માં દાકોરે દૂરજીને રણ આપી વાસથુણે દીર્ઘી કારબાર સોખ્યો. એમણે રખુંછુણે મેઢલી પોરણદના વારણ દોશીના લેખાંતું સમાધાન કરવા મેછલાયા, પણ એ દરમાન ગમે તે વાંદ્યો પણ્યો અને વાસથુણ દીરી ગોંગાની સેવાનો તાગ કરી આવનગર ગયા, ત્યાં દાકોર વનેસિહેનો નોકરીમાં રાખ્યા તથા હેઠળાયું માસ આય્યું.

ઈ. સ. ૧૮૩૬ માં ગોંગા દાકોરે એમને પાણ બોલાવ્યા તારે પોતા પાસે રાજ્યના કે કાગળ હાત તે આપી હોલા અને પોતાનો ઉઠ વર્ષ થયો છે એટલે કાઈ કામ કરવા નિયાર નથી એમ કહેતાં ખાંબાળિયાનો તુંકો દાકોરે તાને કરી આપ્યો. રખુંછેણુણો પોલિટિકલ એજન્સ્ટ નેકેને બોલાની પોતા પાસે રાખ્યા. વાસથુણ નિવસ થયા.

વાસથુણ કાઈ સાલમાં સ્વર્ગવાસી થયા એ જીલ્યુવા મળતું નથી, પણ એમના પુત્રા તથા જુલાભીશામાં પુન્નો ધણ સમયથી ગોંગા રાજ્યમાં જીંયા પહોંચ્યું. ઉપર કામ કરતા હતા.

જી રાજ્યવાસોની વડોદરાઈયુર્વિક લોખાનો નોકરી કરી ગોંગાના નાના રાજ્યનો વિસ્તાર કર્યો અને ગોંગાનું સ્થાન સૌરાષ્ટ્રમાં અગ્રિમ રાજ્યાંની નામાલિયમાં મુક્યું તે મામાલિયક સંનિહિત અને નિમિષ-હસ્ત અધિકારીની રાજ્યાએ કૃતિના થઈ દુર્ઘટા કરી એ એક હું ખદ થાયના છે.

કુ. ‘ઓજાસું’ દાઉનહોલ સાને, સરદાર ચેન્ટ, ગૂલાબાદ-૩૩૨૦૦૧

સ્વામિનારાયણ સંપ્રદાયનો એક વિશિષ્ટ ક્રેસ્ટ

શ્રી. હસસુખ પથાસ

શુદ્ધરાતના ખામીંક સામાજિક અવલમ્બનનું સ્વામિનારાયણ સંપ્રદાયનું મહિનું સ્થાન તેમ પ્રદાન છે. આના સંસ્થાપક અને પ્રવર્તક પ્રસારક શ્રીલ્લ મહારાજ બહુ નાણકના (ઈ.સ. ૧૭૮૧ થી ૧૮૩૦) જીતકોળનાં થેથેબા હોવા જતાં નિજ સંપ્રદાયમાં 'ભગવતા' તરીકે પણ પૂજા થિય છે એ હોકાત છે.

સામાન્ય જનસમાજમાં "સ્વામિનારાયણ સંપ્રદાય" તરીકે જોગ ખાતા આ સંપ્રદાયનું મૂળ નામ તો ઉદ્ઘાટન કર્યું છે. જ્યારે આનો પ્રચાર અને પ્રસાર થવાની શરીરાત થઈ તારે શ્રીસહિનાનંદ સ્વામીએ સ. ૧૮૮૨(ઇ.૧૮૮૨)માં સમગ્ર સંપ્રદાયની વ્યવસ્થા માટે ગુજરાતના જિતર અને દક્ષિણ એમ એ વિભાગ પાડ્યા તથા જિતરનું વહું મથક અમદાવાહ અને દક્ષિણાં મુખ્ય મથક વાતાલા(જિ. જેડા) નક્કી કર્યું, એટલું જ નહિ, આ બંને સચ્ચકની તે તે ગાદીના આચાર્ય તરીકે પોતાના એ લન્નીઓને રસ્તાપિત કર્યા : પોતાના મોટા ભાઈ રામપ્રદીપના પુત્ર અયોધ્યાપ્રસાહને અમદાવાહની અને નાના ભાઈ ઈંગારાસમાં પુત્ર રખુંની જાહીના આચાર્ય નીરા. બંને આચાર્યો ગૃહદર્શી હોય એમ પણ ઢરાયું. આ અગે એઝોશીએ એક ખરીતો પણ લખેલ છે, જેમાં એમણે ગાદીના આચાર્યેની વ્યવસ્થાનિયમ નક્કી કરી આપેલ છે.

ઉપર્યુક્ત વ્યવસ્થાથી થોડા સમય તો વહું વ્યવસ્થિત હયાયું, પણ ધીમે ધીમે આનાં પણ અસરોથી અને અધ્યવસ્થા સંભ્રાંતા કાગાં, જે સંપ્રદાયને અદાલત સુધી લઈ ગશ્યા !

આ સંપ્રદાયમાં ગુણાતીતાનંદ નામના એક પ્રમુખ સ્વામી હતા. આમ તો એઝોશીએ અન્ય ડોઈ શાખાનું ગાન લાંઘિલ ન હતું, પણ નિજ સંપ્રદાયનાં એમને કોંડું ગાન અને સમજ હતાં. જૂનાગઢ મહિના એઝો વધીવર્તકી હતા. સ્વભાવથી એઝો અતિ તેજ અને સંપ્રદાયની માચીની પ્રથા અને પ્રથાલિકાથી થોડા ભિન્ન વિચારો ધરાવતા હતા. એઝો શ્રીસહિનાનંદ સ્વામીને 'ઈશ્વરસરવર્ષ' તો માનતા, પણ કૃષ્ણને માનતા ન હતા. વળી, લ્લીર્વર્ઝ પ્રયોગે પણ લખાય અરુદ્ધિની ભાવના-ઈતિ ધરાવતા અને દર્શિંદ્રા. શ્રીકૃષ્ણને રાધાલક્ષ્માનો કંગ હોવાના કારણે ન માનતા. આ ઉપરાંત લગા અને જગ્યા નામના એ નિમન વર્ગના અનુયાયીઓ હતા, જેઓનું પણ વર્તન થોડું ભિન્ન હતું

વીસમી અદીના પ્રારંભે એક તેજસ્વી જીવાને આ સંપ્રદાયમાં દીક્ષા લઈ 'યત્પુરુષાસ' નામ ધારણ કર્યું. સામાન્ય રીતે એઝો 'શાલીલ મહારાજ' તરીકે જોગાયાના. એઝોશી પણ સંપ્રદાયના અખ્યાલિગત વિચારથી થોડા ભિન્ન વિચારો મંત્રાય અને વર્તન ધરાવતા હોઈ દૂંક સમયમાં સંપ્રદાયના આદિ સાધુસમુદ્દરાયી થોડા અદગ થઈ પડ્યા, આચાર્યી ઈ.સ. ૧૮૦૫ માં એમને સંપ્રદાયમાંથી અગ્ના કરાયા, પણ આનાથી એઝો નિયલિન થયા નહિ, વિદેશનું પોતાનો અદગ ચિષ્પસમુદ્દરાય એકઠો કરી જોયાસચ્ચ-(જિ.જેડા)માં લુંદું જ મથક સ્થાયું ! શાલીલ મહારાજના શિષ્યો સાહુએ વડતાલ વિભાગનાં માનેનાં હરિમહિરોમાં જીતરતા. પરિષામસરારપ એક જ હરિમહિરમાં પરસ્પર લિન પ્રયાર-પ્રસાર થવા લાગ્યો ! છેવટે સન ૧૯૩૬ માં વડતાલ વિભાગના આચાર્યશીએ પોતાના વિભાગનાં હરિમહિરોમાં આવીને શ્રીમહરુપુરુષાસલ અને એમના અનુયાયી સાહુએને એમના સિદ્ધાંતા વિચારોને પ્રચાર ફરતા અટકાવતા એસાંદરી સાધારણ દાનો માંચ્યો.

પણ-હીપોતસવાંક]

૧૯૮૬/ઓડાઠો.-નવે.

[૮૧

वहतालना आचार्यश्रीजे दाखल करें दावा अंगे अंने पक्षे पोतपोताना सिद्धतोः अने निचारेना निष्ठातोने पषु रोड़वा। वहताल तरक्कीना वडोल होता थी इनैपालाल मा. मुनशी अने संप्रदायनिष्ठात होता हरजुनन शाळी, तो सामा पक्षना वडोल होता थी श्री. श्री. देसाई। ओरसहनी अदालतम् आ केत अहु रसप्रद रीते चाल्यो। संप्रदायना सिद्धतोः आदर्शी वक्तव्ये अने वर्तन विशे परस्पर विशद छथावट करवामां आवी। त्वाभिनारायण संप्रदायना ग्रम्यभ अने ग्रसिद्ध सिद्धतोमा जोलोइ अने अक्षरधामना सिद्धांतने गण्यवामां आवे छे। समय दावो आ मुहु—सिद्धांतना वाद-विवाद अने दावा-प्रतिवादा तेमज जिल्ट तपासमा केन्द्रस्थाने रबो। समय दावो(उंच) आना उपर ५ किंद्रित होतो अम छी ए दोपालु अनुयुक्ति नहि गण्य। सामा पक्षना वडोल श्री श्री. श्री. देसाई दरजुनन शाळीनी जिल्ट तपास लीधी अने शाळीलुमे पषु आना (जोलोइ अक्षरधाम) विशे संप्रदायना शाळोना आधार परा पाड्या। श्री मुनशीजे पषु शाळीलु पासेथी संप्रदाय विशे दावाने आनुप्रगिक आहिनी विशे आधारो मेण्यावूँ। आमां ‘वासुदेवमाहात्म्य’ अंथो ग्रम्यभ आधार लीयो। ग्रस्तुत अथां ‘श्रीछ महाराज स्वयं श्रीकृष्ण होता’ अमे प्रतिपाहित करेल छे। आ अंथना १८ मा अध्यायामां श्रीकृष्ण कठी रीते बीज वार श्रीछ तरीके गृही एक वार श्रीकृष्ण वर्षुन करायेल छे। प्ररतुत अंथ स्वाभिनारायण संप्रदायनो शास्त्र-आधारान्थ भनाय छे। आनो ग्रम्यभ आधार नेधायेः

“हे मुनि, अर्जुननी साथे रहीने श्रीकृष्णवरूपे भे जे चापायेतो वष्ट करेल ते कलियुगनी पूरेपूरी सत्ता जामतां ज्यारे पुनः पृथ्वी पर आवाने पापाचार प्रसारये त्यारे नरनारायणुनो आत्मा अवो हुं पिता धर्म ने भाना भूर्ति(लक्ष्मी)ने त्यां सामरेही आहार तरीके जन्म लाईश।”

(अध्याय १८, नवे. ४२, ४३).

स्वाभिनारायण संप्रदायना अनुयायीजे मुख्य पठी ज्यां ज्य छे ते जोलोइ अने अक्षरधाम विशे पषु आमां निष्पत्त करायेल छे।

दूँडमां, ग्रस्तुत अंथां ग्रम्यभ नारजुनने जे उपदेश आपेल तेनुं ५ निष्पत्त संप्रदायना आधार-अंथ के जे श्रीछ महाराजे ज्ञेय-कथावेल छे—‘शिक्षापत्री’मा घोल-करपेल छे।

श्री मुनशीलुमे अदालतमा स्वाभिनारायण संप्रदायनो उद्ग्रहम विकास-आधार वर्षी-हर्यानी ऐमासाथ(ग्रन्थातीनान्ह अने ग्रम्यपुरुषदसङ्ग)नो सिद्धांत मूण्यी कठी रीते अवग पडे छे अम हाखला वडोल सह सामिन करां परिष्ठामस्वदृप वडवातानी ७१ थठः।

सामा पक्षे निजादाना किल्ला न्यायाधीशनी अदालतमां आपाल करेल अडीं अव.व-पक्षना वडोल होतां श्री अम. पी. अमीन (जे पञ्चायी मुंगाई सरकारना गोपनेक्ट-जनरल अन्या होता) अने वडताल पक्षे होता थी क. मा. मुनशी।

अलापत, अडीं पक्ष वराव उत्तुं कुतुं।

परिचय

ओरसहनी अदालतमी श्री क. मा. मुनशी आ डेस छत्या अनो आधार हो। “ही चर्च ओह रोट्टेन्ड’ नामो ई.स. १८०४ नो एक अभीन-डेस आ डेसमां ‘हाउस ओह लोइचे’ जे युक्तो। आपेल तेनो मूण्यानु सिद्धांत आ होतोः

“ग्रम्य संप्रदायने आटे रभागेल ट्रूट्टर्ना व्हाल पांथ के संप्रदायनाणा, अंने संप्रदायना केत्खाक सिद्धांतो सरभा लोवाना कारये ज लागीदर थठ शडे नहि。” लोई डेवाजे युक्तो आपाती आगण ज्ञानेवेल के “ओह संप्रदायना अनुयायीजे वज्ये भतमेह जिमो थाप त्यारे अदालते अे संप्रदायना

મુજા સિદ્ધાંતોને આખારે જ નિર્ણય કરવો જોઈએ. અહુમતી કથા પણ છે અથવા એનો કથો સિક્કાત સાચો અને ભુદ્ધપૂર્વકનો લાગે છે એ વાતને ડેવળ અપ્રતુત ગણી કાઢવો જોઇએ.”
કે, હાઈરફ્ટલ, નમકાડોરથા-૩૬૦૮૦૫

નોંધ : અહાદતોમાં આવા સંપ્રદાયિક સુધ્દમાંનોમાં કથા પણનો વિજય થયો અને કથા પણનો પરાવય થયો એટું મહત્વ અમને તથા લાગતું. આ વિષય નથી અહાદતનો કે નથી વક્તોનો, એ તો સંપ્રદાયિક પ્રશ્નાલીનો છે, એટલે શ્રી વહાતાલની ગાઠનો વિજય થયો તેમ ગોચાસણુના થાલીણ મહારાજનો વિજય થયો હોત તો એનો પણ કોઈ અર્થ નહોતો. આના મુગમાં તો સંપ્રદાયિક પરિપાઠીમાં અને તિદ્દાંતોમાં જ્યારે જ્યારે સુધ્દારાના સંપ્રેખ જીભા થાય છે ત્યારે સંપ્રદાયમાં જુદ્ધ દ્વિક્ષા જીભા થાય છે. વૈદિક હિંસાભય પરાપરિયારીની સામે પાંચરાત્ર-સાતવત-ભગવત સંપ્રદાય અને એના પછી થોડ જ સમયમાં પોંદ સંપ્રદાય તથા કેવી સંપ્રદાય કેવી રીતે જીભા થયા? શ્રીપંકરાચાર્યજી કેવી રીતે અય ભૂમિકામાં આવ્યા? એમના સિદ્ધાંતોની સામે શ્રીરામાનુલચાર્યજી શ્રીરેણુજીના શાન્તિશાંકા-ચાર્યજી શ્રીમંદીરાચાર્યજી શ્રીનવસ્તાલચાર્યજી કેવી રીતે આગળ આવ્યા? શ્રીસંપ્રદાયમાંની જ શ્રી-રામાનંદસ્વામો કેવી રીતે ઝૂટા પડ્યા? શ્રીમદ્ભગવાચાર્યજીના સિદ્ધાંતના વિકાસમાં શાગોત્તમ મહાપ્રભુજી કર્તૃ રીતે અલગ તરીકે આવ્યા? શ્રીરામાનુલચાર્યજીને વેદતાસિદ્ધાંતોના આદર કરનારા શ્રીસહિનનંદ સ્વામી કેવી રીતે આગળ આવ્યા? યુરોપમાં કુરોલિઙ્ગના સામે પ્રાટેસ્ટન્ટ્સ અને ઇસ્લામમાં રિયા તથા સુની અને સુનીજીઓમાંથી કાદ્યિયાની-શેડમહિયા તથા પ્રસાદાધીયા અને દાહીની વેરાઓના સંપ્રદાય કેવી રીતે અવગ થયા? આ અંતી સમયની માંગ છે. શ્રીબન્ધગાંધી, રામાનુષ્ણ ઉદારમતવાદી હતા અને છીઠ તરીકે નરતારાયણ ઉપરાત શ્રીશાંકરના તરફ પણ એટલા જ આદરથી જોતા હતા.

આકું આપણા ભારતીય સંપ્રદાયમાં “આચાર્ય માં વિજનનીયાત-ભગવાન કહે છે કે આચાર્યન માટું સ્વરૂપ માનો” એ હજીએ સંપ્રદાયસ્થાપકોને ભગવાનના અવતાર ભાનવાની આવે એ અસ્વાભાવિક નથી.

ઈતિહાસના નિવાર્થીને તો પોતાની સામે પ્રમાણયાં તરીકે રજૂ કરવામાં આવતો તે તે અંધ પોતે કર્યેલે પ્રમાણસિદ્ધ છે એની કર્યોટી કરવાની હોય છે. આને કારણે નરા રયવાનાં આવેલા અથેની યક્ષાસંશી કરવાની હોય છે. આ તરફ થળ્ઠ અને આવવાની જેવું એ એક વાત છે અને ઈતિહાસની દ્વિષિતે જેવું એ બીજી વાત છે, સંપ્રદાયિક આંતરિક જગતએન અહાદતોમાં બર્દ જવા એ સ્વયં વેરી સંપ્રદાયિકા છે, જેને આજની વાસમાં જદીમાં હારયારપદ ગણ્યવામાં આવે છે. કેળોને જે માનવું હોય તે માનવાનો અધિકાર છે, શાશ્વત સમજે તો જે જીવ જીતરે જેવું હોય તે અરોધર, બાકીનું અગ્રાહ, જેનાથી આગળ જઈ એકાધીનાની નિંદામાં પડવાનો ડોઈ અર્થ નથી.

-તાંત્રી

વડોદરાના

એકુ

વિદ્યાચાસંગી

તરફથી

શુભેચ્છા

પથિક-દીપોત્સવાંક]

૧૯૮૬/એકોડો.-નવે.

[૮૧]

ઓક્ટોબર.-નવે. ૧૯૮૬

Reg. No. GAMC-19

Look for the elephant if you're in the building business.

Now good news for builders and contractors. For good quality cement that makes buildings last and last. Use Elephant Brand Cement from Saurashtra Cement and Chemical Industries, Ltd.



Choose from ordinary Portland cement or Pozzolana Portland cement. Both carry the ISI mark.

RANAVAV-360 560 (Gujarat)
Gram : 'SUCCESS', Ranavav
Tele. 21497/98/99, 21529, 21785
Telex : 166-222 SHRI IN

AHMEDABAD OFFICE :
602, 6th Floor,
Chinubhai Centre, Ashram Road,
AHMEDABAD-9 : Tele. No. 78372



**SAURASHTRA
CEMENT & CHEMICAL
INDUSTRIES, LTD.**

મુખ્ય પ્રકાશક અને તાત્કારી : 'પથીક કાર્યાલય' માર્ગ પ્રો. ડેસ્ટરામ ટા. શાહી, કે. મધુલલ, એલિસસિઓ, અમદાવાદ-360 006
અભિયાન-360 006
મુખ્યસ્થાન : પ્રેરણા મુખ્યાલય, રૂસ્તમયાલીનો ટાળ, મિરજાપુર, અમદાવાદ-360 009
પ્રકાશન : ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ વર્ક્સ, શાહુર, માણવાડાની પેલા સામે, અમદાવાદ-360 009